

जिनस्तुतिचतुर्विंशतिका  
( सरलाख्यटीकागुर्जरभाषानुवादसमझूता )  
तथा  
ऐन्द्रस्तुतिः



प्रकाशक-  
श्रीबुद्धिसागरसूरि जैनज्ञानमंदिर  
विजापुर, ( गुजरात )

SHRI AJITSAGARSURI JAIN GRANTHMALA SERIES NO. 17

# JIN STUTI CHATURVINSHTIKA

By  
SHOBHAN MUNISHVAR

---

*Compiled with*  
The *Tika* and its *Translation* in Gujarati  
By  
**SHRIMAD AJITSAGARSURI**

---

*Researched by*  
**MUNI HAMENDRASAGAR**

---

*Published by*  
**SHREE BUDDHISAGARSURI JAIN GNANA MANDIR**  
**VIJAPUR, (Gujrat)**

---

Vikram Samvat 1991              First Edition  
A. D.              1935              Copies 1000

---

**Price Rs. 1-8-0**

॥ ॐ ॥  
Printed by  
*Shah Gulabchand Lallubhai*  
*At the Mahodaya Printing Press, Danapith-Bhavnagar.*  
॥ ॐ ॥

શ્રીઅજિતસાગરસૂરિજૈનગ્રંથમાલાકુ: ૧૭

શ્રીશોભનમુનીશ્વરપ્રણીતા

# જિનસ્તુતિ-ચતુર્વિશાતિકા

શ્રીમદાજિતસાગરસૂરિવિરચિતસરલાખ્યટીકયા સમલઙ્ગૃતા

તતકૃતગુર્જરભાષાનુવાદસમેતા ચ

મુનિશ્રીહેમેન્દ્રસાગરેણ

સંશોધિતા ચ



પ્રકાશયિતુ

શ્રીવુદ્ધિસાગરસૂરિજૈનજ્ઞાનમંદિરમ्-(વીજાપુર)



પ્રથમસંસ્કરણમ्



વિક્રમ સંવત् ૧૯૯૧ ]

[ ઇ. સ. ૧૯૩૫






પ્રતિ સं. ૧૦૦૦



સાર્વરૂપ્યકમ্







स्व. योगनिष्ठ श्रोमद् बुद्धिसागरसूरीश्वरजी  
१०८ ग्रंथोना प्रणेता

આચાર્ય શ્રીમહેં બુદ્ધસાગરસ્વરૂપીકૃતિને

## સમર્પણ

આપશોંકે પૂર્વાચાર્યોના પંથે આધ્યાત્મિક જીવનમાં સતત  
પ્રયાણ કરી વિવિધ રીતે લક્ષ્ટિકાવ લર્યો હુદયે શ્રી જિનેશ્વર  
ગ્રભુને સહા સ્તુતિ ગોચર કરતાં અપૂર્વ ચોણાનંદ  
અનુભવ્યો એ આપની જીવન પ્રણાલીને દ્યાનમાં  
રાખી, તથા આપે આપનાં જીવનભરનાં અહૃત્યસ્ત  
સમસ્ત અંથરતનોને સંઘિત સ્થિતિમાં રાખવા  
માટે એક સુંદર વ્યવસ્થાની પ્રેરણા કરી સકલ  
સંઘને જ્ઞાનનાં સાધનો પુરાં પાડવાનો  
પ્રયત્ન કર્યો તે ઉપકારિતાને લક્ષ્યમાં  
લઈ, આ આપના પદ્ધતિ શિષ્યરત્ન  
શ્રીમાન અજિતસાગરસ્વરૂપિણીના  
દીકા તથા અનુવાદ સમેત  
શ્રી શોલનસ્તુતિની કૃતિ  
આપને જ સમર્પણ  
કરનાર—

અમે છીએ

શ્રી બુદ્ધસાગરસ્વરૂપ જૈન જ્ઞાનમંદિર  
(વિનાપુર)ના કાર્યવાહકો—  
શા. લોગીલાલ અમથાલાલ વખારીયા  
કેશાંદ્ર અનુતલાલ ડાલ્લાલાંદ વકીલ

# નિવેહન અને આભારદર્શન

‘પાહ્યલચ્છી નામમાળા’ અને ‘તિલકમંજરી’ વિગેરે જેવા પ્રાઇત તથા સંસ્કૃત સાહિત્યમાં અતિ પ્રસિદ્ધ પામેલા અંથ દતોના કર્તા કવીશ્વર સુશ્રાવક શ્રી ધનપાલના બાતા અને ઉપહેશક શ્રીશોભનસુનિનિનો ‘જિન સ્તુતિચતુર્વિશ્વિકા’ નામે અંથ આજે અમે સંસ્કૃત સાહિત્યના રસીક અને ભાવુક અભ્યાસીઓના કરકમદમાં મુકવાને શક્તિવંત બન્યા છીએ. આ અંથ મૂળ તથા તેના પર શ્રીધનપાલ જેવા સમર્થ અનેક વિદ્વાનોથી રચાયલી ટીકા અવચૂરીએં સાથે આજ પહેલાં ટેટલાએક મહાશયો તરફથી મુદ્રિત થઈ ચૂક્યો છે. છતાંપણું એકવાર ફરીથી મુદ્રિત કરવામાં અમારી સંપૂર્ણ સાર્થકતા છે. કારણું પ્રસિદ્ધવક્તવ્ય શાખવિશારદ જૈનાચાર્ય શ્રી અજિતસાગરસુરિણી રચેલી ‘સરલા’ નામની એક નવીન જ સંસ્કૃત ટીકા ગુર્જર અનુવાદ્યુક્ત અમે તેને પ્રસિદ્ધમાં મુક્તાએ છીએ.

શ્રીશોભનસુનિનિના આ સ્તુત્યાત્મક અંથ ઉપર કવીશ્વર શ્રીધનપાલે ( અવચૂરીઃપ ) ટીકા કર્યા છતાં પણ તે ગ્રથની મહત્તમાના મોહને લઈ કંઈ કંઈ વિશેષતા વાળી અનેક ટીકાઓ ને અવચૂરીએં થઈ તેવા જ રીતે આ ‘સરલા’ ટીકાનું પણ નિર્માણ થયું છે. ટીકાના અવલોકનકાર મહાશયો જેણે કે, ખોળ ટીકાએ કરતાં આ ટીકામાં જરૂર કંઈક વિશેષ છે. પાંડિત્ય અને ટીકાકાર તરીકે પ્રસ્તુત ટીકાકાર આચાર્યનો દરજો ફેટલો છે એ નક્કી કરવાનું કામ ધૂર્ધર વિદ્વાનું છે, પણ આ ટીકા પરતે અમે જરૂર એટલું તો કહી શકીએ છીએ કે સરલતા અને સાન્નય

( અર્થાનુસાર પદ ધરના ) વિજેતેથી આ ટીકા રચવાનો પ્રયાસ તેવા પ્રકારના અભ્યાસીઓને ઉદેશી સફળ છે. અને આવી જનતની સફળતા ધ્યાનમાં રાખીને જ અમે આ અંથને સટીક ગુજરાતી અનુવાદ સહ અભ્યાસકોની માગણી અને સુગમતા માટે પ્રકાશિત કરવા લક્ષ્યાયા છીએ.

અમે આ અંથને શ્રીઅનિતસાગરસુરિ અંથમાળાના અન્થાંક ૧૭ તરીકે પ્રગટ કરીએ છીએ. આજસુધી આ અંથમાળા અનિતસાગરસુરિ શાસ્ત્ર સંઅળ-આંતીજ તરફથી બહાર પડતી હતી. તેનો અન્થાંક ૧૬ ‘ગીત પ્રભા-કર’ બહાર પક્ષા પદી તેની બધી વ્યવસ્થા અને દેખરેખ મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીની પ્રેરણુથી અમારે ( શ્રી બુદ્ધસાગરસુરિ નૈન જ્ઞાન-મંહિરને ) દસ્તક આવવા પામી છે. તે સંખ્યા ડેટલોક ખુલાસો અમે અમારા રિપોર્ટમાં બહાર પાડી ચૂક્યા છીએ.

આ પુસ્તકનો બહેણો પ્રચાર થાય તે માટે અમે તેની પડતર કિન્મત કરતાં ઓછી જ કિન્મત રાખી છે. અન્થાંક ૧૬માં જણાવ્યા પ્રમાણે આ એક પુસ્તક બહાર પક્ષા પદી, હવે થોડા સમયમાં જ ‘સ્તોત્ર રત્નાકર ભાગ ૧ લો.’ તથા ‘અનિતસાગરસુરિકૃત સ્તવનાહિ સંઅળ’ ( ગીતરત્નાકર ભાગ ૨ ) આ એ પુસ્તકા સાથે દેવવંદન અને સુભાપિતરત્નાકર પણ અમે જનતાના હાથમાં મુક્તિ શક્તિનું આ બધાં પુસ્તકોનાં વેચાયનું જે કાંઈ દ્રોઘ આવે તે તેના અર્થ પુરતું પણ ભાગે જ હશે. ઉપરાંત બીજાં પણ ડેટલાંક પુસ્તકો આચાર્યશ્રીનાં રચેલાં દરેક વિષયનાં-અત્યાંત ઉપયોગી અપ્રગટ પડ્યાં છે તો તેને પણ છપાવવા અમે છરાડો રાખીએ છીએ તો, તે પુસ્તકા ઓછી કિન્મતે કે બેટ તરીકે આપી શકીએ એમ અને માટે, આશા છે કે ઉદાર ગૃહસ્થો આવા જાન પ્રચારના કાર્યમાં પોતાની લક્ષ્યોનો સહૃપયોગ કરવા ઉદાર હાથ લાંબાવે.

અમને આ ટીકાની પ્રત આચાર્યશ્રીના પ્રિય શિષ્યરત્ન મુનિ શ્રીહેમેન્દ્ર સાગરજીએ આપી અને આ પુસ્તકનું સંશોધન પણ તેમણે જ કર્યું છે.

૮

વળી તેમણે જ પ્રેરણું કરવાથી ન્યાય-કાયતીર્થ મુનિરાજ શ્રીહિમાંશુ-  
વિજયજી (અનેકાન્તી)એ અમને આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી  
છે, જે માટે અમે આ અને મુનિરાજનેના ખાસ કરીને આભારી ધીએ.  
ઉપરાંત આ પુસ્તકના સંશોધનમાં શાસ્ત્રવિશારદ વિદ્વદ્ય ઉપાધ્યાય  
શ્રીસિદ્ધિમુનિજીએ પણ કેટલીક ઉપગોગી સૂચનાઓ આપી છે માટે  
અમે તેમનો પણ આભાર માનીએ ધીએ. વળી માણસા રેટ ન્યાયાનીશ  
રા. રા. વાડીલાલ મોહનલાલ શાહ-ઝી. એ. એલ એલ. ઝી. એ  
ઇંગ્રેજમાં પ્રસ્તાવના લખી આપવા માટે મહેરભાની કરી છે તે અહિંક  
અમે તેમના પણ ઝણું ધીએ.

## પ્રકાશક.

તા. ૧૬-૧૧-૩૪	}	બોાગીકાલ અમથાલ વખારીયા
વીજપુર ( ગુજરાત )		અમૃતકાલ ડાયાલાધ દેશાધ ( વકીલ )
જુન સં. ૧૦		( ઝુદ્ધિસ્થ. ન્ને. શાનમંદિર )



## P R E F A C E

---

“**Sarala**” as the name suggests, is a very lucid commentary on that highly scholastic masterpiece “**Jin Stuti Chaturvinsatika**”, the prayers of twentyfour Tirthankars composed by that learned author **Sobhan**. Gujarat is well familiar with the name of **Budhisagarsuriji**, the undaunted spiritual preceptor of Jains. This book ‘Sarala’ is the creation of his disciple, the late **Ajitsagarsuriji**, who took great interest in Jain poetical and research works as evidenced by the present-writing and several other books written by him. Unfortunate as it was, Ajitsagarsuriji did not survive to see his own publication and so **Hamendrasagarmuni**, the social and loving disciple of the late Guru very willingly undertook the trouble of publishing it.

The present Stuti, originally written by the learned muni Sobhan is greatly appreciated even by the western philosophers. Dr. Hermann Jacobi, the renowned german philosopher, is certainly right when he says “Beside these Sobhan-stutis, I do not know of any other work of the same author but these hymns are sufficient to secure for him for ever the name of a great versifier.”

१०

Every prayer is composed of four poems, addressed to the prayed Tirthankar, to all 24 Tirthankars, to the Holy Scriptures and to the particular goddess respectively. Kavi Sobhan has paid a great deal of attention to forms and not less than eighteen various types of forms of verses are made use of. Rhetorical figures and a variety of meters enrich the composition. Illiteration illuminates the versification. The arrangement of Padas is masterly wonderful. Nay, even from the grammatical view point, " the stutis " stand marvellously infallible.

Indeed, the author's creation is the outcome of his own thoughts, feelings and observation. Hence the present day reader likes to know some thing about the life or the environment of the author before going through the book. But very little was written in the past about the lives of the authors either in their own writings or those of their commentators. However, from the straypieces of information that can be gathered from Tilak-Manjari, Prabhavak-Charitra and other well-known works of Dhanpal, the learned brother of the learned author, and from the contemporary literature, it is ascertained beyond doubt, that the name of the author of " Stuti " is Sobhan. In highly learned Brahmin family Sobhan was born probably at Ujjain in Malva. His grandfather Devarshi, lived in the city of Sāṅkashya in United Provinces. Thereafter he came to stay at Ujjain and thence to Dhara with his son Sarvadeva

११

who was well-versed in all scriptures and was a greatly favoured Pandit of Bhoja.

The story of initiation or भूषण of Sobhan has a romance by itself. Sarvdev the father of Sobhan, wanted to find the whereabouts of the wealth buried by his deceased father Devarshi. He, therefore once visited a Jain Muni Mahendrasuriji and requested the latter to show where wealth was lying. Mahendrasuriji, it is said, showed him the place wherefrom Sarvdev found out wealth valued at 40000 Tunkas. ( Goldmohurs ) To show his gratitude, Sarvdev respectfully urged the Jain Muni to take half of the wealth. The muni refused to take any thing as Jain Saints never keep wealth, but when insisted, asked for one of his sons to be his disciple. Sarvdev had two sons— Dhanpal and Sobhan. The elder brother Dhanpal, strongly protested the demand. It was a painful duty for Sarvdev to make out the way but Sobhan, the younger son came to his father's help and showed his willingness to be initiated. This enraged his brother Dhanpal who therefore moved King Bhoj to issue a Farman prohibiting Jain Saints to move in Malva. The Jain community was greatly dissatisfied by such an order, but could not do anything for a long time. After a period of about twelve years. Jain Sangha sent a deputation to Muni Mahendrasuriji who was then in Gujrat and requested him to show the way. Then, our author Sobhan, under the orders of his preceptor went to the place and successfully persuaded the

१२

antagonists and his elder brother Dhanpal by his powerful eloquence, versatile knowledge and resourceful intellect to withdraw the order. Dhanpal was so much impressed that he became a convert to Jainism and later on wrote good many books on the tenets of Jain religion. This is the short outline of the life and work of the learned poet.

When one goes through the book, he cannot but feel that indeed, much of useful and interesting Jain literature has not seen the daylight because of the want of the research work. Indeed, Jain public is highly thankful to **Sri Agmodaya Samiti** for publishing "Stuti Chaturvinsatika" in Sanskrit along with four scholastic commentaries ably written by Jain Saints. Prof. H. R. Kapadia has equally done a good service for bringing out the same in Gujarati.

In the end, I will conclude in the words of the learned Dr. Jacobi, "These hymns are remarkable as a piece of art and interesting as an excellent illustration of the direction taken by the literature of the Jains who are poor in real poetry and of the accomplishments of which it was capable at its best."

16 Dec. 1934.

Mansa.

**Vadilal Mohanlal Shah.**

B. A. LL. B.

Nyayadhish Mansa State.

## **FOREWORD.**

I am no scholar of Jain theology. The little that I know of Jain philosophy is due to what I have gathered from my contact with Jain Savants, such as Jainacharya Buddhisagarji and Muni shree Hemendrasagarji, the learned desciple of the author of this commentary. I hesitated at first to express an opinion on such a subject of purely literary and theological interest, but when I learned some of the aspects of his work from Muni Shree Hemendrasagarji, I felt I should write a few words about the author and his work.

“Jina Stuti Chatur Vimsatika”, a poem of 96 slokas is the most attractive and fascinating poem of its kind. It is the masterpiece and the only work of the great poet Sobhan, the brother of the poet Dhanpal who was the personal friend of the famous Raja Bhoj. Each verse of this short poem is a standing monument of the skill of the poet, giving us a proof of his great versatility and talent. The learned Jainacharya Ajitsagarji has written a Sanskrit Sarla commentary on this great poem with a lucid and highly commendable Gujarati translation of the same in which the spirit of the original work is so splendidly kept up. Muni Shree Hemendrasagarji has very beautifully traced the history of the poet Sobhan and thrown considerable light on contemporary Jain thought.

and literature. The poem is in this way a work of great historical value and occupies a premier position in the contemporary Jain, Buddhist and Hindu literature.

I should not omit making mention of Nyaya-kavyatirtha Himansuvijayji's Gujarati preface which is of first rate importance in connection with this work.

Moreover, personally I am very pleased to find an eulogistic Sanskrit pen picture in verse of 36 stanzas of my own state Mansa by the learned Muni shree Hemendrasagarji associated with this great poem of unequalled merit composed in the rich, flowing style of the great Jainacharya Buddhisagarji of revered memory.

Scholars and others interested in the Eastern languages and literature will find in this poem a good deal to learn, admire and appreciate. The importance of the poem can hardly be exaggerated. To say the least about it, it reveals the progress and advancement of Jain culture in the past.


Mansa,

YASVANTSING

5th April 35.

General Adviser, Mansa State.

## પ્રસ્તાવના.



મહાકવિ શોભનમુનિ

અને તેમની કૃતિ.

‘કવિ, જગતની એક અનેરી વિલૂપ્તિ છે. કવિત્વ શક્તિ કુદરતની અપૂર્વ અભિસ છે. હુનરો ધનાઢ્યો કે રાન્યો જગતને બે લાલ ન આપી શકે તે લાલ ધારે તો એક સાચેસ કવિ આપી શકે છે. કવિને કવિત્વ શક્તિ શોધવા જવી પડતી નથી. સ્વયમેવ તે શક્તિ સાચા કવિને વરવા આવે છે. આવો કુદરતી કવિજ જગતને અવનવો આનંદ આપી શકે છે.’ કવિ જગતના ગમે તેવા પદાર્થીનું સૂક્ષ્મતમ નિરીક્ષણ કરી તે પદાર્થને પોતાની કદ્વપના શક્તિથી વર્ણવી સુંદર અનાવે છે, અને તે દ્વારા તેમાં તે અનેરો રસ ઉત્પન્ન કરે છે.’ એ જ કવિની ખરી ઝૂણી છે ‘જ્યાં ન પહોંચે રવિ લાં પહોંચે કવિ’ એ લોક કહેવતની પણ આવા કવિ માટે જ સાર્થકતા ગણી શકાય.

જેમ એક રાજ કે ધની અમુક દેશ કે કાળને માટે જ સરણયેલો હોય છે; તેમ કવિ નથી હોતો, સાચો કવિ તો તમામ જગત અને બધા ડાળ માટે સરણયેલો હોય છે, તેમકે તે પોતાના યશઃ—શરીરથી સહા જીવતો જગતો રહી, પોતાની પાછળ મુકેલી કૃતિનો લાલ જગતને સતત આપતો જ રહે છે. કવિ—મનુષ્ય લોકમાં પણ પોતાની અનુપમ પ્રતિભાથી સાક્ષાત્ સ્વર્ગનો અનુભવ કરી; બીજને પણ તેનો સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ હોય છે. આવો કવિ જ સાચો કવિ કહી શકાય, અન્યથા ‘કવય: કપય: સ્મૃતાઃ’ ( કવિઓ વાંદરા છે. ) ની કહેવત લાગુ પડે !

આવા કુદરતી જન્મસિદ્ધ એષ કવિઓ આ લારતમાં થતા આવ્યા છે, તેમાં જૈનોએ મોટો હિસ્સો આપ્યો છે. દરેક જમાનામાં હિન્દની એકેએક ભાષામાં જૈન સુનિયો અને ગૃહસ્થોએ સુંદરતમ કાવ્ય રચના કરી જગતને ચકિત કરી નાખ્યું છે. સંસ્કૃત, પ્રાકૃત અને ડાનડી ભાષામાં તો કેટલાક જૈન કવિઓનું નામ અઠારમી સદી સુધી મોખ્યે રહ્યું છે.

આપણા પ્રસ્તુત સ્તુતિકાર ‘શ્રી શોભન સુનિ’ પણ તેવા વિશેષ કુદરતી કવિઓ પૈડીના એક એષ કવિ શોભન સુનિનું હતા; એમ માનવામાં તેમની ઉપલબ્ધ એક એષ કવિત્વ. જ ‘જિનસ્તુતિચતુર્વિંશતિકા’ દૃતિ મને પ્રેરે છે. તેમની બીજી કૃતિઓ જરી નથી, અને કદાય તેમણે ન પણ બનાવી હોય છતાં પ્રસ્તુત કૃતિથી જ તેમને એષ કવિ કહેવામાં કોઈપણ જતનો વાધો નથી.

‘જેમનાં ધણાં કાવ્યો મળતાં હોય તે જ મોટા કવિ છે’ આવી માન્યતા સાચી નથી. પોતામાં કવિત્વ શક્તિ સારામાં સારી હોવા છતાં કેટલાક મહાકવિઓ ગમે તે કારણે એક પણ કાવ્ય કે મહાકાવ્ય બનાવ્યા વગર જ આ જગત છાડીને

શ્રી શોભનમુનિના જીવન પર પ્રકાશ.

૩

ચાલ્યા જીથ છે, કેટલાએક બીજી વિષયના અંથેા અનાવવામાં આનંદ કે લાલ માની કાવ્યના અંથેા થોડા, અનાવે છે. અથવા અનાવતા ય નથી. આવી અવસ્થામાં તેવા કુદરતી કવિઓને આપણે ‘કવિ’ નહિ માનીએ તો ‘એક મારી ભૂત જ ગણુધ્ય, ખયંકર અન્યાય જ થાય’ એમ મારું માનવું છે. જો તેમ ન હોય તો ‘સિદ્ધસેન દિવાકર’ કે જેએનું ‘કલ્યાણ મહિર ર્સોત્ર’ સિવાય બીજું એક પણ કાવ્ય અત્યાર લગ્ની મળ્યું નથી, છતાં તેમને માટે, હજારો શ્લોકોનાં કાવ્યો રચનાર આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા મહાન् કવિ “અનુસિદ્ધસેન કવય:” (સિ. ૧૦ ૨-૨-૩૯ પૃ. ૭૨) કહી મહાકવિનું માન આપે છે તે ન જ આપત. તેથી એમ માનવું જોઈએ કે કવિતા અનાવવી જુદી વસ્તુ છે અને કવિત્વ શક્તિ હેવી જુદી વસ્તુ છે, આપણા ‘શોભનમુનિ’ પણ તેવા જ કવિ હતા, કે જેએ શાખાદાંકાર અને લક્ષ્મિના પૂરથી છલકતી ‘જિનસુતીચતુર્વિંશતિકા’ નામની એક જ કૃતિ જગતને આપી તરણુવયમાં સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રસ્તુત કૃતિની આદોચના કરવાનું કામ આગળ ઉપર રાખી તે કૃતિના કરતો (શોભનમુનિ) ના જીવન ચરિત્ર તરફ હું વાયકોને લઈ જવા માણું છું.

### શ્રી શોભન મુનિના જીવન પર પ્રકાશ.

અત્યાર લગ્ની પ્રકાશિત થએલ જૂના અને નવા અંથેામાં શ્રી શોભન મુનિનું જીવન ચરિત્ર અહુ જ દૂંકાણુમાં, અને તે પણ અપૂર્ણ મળે છે. તેમનાં જનમસ્થાન, માતા, પિતા અને ગુરુના નામના સંખ્યામાં અનેક અંથકારો જુદા જુદા મત આપે છે, પણ મને તો આમના જીવનના વિષયમાં મહાકવિ ધનપાળ (શોભન મુનિના વડીલ લાર્ઘ) ના અંથેા, પ્રભાવક ચરિત્ર અને પ્રથંધ ચિત્તામણિ વધુ પ્રમાણિક લાગે છે માટે આ અંથેાના આધારે હું કંઈક લગ્નિશા.

शोालन मुनिनुं लुवन ए लिज्ज लिज्ज प्रकारना संस्कारीथी  
घडायुं छे. जन्मथी तेमनामां वैदिक  
शोालनना पूर्वले संस्कारे। पोषाया छे अने दीक्षा  
अने तेनुं प्रारं पठीथी जैन संस्कारेत्ये तेमां अपूर्व  
लिङ्ग लुवन. सुधारणा कुटी नवुं तेज उत्पन्न कुयुं  
छे. जन्मथी तेच्ये। वैदिक आक्षण्यु हुता विग्रहे  
आण्या सहु पहेलां आपण्यु तेमना भार्त धनपाणी कुति  
'तिलकमंजरी' तरइ नजर नांभीशु. महाकवि धनपाण  
पैतानो परिचयः आपतां तेमां लाखे छेः—

मध्यदेश के नेने आजकाल संचुक्त ग्रांत ( थू. पी. )  
उल्लेखामां आवे छे, तेमां आवेला 'सांकेश्य' नगरनो रहेवासी  
'देवर्षि' आक्षण्यु हुतो. तेनो पुत्र 'सर्वदेव' थयो, जे शास्त्र-  
कुणा अने अंथ रचयामां निपुण्यु हुतो. आ सर्वदेवने ए पुत्रो थया,  
भोटो 'धनपाण' अने नानो 'शोालन' आपण्या चरित्रनाथक  
आज शोालन छे. धनपाणना पिता सर्वदेव, 'लोज' नी सुंदर  
'धारा' (धार) नगरीमां आवी रह्या हुता. तेमना अने पुत्रोनो  
जन्म क्यां थयो. तेनो नझी खुलासा जे के आपण्युने भजतो  
नथी, पण्यु अनुभानथी कुही शकाब के, सर्वदेव धण्णा वर्षोथी  
धारामां आवी रह्या हुशी ? आ हिसाबे आ अने तेमना पुत्रोनो  
जन्म धारामां थयो. होय एम लागे छे.

### धारानगरी—

जे वर्खते राज 'लोज' भाणवानुं राज्य करतो हुतो ते  
वर्खतनी 'धारा' नगरी धारी जडोजलालीवाणी हुती. अनेक वीरो,

१ "आसीद् द्विजन्माऽखिलमध्यदेशो प्रकाशसाङ्काश्यनिवेशजन्मा ।

अलब्ध देवार्थिरिति प्रसिद्धि यो-दानवर्षित्वविभूषितोऽपि ॥ ५१ ॥

शास्त्रवर्धीती, कुशलः कलासु, बन्धे च बोधे च गिरां प्रकृष्टः ।

तस्याऽस्तमजन्मा समभून्महात्मा, देवः स्वयंभूरिव सर्वदेवः ॥ ५२ ॥"

तिलकमंजरीनी पीठिका.

દાયકું ધન મહ્યું.

૫

વિક્રાનો અને ધનાખ્યોથી તે નગરી શોભી રહી હતી. વિદ્યાના સુગંધી વાતાવરણુથી મહેંકી રહી હતી. દેશ વિદેશના નામી પંડિતોનો ત્યાં ગર્વ ઉત્તરી જતો હતો. સારા વિક્રાનું કવિઓને લાખોનાં ધનામ અને મોટી ઈજાજત એનાયત કરવામાં આવતી હતી. સરસ્વતી અને લક્ષ્મી ઘનનેનો લાં સાથે વાસ હતો.

રાજ 'લોજ' કેવળ ચોખ્ય રાજક નહિ પણ, એક અઠંગ વિક્રાનું અને રસિક કવિ પણ હતો. સાચા વિક્રાનોનો પોષક અને અનુમોદક હતો; તેથી આ સર્વહૃવ મહાનું પંડિતે આ નગરીમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. આવા વિદ્યાન્યાસંગના સ્થાનમાં રહેવાથી તેના બને પુત્રોને પણ વધારે અનુભવ મેળવવાનો અવસર મળી આવ્યો. ધનપાળ અને શોકસનને પિતા પાસેથી પરંપરા પ્રાસ વિદ્યા તો મળીજ હતી; પણ સાથે સાથે ત્યાંના જુહા જુહા પંડિતોના સમાગમથી તે વિદ્યામાં ધણો સારો વધારો થયો. ધીમે ધીમે આ બને ભાઈઓએ પોતાની પ્રતિબાથી ધારાના પંડિતો અને લોજરાજના હૃદયમાં માનવંતુ સ્થાન મેળવ્યું, અને તેઓ બન્ને આણા ય માલવાના પંડિતોમાં પંકાવા લાગ્યા.

વિક્રાનો માટે ધણે હંમેશાં બને છે તેમ સર્વહૃવ પંડિત ઉપર લક્ષ્મીહૃવી પ્રસન્ન ન હતાં. તેના દાયકું ધન પિતાએ ધરમાં પુષ્ટળ ધન દાયકું હતું, મહ્યું. પરન્તુ તે કબે સ્થળે દાયકું છે? તેની અખર સર્વહૃવને હતી નહિ. તે પોતાના ધરમાં દાયકું ધન મેળવવા ચાહેતો હતો. એક હિવસે તપસ્તેજ અને વિક્રતાથી શોકતા 'શ્રીમહેન્દ્રસૂરિ' ધારામાં આવ્યા. તેમના મહિમા અને પાંડિત્યની વાત રાજ પ્રન અને પંડિતોમાં ફેલાઈ. સર્વહૃવે આ આચાર્યનો સમાગમ કર્યો. આચાર્ય ઉપર તેનો પ્રેમ અને વિશ્વાસ વધતો ગયો. આચાર્ય આગળ પોતાની ગરીબાઈની વાત કરી. પોતાના ધરમાં દાયકેલ ધનને ખતાવવા સાથે વિનતિ કરી.

---

૧ પ્રયંધચિતામણિમાં વર્ધમાનસૂરિ આવ્યાનું લખ્યું છે તેની આલોચના આગળ કરીશું.

આચાર્ય તેના ધરમાં દટાયેલ ધન ખતાવ્યું. સૂરિણુએ ખતાવેલા સ્થળમાં સર્વદૈવને મોટી ધનરાશિની પ્રાપ્તિ થઈ. ધનના આનંદથી તે ગાંડો ઘેલો થઈ ગયો. ધન અગ્યારમે પ્રાપ્ત છે. બાળકથી વૃદ્ધ, મૂર્ખથી પંડિત, અધ્યાત્મ જેની રાતદિવસ જંખના કરે છે. તેનાથી કેમ આનંદ ન થાય?

સર્વદૈવ પંડિત હેલા સાથે પૂરેપૂરો કૃતરૂ હતો. સૂરિણના ઉપગારનો બદલો આપવા તે ચાહતો હતો. તેણે ભળી આવેલ ધનનો અર્ધો લાગ લેવા સૂરિણને પ્રાર્થના કરી, પણ તેઓ તો પંચમહાત્રાર્થી જૈનાચાર્ય હતા. પરિથહ્યા તદ્વન ફર રહેનાર નિર્થન્ય ધનને શું કરે? એક કોડી પણ સૂરિણુએ લીધી નહિ. અંતે સર્વદૈવની પ્રાર્થનાથી સૂરિણુએ એક રસ્તો ખતાવ્યો:— “ઉપકારનો બદલો આપવો જ હોય તો તારા એ પુત્રોભાંથી એક પુત્ર મને આપ, જેથી જગતમાં તારું પણ નામ થાય.” આ ઉત્તર સાંભળી સર્વદૈવ પુત્રાભેમને લીધે સંકોચાયો પણ ઉપકારનો બદલો આપવાનો વિચાર તેને એચેન બનાવતો હતો. પ્રલાવકચરિત્રકાર લખે છે કે:—તેવા વિચારમાં તેનું આપું વર્ષ વીતી ગયું, અંતે તીર્થમાં જઈ મહેનદ્રસૂરિના ઉપકારનો બદલો નહિ આપવા સંભાંધી પોતાના પાપને ઘોવાનો વિચાર કરી સર્વદૈવ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન સમયે ધનપાળો કારણું પૂછતાં ઉત્તરમાં સર્વદૈવે જણાવ્યું કે:—“માર્દ ઋણ ચુકાવવા એમાંથી એક પુત્રની જૈનાચાર્ય માગણી કરે છે. આ ઋણ ચુકાવ્યા વગર હું ભરી જઈ તો મારી સફાગતિ થાય નહિ.”

પિતાની વાત સાંભળી ધનપાળ ચમક્યો અને કોધથી સર્વદૈવને કહેવા લાગ્યો કે:—“તમે પોતાના પુત્રને ઉપકારનો બદલો. જૈન દીક્ષા અપાવી આપણા કુળને કલંકિત કરવા માંગો છો? આપણા કુળમાં શુદ્ધ યસ-ચાગાહિ વેદપાઠ કરનાર પ્રાણણે થયા છે. પ્રાણણે અને અમૃત્ણામાં હુમેશાંથી વિરોધ ચાલતો આવે છે. આની અવસ્થામાં

શોભન આહારુ મરી અમણ થયો.

૭

જૈન સાધુને તમે પુત્ર કેમ આપી શકો ? જે તમે તેમ કરશો તો હું તમારો પણ સંબંધ છોડી દ્વારા. ” પુત્રનાં આવાં અનાદરવાળાં વચન સાંભળી સર્વહેવનો ગલરાટ વધે છે ત્યારે તે વખતે સર્વહેવનો નાનો પુત્ર ‘શોભન’ પિતા પાસે જઈ કહે છે કે:—‘પિતાજી તમે કંઈ પણ ચિત્તા કરશો નહિ. ઉપકાર વાળવાની તમારી અતિજ્ઞા હું પૂરી કરીશ.’ ‘શોભન’ તેના પિતાનો એક સાચો લક્ષ્ણ પુત્ર હતો. ‘ગુરો-રાજા ગરીયસી’ ના સિદ્ધાન્તમાં માનનારો હતો. સાચે સાચે જૈન સાધુનાં અહિસા, તપ્ય અને સંયમનું માહત્વ પણ તે સમજતો હતો. તેથી તેણે પિતાની અતિજ્ઞા પૂરી કરવાનું બીજું જરૂરું:

પ્રતિજ્ઞાને પૂરી કરાવનારાં પુત્રનાં અમૃતમય વચનો સાંભળી સર્વહેવના હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉછ-શોભન આહારુ નવા માંડી. પુત્ર ઉપર પ્રસન્ન થઈ સર્વહેવ મરી અમણ થયો. આશીર્વાદપૂર્વક પોતાનો પુત્ર સૂરિજીને સેચે છે. શોભન ‘આહારુ’ મરી ‘અમણ’ થાય છે. મહેન્દ્રસૂરિ તે નવા શિષ્ય સાચે અન્યત્ર વિહાર કરી જય છે. બહુ થોડા જ સમયમાં જૈનાગમાદિ વિવિધ પ્રકારની વિદ્યા લણીની સુરિજી પોતાના આ નવા શિષ્યમાં અનુભબ અને પાંડિલનું નહું તેજ ઉમેરે છે.

ગુરુસેવા કરી શોભનસુનિચે એક ખાનુ સમ્યગુ શાત મેળવ્યું અને બોજુ ખાનુ ચારિત્રની સંપત્તિ શોભનસુનિની મેળવી. પૂર્વની વિક્ષતામાં આ એ વસ્તુઓ અગ્રાત. ઉમેરાતાં તેણો મહાન् પ્રલાવશાળી બની ગયા. થોડા વર્ષોમાં પોતાના પ્રાંતમાં જ નહિ પણ ફર ફરના અનેક પ્રાંતોમાં શોભનની કીર્તિ ફેલાણી. શિષ્યની વધતી જતી કીર્તિને જોઈ મહેન્દ્રસૂરિનું હૃદય આનંદથી ઉછળવા લાગ્યું.

आ बाणु धनपाणनी सभत मनाई छतां शोलने जैन  
साधु पासे दीक्षा लीधी हेवाथी धनपाणे  
धनपाणनो कोध, पिता उपर कुद्ध थर्द पिता साथेनो संबंध  
अने जैन साधुनो छाडी दीधो. जैन साधुओनो ते पहेलां करतां  
विहार बंध. कहर हुश्मन खनी गयो. लोजराजना कान  
लंबेरी भाणवामां जैन साधुने नहि विचरवा  
हुकम कढावयो. भारतमां धर्मदेवने लीधे पोतानी सत्ता अने  
शक्तिओनो आटो. उपयोग करवाना दाखला आवी ज रीते  
भनता हुता. भाणवामां जैन श्रमणो (सुनियो) नां दर्शन  
हुर्वाल थयां. आ वातने जेतनेतामां भार भार वर्षनां वडाणुं  
वही गयां. जैन साधुओनो विहार बंध हेवाथी भाणवाना जैन  
लोकेमां सर्वत्र उदासीनता अने हुःखनी लागण्ही झेलाओली हुती.

जैनोमां धर्मप्रेम अने आत्मालिमान लगवाथी भाणवाना  
संघे श्री अहेन्द्रसूरि पासे जै भाणवानी धर्म संबंधी  
कडेडी स्थिति कही संलग्नावी अने तेमने त्यां पधारी  
लोजनी आज्ञा बंध करावी, जैनशासननी प्रलापना करवा  
विनति करी. आ अधी वात शुरुपासे ऐडेला शोलनमुनि अहु ज  
चीवटताथी संलग्नता हुता. ते वर्षते तेओ शुजरातमां हुता.

शोलनमुनि लाणी गणीने क्यारना य एक असाधारण विद्वान्  
थर्द गया हुता. सचेट उपहेश आपवानी  
संघनी विनति शक्ति तेमनामां सहजे आवी गह छुती तेथी  
अने शोलन शुरुओ चेऱ्य गणी तेमने 'वाचनाचार्य'  
सुनिनुं धारमां पद आँचुं हुतुं. पोताना देशना (भाणवाना)  
जवुं. लोकेनी विनती संलग्नी तेमने लाणी आँचुं  
के:—'आ अधुं भारा ज निभिते थयुं छे  
भाटे गमे तेम करीने भारे ज आनो प्रतिकार करवो जेठेय.'  
शोलनमुनि इरपोक अने सुभमां भस्त रहेनार साधु न  
हता, के कर्मी उपर अथवा कलिकाल उपर दोप दृष्ट निराशा

संधि विनीथी शोक्लनमुनितुं धारामां आवतुः

६

थृष्णु ऐसी रहे. तेमनामां हिम्भत हुती, शासननी दाख हुती अने जमे तेवाने सभन्नववानी विक्रिता पछु हुती तेथी माणवामां जैरु अगडेली स्थितिने सुधारवानी पोतानी ईच्छा शोक्लनमुनिए युरु आगण कुही आतावी. युरुओ तेमने हुरैक दीते चोय सभल्ल त्यां जैरु सुधारै करवा आज्ञा आपी. बस, पक्षी शु ! ‘इष्ट वैद्योपदिष्ट ’ ‘लावतुं हतुं ने वैद्ये कहुं’ जेवुं थयुं. युरुनी आशिष् मेणवी केटलाक साधुओने साथे लै शोक्लनमुनिए धारा भाष्टी विहार लंभाव्यो. उथ विहार करी थाडी मुहतमां तेओ धारानगरीमां प्रवेश करता हेखाया. लोडो तेमने अनिमेष दृष्टिए चक्रित थृष्णु जेता हुता. ‘अरे ! आ जैन साधुओ अहीं क्यांथी ? शा माटे आव्या ? हुमणां राज्यपुरुषो पकडेहो. राज्य गुस्से थृष्णने डेणु बाणे शुं करहो.’ आम ज्यां त्यां लोडो आपसमां अनेक प्रकारनी वातो करता हेखाता हुता. जैन धर्मना देवी केटलाक लोडोने ईर्ष्या थवा लागी ज्यारे जैनो आनंदथी उलरावा लाग्या.

प्रवेश करती ज वधुते राज्यवाडामां जतो कवि धनपाल रस्तामां मज्ज्यो. जैन साधुओने जैरु तेमनुं उपहास करवा एक वाक्य तेणु कहुं:—‘ गर्दभदन्त ! भदन्त ! नमस्ते ! ’ अर्थात्:—गयेडा जेवा दांतवाणा हे लग्वन् तमने नमस्कार थाओ. धण्डा वषो वीती ज्वाथी शोक्लनमुनिने ते पोताना लाई तरीके ओणाभी शुक्तेहो नहि, पछु शोक्लनमुनिए तो धनपालने ओणाभी लीध्या हुतो. तेथी उपहासवाणा वाक्यने अनुकूल चमत्कारयुक्त उपहासवाणा शोक्लनमुनि जोत्या के:—‘ कविवृत्तास्य ! वयस्त ! सुखं ते ? ’ अर्थात्—वांदराना वृष्णु ( अंडेश ) जेवा सुखवाणा हे भिन्न ! हुं सुखमां तो छेना ? पोताना करतां वधु चमत्कारवाणुं शोक्लननुं वाक्य सांलग्नी धनपाण चमक्यो ने आंगो पडी जोत्यो के, ‘ हुं तमारी वाक्य अतुराईथी परास्त थयो छुं. आप डेणु छो ? क्यांथी आवो छो ? अने डेना मेमान छो ? ’ शोक्लने ‘ अमे तमारा ज भेमान छीये ’ एम कुही धनपाणने वधारे सुंअवण्युमां नाज्यो. शोक्लनमुनिनी विक्रिताथी आकर्षी चेताना

૧૦

પ્રસ્તાવના.

માણુસ સાથે ધનપણે શોલનમુનિને ઉપાશ્રે મોકદ્યા, ધારા-  
વાસિઓમાં હંબુ કોઈપણ જાણી શક્યું ન હતું કે આ અને  
એક જ માતાના પુત્ર સગા લાઇ છે.

ધારાની સ્થિતિ સુધારવા શોલનમુનિના મનમાં અનેક સંકલ્પ  
વિકલ્પો થવા લાગ્યા. તેઓ ભાહોશ અને  
ધનપણને પ્રતિ- ચુક્તિબાજ-હતા. તેમણે પોતાના સાધુઓને  
ઓધ અને એ ધનપણને લાં ગોચરી લેવા મોકદ્યા. પ્રશાંત  
લાઇઓની લેટ. આકૃતિવાળા એ જૈન સુનિઓએ જૈન ધર્મના  
કંદુર હુસ્ખમન ધનપણના વેર જઈ ધર્મલાલનો  
પવિત્ર નાદ સંલગ્નિયો. ધનપણ તે વખતે સ્નાન કરતો હતો.  
તેની સ્વીએ સાધુને કંદું કે, અહીં આવાનું નહિ ભળે, ચાલ્યા  
જવ. ધનપણે પોતાની સ્વીને કંદું કે:—‘ અતિથિને નિરાશ કરવો  
તે માટો અધર્મ છે, માટે કંઈને કંઈ તો આપ. તે સ્વી ત્રણ દિવસનું  
દહી લાવી સુનિને આપવા લાગ્યો. સુનિએ પ્રશ્ન કર્યે કે:—‘ખેન,  
આ કેટલા દિવસનું છે ? ઉત્તરમાં તે ચિડાઈને બાલી કે આમાં  
જીવદાન ( પોરા ) પડી ગયાં છે શું ? કેવું હોય તો કોણ નહિ તો  
રસ્તો પકડો. સુનિ બાલ્યા કે:—ખેન તમે નકામો કોધ શા માટે  
કરો છો ? અમારો આચાર છે માટે પુણીએ છીએ. હું રહી  
જીવદાની વાત. તેના ઉત્તરમાં કહેવાનું કે:—એ દિવસ ઉપરાંત  
દહીમાં ખદાશ વધેતી જાય છે, તેથી તેમાં તે રંગના  
જીવો ઉત્પન્ન થાય છે એમ જૈન શાસ્કો કહે છે. તેની સાક્ષાત્  
પ્રતીતિ કરવી હોય તો અલતો લાવી દહીમાં નાખો. ’ ધનપણ  
ત્યાં આવી આ બધી વાત રસપૂર્વક સંલગ્નતો હતો. તેણે કૌતુક  
નેવાની ખાતર અથવા તત્ત્વ નિક્ષેપ કરવાની ખાતર અલતો  
મંગાવી દહીમાં નાખ્યો. થાડી વારમાં જ તેમાં કેટલાક તેજ  
વર્ણના-દહીના રંગના જંતુઓ ઉપર ચાલતા દેખાયા. ધનપણનું  
હૃદય આ દર્શય નોઈ પીંગળયું. બહુ આક્ર્ષ્ય થતાં તેના હૃદયે  
પલટો ખાય્યો. જૈન ધર્મની અદ્ધાનું તેનામાં થીજ રોપાયું,  
નાણે શાખાર્થમાં પરાસ્ત થયો હોય; તેમ ના થર્ઝને સુનિને

ધનપાળને પ્રતિસ્થાધ અને એ ભાઇની બેઠ.

૧૧

કહેવા લાગ્યો કે, આપ કેણું છો ? તોના શિષ્ય છો ? કયાં ઉત્તર્યા છો ? મુનિએ ચોખ્ય ઉત્તરો આપ્યા. પછી મુનિઓની સાથે જ ધનપાળ ઉપાશ્રય ભણ્ણી ચાલ્યો.

શોલન મુનિએ પોતાની ચુક્કિતથી જે સુંદર પરિણામ ધાર્યું હતું તે જ આવયું. તે પરિણામનો સાક્ષાતકાર કરવાની તેચો વાટ જોઈ રહ્યા હતા. ધનપાળને હૃદ્યી આવતો જોઈ પોતાના મણાટા લાઈ સમજી, અથવા તેને બધુ આકૃષ્ણવા તેચો (શોલન-મુનિ) થોડા સામે આવ્યા. ધનપાળને મધુર વચ્ચનથી શોલનમુનિએ ઓલાવ્યો, અને માનપૂર્વક સમાન આસને ઘેસાડ્યો. જ્યારે ધનપાળને ખરદર પડી કે આતો ‘મારો નાનો ભાઇ શોલન છે’ ત્યારે તેનું હુદ્ધય ગ્રેમ અને લનજલથી વિચિત્ર પ્રકારનું થન્યું, તેમાં શ્રદ્ધા અને વાતસદ્યનાં પૂર ઉછળવા લાગ્યાં. જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર તેનું માન વંદ્યું. ધનપાળે શોલનમુનિને કહ્યું કે:—‘તમે જૈન દીક્ષા લઈ આપણા કુળને ખરેખર અજવાણ્યું છે. તમને ધન્ય છે, તમે મહાત્મા છો, શાસ્ત્રના પારંગત છો, માટે મને સાચો ધર્મ બતાવો.’ શોલનમુનિને જોઈતું હતું તેજ થયું. તેચોએ પ્રશાન્ત, ગંભીર અને પ્રેમાળ વચ્ચનથી જૈન ધર્મના સર્વ-વ્યાપિ અકાશ્ય સિદ્ધાન્તો અને આચારોનો મહાકવિ ધનપાળને સુંદર પરિચય કરાવ્યો. ધનપાળ એક મહાન् પંડિત તો હતો જ એટલે જૈન સિદ્ધાન્તો સમજવામાં તેને સુશ્કેલી પડી નહિ, કેમકે જૈન ધર્મ સાચો બુદ્ધિશાળીઓને માટે જોઈલો જઈથી સુકર અને આદરણીય થઈ શકે છે તેટલો અનલિઙ્ગો-અવંપણુદ્ધ્વાળાઓ માટે નહિ.

શોલનમુનિનો શોલન અને સાત્ત્વિક ઉપરોક્ત સાંલળી આનંદ-પૂર્વક અતિ ભાવુક શરૂદોથી ધનપાળે કહ્યું જ્યારે ધનપાળ કે:—‘આજે મેં સાચો ધર્મ જાળ્યો છે જૈનધર્મ સર્વી. માટે અત્યારથી જ હું તે જૈન ધર્મ

૧૨

પ્રસ્તાવના.

કારી પોતાનું સ્વીકારી તેતું શરણ લઉં છું. પહેલાં જીવન જૈનધર્મને જૈન ધર્મનો દેખ કરી આ પ્રદેશમાં બાર સોંપે છે. વરસ સુધી જૈન સાધુનો વિહાર બંધ મેં કરાવ્યો તે મોટો અપરાધ કર્યો છે.

અત્યારે હું તે મારી લયંકર ભૂતનો પદ્ધાતાપ કરું છું. આખાય માળવામાં પંકાચેતિ વિક્ષાન કવિ ધનપાળ ઉપર શોભનમુનિના ઉપદેશની ડેટકી સચોટ અસર થઈ હુશે તેતું અનુમાન, તેના શ્રદ્ધા, અક્ષિત અને નઅતાથી ભરેલા શાખાથી સહેલે કરી શકાય છે.

આ પછી તત્કાલ મહાકવિ ધનપાળો શોભન મુનિની સાથે મહાવીર પ્રલુના મંદિરમાં જઈ લાવપૂર્વક પ્રલુની સ્તુતિ કરી વિદ્યિપૂર્વક જૈન ધર્મ સ્વીકાર્યો. ધનપાળના જીવનમાં આજે મહાન પરિવર્તન થયું. એક વખતનો જૈનધર્મનો મહાન વિરોધી આશ્વાણું પંડિત આજે જૈનધર્મનું શરણ સ્વીકારી ચુસ્ત જૈન બને છે. હવેથી બોજરાજનો માનીતો પુરેહિત અને બાળના બીજા અવતાર સમેં ધનપાળ કવિ પોતાની વિક્ષતા અને યશ જૈનધર્મને આપવા નિર્ણય કરે છે. ધનપાળના આવા મહાન પરિવર્તનનો યશ: અને પુણ્ય આપણા ચરિત્ર નાયક શોભનમુનિને જ છે. શોભનમુનિના જીવનમાં આ એક મહાન કાર્ય થયું. ધણા વખતની તેમની લાવના સર્કણ થતાં તેમના આત્મામાં આનંદ અને સંતોષ થયો. તેઓ પોતાનું સર્કણ જીવન વિશેષ સર્કણ માનવા લાગ્યા. પહેલાંના સાધુઓમાં શાસન સેવા કે પ્રભાવના કરવાની ડેવી લાવના અને શક્તિ હતી તે આ બનાવથી પાડકો જાણી શકશો. જૈન સંધમાં આ બનાવથી ચોમેર આનંદ ફેલાયો. દૃશાપરદેશમાં વીજળીના વેગે આ સમાચારો ફરી વણ્યા. હિંદુભરમાં શ્રીશોભનમુનિનું નામ વધારે મશહૂર અને, પ્રલાનિક બન્યું.

धनपाणनो दूँक परिचय.

१३

**सिद्धसारस्वतकवि** धनपाणनुं लुवन द्विसे द्विसे बधारे  
धार्मिक थतुं गयुं. ते श्रद्धाथी शुद्ध श्रावक-  
धनपाणनो दूँक धर्मने पाणवा लायें. तेषु राजा लोजने  
परिचय, समन्वी मालवामां जैन साधुनो विहार  
छूटो करायें. कव्यना शक्ति अने शण्डार्थनी.

प्रौढतामां कादं अरीने पथु टक्कर मारे तेवी नव रसथी पूर्णी  
'तिलकमंजरी' नामनी जैन आध्यायिका, ( कथा ) अनावी  
तेषु जैन साहित्य अने पेताना लुवनने यशस्वी कर्यां. ते  
उपरांत सत्यपुरीय महावीरोत्साह, वीरसत्तव, पाठ्यव-  
ष्टीनामभाणा, ऋषभपंचाशिका अने आवयविही विग्रे  
अथो पथु धनपाण कविये अनाव्या के जे संस्कृत प्राकृतना साहि-  
त्यमां आजे पथु उंचुं स्थान लोगवे छे. तेना समयमां धनपाण,  
आणवामां एक महाकवि अने प्रबंड पंडित तरीके भानतो होतो.  
कैवल्यविधर्म विग्रे पंडितोने तेषु परास्त कर्या होता.

मुंजराज तेने पुत्र तरीके भानतो. अने लोजराज तो  
तेनो आस भित्र अने भहेरभान होतो. सरस्वतीतुं टाईटल  
तेने मुंजराज तरक्थी भज्युं हुतुं. ( ज्ञाना ति. भ. ५३ )  
सर्वतंत्रस्वतंत्र सर्वशास्त्रपारंगत श्रीहेमचंद्राचार्य जेवाये पथु  
अहुमानपूर्वक; धनपाणनी अनावेदी स्तुतिथी श्रीजिन-  
भादिरमां जिनेश्वरनी स्तवना<sup>१</sup> करी होती. 'हैमडेष' अने  
'हैमकाव्यानुशासन' अने 'हैमधनोऽनुशासन' नी वृत्तिमां

१ कुमारपाण प्रथंधमां हेमाचार्ये धनपाणनी अनावेद रतुति ओल्यानो  
उल्खेभ छे.

" xxx व्युत्तिर्धनपालत. " | xxx हैमडेषनी स्वेषपश्च दीका  
उ हैमकाव्यानुशासनना " अर्थमेदभिजानां भज्जभज्जाभ्यां युगपदुक्तिः  
श्लेषः " सूतनी स्वेषपश्चवृत्ति ( अध्याय ५, पेज २३१ निर्णय सागरीया  
वृत्ति ) आं तिलकमंजरीनी लूभिकाना " प्राज्यप्रभावः प्रभवो० "  
पद्मने उदाहरण तरीके टांक्युं छे. तथा हैमछन्दोनुशासनना पांचमा  
अध्यायना सोलमा " प्राचदाश्चिः... " ( ५-१६ ) सूतनी स्वेषपश्चवृत्तिमां

ધનપાળ અને તેની કલિતાનો ઉદ્દેખ મળી આવે છે. આ ઉપરથી સમજાય છે કે, ધનપાળ દશ સમ્બક્તવી, આદર્શ કવિ તથા સમર્થ વિક્રાન્ત હતો. ‘મવિયસત્તકહા’ નો કર્તા ધનપાળ; આ ધનપાળથી જુદો છે. અન્યાન્ય અણીમાં ધનપાળનું લુધન લાંબું અને ધણું રસિક છે. પણ આ સ્થળે અપ્રસ્તુત હોવાથી મને લખવાની જરૂર જણ્ણાતી નથી. પાઠકો અહીં તો આટલાથી જ સંતોષ માની લેશે એવી આશા રાખું છું. અસ્તુ.

હવે આપણે કૃતી પ્રસ્તુત વાત ઉપર આવીશું. શોલન-  
સુનિના મહાન् પ્રયત્નથી આપા ભાગવામાં  
ભાગવામાં જૈન કૈત સાધુઓના સમૂહો વિચરવા લાગ્યા:  
સાધુઓ. ભાગવાના જૈનોમાં નહું લુધન આવ્યું. ડેર  
ડેર ધાર્મિક ઉત્સવો થવા લાગ્યા. સંઘની  
વિનંતીથી શોલનસુનિના શુરૂ ધારાનગરીમાં પદ્ધાર્યા. શિષ્યના

( શ્રી આનંદસાગરજી સંપાદિતા વૃત્તિ પૃષ્ઠ ૩૬ માં ) તિલકમંજરી ( પૃષ્ઠ ૧૭૭ ) તુ “શુદ્ધકશિકરિણ કલપશોયીવ.....” પદ મળી આવે છે.

તિલકમંજરી ઉપર શાંતિસરિણે વિ. ની ૧૧ મી સદીમાં રિપથુ  
રચ્યું. પાણુના પદિવાલ ધનપાલે વિ. સં. ૧૨૬૦ મા. તિ. મા. નો સાર  
પદમાં ઉતાર્યો. લક્ષ્મીધર પદિતે વિ. સં. ૧૨૮૧ મા. એક ભીજે સાર આરસોં  
ક્ષેટ્રથા અતુષ્ણુપ્ર શ્વોડામાં બનાવ્યો. અઠાર્મી સદીમાં પડ્ગસાગરગળણે  
તિ. મા. ઉપર વૃત્તિ અને વાસમી સદીમાં પં. લાવણ્યવિજયજીએ ગીર્ણ  
અનાવી છે. જુઓ જિન. વિ. નો ‘તિલકમંજરી’ લેખ.

મહાકવિ ધનપાળ માટે મેરેતુંગાચાર્ય કહે છે: —

“ વચન ધનપાલસ્ય ચન્દ્રન મલયસ્ય ચ ।  
સરસ વૃદ્ધિ વિન્યસ્ય કોડમૂચામ ન નિર્ણત: ॥ ૧ ॥ ”

—પ્રથ્યંધચિંતામણિ ૪૨.

૧ પ્રાચીન ‘ધારા’ અને તાંના સ્થાનો વિષે માહિતી માટે જુઓ  
છસ્તીસન ૧૯૩૩ના જુનના ‘શારદા’ ના અંકમાં છપાયેલ “લોઽજરાજની  
ધારા નગરી” નામનો ઝડપો લખેલો લેખ.

शोक्षन मुनिनुं व्यक्तित्व.

१५

प्रयासनी थयेदी सहजता अने सर्वत्र द्वैतायती शिष्यनी कीर्तिज्ञे  
कोई गुणना आनंदने पार रहो नहि. धनपाणे पैताना भर्य  
धारामां ऋषलहेवनुं जैनमंदिर धंधारी तेनी प्रतिष्ठा शोक्षन-  
मुनि अने तेमना गुरु पासे करावी. भाणवामां भीजां पशु अनेक  
धार्मिक कर्यां करी शोक्षनमुनिए गुरु साथे गुजरात तरह विहार कर्यो.

**संस्कारी कुटुंभमां जन्म्या होवाथी अने योग्य गुरुना समा-**  
**गमथी शोक्षनमुनिमां उच्चा प्रकारनुं व्यक्ति-**  
**शोक्षनमुनिनुं त्व अगरथुं हतुं. तेमना व्यक्तित्व माटे**  
**व्यक्तित्व.. धनपाण कवि ‘चतुर्विंशतिका’नी दीक्षामां**

लगे छे. के:—‘शरीरथी इपाणो, गुणुथी  
उज्ज्वल, सुंदर नेत्रोवाणो शोक्षन शोक्षन नामनो. सर्वहेवने पुत्र  
हुतो. जे कातन्त्र व्याकुरणुना ग्रुठ तत्त्वोनो जाणुकार हुतो,  
जैन ऐङ्ग तत्त्वोमां निखुत्त पंडित हुतो. अने साहित्य शास्त्रनो  
अठंग विद्वान् होइ, कवियोने माटे उदाहरणुभूत हुतो.<sup>१</sup> कुमारा-  
वस्थामां ज शोक्षने कामने परास्त कर्यो अने सर्व पाप व्यापारनो  
त्याग कर्यो हुतो. अहिंसा धर्मने सारी ऐडे पालन कर्यो.’

**शोक्षनमुनिनी भुद्धि तीक्ष्णु हुती. लावना उदात हुती. लुब्जनु**  
**लृथ अने रसीक हतुं. काव्य साहित्यमां तो**  
**शोक्षनमुनिनी तेओ धण्डा ज आरपार उतरी गया हुता.**  
**कृति, तेना इत स्वदृपमां तेओयो ‘मव्याम्भोजविवोध-**

**नैकतरणे !’ थी शरु थती ६६ श्लोकनी न्हानी**  
**पशु विविध जलना अलंकारीथी पूर्ण अमरकार वाणी एक दृति**  
**जनावी. आमां प्रत्येक तीर्थंकर, चावीसे तीर्थंकर, जैनागम अने**  
**सोण विद्याहेवीयो विगेरेनुं काव्यनी पद्धतिथी वर्णन छे. आ**  
**दृतिनी अंदर शब्दादांकार अने तेमांय भास करीने**  
**‘यमकु’ अने ‘अनुग्रास’ नी अनेरी छया ज्ञेवामां**

<sup>१</sup> “कातन्त्रतन्त्रोदिततत्त्ववेदी यो बुद्धवौद्धाऽहृततत्त्वतत्त्वः ।

साहित्यविद्यार्णवपारदर्शी निर्दर्शनं काव्यकृतां वभूत ॥ ४ ॥

शोक्षन रुतिनी धनपाणीय दीक्षाना १ थी ७ श्लोक सुनी उपयोगी छे.

આવે છે. કોઈ ડેકાણુ મધ્યાન્ત યમક, કોઈ સ્થળે આઈદમધ્યાન્ત યમક ( મધ્યાન્ત યમકની સાથે ), કોઈ જગ્યાએ આદ્યાન્ત યમક, કોઈ પદમાં સંચુતાવૃત્તિ યમક અને કોઈ સ્થળે અસંચુતાવૃત્તિ યમક અલંકારો ગોડળ્યા છે.?

આ કૃતિમાં નહાના મોટા અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ છેંદો છે; કે જે વિદ્જાનોને રસ અને આનંદ ઉત્પન્ન કરે છે. વિવિધ અલંકારો અને છેંદોઓં પોતાના લાલો ગોઠવવા તે કેટલી મુશ્કેલની વાત છે તે કવિતા અનાવનાર જ સમજી શકે તેમ છે. આ અંથ અનાવતી વખતે શોભનમુનિનું ચિત્ત કેવું એકાથ અન્યું હતું તેનું એક ઉદાહરણું પ્રભાવક ચરિત્રમાં મળે છે. જ્યારે શોભનમુનિ પ્રસ્તુત ‘ જિન સ્તુતિ ચતુર્વિશતિકા ’ અનાવતા હતા તે અરસામાં તેઓ ગૌચરી ( લિક્ષા ) લેવા ગયા. આલતાં આલતાં પણ પ્રસ્તુત કૃતિ અનાવવાની એકાથતામાં તેમનું ચિત્ત પરૈવાયેલું હતું, તેથી જ્યાદ નહિં રહેવાથી તેઓ એક જ શ્રાવકના ધરે ત્રણવાર ફરી ફરી ગૌચરી ગયા. જ્યારે શ્રાવિકાએ શોભનમુનિને પૂછ્યું કે, આમ ફરી ફરી ગૌચરી આવવાનું શું કારણ ? ઉત્તરમાં શોભનમુનિએ કહ્યું કે:- ‘ અત્યારે કવિતા અનાવવામાં જ મારું મન પરૈવાયલું છે. તેથી મને ખખર ન રહી કે હું કેને ત્યાં જડ છું અને શું કરું છું ? ’ પૂછનાર બાઈએ શોભનમુનિના ગુરુની આગળ પણ આ વાત કહી. ગુરુ આ વાતથી ધણ્ણા જ રાજુ થયા અને શિષ્યની જ્ઞાનરસિકતાથી સંતોષ પામી તેમણે શોભન મુનિનાં વખાણુ કર્યા.૨ શોભનમુનિને કવિતા અનાવવાનો કેવો રસ હતો તે આ એક જ પ્રસંગથી વાચકો જાણી શકશે. ખુશીની વાત છે કે પ્રસ્તુત કૃતિની સુંદરતાથી આકર્ષાઈ ધણ્ણા લેવકો બાહુદ્વયતાથી આ જ સ્તુતિ-‘ થોય ’ પ્રતિકમણુદિક્કિયાએમાં ઓદે છે.

૧ આ બધા યમકોનાં લક્ષ્યો અને ઉદાહરણો વાગ્યાસાલાં કાર, સરસ્વતી કંઠાલરણ વિગેરે અન્યોમાં જુઓ.

૨ જુઓ મહેન્દ્રમુરિ ચરિત. ( પ્રભાવક ચરિત્રમાં ).

શોભનમુનિનું અવસાન.

૧૭

હુનિયામાં વિક્રાનો અને સજજનો કોઈ કોઈ વાર જલ્દીથી જગતને છોડી ચાલ્યા જય છે. શોભનમુનિ માટે પણ તેમજ થયું ! તેમને તાવનો લયંકર અવસાન. જીવલેણ રોગ લાગુ પહ્યો, તેના પરિણામે થુવાવસ્થામાં તરત જ તેઓ મર્યા ( મર્યાદ ) દોકને છોડી અમર્યા સૌધર્મહેવદોકના અતિથિ થયા—સ્વર્ગવાસી થયા. હસ્તિયે તેમનું આ મરણ શા કારણુથી, કૃતે સ્થળે અને કરે દ્વિસે થયું ? તેનું ચોક્કસ સાધન અત્યારે આપણી પાસે નથી, શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્ર૦ ચિંની આવૃત્તિના ‘ લોજલીમ પ્રભાંધ ’ માં પાઠ છે કે:—‘ શોભનમુનિ સ્તુતિ કરવાના ધ્યાનની એકાશતાથી એક બાધને ત્યાં ત્રણવાર ( ગૌચરી માટે ) જવાથી તે બાઈની નજર લાગી અને તેથી શોભનમુનિ કાઢ કરી ગયા—સ્વર્ગવાસી થયા. ૧ મને લાગે છે કે કે કે શ્રાવિકને ત્યાં ત્રણવાર ગૌચરી જવાનું પ્રલાનક ચરિત્રના જ મતથી હું ઉપર લખી ગયો છું તેજ બાઈની કદાચ શ્રી શોભનમુનિને નજર લાગી હુશે. આવા કારણુથી સાધુનું મૃત્યુ થાય તેવા હાખલાચ્છે. ખંડુજ વિરલ બને છે. એ ઐતિહાસિક અથ્યાના પાઠો છે એટલે આ વાતને આપણે બુઝી કહેવાનું સાહસ તો નજ કરી શકીએ. મને લાગે છે કે ઉપર્યુક્ત કારણુથી તેઓ ગુજરાતમાં ( પાટણુમાં ? ) લુગલ્લા ક્રીશથી ચાળીશ વર્ષની ઉમરમાં અકાળી સ્વર્ગવાસી થયા હશે ?

સાહિત્ય દૃષ્ટિ મહાન् શક્તિ ધરાવનાર, અનેક અથ્યા લખવાની અને શાસનની સેવા કરવાની ઉદાત્ત ભાવનાવાળા આ તરણમુનિ જે વધુ જીવ્યા હોત તો કાવ્ય અને અલંકારના અનેક મૌલિક અથ્યાનો જૈન સમાજને વારસો આપી

૧ [ ઇતશ્ચ શોમન: સ્તુતિકરણધ્યાનાદ્ય એકસ્યા ગૃહે ત્રિગ્રમનાત્ર તસ્યા હષ્ટિરોગાદ્ય મૃત: । પ્રાન્તે નિજ બ્રાહુ: પાર્શ્વાત્ સુતીનાં બૃત્તિ કારથિતવા અનશનાત્ સૌધર્મ ગત: । પ્રબન્ધचિન્તામળિપૃ. ૪૨.

शक्या हेत पणु कमनसीभे तेम न अन्युं ! इक्ता तेमनी प्रस्तुत  
 ‘जिन स्तुति चतुर्विंशतिका’ नामनी एकज कृति आजना  
 जैन समाजने वारसामां भणी छे. जे के तेमनी आ एक कृति पणु  
 तेमना उङ्गवल यशने करनारी छे अमां तो डेहि जातनो शक नथी.

### ऐतिहासिक आदेशना.

पछेकां हुं कणी गयो छुं तेम श्री शोभन भुनिना गाम,  
 शुरु, विगेरेनी बाणतोमां अनेक अंथकारोनां भत लेहो छे,  
 तेमां मुण्य आ छे—

### भतलेद्दनुं कोष्ठक.

अंथनुं नाम.	अंथकार.	शोभननुं गाम.	शोभनना पिता.	शोभनना शुरु.
तिलकमंजरी	कवि धनपाल	धारा	सर्वदेव	
स्तुति चतुर्विंशतिका- गीका	”	”	”	
प्रभावक चरित्र	प्रभावंद्रसूरि	”	”	महेन्द्रसूरि
उपदेशप्रापाद	विजयवक्षभीसूरि	”	लक्ष्मीधर	
उपदेशकृपवल्ली	”	”		
सम्यक्तवसमतिका	संघितिलकसूरि	उज्जैन	सोमचंद्र	जिनेश्वरसूरि
आत्मप्रभोध	जिनवानसूरि	अवन्ती	सर्वधर	
प्रथं धन्यं तामर्थी	भेलुतुंगसूरि	विशाला	”	वर्धमानसूरि

उपर लघेला आठ अंथामां शोभनना गामविषे चार भत,  
 पिता विषे चार, अने शोभनना दीक्षा शुरु विषे त्रिणु भत थवा  
 पाम्या छे. आमां क्यो भत साचो ? ए प्रश्न धण्डो शुं चबणु लरेद्दो  
 छे. श्रीयुत प्रौ. हीरालाल. आर. कापडीयाए ‘शोभनस्तुति’  
 अने तेनी धण्डी दीक्षाएना संपादन उपरांत आ अंथनुं अति

ખિસ્તુત ગુજરાતી ભાષાન્તર કર્યું છે. તેઓએ લંખાણુથી પ્રસ્તાવના લખવા છતાં શોભન મુનિના જીવન વિષે ડોઈ પણુ જતનો નિર્ણય કર્યો નથી. હું નથી સમજ શકતો કે આટલા મોટા પુસ્તકમાં તેઓએ શોભનના વિષયમાં મહત્વનું કેમ નથી લખ્યું ? અસ્તુ. જમે તે કારણું હો.

મહારી પાસે અત્યારે એટલાં ખેડોળાં સાધનો નથી અને વધુ ઉંડાણું અને વિસ્તારથી હું લખવા એઠો પણ નથી, છતાં આ સ્થળે આ સંબંધે હું થાડી વિચારણા કરવા યત્ન કરીશ.

ઉપરના ડોઇકથી જણાય છે કે બુદ્ધ બુદ્ધ અંથોમાં શોભન અને ધનપાલની નગરીનાં ધારા, ઉજજયિની, આમની પરીક્ષા, અવન્તી અને વિશાળા એમ ચાર નામો લખ્યાં છે.

આચાર્ય શ્રીહેમચંદ્રના અભિધાનચિંતામણિ ડોપમાં અવન્તી, વિશાળા અને પુઃપ્રકરણિની આ ત્રણે ઉજજયિની ( ઉજજૈન ) ના પર્યાર્ય<sup>૧</sup> શરૂદ્વા લખ્યા છે. આનાથી આટલો ખુલાસો તો થઈ જાય કે, અચન્તી અને વિશાળા આ એ ઉજજૈનનાં અપર ( પર્યાર્ય ) નામો છે. હવે શોભનની નગરી વિષે ધારા ( ધાર ) અને ઉજજૈન વિષયક આ એ મત રહ્યા. ધારાના મતમાં પાંચ અંથો છે જ્યારે ઉજજૈનના મતમાં ત્રણુ અંથો છે. આ એ મતલેદ ધરાવનાર અંથોમાં એક બાળુ પ્રભાવકુચરિત્ર, તિલકમંજરી, શોભનસ્તુતાતીકા જેવા અંથો છે અને બીજું બાળુ પ્રભાંધ ચિંતામણિ છે. પ્રભાંધ ચિંતામણિના ઉદ્દેખને પ્રમાણુ વગર વખોડી પણ કઢાય નહિ તેથી મારો મત તો એવો

૧ “ ઉજજયિની સ્વાદ વિશાળાવન્તી પુષ્પકરણિની ॥

અભિધાન ચિન્તામણિ: ” ૪-૪૨

૨ હુસ્ત્રધક્ષારાનત અવન્તિ શર્ણ માત્રવાદેશ વાચક છે, જુઓ હૈમકોપમાં ( ૪-૨૨ ).

૨૦

પ્રસ્તાવના.

છ કે. ‘પરમાર વંશીય સુંજ’ ઉજાજૈનમાં રાજધાની રાખી માળવાનું રાજ્ય કરતો હતો, તેના ઉત્તરાધિકારી લોજે પણ ત્યાં જ પ્રારંભમાં રાજધાની રાખી હતી, પણ ગુજરાત તરફના રાજાઓના આડુંભોગ તે વખતે અવારનવાર થયાં કરતાં,<sup>૧</sup> તેથી કદાચ ગુજરાતથી દાહોદ, ગોધરા રાજગઢ, ધારાના રસ્તે થઈ ગુજરાતના રાજ માળવા ઉપર ચઠાઈ કરી આવે? એવી આશાંકથી લોજરાજાએ ધારમાં વધુ સ્થિરતા કરી બધાં દૃષ્ટર ત્યાં આણ્યાં હોય? એટલે ધારાનગરીને રાજધાની જેવી કરી ત્યાં વધુ વખત લોજ રહેવા લાગ્યો. તે પછીના ઉલ્લેખોમાં લોજ રધારાધીશ, ધારાપતિ તરીકે એળખાય છે.

જ્યારે રાજ લોજ ઉજાજનથી ધારા રહેવા ગયો તો તેના આશ્રિત પંડિતોએ પણ ત્યાંજ (ધારામાં) રહેવું જોઈએ એટલે ધનપાલ, શોલનના પિતા પહેલાં ઉજાજૈન રહેતા હશે? અને પાછળથી રાજ લોજની સાથે પોતાના પુત્રો ધનપાલ અને શોલનને લઈને ધારામાં રહેવા ગયા હશે<sup>૨</sup> એ હિસાએ ઉજાજૈન અને ધારા બનને નગરીમાં ધનપાળ તથા શોલન રહ્યા હતા એમ માનવામાં કરોડ બાધ નથી. મારા આ મતથી પ્રલાલક ચરિત્ર અને પ્રભાંધ ચિંતામણિ વિગેરે અંશોના ઉલ્લેખોમાં સમન્વય થઈ

૧ નુઝો પ્રભાંધચિંતામણિનો લોજલીમ પ્રભાંધ.

૨ નુઝો સરસ્વતી કંદાલરણુની પ્રરતાવના તથા તિલકમંજરીની પ્રરતાવના. બોજનો રાજ્યકાલ વિકિમ સં. ૧૦૬૭ થી ૧૧૧૧ છે.

૩ લોજની રાજધાની ધારા (ધાર) માં થઈ હતી તે વિષે શાંતિસૂરિ ચરિત્ર, મહેન્દ્રસૂરિ ચરિત્ર, સૂરાચાર્ય ચરિત્ર, અભયદેવસૂરિ ચરિત્ર, બિહલણુ કવિનું વિકમાંક દેવચરિત્ર, લોજલીમ પ્રભાંધ, પાદ્મઅલઘીનામમાળા, સરસ્વતી કંદાલરણુ, પ્રમેષકમલમાર્તઙ્ણની પ્રરતાવના, રાજવંશાવલી અને છિંદુસ્તાની તૈમાસિક વિગેરે અંશો જોવા. વિસ્તારની ભૂતિથી હું અહીં વધુ વિચાર કરેતો નથી, તથા તે તે અંશોના પાડો આપતો નથી.

शोभनना पिता.

२१

શકે છે. પ્રભાંધ ચિંતામણિમાં પૂર્વકાલની દષ્ટિએ વિશાળા (ઉજાજૈની)નો<sup>2</sup> અને પ્રભાવક ચરિત્રાદિમાં ઉત્તરકાળની દષ્ટિએ ધારાનો ઉલ્લેખ છે એમ જણ્યાય છે.

શોભનને માટે ઉલ્લેખ કરનારા અથે છે તેમાં જ્ઞાનામાં જ્ઞાના અથે શોભનના સગાલાઈ કવિ ધનપાલની શોભનના પિતા. તિવાકમંજરી, શોભનસ્તુતિચતુર્વિંશિકા રીકા, પ્રભાંધકૃત પ્રભાવક ચિંત્ર અને પ્રભાંધ ચિંતામણી જેવા ઐતિહાસિક અથે છે. તે બધામાં શોભનના પિતાનું નામ ‘સર્વહેવ’ લખયું છે, સર્વહેવ નામ સિવાય ભીજા નામવાળા અથે ધણા અવીચિન અને ઐતિહાસિક દષ્ટિએ મહુત્વના નહિ હોવાથી તેમાં લખેલાં ભીજાં નામો વિદ્યસનીય નથી. વળી ઉપરે પ્રાસાદમાં શોભનના પિતાનું નામ લક્ષ્મીધર લખ્યું છે તો તે ભ્રાન્તિ મૂલક છે.

૧ શરૂઆતમાં પ્રભાંધ ચિંતામણિકારે ‘મુરાસમૃદ્ધિશાલાયાં વિશાળાયાં પુરિ’ કહી સર્વહેવની નિવાસ નગરી ઉજાજૈન ખતાવે છે પણ જ્યારે શોભનમુનિ વિદ્ધાન્દ થથ દૂરી ભાલવામાં પોતાના ભાઈને પ્રતિઓધવા આવ્યા છે ત્યારે તેઓ ધારાનગરીમાં આવ્યા છે એવો ઉલ્લેખ કરે છે. નેમઃ— “ અમ્બ્રસ્તસમસ્તવિદ્યસ્થાનેન ધનપાલેન શ્રીમોજપ્રસાદમસ્ત્રાસમસ્તપણિડત-પ્રષ્પત્રિષ્ઠેન નિજસહોદરાર્મભાવાદ દ્વારાદવ્દીં યાવત્ સ્વદેશે નિયિદ્રજૈનદર્શન-પ્રવેશેન તહેશોપાસકૈરત્યર્થમભ્રયર્થનયા ગુરુધ્વાહૂયમાનેષુ સકલસિર્દાન્તપારાવાર-પારવિશ્વા સ ‘શોભનનામા’ તપોધનો ગુરુનાપુચ્છથી તત્ત્વ પ્રયતો ધારાયાં પ્રવિશન્ પણિતધનપાલેન રાજપાટિકાયાં બ્રજતા તં સહોદરમિત્યચુપલક્ષ્ય શોપહાસં ગર્દભદન્ત ! ભદ્રન્ત ! નમસ્તે ઇતિ પ્રોક્તે”...પ્રભાંધચિંતામણી ( નિનવિજયળ સંપાદિત ) પૃ. ૩૬.

આનાથી ભડકી કલ્પના ભજભૂત થાય છે કે:—શોભન વિગેરે પહેલાં ‘ઉજાજૈનમાં રહેતા હતા અને પાછથી ધારામાં રહેવા આવ્યા. આમ માન-ચાથી બન્ને ભતોનો સમન્વય પણ થાય છે.

**शोभन मुनिना** शुरु तरीके ज्ञानां नामो डोषकमां हेखाय छे.  
**एक तो भग्नद्रसूरि,** बीज वर्धमानसूरि  
**शोभन मुनिना** अने बीज जिनेश्वरसूरि. धनपाल कविए  
**गुरु.** स्पृष्टरीते ए उद्घेष्ट क्यों नथी ते सर्वदेवने  
 निधि डेणे अताव्यो, तेनी श्रद्धा क्या  
 आचार्य उपर थह अने शोभने दीक्षा डेणी पासे लीधी. विगतवार  
 ज्ञानामां ज्ञानो उद्घेष्ट अत्यारे तो प्रभावकुर्याचित्रमां शोभनना  
 विषे भणे छे १तेमां लण्युं छे ते शोभन मुनिना शुरु भग्नद्रसूरि  
 हुता. आ आचार्य यासेथी ज शोभनना पिताए निधाननुं  
 स्थान जाण्युं, धर्म पास्यो अने आमने ज पोतानो शोभन  
 नामनो पुत्र हीक्षा आपवा सोंयो. आ वातने प्रभाषित करवा  
 सूचनाइपे साधन<sup>१</sup> तिळकमंजरी छे, ते जे शोभनना सगां  
 भाई कवि धनपाणे अनावी छे. तिळकमंजरीमां व्यास वालिमकाहि  
 कविएनी स्तुति डरी श्री भग्नद्रसूरिनी पण स्तुति डरी छे.  
 पोताना सभयमां शांतिसूरि, सूराचार्य, अक्षयहेवसूरि, वर्धमान-  
 सूरि विगेरे अनेक विद्वान् लैनाचार्येनी अस्ती होवा छतां तेमनी  
 स्तुति नहि करतां आ आचार्यनी ज स्तुति करवामां धनपालनो  
 तेमना उपर दृढ़ धर्मराज अने शोभनना शुरु तरीकेनो संख्यन्ध  
 होय ए कुटपना कंध घोटी न कुडेवाय. शोभनना शुरु आ  
 भग्नद्रसूरि डेना शिष्य हुता, डेनी परंपरामां थया ? क्या केटला  
 अथें लण्या ? ते विषे हुल सुधी कंधपणु ज्ञानायुं नथी. अक्षा-  
 वकु चरित्रमां भग्नद्रसूरिनो अण्डध छे तेनाथी तेच्यो चांद्र-  
 गच्छना विद्वान् आचार्य हुता अटलुं ज्ञानाय छे.<sup>३</sup>

१ नुओ प्रभावक चरित्रमां भग्नद्रसूरि चरित्र.

२ “ सूर्रिमहेन्द्र एवैको वैतुधारावितकमः ।

यस्यामत्योचितप्रौढि कविविस्मयकृद् वचः ॥ १५. तिळकमंजरी ३४.

३ तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्करः ।

श्रीमहेन्द्रप्रभुः पारदशा श्रुतपर्योनिधेः ॥ भग्नद्रसूरिचरित्र १२..

થીજે ઉલ્લેખ ‘પ્રભાધચિત્તામણિ’ માં છે, તેમાં શોભના ગુરુ શ્રી વર્ધમાનસૂરિ લખ્યા છે, અને ત્રીજે ઉલ્લેખ ‘સર્વકલ્પ સમતિ ટીકા’ નો છે. તેમાં શ્રી જિનેશ્વરસૂરિ જણાવ્યા છે.

એ વાત તો નક્કી છે કે:—શોભના સમયમાં શ્રી વર્ધમાનસૂરિ વિદ્યમાન હતા, તેઓ ઉધોતનસૂરિના ઉત્તરાધિકારી તરીકે લગ્નવાનું મહાવીરની ઉલ્લભ પાટે બેઠા હતા, અને તેમના જ શિષ્ય જિનેશ્વરસૂરિ ૪૦ મી પાટે થયા એમ જૂની પદ્માવતીએથી જણાય છે. પ્રભાધચિત્તામણિ વેવા થંથના ઉલ્લેખની આપણે સર્વથા અવગાણના તો ન જ કરી શકીએ તેથી એમ કદમ્પના થાય છે કે, શ્રી વર્ધમાનસૂરિ સાથે પણ સર્વદૈવનો પહેલાં સંબંધ જોડાયો હશે? સર્વદૈવ સાધુલક્ત હતા એટલે તે આચાર્યથી પણ કંઈક લાલ મેળાયો હશે? અને મહેન્દ્રસૂરિનો પાછલથી સંબંધ જોડાઈ વધ્યો હશે. અથવા વર્ધમાનસૂરિ પાસે શોભનસુનિએ થાડું ઘણું અદ્યયન કર્યું હશે તેથી વર્ધમાનસૂરિના ઉલ્લેખમાં કંઈક સત્યતા જણાય છે. જ્યારે વર્ધમાનસૂરિના ઉલ્લેખ શક્ય લાગે છે તો તેમના શિષ્ય જિનેશ્વરસૂરિના ઉલ્લેખ ગુરુના સંબંધથી પાછળના થંથમાં થવો સંભવિત છે. ઘણા થંથકારો આવી ભૂત સહેલે કરી બેસે છે એટલે ‘સર્વકલ્પ સમતિકા’ નો ઉલ્લેખ તેવો જ હશે? એ બધું વિચારતાં શોભના દીક્ષાગુરુ તો મહેન્દ્રસૂરિ જ હોવા જોઈએ એમ મહારી કદમ્પના છે. મતલભ કે તિલકમંજરીનો સંવાદ હોવાથી અને પ્રલાવક ચરિત્ર, પ્રભાધચિત્તામણિ વિશેરેથી વધુ પ્રામણિક તથા જૂનું હોવાથી શોભનસુનિના દીક્ષાગુરુ તરીકે મહેન્દ્રસૂરિને માનવા વધારે ચોગ્ય છે.

૧ ગુણો ‘ખરતરગચ્છપદ્મલિસંગ્રહ’ ૫૦ ૨૦ ( શ્રીજિનવિજયજ્ઞ-સંપાદિત ).

શોભનના દાદાનું નામ ‘દેવપિ’ હતું, કેચો મહોટા દાની અને પંડિત તથા જાતથી ખાલ્સાણું હતા. શોભનનું ગૃહસ્થ તેમના પુત્ર ‘સર્વદેવ’ થયા, તેચો વિક્રાન્કુદુંબ. કલાપિય અને મહાકવિ હતા. સર્વદેવ શોભનસુનિના પિતા થતા હતા. મહાકવિ ‘ધનપાત્ર’ શોભનને મહોટા બાઈ હતો. તેમની ‘સુંદરી’ નામના એક અહેન હતી કે કેને માટે કવિ ધનપાત્રો વિક્રમ સં ૧૦૨૬માં ‘ગાંધાલચ્છીનામાલા’ (કોશ) <sup>૨</sup> બનાવી છે એમ તે અંથની પ્રશસ્તિથી જણાય છે. તેનું કુદુંબ લાંખાકાળથી વિદ્યાપ્રેમી તથા યશસ્વી હતું.

શોભનના દાદા પહેલાં ‘સાંકાશ્ય’ નગરના હતા, આ નગર પૂર્વદેશમાં છે અસારે ફૂરુકાખાદ જિલ્લામાં ‘સાંકિસ’ નામના જામથી તે પ્રસિદ્ધ છે.<sup>૩</sup> સર્વદેવ વ્યવસાય આજુવિકા માટે માલવાની રાજધાની ઉજ્જ્વલિની (ઉજ્જ્વલૈન)માં આવી રહ્યા હતા. પાછુના સમયમાં જ્યારે લોજે ધારા (ધાર)માં સ્થિરતા ડરવા માંડી ત્યારે તે ધારમાં રહેવા આવ્યા.

શોભનસુનિની પ્રસ્તુત કૃતિ બહુ જુની છે. જૈન અને વैદિકામાં યમકાદિ શખદાદાંકારથી છલકાતી શોભનસ્તુતિ આઠલી જુની કૃતિઓ બહુ જ એધી મળે છે. ચતુર્વિંશતિકાની શોભન સ્તુતિની અસર તે પણીના ઘણ્ણા કવિ દીકાયો. વિક્રાને ઉપર થઈછે. મહાકવિ વાગ્બલટ, અમર-

૧ અલદ્ધદેવવિરિતિ પ્રસિદ્ધ યો દાનવર્ષિતવિભૂપિતોડપિ...।

તિલકમંજરી શ્રોદ્ધ ૫૧-૫૨.

૨ અત્યારમુદ્ધી ભગતા પ્રાણુતકેષામાં આ જૂતામાં જૂતો પ્રાણુતકેષ છે.

૩ જુયો ધનિદ્યન હિસ્ટેરિકલ કોયાટરલી ધર્મસન્ત ૧૯૨૮ પેજ ૧૪૨. ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની લધુત્તત્ત્વ’ માં એક ડેકાણે લખ્યું છે કે “સાઙ્કાશ્યકેષ્ય: પાટલિપુત્રકા આબ્દતરા:” (૭-૩-૬) નિજસંપાદિત આવૃત્તિના ૫૬૨ પેજમાં) આનાથી સ્પષ્ટ જણાય છે કે સાંકાશ્ય ને કે પણાથી ઉત્તરું પણ સમૃદ્ધ નગર હતું, તથા મર્યાદદેશમાં પ્રસિદ્ધ હતું.

શોભનસ્તુતિ ચતુર્વિંશતિકાની દીકાઓ.

૨૫

ચંદ્રસૂરિ, કીર્તિરાજોપાદ્યાય, મહામહોપાદ્યાય શ્રી યશોવિજયજી વિગેરેની ઐન્દ્રસ્તુતિ વિગેરે કૃતિઓ પ્રસ્તુત કૃતિના અનુકરણું અથવા પ્રેરણાનું ઇલ છે.

શોભનસ્તુતિની અનેરી સુંદરતા અને ગંભીરતા હોવાથી અનેક આચાર્યો અને કવિઓએ શોખ કે પરોપકારાર્થ તેના ઉપર દીકાઓ બનાવી છે. જેમાંની નવ દીકા તો આજકાલ જાળીતી છે. એનાથી પ્રસ્તુત કૃતિની મહત્ત્વ ગંભીરતા અને પ્રસિદ્ધ સહેલે સમજી શકાય તેમ છે. તે દીકાકારેનાં નામો આ છે:—

ધનપાલ, જયવિજયજી, રાજમુનિ, સૈભાગ્યસાગરસૂરિ, કનકફુશાલગણિ, સિદ્ધિયંગગણિ, હેવચંડ, અજણસાગર અને એક બીજી અવચૂર્ણિકાર પૂર્વિચાર્ય (આમના નામનો પત્તો મળ્યો નથી).

વીસમી સહીમાં પણ ડેક્ટર હરમન યાકેથી વિગેરે વિક્રાનોએ અંગ્રેજ, હિન્દી, યુજરાતી વિગેરેમાં આનાં ભાષાન્તરો કર્યાં છે. પ્રે. હીરાલાલ રસિકપાસ કાપડિયાએ સ્તુતિચતુર્વિંશતિકાની અનેક દીકાઓનો સંચહ કરી તથા વિસ્તારથી ભાષાન્તર કરી હેવચંડ લાલભાઈ પુ. ઇંડ. સુદેતથી પ્રકાશિત કરેલ છે. જેની હું પ્રસ્તાવના લખી રહ્યો છું તે આ બંધમાં પણ તમે શોભન મુનિની પ્રસ્તુત સ્તુતિની એક સંસ્કૃત ‘સરદા’ નામની દીકા જેશો, કે જે ચાલતી આ વીસમી સહીમાં બનેલી છે. એના કર્તાં આચાર્યશ્રી અજિતસાગરસૂર્યજી છે. સહૃગત શ્રીમાન અજિતસાગરસૂર્યજી મહારાજ કાબ્ય સાહિત્યના અપૂર્વ રસિક અને પ્રેરી હતા. જો કે તેમની સાથે મારો પ્રત્યક્ષ પરિયથ નહોતો થયો પણ તેમનો કાવ્યનો અભ્યાસ સારો હતો એમ સંભળાય છે. તેઓ આ કૃતિની સુંદરતાથી આકર્ષણી ને તેના પર કાંઈક લખવું એવો ઉત્સાહ જાગતાં આ સ્તુતિ વિષે પોતાનો અનુભવ પ્રસ્તુત દીકામાં

૨૬

પ્રસ્તાવના.

તેમણે વ્યક્ત કર્યો. એથી ભરહૂમ આચાર્યશ્રી અનિતસાગરસ્યુરિજી મહારાજ સમાજમાં અનેક પ્રકારના આઠંખર, ધાંધલ અને ડલહો ઉત્પન્ન કરી સમાજને અધોગતિમાં લઈ જનાર નહિ; પણ જ્ઞાનધ્યાનમાં મસ્ત રહી ગુજરાતી અને સંસ્કૃતમાં અનેક કૃતિઓ જૈન સમાજને આપી ઉત્તરિના માર્ગ લઈ જનાર વિદ્ધાન આચાર્ય હતા એ કાંઈ ઓછી આનંદની વાત નથી. ખાસ કરી કાંયમાં તેમનો પ્રેમ ધણો જ હતો.

તેઓશ્રી અદ્યાત્મપ્રેમી, ભજન સાહિત્યના ચુનંદા લેખક શ્રીમાન બુદ્ધસાગરસ્યુરિજીના પ્રસિદ્ધ વક્તા અને સમાજહિત-ચિંતક શિષ્ય હતા એ પણ એમના મહત્વનું એક કારણ છે. આ બદ્ધે આચાર્યો જૈન સમાજમાં પ્રસિદ્ધ હતા; એટલે એવ્યાના લુધન વિષે અહીં વધુ લખવાની હું આવશકતા સમજતો નથી.

શ્રીમાન અનિતસાગરસ્યુરિના વિનીત, પ્રિય અને વિદ્ધાન શિષ્ય મુનિરાજશ્રી હેમેન્ડ્રસાગરજી મિલનસાર તરીકે જાણીતા છે. તેમનો જ્ઞાન વ્યવસાય, લક્ષ્ણિકાવ, પ્રેમ અને ભધુર સ્વભાવ હુરેમનને પણ મિત્ર બનાવે છે. કમનશીલે એમના ગુરુજી પ્રસ્તુત ટીકા મુદ્રિત થયેલી લેઠ ન શક્યા પણ ગુરુજીના ઉદેશની પૂર્તિ માટે શ્રી હેમેન્ડ્રસાગરજી આ ટીકા છયાવી પ્રસિદ્ધ કરે છે એ ખુશી થવા નેવું જરૂર છે. શ્રી હેમેન્ડ્રસાગરજી પોતાના ગુરુને પગલે ચાલી સંસ્કૃત અને ગુજરાતી કાંયમાં સારો રસ લે છે. એમના સહ્ભાવસર્થી આથળે આ પ્રસ્તાવનાની પંચિતા લખવા મને

૧ પ્રસ્તુત ટીકા પ્રહુલાહનપુર (પાલનપુર) માં ૧૯૭૫ શ્રાવણ શુદ્ધ સાતમે પૂર્ણ કરેલી છે. તેની પ્રશસ્તિમાં જુઓ ૩લોક ૧૦ મે.

ભવ્યશ્રાદ્ધકર્મવાજિતપથે પ્રહ્રાદને પત્તને,  
ચાતુર્માસ્યકૃતે સ્થિરિં કૃતવતા યેનોપકારક્ષમા ।  
અક્ષાડશ્વાડક્ષાશાક્ષસંમિતવરે (૧૯૭૫) સંવત્સરે શ્રાવણ,  
સપ્તમાં રવિવાસરે શુભતિથી પૂર્ણિકૃતા સ્વાતિતે ॥ ૧૦ ॥

શોભનરતું ચતુર્વિશત્તિકાની ટીકાઓ.

૨૭

તત્પર કર્યો છે. એ પ્રસંગથી મને શ્રી શોભનમુનિ વિષે જાણુવાનું તથા લખવાનું મહિયું છે. એ માટે પ્રેરણા કરનાર મુનિરજશ્રી હેમેન્ડ્રસાગરજીને હું ધન્યવાદ આપ્યા વગર રહી શકું નહિ.

શોભનરતું ભક્તિ અને કાવ્યની દિલિએ મહત્વની કૃતિ છે. ટીકાને કેમ અને તેમ સહેલી અનાવવા પ્રયત્ન કર્યો છે; અને તેમાંથી ખાસ આન્વય પદ્ધતિ સ્વીકારેલી છે, એ આની બીજી ટીકાઓથી વિશેપતા છે. સાથે સાથે મૂળાનું સરલ ગુજરાતી ભાષાન્તર છન્હે વિગેરે આપી ઉપયોગિતા વધારી છે. જનતા આ કૃતિના લાભ લઈ રતુંટકાર અને ટીકાકારના પ્રયત્નને સફળ અનાવે એવિનું ધ્રચ્છી વિરસું છું.

લેખક:-  
મુનિ હિમાંશુવિજય  
( અનેકાન્તી )





અચેતરમાં પેટલાદ પાસે આવેલું નાર ગામ નૈનોમાં જણ્ણિતું છે, કારણ કે આ ગામ લેઉવા પાડીનાર નૈનોઓ એ જેનથી પણ વધારે જોતાના સંતાનોને ચારિશ્ચ લેવા સમર્થ્ય છે. આ નાર ગામમાં સં. ૧૯૪૨ ના ચોપ શુદ્ધિ પંચમીના રોજ લેઉથા પાડીનાર પટેલ લલુભાઈને લાં આચાર્ય શ્રી અનિતસાગરસ્વરીધરણો જન્મ થયો હતો. તેમનું જન્મ નામ ‘અંધાલાલ’ ગાયવામાં આવ્યું હતું. તેમના પિતા લલુભાઈ પટેલ અને માતા સૌનાયાધ અને ભોગા ડિલનાં, ધર્મનિષ્ઠ, પ્રભુભક્ત, ઉત્તરચિત, સાધુપ્રેમી તથા માયાળુ હતાં. એ વડીલનો વારસો આસ્થાવસ્થાથી જ અંધાલાલમાં પણ આબાદ રીતે ઉત્તરી આવ્યો હતો. ઉપરાંત ભવિષ્યમાં થનારા ભાગ્યોદય અને પ્રભાવિકતાનાં કંટલાંક સુયોગો પણ આ અંધાલાલના શરીર પરનાં સામૃદ્ધ લક્ષણો તથા પ્રકૃતિ પરથી થતાં હતાં. તે વખતે પણ તેમનામાં કુરતી વચ્ચન-ચાતુર્ય અને વિશાળ ઝુદ્ધિ હતી. તેના ફળ તરીક તેઓ સુગમતાથી યુહરાતી સાત ચોપીઓનો અભ્યાસ કરી ગયા. તેઓ જોતાનામાં રહેલી વાક્યાંતરિનો ઉપયોગ કરવા માર્ગ શાધતા હતા તેવામાં તેમના માત-પિતા સ્વર્ગવાસ પામ્યાં અને તેથી તેમને સંસારની અસારના અને અસ્થિરતા સમગ્રાદ ગઈ. સં. ૧૯૪૬ માં સ્થાનકવાસી સાધુઓના પ્રસંગમાં આવતાં તેમણે જોતાનો વૈરાગ્ય આ રસ્તે વાળ્યો—સ્થાનકવાસી દીક્ષા અંગી-કાર કરી. આ પછી સ્થાનકવાસી સાધુ અમીત્રપિ તરીક તેમણે મહારાજી, ખાનકેશ, કર્ણાટક, ભાગવા, મધ્ય હિન્દ વર્ગો દેશોમાં વિલાર કર્યો, ભિન્ન ભિન્ન ધર્મના અંથોનો તથા ભાષાઓનો અભ્યાસ કર્યો અને અનેક સાધુ-સંત તથા મહાત્માઓની સાથે જ્ઞાનયર્થી કરી પૂર્તો અનુભવ મેળવ્યો. સ્થાન-



प्रसिद्धवक्ता श्रीमद् अजितसागरसूरि.

श्री महेश्वर प्रेस-भावनगर.

क्वासी पंथमां भूतिपूजन मानवामां आवतुं नदी ते वात तेमने पोतानां शानपूर्वक भजेला अनुभवथी अनुग्रहित भासी. ऐतिहासिक प्रभाण्याथी तेमने जणायुं के अत्रीश सज्जेनी जे शास्त्रमर्यादामां जोंधी रहेवानी पक्षति अमभूलक अने भूतिपूजने धरादापूर्वक उडाववाने जे उत्पन्न करेली छे. आ संभंधी थती शंकाओनानुं समाधान श्री अभीऋषिज्ञने स्थानकवाऽ पंथमां न ज थयुं. डेटलाङ्काए तेमनी शंकाओना प्रश्नोने उडाव्या तो डेटलाङ्काए मौन सेव्युं अथवा भिथ्या अद्वाशीलतामां जे ज्ञवन वीताववा जणायुं; पण् सत्यशोधकने आयी संतोष न ज थाय. तेओन्ये अध्यात्मतान-हिवाकर योग्निष्ठ आचार्य श्री बुद्धिसागरसूरीश्वरज्ञ भद्राराज साथे पत्रव्यवहार शह उर्यो अने तेमां पोतानी शंकाओ रङ्गु करी. धण्डाखरा खुबासाओ. थर्च गया एटले तेओ. श्रीभद्र बुद्धिसागरज्ञने ज्ञै मल्या अने तेमणे तेमनी साथे आचार, लक्ष्यालक्ष्य, सामाचारी, ज्ञवहया, प्राकृत-संस्कृत भाषा, सूत्रव्यना तथा भूतिनी प्राचीनता अने आवस्यकता वगेरे वगेरे संभंधी पुष्टण उहायेक, चर्चा अने भिमांसा करी. छवेरेसंपूर्ण भावी थष्ट के स्थानकवासी भत खड ज अर्वाचीन छे. स्थानकवासीओ पोते पण् आउकरी रीते के छुपी रीते भूतिना सहजसह रक्षणा इपमां भाननारा छतां तेओ. अज्ञान भतुण्योने भिथ्या अभगतणमां नाभी तेओना अने पोताना साचा आतिमिक हितनो नाश करे छ. आम अभीऋषिज्ञ असंपूर्ण परीक्षा करी सः १६६५ नी सालमां स्था. भतनो त्याग करी श्रीभानु ज्ञैनाचार्य बुद्धिसागरज्ञ भद्राराज पासे श्वेतांखर संप्रदायमां संकेंगीपण्यानी दीक्षा अंगीकार करी. हवे तेओ. अही अजितसागरज्ञना नामथी ओणाखावा लाभ्या. ज्ञे के तेओन्ये आम पोताने भिथ्या लागवाथी स्था. भतनो त्याग कर्यो, तो पण् तेओ. परमतसहिष्यु हेवाथी जीज भतोनी साथे ज्ञेभ समझाव राखता हता तेम आ भत साथे पण् सदा समझाव राख्यो. छे. अभणे धर्मी वर्षत स्था. साधुओनी साथे रही अहेर भाषण्याहि प्रवृत्तिओ. करेली हेवाथी आपण्युने साभीत आय छे के तेओने भाज्ये जे डाइना तरक्कि तिरस्कार के देष्प पोताना शांत ज्ञवनमां जाऊ. सौनी साथे ग्रेमसावथी वर्तन राख्युं ने संसप्ते आवतुं ए तेमना ज्ञवनतुं धेय हरुं.

श्री. अजितसागरज्ञ भद्राराजे हवे ज्ञानहिंशामां आगण वधवा मांडयुं. संस्कृत प्राकृत भाषा पर सारो आशु भेण्यो. अने ते द्वारा आगभोने झरी अवलोक्यां. टीकाओ. निर्युक्तिओ. अने भाज्यो. तथा चूर्णिओथी

आगमेनुं गौरव अदलोऽक्युं, तथा, दीक्षामां जे वयनशक्ति अने ओम-  
सप्तष्टुयां लारे प्रसिद्ध अने सन्मान मेणान्युं लतुं ते वयनशक्ति अने  
ओम्सनी साथे आगमेनुं गौरवज्ञान तथा गुरुमहाराज तरङ्गथी निःंतर  
भणती रहेती अध्यात्मज्ञान विग्रेनी सुंहर प्रसादी भणतां रख्यां, तथा  
तपथी कायाने पण्य तपाववा मांडी. अद्वाई विग्रे तप्यो वण्यावार कर्यां.  
वण्यो योगोऽवृवहनतुं तप करी ज्ञान आराधना करी. परिणामे साणुंदमां  
तेमने प. श्री वीरविजयज्ञ गण्यां ए पंन्यास तथा गण्यापह समर्पणु कर्यां.  
धनुष्यना टंकार समा भुवंह अवाने सतत हेशना दृष्टि वेक्षा पर उपकार  
करता प. श्री अनितसागरज्ञ गण्यां ज्ञान परिविमां ज ज्ञवन वीतान्युं  
छे. संस्कृत अने गुजराती भाषामां तेओयो सुंहर लाण्युं छ, तेमणे प्रारूप  
संस्कृत अथेनां भाषांतरे पण्य कर्यां छे. भीमसेन चरित्र, अनितसेन चरित्र,  
तरंगवती कथा, (पद्य) यंद्रगाज चरित्र, स्तुतियो, शोभन स्तुति वीका साथे,  
धर्मशर्माभ्युदय, नेभिनिर्वाणु, तिलकमंजरी, शांतिनाथ चरित्र विग्रे भवाणायो  
उपर वीकायो, शण्डसिंधु, (डाप) बुद्धिप्रब्ला व्याकरणु, सुभाषित साहित्य,  
बुद्धिसागरसूरि चरित्र, श्री उपसनन सुभग्नेयिका. आ तेमना संस्कृत  
भाषामां लभेता अथो छे. तेमनुं संस्कृत सुंहर, लालित्यलर्दुं अने सुगम  
छ. वेदांतरहस्य विं वेदांतना; पण्य अथो रच्या छे. तेमनी लभेती गुजराती  
कवितायो. पुष्टुण छोर्ध, ते भधुर, भावनालरी, सामिक, सुलित अने छहस्यने  
आळ्लाळक छे. सुपासनाह चरित्र तथा सुरसुंहरी चरित्र अने कुमारपाल चरित्र  
विग्रेनां तेमनां भाषांतरे पण्य सरल अने सुंहर छे. आम आ पंन्यास-  
ज्ञायो भालियना प्रदेशमां सारो झालो आयो छे. आवी प्रभाविकतानी  
शक्ति तथा तेवी भीजु पण्य अनेक प्रकारनी योज्यताने अंगे आचार्य  
श्रीमद्भुद्धिसागरसूरीश्वरज्ञयो तेमने प्रांतीज मुकामे स. १६८० नी सालमां  
आचार्यपद्थी अवस्कृत कर्या अने सागरशाखाना संवादानो भार तेमने  
समर्पणु कर्यो. आ पधी तेओयो थोडां वर्षों ज देवात रख्या छे, पण्य तेट-  
लामाये तेमणे लभ्यामां तथा उपहेश देवामां कथाश राखी नथी. उतम  
पुरुषोना ज्ञवननी एक क्षणु पण्य आ हुनियाने वण्यी किंमती छे, ए डाण्यु  
नथी जाणुतुं ? तेओयो धार्मिक, सामाजिक उन्नतिकारक व्याख्यानो  
आपवा साथे डेटलीक धार्मिक संस्थायोने भद्र अपानी प्राणवान भनावी  
छे. योगसाधनामां पण्य सारी प्रवृत्ति हती. गुरु अक्षिं पण्य अनेक हती,  
ए तेमना उपहेशथी अंधायक्षां श्री बुद्धिसागरसूरियना गुरु भद्रिया साक्षी

पूरे छ. तेजो आर्यसमाज, सनातन धर्मी, ओस्ति, पारम्परी तथा मुसल्मानोना धर्म स्थगोमां जैश व्याख्यानो भए आपता हता. तेमणे राज महाराजान्नेना परिचयमां आवी नहाना भेटा स्टेगोमां व्याख्यानो आणी अदिंसा धर्मनो प्रत्यार करेलो छे, तेजो सतत विलार करतां चोमासामां अनुक्तमे अभद्रावाद, सुरत, मुंगाई, पाटण्य, राघनपुर, विज्ञपुर, साणुंद, प्रांतीज, वडाली ( धडर ), पालण्यपुर, भडेशाळा, उंजा, पालीताळा, जमनगर, अभद्रावाद, प्रांतीज, पेथापुर, विज्ञपुर, भाण्यसा, विज्ञपुर. आ स्थगोमां स्थिर रख्या हता. आम समुदायना वडा अन्या अतां ये तेमनामां भेटाईतुं अभिमान न हतुं, तेजो सहा औजने महत्तमां स्थापवाने ज राज हता. आ ज कारण्युथी तेमणे उडार दीवाथी गोताना युद्धाधी मुनिराज श्री ऋषिसागरज्ञ तथा मुनिराज श्री कीर्तिसागरज्ञने, अने विजयशाखाना मुनिराज श्री दुर्लभविजयज्ञ, विमणशाखाना मुनिराज श्री रंगविमलज्ञ तथा अंचलगच्छीय मुनिराज श्री हानसागरज्ञने गण्डी तथा पन्यास पठवील्या समर्पणे करी हली. छेद्वा १८८५ नी सालना चोमासामां आसो शुहि ३ ना राज विज्ञपुरमां तेजोशी स्वर्गस्थ थया. तेजोअे गोताना आत्मानुं कल्याण साधवा याचे जगतनुं कल्याण थाय तेजो वडो ज अयत्न कर्तो छे जेथी आपणी वच्चे हैयात न अतां पण अभर छे. आपणे पण तेजोना लग्न परथी धडो लध तेमना मार्गे आत्मकल्याण तथा शासन अने जगतनुं हित करीले अंवी भावना साचे आ संक्षिप्त ज्ञन आवेदन करतां विमनार-

<b>भाण्यसा ( महिकांडा ).</b> आसो शुहि ३ युद्धांती हिने.	<b>कुं छुं</b> तेमनो अंतेवासी <b>हेन्द्रसागर.</b>
--	---

॥७॥

## श्रीसद्गुरुस्मरणम्—

—५८—

( सग्धरावृत्तम् )

माध्यस्थयं यन्मनोऽब्जे स्थितमतिविलसत् सहयाभानुभासि,  
सद्विद्याकामिनी यं सुचिरमनुगता स्वेच्छया क्रीडति स्म ।  
रैगद्वेषादिवर्गः प्रशमनमगमच्छुद्धसत्त्वानुयोगाद्,  
विश्रान्तिस्थानमेष श्रमणगुणगणस्यैकमाराधनीयम् ॥ १ ॥


सौम्याकारो विनीतः स्फुरदधिकमर्तिर्धर्मतत्त्वप्रवीणः,  
सोऽहैङ्कारैकलीनः श्रुतधरविदितः सत्यवादात्मनीनैः ।  
काव्यालङ्कारवेदी कलितनयगणः साध्यकर्मस्वधीनो,  
दिव्यानन्दानुरक्तः प्रथितमदनः शुद्धभावेष्वदीनः ॥ २ ॥

श्रीगन्तः साधुवर्याः प्रथितगुणगणाः सेव्यपादारविन्दाः,  
स्लाघन्ते यत्प्रतापं परहितनिरतं नित्यशर्मप्रदानम् ।  
सिद्धान्तोद्धीततत्त्वाऽद्यगुणगुणितं लघ्वसत्कर्मसिद्धिं,  
तं वक्तारं प्रसिद्धं जलनिधिमजितं सूरिवर्णं स्मरन्तु ॥ ३ ॥

( मुनिहेमेन्द्रसागरः )

- 
- १ यस्येति शेषः । २ सोऽहमितिशब्दः योगवित्समाराधनीयः ।
  - ३ सत्यवादात्मभ्यो हितः, अथवा सत्यवादेन आत्महितः ।

॥८॥



शास्त्रविशारद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिजीना  
शिष्यरत्न मुनि श्रीहेमेन्द्रसागरजी.

थ्री महोदय प्रेस,—भावनगर.

## प्रस्तावना ।

“ सिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं ।  
कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ॥ १ ॥ ”

( सन्मतिप्रकरणम् )

केषामविदितमेतच्छेमुषीमतां विद्वत्पुङ्गवानां श्रीशोभनमुनिविनिर्मिता जिनस्तुतिचतुर्विंशतिका शोभनस्तुत्यभिधेया स्तुतिप्रवरा सुजनचित्तचमल्कारिणी सहदयहदयहारिणी यमकादिविविधालङ्कार-विभूषिता नैकधा छन्दःसन्दोहकरम्बिता काव्यमूर्खन्यतां विभर्ति ।

अवचूरिकाकृदादिभिरस्याः स्तुतेः शोभनस्तुतिरिति व्यपदेशेन व्यवहृतिर्थायि, स्तुतिकारस्यास्य सम्पूर्णं जीवनाख्यानं नालभ्यत, बत्किञ्चनाऽवलम्बनमासाद्याऽत्र तदर्शयितव्यमिति नाऽसमञ्जसम्—

श्रीशोभनस्य ज्येष्ठबन्धुना कविकुलललामभूतेन धनंपालेनाऽपरै-

१ श्री शोभनस्य कविकुलावतंसस्य ज्यायान्वन्धुर्धनपालोऽपि कविताकामिनी-मसाधारण्या भक्त्या सिधेवे । सोऽपि महाकविरभूत् । तत्र हेतुश्रायम्, भगवता हेमचन्द्राचार्येणापि तस्य श्लोकाः स्वकीये काव्यानुशासनग्रन्थे वचनलेषस्योदाहरणत्वेन संप्रहीताः । स व्युत्पत्तिशास्त्रविशारदोऽपि बभूव, यतः श्रीमद्द्विर्हेम-चन्द्राचार्यैरभिधानचिन्तामणिकोषटीकायां “ व्युत्पत्तिर्थेनपालतः ” एवविध उल्लेखो विहितः । तेन बहवोऽसाधारणा ग्रन्था विरचिताः । तेषां विरचिता तिलक-मञ्चरी, पांडियलच्छो नाममाला, कदप्रभपद्माशिंका, वीरस्तवः, सावयविहित्यादि ग्रन्था उपलभ्यन्ते ।

मुख्यन्पो ( श्रीवाकपतिराजः ) भोजराजं कनीयांसं धनपालञ्च ज्येष्ठं सुतं मेने ।

३४ ]

[ शोभनस्तुते:

धनपालाय तद्विद्याचमत्कृतः स ‘सिद्धसारस्वत’ इति विश्वं दत्तवान् । धनपालभोजयो-  
र्मित्रभाव आसीत् । भोजराजस्य राज्यसत्तासमयस्तु वि. सं. सप्तषष्ठ्युत्तरसहस्र-  
मारभ्य ( १०६७ ) एकादशाधिकैकादशशत ( ११११ ) पर्यन्तमभूत् ।

श्रीशोभनसुनेहपदेशतः संप्राप्तजैनधर्मे धनपालस्तिलकमञ्जरीमपरां कादम्बरी-  
मिव रचितवान् । तद्वचनरचनाऽतीव माधुर्यमावहति ।

वचनं धनपालस्य, चन्दनं मलयस्य च ।

सरसं हृदि विन्यस्य, कोऽभूम्नाम न निर्वृतः ॥ १ ॥

( प्रबन्धचिन्तामणी )

वादिवेतालश्रीशानितसूरिभिस्तिलकमञ्जरी संशोधिता, टिप्पण्या च समलङ्-  
कृता । महेन्द्रसूरिकवीन्द्रश्रीशानितसूरिसुराचार्यप्रभुतीनां जैनाचार्याणां परिचितोऽभू-  
द्धनपालः । श्रीकृष्णभद्रेवप्रापासादस्तेन निर्मापितः, तत्प्रतिष्ठा श्रीशोभनसुनिना तद्गुरुणा  
महेन्द्रसूरिणा च विहिता । धनपालकविभरः सत्यपुरे ( साचोरपुरे ) केनचित्का-  
रणेन कियत्समयं वसन् श्रीमहावीरस्वामिरेवापरायणः कालं व्यनयत् । आयुषो-  
न्तेऽसौ महेन्द्रसूरिसच्चिदौ सलेखनां विधाय गृहस्थाश्रमी सन् स्वर्गमागम्भूत् ।

अयं धनपालपण्डितो ज्योर्विदप्यासीत् । तथा चोक्तं प्रबन्धचिन्तामणी—  
“अथ कस्मिन्द्युपवसरे नरेश्वरः ( भोजः ) सरस्वतीकण्ठभरणप्रापादे व्रजन्  
सदा सर्वज्ञशासनप्रशंसापरं पण्डितं धनपालमालपत्—‘सर्वज्ञस्तावत्कदाचिदासीत्  
तद्वर्णने साम्प्रतं कथित्यज्ञानातिशयोऽस्ति’ इत्यभिहिते ‘अहृकृतेऽहृच्छूडामणि-  
ग्रन्थे’ विश्वव्रयस्य विकालवस्तुविषयस्वरूपरिज्ञानमयाऽपि विद्यते” इति तेनोक्ते  
विद्वारमण्डये स्थितः कस्मिन् द्वारेऽस्माकं निर्गमः । इति शास्त्रकलङ्कारोपणोदयते  
नृपे ‘बुद्धिमात्रा त्रयोदशी’ इति पाठं सत्यापयता भूर्जपत्रे नृपप्रभुनिर्णयमालिख्य  
मृण्यगोलके निर्वाय च छगलिकाधरस्य तं समर्थं देव? पादोऽवधार्यताम् इति  
नृपं प्राह ‘तद्विद्यासंकटे निपतिं स्वं मन्यमान एतद् द्वारत्रयस्य मध्यान्तिमपि  
निर्णितं भविष्यति’ इति विमूल्य सूत्रभूद्विर्मण्डपपद्मशिलातलमपनीय तन्मर्णेण  
निर्गत्य तं गोलकं भित्त्वा तेष्वक्षरेषु तमेव निर्गमनिर्णयं वाचयेत्सत्कौतुकोत्ताल-  
चित्तः श्रीजिनशासनमेव प्रशशांतः । तथाहि—

द्वाभ्यां यन्न हरिस्त्रिभिर्न च हरः सुप्ता न चैवाश्रमि—

यद्य द्वादशभिर्गुहो न दशकद्वन्द्वेन लङ्घापतिः ।

यच्चेन्द्रो दशभिः शतैर्न जनता नेत्रैरसंख्यैरपि,

तत्प्रक्षान्यनेन पश्यति बुधश्चैकेन वस्तु स्फुटम् ॥१॥ ”

प्रस्तावना । ]

[ ३५

**अैतरस्तुतिटीकाऽवतराणदिग्प्रन्थेषु तदंशादिनिर्देशो दर्शितः ।**

अन्योऽपि कथन धनपालनामा कविरासीत्, तेनाऽपभ्रंशभाषायां ‘भविय-  
सत्तकहा’ इति पुस्तकं विरचितम् । अयं धनपालोऽन्य एव यतः स धक्कडवणिग्  
जातौ समुत्पेदे । ‘धनसिरि मथिसर’ इति तस्य पितरावास्ताम् । अन्यच्च  
स दिग्म्बरो बभूत इति प्रतिभाति, यतो योऽन्युतदेवलोकः श्वेताम्बरमते द्वादशः  
प्रकीर्तिः स एवानेन धनपालेन घोडशः प्रकीर्तिः ।

तस्य ग्रन्थेषु ‘भजिवि जेण दियंवरि ।’ एवंविध उल्लेखो वर्तते । अन्यच्च  
भवियसत्तकहायां ये देशशब्दास्ते पाइयलच्छिनाममालायां नोपलभ्यन्ते । अतोऽयं  
धनपालः कथिदन्य एव इति सिद्धम् ॥ पट्टणपुरवास्तव्येन पल्लिवालज्ञातीयैन  
धनपालेन वि० सं. (१२६०) वत्सरे तिलकमञ्जरीसारः पद्यात्मको व्यलेखि,  
लक्ष्मीधरपणिङ्गतेन वि० (१२८१) वत्सरेऽन्यस्तिलकमञ्जरीसारो द्वादशाशतानुष्ठुप्  
श्लोकोर्जीर्तिः । अष्टादशाशताव्यां श्रीपद्मसागरगणिना तिलकमञ्जरीत्रितिविहिता ।  
विंशतिशताव्यां पं. लालण्यविजयैन श्रीमद् अजितसागरसूरिणा च तदृतिर्जितरमात्रि ।

१ श्रीधनपालकृतटीकाऽवतरणश्लोकाश्रेमे —

आसीद् द्विजन्माऽखिलमध्यदेश-  
प्रकाशसांकाश्यनिवेशजन्मा ।  
अलद्य देवर्षिरिति प्रसिद्धि  
यो दानवर्षित्वविभूषितोऽपि ॥ १ ॥

शास्त्रेष्वधीती कुशलः कलासु,  
वन्धे च वोधे च गिरां प्रकृष्टः ।  
तस्यात्मजन्मा समभून्महात्मा,  
देवः स्वयम्भूर्हित्व सर्वदेवः ॥ २ ॥

अद्जायताक्षः समजायतास्य,  
श्लाघ्यस्तनूजो गुणलब्धपूजः ।  
यः शोभनत्वं शुभवर्णभाजा,  
न नाम नामना वपुषाऽप्यधत्त ॥ ३ ॥

कातन्त्रन्त्रन्दोदिततन्त्रवेदी,  
यो वुद्धवौद्धार्हतत्त्वतत्त्वः ।  
साहित्यविद्यार्णवपारदर्शी,  
निर्दर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥

३६ ]

[ शोभनस्तुते:

एतेन ज्ञायते च विक्रमनुपतेरेकादशशताब्द्यां श्रीशोभममुनेरस्ति-  
त्वमासीत् । तस्य पितामहो देवर्षिनामा काश्यपगोत्रो वाडवान्वय-  
विभूषको दानशैण्डो मध्यदेशवर्त्तिसांकाश्यनगरीवास्तव्योऽभूत् ।

तस्य च देवर्षेः सर्वशास्त्रनिपुणो लब्धसर्वकलाकौशल्यः कवि-  
प्रवरो भाषाशास्त्रसंप्राप्तस्वातन्त्र्यः सर्वदेवाऽभिधः सूनुरभूत् । ततो  
देवर्षिः सपरिवारः साङ्काश्यनगरमपहाय विद्वज्जनसन्मानदानैकवीर-  
श्रीमन्मुखराजसंरक्षितविशालायां तिवासमकार्णीति ।

तत्र सर्वदेवस्य सोमश्रीनामा भार्याऽतीवगुणनिधिभूतौ धनपाल-  
शोभननामानौ पुत्रौ सुन्दरीनामैकां सुताच्च प्रासूत । यस्याश्च कृते

कौमार एव क्षतमारवीर्य-  
श्चेष्टां चिकीर्षन्निव रिष्टेनेमेः ।  
यः सर्वसावद्यनिवृत्तिगुर्वीं,  
सत्यप्रतिज्ञो विदधे प्रतिज्ञाम् ॥ ५ ॥

अभ्यस्यता धर्ममकारि येन,  
जीवाऽभिद्यातः कलयाऽपि नैव ।  
चित्रं चतुःसागरचक्रकाञ्छि-  
स्तथापि भूवर्यापि गुणस्वनेन ॥ ६ ॥

एतां यथामति विमुश्य निजाऽनुजस्य,  
तस्योज्ज्वलां कृतिमलंकृतवान् स्ववृत्त्या ।  
अभ्यर्थितो विदधता त्रिदिवप्रयाणं  
तेनैव साम्प्रतकविर्घनपालनामा ॥ ७ ॥

१ मध्यदेशस्वरूपमभिधानचिन्तामणी—

हिमवद्विन्ध्ययोर्मध्ये, यत् प्राग् विनशनादपि ।  
प्रत्यगेव प्रयागाच्च, मध्यदेशः स मध्यमः ॥  
( श्लोक-१७-कां-४ )

२ उज्जितिनी स्याद्विशाला-उवन्ती पुष्पकरण्डिनी । का० ४ श्लो० ४२

प्रस्तावना । ]

[ ३७

धनपालेन 'पाइयलच्छी नाममाला' रचितास्ति । देवर्षिणा च राज्य-  
शासनाङ्गप्रवृद्धौ धारायां गतेन राजवह्नभेन निजपाणिडत्यप्रकर्षाद्वि-  
पुलं धनमुपार्जितम् । पूर्वोपार्जितं सर्वं च तद्वित्तं पृथिव्यां तेन  
निभानीकृतम् । अथ सर्वदेवो विपुलपरिवारो निजाऽपत्यानि पाठ-  
यितुं सदोद्योगपरायणः स्वजीवनमनयत्, पितरि दिवं गते तन्निहितं  
धनमजानानः स संभ्रान्तमनाः सद्वनि सर्वत्र व्यलोक्यत् । धन-  
मलभमानश्चिन्तातुरोऽजनिष्ट सः । तदानीं धनपालशोभनौ तत्पुत्रौ  
चतुर्दशसु विद्यासु पारगामिनौ बभूवतुः, सर्वदेवो धनपालशोभौ  
मुञ्जभोजनृपयोरतीव माननीयौ जातौ सुखेन निर्वाहमकार्ष्टम् ।  
तथाऽपि महादानित्वात् बहुपरिवारत्वाच्च सर्वदेवस्य विपुलतर-  
वित्तापेक्षिणः धरानिहितधनलिप्सया तत्स्थानं च निश्चेतुमुत्कण्ठा  
समुद्भूता । तस्मिन्समये चान्द्रगच्छीय-आचार्यश्रीमहेन्द्रसूरिर्विहरन्  
क्रमेण धारायां समागमत् ।

स च ज्ञानप्रभावेण सर्वत्र नगर्या प्रसिद्धो बभूव, तद्वृत्तान्तं  
सर्वदेवेन श्रुतं, ततः सर्वदेवो दिनत्रयं उपाश्रये महेन्द्रसूरिसन्निधौ  
तृष्णीं तस्थौ ।

तथाविर्यं तं निरीक्षमाणः सूरिस्तत्कारणमपृच्छत्, तेनोक्तम्-  
मतिपत्रा निधानीकृतधनस्थलं दर्शय, आचार्येण तत्प्रेयोवस्त्व-  
र्धभागप्रदानप्रतिज्ञया धनस्थानं तस्मै संदर्शितम् । चत्वारिंशलक्ष-  
मितमुवर्णटङ्कास्तेन निधानतो लब्धाः । जैनमुनयो निषिक्कन्ना इति

<sup>१</sup> विकमकालस्स गण, अउणत्तीसुत्तरे संहस्सम्मि ।

मालवनरिंद धाढिए, लूडिए मन्नखेडम्मि ॥ १ ॥

धारानयरीए परि-ट्टिएण मग्गे ठिआए अणवज्जे ।

कज्जे कणिटुवहिणीए 'सुंदरी' नाम घिज्जाए ॥ २ ॥

( पाइयलच्छीनाममाला ) पृ० ४५.

३८ ]

[ शोभनस्तुतेः

विस्मरन् सत्यसन्धः स विप्रो लब्धधनस्यार्थभागं सूर्ये प्रदातुं  
समुद्यतः, तथापि स आचार्यो तं नै स्वीचकार

सर्वदेवेन चिरं प्रार्थितोऽपि सूरस्तदाग्रहं नाऽमन्यत, कथितश्च  
यदि स्वप्रतिज्ञां सत्यापयितुं त्वमिच्छसि तर्हि पुत्रयोर्द्वयोरेकं मे देहि ।  
ततः सर्वदेवेन जैनदीक्षां स्वीकृत्वा धनपालो ज्येष्ठसुतोऽवाचि, सोऽपि  
जैनमतविरोधित्वात् पितुर्वचनं नाऽमन्यत । पितुः सन्तोषाय  
तद्वचनं कनीयसा सूनुना शोभनेन स्वीकृतम् । महेन्द्रसूरिणा स  
दीक्षितः कृतः ।

केषुचित्प्रबन्धेषु शोभनमुनेर्गुरोर्नामान्यन्यानि निर्दिष्टानि, तं  
केचिद्वर्धमानसूरिः केचिच्च जिनेश्वरसूरिरिति संबोधयन्ति, वयं त्वत्र  
प्रभावकचरित्रादिजैनैतिहासिकग्रन्थानाश्रित्य महेन्द्रसूरिरित्यभिधानं  
अनुमन्यामहे, यतो धनपालेन स्वरचित्तिलकमञ्जर्या तदेव नाम  
स्मृतम्, महेन्द्रसूरिः प्रायः कामपि ग्रन्थरचनां कृतवानिति न ज्ञायते,  
तथा च प्रभावकचरित्रे जन्महायनादिप्रतीतिर्न लभ्यते । प्रभाव-  
शालीसूरिरित्यम् । उक्तश्च—

सूरिर्महेन्द्र एवैको-चैबुधाराधितकमः ।

यस्याऽमत्योचितप्रौढिः, कविविस्मयकृद्वचः ॥ १ ॥

( तिलकमञ्जर्यम् अलो ३४ )

विद्वान् व्याख्यातुचूडामणिरसौ बभूव—

धराधवान् धर्मसुकर्मवोधत-शकार वश्यान् श्रुतधर्मवर्तमनि ।  
निवर्त्यामास विकर्मसेवनान्-निजक्रमाऽभ्यर्णगतान् विधर्मिणः । १ ।

१ यतिने काश्चनं दत्या, ताम्बूलं ब्रह्मचारिणे ।

चोरेभ्योऽप्यभयं दत्या, स दाता नरकं ब्रजेत् ॥

पाराशरस्मृतिः अ. १ अलो. ६०.

प्रस्तावना । ]

[ ३९

निवृत्तर्थः परिवर्तमानः, सदात्मतच्चेषु विभासमानः ।  
 महेन्द्रवत्सूरिरयं व्यराजत्, धर्माधिराज्यं नितरां दधानः ॥ २ ॥  
 धर्मद्विषोऽन्ये कलुषाः कषाया-बवाधिरे तं न निजप्रभावात् ।  
 कियान् हि बाह्यो रिपुवर्ग ईशो-विकारदृष्ट्या समवेक्षितुं वै ॥ ३ ॥

प्रभावकचरित्रे महेन्द्रसूरिवृत्तान्तं प्रदर्शितम् । तत्र शोभनमुनि-  
 धनपालकौलकविधर्माणां विदुषामाख्यानं वर्णितम् । किन्तु अस्मिन्  
 प्रबन्धे महेन्द्रसूरिवृत्तान्तं स्वल्पतरं लभ्यते । अतस्तज्जन्मजातिगुर्वादि-  
 संबन्धः कञ्चिदपि न प्रतीयते ।

अथ धनपालः कनिष्ठभ्रातरं दीक्षितं विज्ञाय तस्मै सूखे भृशं  
 चुक्रोध, निजपित्रा विरोधं कुर्वत् स्वमित्रीभूतं युवराजं भोजराजं  
 विवोध्य द्वादशवर्षपर्यन्तं मालवदेशे मुनिविहारं न्यवारयत् । यदा

( १ ) मृगुकच्छ( भरुच )पुरवास्तव्यः सुरदेववाङ्मणस्ततुत्रोऽयं बाल्यावस्था-  
 यमनभिज्ञो बभूव, कस्यनियोगिनो वितीर्णवरेण कवित्वशक्तिं प्राप्य शक्त्युपासकः  
 सोऽभूत् ततो गृहवासं परित्यज्य पर्यटन् स शास्त्रविवादे बहून् विदुषो जयन्  
 श्रीशानितसूरिणा महाकविधनपालेन च विजितस्ताभ्यां सह चिरं मित्रात्मधात् ।

( २ ) महेन्द्रसूरिस्मयः शिथिलाचारप्रधानोऽभूत् । तत्र श्रीमहेन्द्रसूरि-  
 श्रीवाचनाचार्यशोभनमुनी सुविहिताविति तयोराचारविहारादिभिर्जायते ।

३ महाकविधनपालेन वि. सं. ( १०२९ ) पाइअलच्छीनममाला रचिता,  
 तदानीं स षोडशहायनो विशतिहायनो वाऽभवत् । स च जेनमतावलम्बी नाऽभूत्,  
 यतस्तस्यां नाममालार्था जैनपरिमाधिकाः शब्दा न दृश्यन्ते, किन्तु संस्कृतसम-  
 दैशिकप्राकृतशब्दा निवेशिताः ।

पृष्ठ ( १३ ) पादे ( १७१ ) “ तित्थाहिवै जिणो अरहा ” इत्युल्लेखेन  
 केचित्तं जेनं मन्वते तदनुचितं, यतस्तदुद्देखः पश्चात्प्रक्षिप्तः संभाव्यते । किंवाऽहं-  
 चिति जनप्रसिद्धत्वात्तदुद्देखः स्वेनैव कृतो ज्ञायते । आयमङ्गले ब्रह्मणो नामस्मरणेन  
 च जैनेतरः प्रतीयते ।

श्री वाक्पतिराज( मुख )स्य राज्यसमयस्तस्मिन्समयेऽभूत् । ततो भोजराजो  
 युवराजपदरूप आसीत् ।

४० ]

[ शोभनस्तुते:

मालवदेशे साधुविहारनिषेधस्तदानीं महेन्द्रसूरिः शोभनमुनिश्च  
गुर्जरदेशेऽभूताम् । गुरुणा जैनसिद्धान्तं पाठयित्वा शोभनमुनये  
वाचनाचार्यपदवी प्रदत्ता, यः गुणाकरत्वात् सुरेन्द्रस्याऽपि स्तव-  
नीयोऽभूत् । इथं प्रबंधकारो विज्ञापयति—तस्मिन् समये शोभन-  
मुनिस्तीव विद्वानासीत् ! सौभाग्यसागरसूरिः शोभनस्तुतेष्टीकां  
निर्मितवान्—सोऽपि प्रस्तौति—

“ शोभनः सर्वशास्त्रेषु, शोभनः स्तुत्यकीर्तिभाक् ।  
विदुपां माननीयश्चाऽप्रमेयकविशक्तिभाक् ॥ १ ॥ ”

शोभनमुनिं विद्वत्तमं विज्ञाय तद्गुरुस्तस्मै सूरिपदं समर्पितवान् ।

ततो मुनिदर्शनविरहादुपदेशाभावाच्च जैनशासनस्य लघुतां विदि-  
त्वा धारासंवेन श्रीमहेन्द्रसूरिरभ्यर्थितः, भगवन् ! मुनिविहारनिषेधो  
दूरीकर्त्तव्यः । आचार्येण जैनशास्त्रनिष्णातः शोभनमुनिस्तत्र  
गमनायाऽज्ञप्रसः ।

धनपालः प्रतिबोद्धव्यो जैनशासनोन्नतिश्च विधातन्येति कार्य-  
द्वयचिकीर्षुणा तेन प्रागेव वाक्चातुर्यथारित्रिवलेन शासनप्रभावेण  
च तत्कार्यं साधितम् । ततो धनपालं विशुद्धं श्राद्धं विधाय मालवदेशे  
मुनिविहारं स प्रावर्तयत् । तेन धनपालेन समयोचितोक्त्या भोज-  
राजो मृगयाव्यसनपराऽमुखी कृतः । वैक्रमैकादशशताब्द्याश्ररमभागे  
विद्यमानोऽयं मुनिः कदा स्वर्गस्थोऽभूदिति विज्ञानसाधनं लब्धपूर्वं  
नासीत् । अतस्तदत्र न निश्चीयते । परन्त्वस्याः स्तुतेर्थनपालकृतटीकाया  
अवतरणतो ज्ञायते—

असौ स्तुतिकारो धनपालस्यानुजस्तेन मुनिना ज्येष्ठवन्धुं धनपालं  
परमार्हतं विधाय पश्चादणहिलपुरे शोभनस्तुतिर्निरमायि । विद्यमाने

( १ ) पष्टणपुरे प्रायः स्थितिमन्तौ, तदानीं श्रीभीमदेवस्य राज्याधिकारो  
विं सं० ( १०७८-११२० ) अष्टसप्तत्युत्तरसहस्रमार्भ्य विंशत्युत्तरैकादशशत-  
परिमितो वभूत् ।

प्रस्तावना । ]

[ ४१

च ज्येष्ठबन्धौ स मुनिः पञ्चत्वमिथाय । अस्य मुनेः स्तुतिनिर्माणं  
स्वर्गगमनञ्च गुर्जरदेश एवेति प्रतीयते ‘शोभनसूरेः स्वर्गगमन-  
विषये विविधप्रकारः प्रदर्शितः’ महेन्द्रसूरिप्रवन्धे चेत्थमुक्तम्—

“ तदीयदृष्टिसङ्गेन, तत्क्षणं शोभनो ज्वरात् ।

आससाद् परं लोकं, संघस्याऽभाग्यतः कृती ॥ १ ॥

तासां जिनस्तुतीनां च, सिद्धसारखतः कविः ।

टीकां चकार सौन्दर्य-स्नेहं चिन्ते वहन दृढम् ॥ २ ॥ ”

शोभनमुनिविरचिता ग्रन्थाः शोभनस्तुतिमन्तराऽन्येऽधुना न ल-  
ख्यन्ते, केनाऽपि ग्रन्थकारेणाऽन्ये तद्रचिता ग्रन्थाः सन्तीत्युल्लेखोऽपि  
न कृतः तथाप्येतादृगसाधारणग्रन्थकर्तुरपरा: कृतयः संभाव्यन्त एव ।

पुनर्जैनदर्शनेऽस्याः स्तुतेरनेकधा जैनपण्डितैष्टीका विरचिताः  
अतिप्रसिद्धिश्चास्या इति वाचनाचार्यपदारूढस्य शोभनमुनेः कवि-  
त्वशक्तिरत्युच्चतरा विद्यते, सम्यक्त्वसप्ततिटीकाकारश्रीमत्संघतिल-  
कसूरिल्येनं कविराजमुद्दिश्याऽधस्तनां स्तुति विहितवान्—

“ बीओ सोहणनामा, जस्स कवित्तं विचित्रयं सुणिउं ।

कोहि न विद्धियहियएहिं पंडिएहिं सिरं धुणियं ॥

बहुपरियणपरियरिया, अखण्डपंडिच्छदप्पदुप्यिच्छा ।

सिरिभोयरायरायंगणस्स मुहमंडणं जाया ॥ ”

सम्यक्त्वसप्ततिटीका ( पत्रांक ७२ )

असौ स्तुतिर्निंजगुरुणाऽपि संस्तुता श्रीप्रभावकचरित्रे श्लो. ३ १९.

“ स प्राह न स्तुतिध्याना-ज्ञानेऽपश्यदहो ! गुरुः ।

तत्काच्यान्यथ हर्षेण, प्राशंसत्तं चमत्कृतः ॥ १ ॥ ”

१ इतश्च शोभनः स्तुतिकरणध्यानादेकस्या गृहे त्रिग्मनात्तस्या दृष्टिदोषा-  
न्मृतः। प्रान्ते निजब्रातुः पार्श्वात् स्तुतीनां वृत्तिं कारयित्वाऽनश्चनात्सौर्यम् गतः।

( प्रबन्धचिन्तामणौ पृ० ४२ )

४२ ]

[ शोभनस्तुते:

धनपालोऽपि स्वनिर्भितटीकायामेवं स्पष्टतया तद्विज्ञापयामास ।  
 भिक्षाटनं कुर्वताऽनेन मुनिनाऽपूर्वभाववाहिनी गम्भीरार्थगौरवान्विता  
 विचिधच्छन्दोऽलङ्कारादिसमन्विता पण्णवतिकाव्यमयी स्तुतिरियं  
 व्यधायि, तर्हि तत्कृता अन्ये ग्रन्थाः कथं न भवेयुः ? अखिलानि  
 पुस्तकनिधनानि दुःषमसमये नष्टप्रायाण्यभूवन् तत्र किमक्षयं भवेत् ?  
 केवलं सिद्धान्ततत्त्वकोविदोऽयं नासीत्, महामुनिवर्मविराजितोऽप्य-  
 भवत् । धनपालः स्वयमेवोचे—रूपेण स्वाकृत्या सद्गुणैश्च स शोभनः  
 समभूत्, नाम्नैव न । अस्य स्तुतिकारस्य ज्येष्ठभ्रातृधनपालरचितै-  
 तस्तुतिटीकाऽवतरण—तद्रचिततिलकमञ्जरीपीठिका-चन्द्रप्रभसूरिकृत-  
 प्रभावकचरित्रश्चश्रीमहेन्द्रसूरिप्रबन्ध—श्रीमेरुज्ञाचार्यविहितप्रबन्ध-  
 चिन्तामणौ भोजभीमप्रबन्ध-श्रीहरिभद्रसूरिकृतसम्यक्त्वसप्तति-श्रीसं-  
 धतिलकसूरिरचितवृत्ति—श्रीविजयलक्ष्मीसूरिकृतोपदेशप्रासाद-श्रीजि-  
 नलाभसूरिरचितात्मप्रबोधादिग्रन्थानुसारेण मया यथोचितमिदं शोभ-  
 नमुनिवृत्तं निवेदितम् । तर्कालंकार—न्याय—काव्यतीर्थोपाधिधारिणा  
 श्रीहिमांशुविजयमुनिराजेन गुर्जरप्रस्तावनायां तच्चित्रं सम्यग् विशदी-  
 कृतं, तेनाऽपि महाशयाः तुष्टि लभेन् । अस्मिन्विषये क्वचिन्मतभे-  
 दोऽप्यस्त्येव, वस्तुतस्तदकिञ्चित्करम् । श्रीशोभनमुनेः पितरं सर्वदेवं  
 गुणनिष्पन्नतया—उपनामतः, सोमश्रीभार्यायाः साम्यतश्चाऽन्ये ग्रन्थ-  
 काराः लक्ष्मीधर—सर्वधर—सोमचन्द्रनामतो निर्दिशन्ति धनपालस्तु  
 निजपितरं ‘सर्वदेव’ इत्याख्यया रूपापयति, मयाऽप्यतस्तन्नाम-  
 निर्देशो विहितः । श्रीधनपालः स्वरचिततिलकमञ्जर्यौ श्रीमहेन्द्रसूरि  
 प्रशंसति—अतो दीक्षागुरुः स एवात्र निर्दिष्टः, केचिच्च वर्द्धमानसूरि  
 जिनेश्वरसूरि च दीक्षागुरुं दर्शयन्ति । जैनग्रन्थकाराः दीक्षागुरुं  
 विद्यागुरुं च तं निर्दिशन्ति । इत्थं मतभेदाः सन्ति यतो—वर्धमान-  
 सूरेः, महेन्द्रसूरेश्च समकालीनत्वं तत्र हेतुत्वेन गण्यते । परं तु  
 दीक्षागुरुस्तु महेन्द्रसूरिरेव विद्यागुरुत्वेन श्रीवर्धमानसूरिर्यदि संभा-  
 व्येत तर्हीष्युक्तं स्यात् ।

प्रस्तावना । ]

[ ४३

पित्रा वा तत्पूर्वजेन निधानीकृतं धनं दर्शीतमिति विकल्पयन्ति केचन, यदि सांकार्ये तद्वनं निहितं चेत्पूर्वजेन, तद्वारायां कर्यं संभाव्यते ? धारानगर्या देवर्षिणैव गुप्तीकृतं संभाव्यते । अत्र च देवर्षिसम्बन्धस्तद्विषये प्रकाशितः । अतोऽन्ये मतभेदा नाऽत्र प्रदर्शिताः कारणशून्यत्वात् । इत्थं शोमनमुनिख्याति प्रदर्श्य तत्कृति स्तवीमि—

अस्यां शोभनस्तुतौ श्रीमदृषभादिचतुर्विंशतिजिनानां स्तुतयः पृष्ठवतिश्लोकपरिमिताः । प्रत्येकजिनस्तुतौ चत्वारि काव्यानि, तेषु प्रैथमकाव्येन यस्य जिनस्य स्तुतिस्तवत्वना, द्वितीयस्मिन् चतुर्विंशतिजिनानां स्तुतिः, तृतीयस्मिन्नागमस्तुतिः चतुर्थे च काव्ये शासनरक्षकदेवस्तवनम् । इमाश्चतुर्विंशतिजिनानां स्तुतयोऽष्टादशधा छन्दोभिन्निबद्धाः छन्दःशास्त्रनियमोपेताः सर्वसौन्दर्यानपेताः कवि-प्रवरस्य पाण्डित्यं प्रकाशयन्ति । अधिष्ठायकदेवीनामेव स्तुतिविहितेति न किन्त्वत्र श्रुतदेवताः षोडश विद्यादेव्यः अस्त्रिका-शान्तिदेवी ब्रह्मशान्तिकपर्दीयक्षाश्च स्तुताः

शब्दाऽलङ्घारेष्वनेकधा यमका योजिताः, अनुप्रासानां घटनाऽप्युच्चतरा निवेशिता, विस्मयस्त्वेषः, प्रकृतशब्दानामुपयोगतः शब्दसौन्दर्यार्थसुगमत्वसम्पादने प्रयत्नो विहितः । अस्याः स्तुतेगौरवत्त्वन्त्व-दमेव लक्ष्यते यश्यायाचार्य-न्यायैविशारदश्रीमद्यशोविजयोपाध्याय

( १ ) अहिगयजिणपद्मथुई, वीआ सव्वाणतइयनाणस्स ।

वेयावच्चगराणं, उवओगत्थं चउत्थ थुई ॥ १ ॥

( देववन्दनभाष्ये गाथा० ५२ )

( २ ) श्री यशोविजयमहामहोपाध्यायविनिभित्तिन्द्रस्तुतिरिति काञ्चिदलौकिका कविजनमनोहारिणी कृतिः । शोभनमुनिकृतजिनस्तुतिचतुर्विंशतिकाव्या अनुकृतितया विदुषां समाजे प्रसिद्धच्छन्दोऽलङ्घारैः क्वचिच्छब्दार्थेरपि जिनस्तुतिचतुर्विंशतिकाव्या अस्या कृतेः सादृशं दरिदृश्यते । अत एव विदुषां प्रमोदाय अस्य प्रम्भस्य परिशिष्टे मूलकृतिः संगृहीता ।

४४ ]

[ शोभनस्तुतेः

(सदृशैः) पण्डितप्रवरैः शोभनस्तुतिमिमामनुसृत्य तथैवच्छन्दोऽल-  
ङ्कारैः समलङ्घता (ऐन्द्रस्तुतिनामा) स्तुतिर्थ्यधायि । यस्यां स्तुतौ  
शब्दतोऽर्थतश्च क्वचिद् साम्यं वरिवर्तते । प्रस्तुतस्तुतेरनन्तरं मेरुविजय-  
गणिप्रभृतिजैनकविवरैरीदृशीः स्तुतीर्विधाय साहित्यवृद्धिरक्रियते ।  
अस्मिन् विषयेऽधिकमुलेखमकृत्वा स्तुतिरियमवेक्षणीयेति विरम्यते ।  
अस्याः स्तुतेः सुबोधाय—आचार्यश्रीमद्भूअजितसागरसूरिविरचित-  
सरलाख्या टीकाऽन्वयानुसारिणी मूलार्थानुवादश्च वाचकानामतीव  
साहाय्यं ब्रजिष्यतः ।

सरलाख्यटीकाकर्तुणां कविकोविदानां जैनाचार्याणां श्रीमद्भू-  
अजितसागरसूरिवर्याणां जीवनं तद्विरचितप्रन्थावलोकनेनैव लोके  
प्रसिद्धमेव ।

अस्याः सरलायाः संशोधनार्थं प्रो. रसिकलालात्मजमहाशय्हीरा-  
लालकृतस्तुतिचतुर्विशतिकाया भाषान्तरादीनामप्युद्धीक्षणं विहितम् ।

एतद्ग्रन्थसंशोधने च व्याकरणसाहित्यपारंगतेन श्रीमता  
वैकुण्ठरामात्मजेन भाइशङ्करशास्त्रिणा प्रभूतं साहाय्यं विहितम्,  
अतस्योरुपकृतिं न विस्मरामि ।

गच्छतः स्वलनं क्वापि, भवत्येव प्रमादतः ।

हसन्ति दुर्जनास्तत्र, समादधति सज्जनाः ॥ १ ॥

इति प्रार्थियता ।

कर्तिक्यां पौर्णमास्यां बुधवासरे }  
वैक्रमाच्छ्वे १९९१ }  
मु० माणसापत्तने. } } मुनिश्रीहेमन्द्रसागरः ।

इयं शोभनस्तुतिचतुर्विशतिकां सर्वमतानुयायिसंमता । अस्याः टीकाकर्त्ता  
श्रीमद्भूअजितसागरसूरिपुज्जवेन तद्भावार्थमुद्दत्य यथेष्टव्यैः क्वचिद्भिन्नवा कृतिः  
विरचिता साऽपि स्वरचितस्तोत्ररत्नाकरग्रन्थं मुद्रिताऽस्ति, जिज्ञासुभिर्विलोकनीया तत्र ।



## जैनाचार्यश्रीमद्भाजितसागरसूरिवृत्तान्तम् ।

प्रणम्य पद्मप्रभपद्मनाथं, संक्षेपतोऽहं कथयामि किञ्चित् ।  
गुरुप्रसादाद् गुरुजीवनस्य, शुभं चरितं गुणवृद्धिहेतुम् ॥१॥

विविधवैभवशालिनि चारुतर( चरोतर )देशे पेटलादपत्तनस-  
न्निधौ प्रधानतो वैश्यजनमण्डितोऽन्वर्थनामा नार( नरसमूह )इत्य-  
भिधानं दधानो ग्रामः प्रसिद्धः समस्ति । यस्मिन्वीतरागधर्मोपासकाः  
कियन्तः स्वेष्टदेवता उपासते, यैर्धर्मसन्तानकराः कतिपयाऽर्भकाः  
सद्गुरुभ्यः समर्पिताः, दीक्षिताश्च ते धर्मोन्नतिं विद्धति, एतस्मिंश्च ग्रामे  
परमात्मिकधर्मनिष्ठो वैश्य( लेउआपाटीदार )कुलविभासकः ( लल्लु-  
भाइ ) इत्याख्याख्यापकोऽभवत्, धर्मपत्नी च तस्य शीलवतीनां  
प्रशंसनीया ( सोनबाई ) नामाऽसीत्, दम्पती चोभौ समानशुभ-  
शीलौ विनीतस्वभावौ प्रभुभक्तपरायणौ शुद्धदेवगुरुभक्तिभाजाबु-  
दारमानसौ प्रेमाङ्करपोषकौ सततं बभूवतुः । यस्याः कुक्षौ शुभस्वप्र-  
सूचितोऽयं गर्भत्वेन समवातरत् । वि. सं. द्विचत्वारिंशदधिकैकोन-  
विशतितमे हायने पोषशुक्लपञ्चम्यां सा बालमजीजनत्, द्वादशोऽहि-  
पित्रा ( अंत्रालाल ) इत्यभिधानमकारि । क्रमेण बालशशाङ्क इव स  
वृद्धिमगमत्, प्रकृत्यैवासौ निजपितृगुणानुसारी शुभलक्षणसूचितो  
भविष्यद्वायोदयवशात् सामुद्रिकलक्षणैः कियद्विरुपलक्षितोऽभूत,  
आद्यवयस्येव तं बाग्मित्यं बुद्धिवैश्यद्वाशिश्रियताम् । अत एवासा-  
चिराद् गुर्जरगिरां रहस्यमवेदीत् । स च वाक्चातुर्यवृद्धिप्रभावं

सफलीकर्तुं व्यचिन्तयत् । तस्मिन्समये दैवनियोगात्तन्मातापितरौ  
पञ्चन्त्वं गतौ, भवस्वरूपमेतादृशमेव—

उत्पद्यते कर्मनिवद्वजन्तु—विंलीयतेऽसौ किल कर्मयोगात् ।  
सुखं च दुःखश्च चलस्वभावं, प्रकीर्तिं चक्रवदत्र लोके ॥ १ ॥  
संसारस्वासः खलु सारहीनो,—निःसारसेवा बहुदुःखवानिः ।  
एकस्य दुःखस्य न यावदन्त—स्तावद् द्वितीयं निपतत्यकाण्डम् ॥२॥

इत्थं संसारस्थितिं परिभाष्य पट्पञ्चाशदधिकैकोनविशतितमे  
वैक्रमाद्वे स्थानकवासिसाधूनां समागमं प्राप्य विरक्तमनाः स तेषां  
सन्निधौ दीक्षामङ्गीकृतवान् । अमीक्रपेति नामनिर्देशं जग्मिवान् ।  
ततो गुरुभिः सह तेन महाराष्ट्र—खानदेश—कणाटक—मालव—मध्य-  
हिन्दुस्तानप्रभृतिषु देशेषु विहारो व्यधायि, तत्रत्यजनाः प्रबोधिताश्च  
निजद्वुद्धिवैभवेन ।

अनेकधा धर्मशास्त्राणां विविधभाषणां चाभ्यासस्तेन विहितः ।  
ततोऽनेकविदुषां मुनीनां महात्मनाङ्ग समागमं कुर्वाणः स सम्यग्  
ज्ञानाऽनुभवं प्रापत् । ततस्तस्य स्थानकवासिमुनीनां परिचयो  
जातस्तत्र मूर्तिपूजनं सर्वथा न्यषेधि, तत्र तस्मै निजज्ञानाऽनुभवा-  
न्नारोचत, शास्त्रोक्तैतिहासिकप्रमाणैश्च तेन विज्ञातम्—द्वात्रिशतसूत्र-  
सूत्रितमेव माननीयं नान्यदितिमर्यादा ध्रमजनका तैर्मूर्तिपूजां खण्ड-  
यितुञ्चाङ्गीकृताऽस्ति । तत्सम्बन्धिनिषङ्कासमाधानं तन्मतावलम्बिना  
तेन नाऽसादि । केचित्तन्मतानुयायिनस्तदीयशङ्काः श्रुत्वा हास्या-  
स्पदीचक्रुः, केचित्तूष्णीं वभूतुः, अपरे च मिथ्याश्रद्धाशीलनत्वेनैव  
जीवनं निर्वाहयितुं उपदिदिशुः । तेन सत्यशोधकः स नातुर्ज्यत् ।

ततस्तेन विजिज्ञासुना—अध्यात्मज्ञानदिवाकरयोगनिष्ठाचार्यश्री-  
मद्बुद्धिसागरसूरीश्वरैः साकं पत्रव्यवहारः प्रारम्भ्यत, क्रमेण च  
प्रभोत्तरसन्तानेन बहुधा शङ्कासमाधानमजनिष्ट, ततः स्वयमेव स

वृत्तान्तम् । ]

४७

समागत्य सूरीश्वरदर्शनमकार्षित्, तैश्च साकं तेन भक्ष्याऽभक्ष्या-  
चारसमाचारीजीवदया—प्राकृतसंस्कृतभाषा—सूत्ररचना—मूर्तिप्राचीन-  
त्वावश्यकताप्रभृतीनां प्रभूता ऊहापोहा विहिताः, मीमांसाऽप्यकृत् ।  
ततो निश्चितं तेन—यत् स्थानकवासिमत आधुनिक एव, तेऽपि  
रूपान्तरेण गुप्रतया तत्सदृश (स्थापना) स्वरूपेण मूर्तिं मन्यमाना  
अब्रजनान् भ्रान्तान् कुर्वाणास्तेषां स्वस्य चात्मिकहितं नाशयन्ति ।  
इत्थं तेन (अमित्रङ्गिपि) मुनिना सुपरीक्षां विधाय पञ्चषष्ठ्युत्तरैकोन-  
विशतितमे ( १९६५ ) वि. संवत्सरे गृहीतमतमनादृत्य पूर्वोक्त-  
सूरीश्वरपादान्ते श्वेताम्बरसम्प्रदायिका संवेगिदीक्षा स्वीकृता । अजि-  
तसागर इत्यभिधया ख्यातिमभजदस्मिन् सम्प्रदाये, यद्यपि स्थानक-  
वासिमतं वितर्थं विज्ञाय त्यक्तवान् तथाऽपि परमतसहिष्णुत्वात्  
सोऽन्यमतानिव तन्मतमपि समानभावेनाऽपश्यत् ।

बहुशस्तेन स्थानकवासिसाधुभिः समं प्रसिद्धभाषणादिप्रवृत्तयो  
विहिताः, अत एव निश्चीयते, तन्मनसि कचिदपि केनाऽपि साद्व तिर-  
स्कारो द्वेषबुद्धिश्च न प्रादुरभवत् । सर्वैः सह ग्रोदभावेन वर्तितव्यं  
सत्यवर्त्म न परित्याज्यमिति तज्जीवनस्य प्रधानताऽसीत् । अथ  
स मुनिराजः प्रत्यहं ज्ञानवृद्धिं विधातुं प्रावर्त्तत, संस्कृतप्राकृतवाङ्मय-  
तत्त्वानि सम्यक् ज्ञातवान् । तदन्वागमिकभावान् पुनरवलोकितवान् ।  
तत्त्वीकानिर्युक्तिभाष्यचूर्णिकापर्यालोचनत आगमिकगौरवं तेन प्रत्य-  
क्षीकृतम् । प्राथमिकवक्तृत्वशक्तिप्रभावेण सज्जातप्रसिद्धिसन्मानं विशे-  
षतः स्वागमज्ञानपूर्वकं निजगुरुसकाशात्प्रत्यहं संप्राप्ताध्यात्मज्ञानादिना  
व्यस्फुरत् । विज्ञानतपसा वपुरपि सविषयं कृशतामभजत् । अष्टाहि-  
कादितपश्चर्या बहुशः परिचिता तेन, योगोद्वहनतप आराध्य ज्ञानञ्चा-  
राधितम् । ततः सानन्दनगरे तस्मै महोत्सवपूर्वकं पन्न्यासश्रीमद्वी-  
रविजयेन पन्न्यासपदं गणिपदं च प्रदत्तम् । मेघगम्भीरनादेन सततं  
देशनाप्रदानेन लोकोपकारकारिणा प० श्रीमद् अजितसागरगणिना

जीवनं परहितायैव व्ययितम् । संस्कृत—प्राकृतभाषायां तेन बहवो  
लेखाः प्रादुष्कृताः, संस्कृत—प्राकृतभन्थार्थाः देशभाषया प्रकटीकृताश्च ।  
तद्विरचितग्रन्थाश्चेमे भीमसेनचरित्रं, अजितसेनचरित्रं, तरङ्गवती-  
कथा ( पद्यात्मका ) चन्द्रराजचरित्रं, स्तुतयः, श्रीशोभनस्तुतेष्टीका,  
धर्मशमाऽभ्युदय-नेमिनिर्वाण-तिलकमञ्जरी-शान्तिनाथचरित्रादिमहा-  
काव्यानां टीकाः, शब्दसिन्धुः, बुद्धिसागरसूरिचरित्रं, श्रीकलपसूत्रसुखबोधिका चेति संस्कृत-  
गिरा गुम्फिताः सन्ति । कृतिश्चैषां मनोहारिणी सुगमा रसमयी च ।  
वेदान्ततत्त्वव्व तेन ग्रन्थद्वाराद्यक्तीकृतम् । वेदान्तरहस्यं च  
काव्यप्रबन्धेन गुर्जरगिरा वहुधा विशदीकृत्य प्रकाशितम् । तच्च  
समयोचितभावमयं हृलासकं जनानानन्दयति । सुपार्श्वनाथचरित्र-  
सुरसुन्दरी—कुमारपालचरित्रादीनां भाषान्तराणि तद्रचितानि वर्तन्ते ।  
इत्थं तेन मुनिना साहित्यप्रमुखप्रवृद्धिर्विशेषतो विहिता ।

तेषामीदृशी शक्तिमनेकधाऽपरयोग्यतां च निरीक्ष्य तस्मै योगनि-  
ष्ठाध्यात्मज्ञानदिवाकरशीमदाचार्यबुद्धिसागरसूरिमिः ( प्रांतिज ) पत्तने-  
अशित्युत्तरैकोनविंशतितमेऽव्दे आचार्यपदं प्रदत्तं सागरसंघाटकस्य-  
धूश्च समर्पिता । ततोऽसौ कियत्कालं सूरिपदं व्यभूषयत्, तदन्तरेऽपि  
ग्रन्थविलेखने देशनादाने च तेन सर्वथा समयो व्ययितः । महा-  
त्मनां क्षणोऽपि जगज्ञनानाममूल्य इति को न विजानाति ? ।  
धार्मिकसामाजिकोन्नतिकारकप्रवचनप्रदानेन सह कानिचिद्वार्मिक-  
क्षेत्राणि गुरुकुलविद्यानिकेतनानि च साहाय्यदानद्वारासज्जीवनानि  
विहितवान् सः । अभ्यस्तयोगविद्यः स गुरुभक्तिमेव मुख्यतोऽम-  
न्यत । इति तदुपदेशेन निर्मापितानि श्रीमद्बुद्धिसागरसूरीधरस्य  
गुरुमन्दिराणि सूचयन्ति । आर्यसमाजिसनातनधर्मियिस्तिपारसिक-  
यवनानां धर्मस्थानेषु गत्वा स्वयं व्याख्यानानि धर्मप्रवृत्तयेऽदात् ।  
तेन च नरेशाननेकधा प्रबोधयता राज्यस्थानेषु सदुपदेशेनाहिसाधर्मः

वृत्तान्तम् । ७

४१

प्रतिष्ठितः । सततं विहारप्रियः स सूरि: क्रमेण श्रीनगर (अमदावाद)–सुरत–मुम्बापुरी–पट्टण–राजधन्यपुर (राधनपुर) विजयपुर (विजापुर) सानन्द–प्रान्तिक (प्रांतिज) वटपल्ली (बड़ाली) प्रलहादनपुर–महेशान–उमापुर (उंझा) पादलिम (पालीताणा)–यामनगर–अमदावाद–प्रांतिज–पेथापुर–विजापुर–महानसादिपत्तनेषु—चातुर्मासीः कृतवान् । इत्थं स महानपि सभाजकार्याणि धर्मबुद्ध्या साधयन् महत्त्वमानं मनसाऽपि नाऽचिन्तयत्, अन्यान् प्रभावशालिनो विधातुं सदैव स प्रमुदितोऽभूत् । अतस्तेन सतीर्थ्याभ्यां मुनिश्रीऋद्धिसागर-मुनिश्रीकीर्तिसागराभ्यां मुनिश्रीदुर्लभविजय–मुनिश्रीरङ्गविमल–अञ्चलगच्छीयमनश्रीदानसागरे भ्यो गणिपदं पद्म्यासपदञ्च व्यतीर्यत ।

ततः पञ्चाशीत्युत्तरैकोनविंशतितमे वैक्रमसंवत्सरे चाश्चिनशुक्ल-  
वृत्तीयायां स्वर्गस्थोऽभूत् । येनात्मकल्याणं साधयता जगदुद्धाराया-  
ऽनल्पः परिश्रमः सेवितः, यतोऽधुना सोऽसन्नपि विद्यमानतां भजति ।  
अस्माभिरपि तज्जीवनपरिचयेन निजात्मकल्याणं शासनजगद्वितं च  
यथास्यात्तथा यतितन्यमितिभावनया तत्संक्षिप्तमजीवनं पूर्णयन्विरमति ।


( माणसा ) कार्तिकशुक्ल-  
पञ्चम्याम् सं. १९९१ }

तत्पादपङ्कजालिमुनि—  
हेमेन्द्रसागरोऽन्तेवासी




  
**परिशिष्टम्**

**कविकुलाऽवतंसपण्डितशिरोमणिमहाकविधनपालविरचित-**  
**तिलकमञ्जरीपीठिका.**



स वः पातु जिनः कृत्स्न—मीक्षते यः प्रतिक्षणम् ।  
 रूपैरनन्तैरेकैक—जन्तोऽर्थात्मि जगत्त्रयम्      || १ ॥  
 प्राज्यप्रभावः प्रभवो—धर्मस्यास्तरजस्तमाः ।  
 ददतां निवृतात्मान—आद्योऽन्येऽपि सुदं जिनाः      || २ ॥

१ विक्रमाकैकोनाशीत्यधिकेकोनविंशतितमे वत्सरे आचार्यत्रीमदजितसागरसू-  
रिविरचिततिलकमञ्जरीप्रकाशिकाख्याकाया: प्रारम्भपदान्यत्र लिख्यन्ते ।

बभूव योऽन्नं प्रथमो नरेशो—योऽभून्मुनीनांप्रथमो वरेण्यः ।  
 यस्तीर्थनाथः प्रथमो व्यराज—त्तमादिनाथं प्रथमं स्तुवेऽहम् ॥ १ ॥  
 श्रीशान्तिनाथं भुवि वैश्वसेनं, प्रशस्तशान्तिप्रदमर्जुनच्छविम् ।  
 शाश्वत्कल्क्षमाङ्कितभूघनं विभुं, स्मरामि नित्यं विनयाञ्चितोऽहम् ॥ २ ॥  
 विनिर्जिताक्षं गतपक्षपातं, लक्ष्यीकृताऽशेषगरोक्षवादम् ।  
 विवक्षितार्थप्रदमाधितानां, श्रीनेमितीर्थाधिपमानमामि      || ३ ॥  
 विभ्राजमानं फणिरादक्षणमिः, प्रदीपसरत्नावलिभिर्नितान्तम् ।  
 सगमज्जनास्त्रुपृशतो निरामयै—रूपास्यमानं प्रभुषाप्रवर्मीडे      || ४ ॥  
 विजित्य मानाद्यरिवर्गमुद्दत्तं, निवृत्तिभाजं त्रिशालात्मजातम् ।  
 सिद्धार्थसूत्रं प्रणमामि भूयो—विज्ञातनिःशेषजगत्प्रभावम्      || ५ ॥

थीठिका.

५१

दिशतु विरतिलाभानन्तरं पार्श्वसर्प-

न्रमिविनमिकृपाणोत्सङ्गदृश्याङ्गलक्ष्मीः ।

त्रिजगदपगतापत्कर्तुमात्ताऽन्यरूप-

द्वय इव भर्गवान् वः सम्पदं नाभिसूनुः ॥ ३ ॥

ध्वानेनामृतवर्धिणा श्रवणयोरायोजनं भ्राम्यता,

भिन्दाना युगापद्विभिन्नविषयं मोहं हृदि प्राणिनाम् ।

आद्ये धर्मकथाविधौ जिनपतेरायस्य वाणी नृणां,

वृन्दैरुद्यदपूर्वविस्मयरसैरगकर्णिता पातु वः ॥ ४ ॥

अव्याज्जगन्ति पुरुषोत्तमनाभिसूते-

देवस्य वक्त्रकमलोदरमावसन्त्याः ।

धौतेवदन्तकिरणप्रकरेण मूर्ति-

देव्या गिरामधिपतेः शरदिन्दुगौरी ॥ ५ ॥

रक्षन्तु स्वलितोपसर्गगलितप्रौढप्रतिज्ञाविधौ,

याति स्वाश्रयमज्ञितांहसि सुरे निःश्वस्य सञ्चारिताः ।

वाग्देवता कल्पितपञ्चविष्टरा, निवर्त्तिताऽज्ञानतमोविताना ।

कराम्बुजस्थस्फटिकाक्षमाला, विचिन्तनीयाऽस्ति सुचिन्तितप्रदा ॥ ६ ॥

गुरुं गुणजं सुविद्यां सुसंमतं, तत्त्वार्थरत्नाकरमात्मनिष्ठम् ।

बुद्धिप्रभाभास्वदशेषपतत्वं, नमामि सूरीश्वरबुद्धिसामरम् ॥ ७ ॥

थैर्निर्मिता ग्रन्थतिर्विभास्वरा, दीपयमाना वरिवर्ति लोके ।

महाकवीशाः स्मृतिगोचरास्ते, भवन्तु लोकोपकृतौ परायणाः ॥ ८ ॥

कवीशधनपालेन, कृता तिलकमञ्जरी ।

प्रकाशिकाख्यां, तटीकां कुर्वे सदबोधहेतवे ॥ ९ ॥

१ भगो ज्ञानादिसम्पत्तिरस्त्यस्येति भगवान्-तथा च—

भगोऽर्कज्ञानमाहात्म्य—यशोवैराग्यमुक्तिषु ।

रूपवीर्यप्रयत्नेच्छा—श्रीधर्मेश्वर्योनिषु ॥ १ ॥

तत्र योन्यर्कभिज्ञायोऽन्न भगवान्दो ग्रास्यः ।

५२

तिलकमजरी-

आजानुश्रितिमध्यमग्रपुषश्चकाभिघातव्यथा—  
 मूर्च्छान्ते करुणाभराङ्गितपुटा वीरस्य वो दृष्टयः ॥ ६ ॥  
 प्रबन्धानामनध्यायः, सा वाग् जयति शुद्धया ।  
 यथा प्रतिपदेवेन्दुः, कविः क्षीणोऽपि जीवति ॥ ७ ॥  
 वन्द्यास्ते कवयः काव्य—परमार्थविशारदाः ।  
 विचारयन्ति ये दोषान्, गुणांश्च गतमत्सराः ॥ ८ ॥  
 वार्योऽनार्यः स निर्देषे, यः काव्याऽध्वनि सर्पतांम् ।  
 अग्रगामितया कुर्वन्, विन्नमायाति सर्पतांम् ॥ ९ ॥  
 शेषे सेवाविशेषं ये, न जानन्ति द्विजिह्वतः ।  
 यान्तो हीनकुलाः किं ते, न लज्जन्ते मनीषिणाम् ॥ १० ॥

व्याख्या—शेष इति ‘ये’ ‘हीनकुलाः’—दुर्जनाः, ‘शेषे’ स्वस्मादतिरिक्ते सेवाविशेषं’ सेवाविधिं, यद्वा शेषे से-शकार-षकार—सकारविषयकं भेदं ‘द्विजिह्वतः’ रसनाद्वयात्, ‘न जानन्ति न विदन्ति, ‘ते’ अकुलीनाः’ ‘मनीषिणां’ पण्डितानां, मध्यमिति गम्यम् । ‘यान्तः’ ब्रजन्तः किं न लज्जन्ते—अर्थात् लज्जां प्राप्नुवन्त्येव अहिपक्षे—‘अहीनकुलाः’ अहीनां—सर्पाणां, इनानां स्वामिनां कुलमन्वयो येषां ते—अहीनवंशोऽव्वाः ‘ये’ भुज-ङ्गमाः द्विजिह्वते सति ‘शेषे’ शेषनागे सेवेत्यादिपूर्ववद् ॥ १० ॥

अधुना कविगुणं दर्शयति—

स्वादुतां मधुना नीताः, पशूनामपि मानसम् ।  
 मदयन्ति न यद्वाचः, किं तेऽपि कवयो भुवि ॥ ११ ॥

१ विशिष्टामी—अथियं राति—भव्यजनेभ्यो ददाति स वीरः । उक्तस्म-

विदारयति यत्कर्म, तपसा च विरजते ।

तपोवीर्येण युक्तश्च, तस्माद्वार इति स्मृतः ॥ १ ॥

२ जीवो—बृहस्पतिरिवाचरति । ३ गच्छताम् । ४ भुजङ्गताम् ।

गीठिका-

५३

व्याख्या—‘यद्वाचः’ येषां गिरः, ‘मधुना’ मधुरत्वेन,  
 ‘स्वादुतां’ स्वादुत्त्वं ‘नीताः’ प्राप्ताः ‘पशूनामपि’ दिवौकसामपि,  
 ‘मानसं’ चित्तं, ‘न मदयन्ति’ न मोदयन्ति, ‘तेऽपि’ तथाविधा  
 अपि, ‘भुवि’ क्षितौ ‘किं कवयः’ अर्थात् कवयो न भवन्ति ।  
 पक्षे—यन्नादाः, चेत्रेण स्वादुतां—स्वादुभावं गताः पशूनां—तिरश्चामपि  
 मानसं न रञ्जयन्ति ते पिकवयः—कोकिलपक्षिणः किम् ॥ ११ ॥

संप्रति काव्यं समीक्षमाण आह

काव्यं तदपि किं वाच्य—मवौच्छि न करोति यत् ।

श्रुतमात्रममित्राणां, वक्त्राणि च शिरांसि च ॥ १२ ॥

उत्पत्तन्त्यजबद् व्योम्नि, केचित्प्राप्तपद्वयाः ।

विशन्त्यन्ये प्रबन्धेऽपि, लब्धेबलिरिव क्षितिम् ॥ १३ ॥

व्याख्या—‘केचित्’ कवयः प्राप्तं पदत्रयं स्त्याद्यन्तं यैस्ते  
 तथाभूता; प्रमाणभूतं चरणत्रयं प्राप्त्य विष्णुवत्, व्योम्नि—अस्वरे,  
 उत्पत्तन्ति प्राप्तुवन्ति । अन्ये—अपरे विवुद्धाः प्रबन्धे लब्धेऽपि,  
 बलिरिव क्षिति, विशन्ति—बुद्धिरहितत्त्वात् ।

दुर्जनदशां दर्शयति—

कषायामनेव श्यामेन, मुखेनाधोमुखे क्षणः ।

काव्यहेम्नो गुणान् वक्तित, कल्लाद् इव दुर्जनः ॥ १४ ॥

१ पश्यतीति ( सर्वमविशेषेण—दृश्ये: कुप्रत्ययः ) पशुः ।

मृगादौ प्राणिनि प्रमथे, प्राणिमात्रे शिवात्मनि ।

यज्ञीयोदुम्बरे छागे, अजेऽपि पशुयज्ञके ॥ १ ॥

शैवागमप्रसिद्धात्म—न्यग्नी च चित्रपादपे ।

पशुर्मासादिकेऽज्ञाने, पशुर्हव्यर्थमव्ययम् ॥ २ ॥

इति शब्दसिन्धुः ।

२ वक्त्रविशेषेण—न विद्यते वाग् येषु तानि, अवाच्छि—वचनरहितानि ।

शिरोविशेषेण—अवाच्छीति—अव—अथःअचन्ति—अधोगतानि ।

३ कषपहेनेव ४ पश्यतीहरः ।

५४

तिलकमञ्जरी-

## अमनोहरं गदं निर्दिशति--

अखण्डदण्डकारण्य—भाजः प्रचुरवर्णकात् ।  
 व्याघ्रादिव भयाघ्रातो—गदाद् व्यावर्त्तते जनः ॥ १५ ॥  
 वर्णयुक्ति दधानाऽपि—स्निग्धैङ्गनमनोहराम् ।  
 नातिश्लेषघना श्लाघां, कृतिर्लिपिरिवाश्रुते ॥ १६ ॥  
 अश्रान्तगद्यसन्ताना, श्रोतृणां निर्विदे कथा ।  
 जहाति पद्मप्रचुरा, चम्पूरपि कथारसम् ॥ १७ ॥  
 सत्कथारसवन्धेषु, निवन्धेषु नियोजिताः ।  
 नीचेष्विव भवन्त्यर्थाः, प्रायो वैरेस्य हेतवः ॥ १८ ॥  
 नमो जगन्नमस्याय, मुनीन्द्रायेन्द्रभूतये  
 यः प्राण्य त्रिपदीं वाचा, विश्वं विष्णुरिवानशो ॥ १९ ॥  
 प्रस्तावनादिपुरुषौ, रघुकौरववंशयोः ।  
 वन्दे वाल्मीकिकानीनौ, सूर्यचन्द्रमसाविव ॥ २० ॥  
 सत्यं बृहत्कथाम्भोधे—र्विन्दुमादाय संस्कृताः ।  
 तेनेतरकथाः कर्त्त्वाः, प्रतिभान्ति तदग्रतः ॥ २१ ॥  
 जितं ग्रवरसेनेन, रामेणेव महात्मना ।  
 तरत्युपरि यत्कीर्तिः, सेतुर्बाँडमयवारिधे ॥ २२ ॥  
 प्रसन्नगम्भीरपथा, रथाङ्गमिथुनाश्रया ।  
 पुण्या पुनाति गङ्गेव, गां तरङ्गवती कथा ॥ २३ ॥

१ दण्डकः छन्दो—विशेषः पक्षे दण्डकनामाऽरण्यम् । २ वर्णाः कादयः,  
 पीतादयश्च । ३ स्तिंगधामिति भिजं पदं रसयुक्तां, स्तिंगधेनाङ्गनेन मनोहराम् ।  
 ४ उद्गेगाय । ५ विरसत्त्वं, विद्वेष्ट्वेति पृथक्पदम् । ६ जीर्णवसनखण्डानि ।

७ पादलिप्ताचार्यनिर्मितेयं तरङ्गवती कथा विद्यते । यतः—निर्वाणकलिका  
 काल—ज्ञानप्रश्नप्रकाशकः । तरङ्गवतीत्याङ्गुष्ठेखात् ।

विद्यमानसमयोऽस्य सूर्यविक्रमसंवत्प्रदृष्ट्यविकशतद्वयप्रभितः, दोक्षासमयम्

पीठिका.

५५

प्राकृतेषु प्रवन्धेषु, रसनिष्यन्दिभिः पदैः ।  
राजन्ते जीवदेवस्य, वाचः पल्लविता इव ॥ २४ ॥

म्लायन्ति सकैलाः कालि-दासेनासन्नवर्त्ति ना ।  
गिरः कवीनां दीपेन, मालतीकलिका इव ॥ २५ ॥

केवलोऽपि स्फुरन् बाणः, करोति विमदान् कवीन् ।  
किं पुनः कल्पसन्धानं-पुलिन्धकृतसन्निधिः ॥ २६ ॥

व्याख्याः--केवलोऽपि बाणः—बाणकविः, पक्षे सायकः, कवीन्—काव्य—कर्त्तृन्, पक्षे कस्य—वारिणो वयः—हंसाद्यस्तान्, विमदान्—मदरहितान् करोति, किं पुनः कल्पं—कृतं सन्धानं—कादस्वर्या उत्तर्धनिर्मितिरूपं येन स चासौ पुलिन्धो बाणसूनुस्ततः सन्निधिः सामीप्यं यस्य सः । पक्षे कल्पं—सन्धानं करयोजनादिकं येन स चासौ पुलिन्धो भिलस्तत्कृतं सन्निधानं यस्य सः ॥ २६ ॥

तृतीयशताब्द्याः समीपवत्तीं, अष्टहायनो दीक्षितः । निजगुरुणाऽर्यनागहस्तिना पद्धधरं विदित्वा दशहायनाय तस्मै सूरिपदं प्रादायि, फुलश्रेष्ठिनामाऽस्य पिता, माता च प्रतिमाभिधा, वैरोच्यादेवीप्रसादतः स जात इति मातापितृभ्यां नागेन्द्रनामाचक्रे । अवन्ध्याधिपतिविजयब्रह्मनृपतिसमयेऽस्य जन्म संभाव्यते । पादलेपत्यभिधानं कारणवशाद्गुरुणा प्रकल्पितम्, आदिमाऽवस्थाऽनेन मधुरायां पाटलीपुत्रे च व्ययिता, शेषसमयो मानखेटप्रतिष्ठानपुरयोर्वित्वा सौराष्ट्रदेशे विहरन् समाप्तिऽनेन । पाटलीपुत्राधिपतिमुण्डराजः प्रतिष्ठानपुरेशः सातवाहनः मानखेटप्रतिकृष्णराजादयश्चैते भूपतयशारित्रविद्वत्ताभ्यां तद्वत्ताः सञ्चाताः । स च शङ्करवृहस्पतिपाञ्चलादिविद्विद्विर्विवादे विजयं लेभे ।

१ जीवदेवस्मरिविक्रमादित्यसमकालीनो भन्त्रतन्त्रादिविद्यासिद्धः प्राप्तसिद्धिरहु-  
तप्रभावशाली चासीत्, प्रवन्धकारास्तु विक्रमसमकालीनोऽयमितिज्ञापयन्ति तथाऽपि  
पञ्चमशताब्द्यामसौ विद्यमान इति प्रतीयते । प्राकृतग्रन्था बहुवा तर्भिर्मिताः प्रतीयन्ते ।

२ समस्ताः कलेन—मधुरेण व्यक्तेन च अनिना सहिताः ।

५६

तिलकमञ्जरी-

कादम्बरीसहोदर्या, सुधया वैवुधे हृदि ।  
हृषीरूपायिकया रूपातिं, बाणोऽधिरिव लब्धवान् ॥ २७ ॥

माघेन विन्नितोत्साहा—नोत्सहन्ते पदक्रमे ।  
स्मरन्ति भारवेरेव, कवयः कपयो यथा ॥ २८ ॥

व्याख्यार्थः—माघेन—माघकविना, पक्षे माघमासा, विन्नित  
उत्साहो येषां ते तथाभूताः कवयः, कपय इव पदक्रमे—काव्यरच-  
नायां, पक्षे चरणानां विन्यासे, नोत्सहन्ते उत्साहं न कुर्वन्ति, अपि च  
भारवे:—भारविकवेः, पक्षे सूर्यस्य, भाः—किरणानेव स्मरन्ति ॥ २८ ॥

निरोद्धुं पार्यते केन, समरादित्यजन्मनः ।  
प्रशमस्य वशीभूतं, समरादि त्यजन्मनः ॥ २९ ॥

व्याख्यार्थः—समरादित्यात्—समरादित्यनृपकथानकात् जन्म—  
प्रादुर्भावो यस्य तथाभूतस्य प्रशमस्य-शान्तेर्वशीभूतं, समरादि-युद्धादि  
त्यजत्—परिहरत् मनश्चेतो निरोद्धुं—वशीकर्तुं केन पार्यते—शक्यते !

स्पष्टभावरसा चित्रैः, पदन्यासैः प्रवर्त्तता ।  
नाटकेषु नटखीव, भारती भवभूतिना ॥ ३० ॥

दृष्टा वाक्यतिराजस्य, शक्ति गौडवधोद्धराम् ।  
बुद्धिः साधवसरद्धेव, वाचं न प्रतिपद्यते ॥ ३१ ॥

भद्रेकीर्तेष्वमत्याशाः, कीर्तिस्तारागणाध्वनः ।  
प्रभा ताराधिपस्येव, श्वेताम्बरशिरोमणः ॥ ३२ ॥

१ माधुर्यादिना स्वोपज्ञकादम्बरीकथातुल्यया, पक्षे कादम्बर्या—मदिरायाः सहोदर्या ।

२ विद्वानानां—पण्डितानां देवानाष्वेदं तस्मिन् । ३ वज्राम्ना आरूपायिकया—  
प्रसोदारूप्या च । ४ चतुश्वत्वारिंशदशिकचतुर्दशशतप्रन्थकर्तृश्रीहरिभद्रसूरि-  
चिता समरादित्यकथा प्राकृताऽधुना मुद्रिता लभ्यते ।

५ बप्पमद्विराचार्यः पञ्चलदशनिवासी । बप्पिरततिपता, दन्माता च भट्टिनामनी,

पीठिका.

५७

समाधिगुणशालिन्यः, प्रसन्नपरिपक्वित्रमाः ।  
यायावरकवेदाचो—मुनीनामिव वृत्तयः ॥ ३३ ॥

सूरिर्महेद्र एवैको—वैबुधाराधितक्रमः ।  
यस्याऽमत्तर्योचितप्रौढि, कविविस्मयकृद्वचः ॥ ३४ ॥

समदान्धकविध्वंसी, रुद्रः कैर्नाऽभिनन्द्यते ।  
सुश्किष्टा ललिता यस्य, कथा त्रैलोक्यसुन्दरी ॥ ३५ ॥

सन्तु कर्द्मराजस्य, कर्थं हवा न सूक्तयः ।  
कविष्वैलोक्यसुन्दर्या—यस्य प्रज्ञानिधिः पिता ॥ ३६ ॥

केचिद्वृचसि वाच्येऽन्ये, केऽप्यशून्ये कथारसे ।  
केचिद्गुणे प्रसादादौ, धन्याः सर्वत्र केचन ॥ ३७ ॥

अस्त्याश्र्वयनिधानमर्बुद इति ख्यातो गिरिः खेचरैः,  
कृच्छ्रालङ्घितदिग्विलङ्घिशिखरग्रामोऽग्रिमः द्वमाभृताम् ।  
मैनाकेन महार्णवे हरतनौ संत्या प्रवेशे कृते,  
येनैकेन हिमाचलः शिखरिणां पुत्रीति लक्ष्योऽभवत् ॥ ३८ ॥

वासिष्ठैः स्म कृतस्मयो वरशतैरस्त्यग्निकुण्डोऽद्वचो—  
भूपालः परमार इत्यभिधया ख्यातो महीमण्डले ।

निजाभिधानं सुरपालः, सप्तमे वर्षे स दीक्षामग्रहीत् । सिद्धेनाचार्यस्तद्गुरुस्तन्माता पितृसन्तोषात् वप्पमद्विरिति नाम चकार । सुख्यमभिधानं तु भद्रकीर्तिरित्यासीत् । कनोजधराधिप आमराजस्तं भित्रसममन्यत, मरणसमये च तं गुरुभूतं मन्यते स्म । ‘गउडवह’ नाममहाकाव्यकर्ता महाकविश्रीवाक्पतिस्तस्य च—रमावस्थायां प्रतियोधकर्त्ताऽपि स बभूवेति श्रूयते । अस्य जन्म वि. सं. (८००) भाद्रपदनृतीयायां रवौ हस्तनक्षत्रे, दीक्षा च (८०७) वैशाखशुक्लनृतीयायाम् । आचार्यपदं सं (८११) चैत्रकृष्णाष्टम्यां, स्वर्गवासः (८१५) श्रावणशुक्लाष्टम्यां स्वातौ । तारागणाभिधं ग्रन्थं स विहितवान्, योऽधुना दृष्टिगोचरो न भवति ।

( १ ) रुद्रनामकविः, शङ्करश्च । ( २ ) सत्या—पार्वत्या ।

५८

तिलकमञ्जरी.

अद्याऽप्युदत्तहर्षगद्वगिरो गायन्ति यस्याबुद्दे,  
विश्वामित्रजयोर्जितस्य भुजयोर्विस्फूर्जितं गुर्जराः ॥ ३९ ॥

तस्मिन्नभूद्रिपुकलत्रकपोलपत्र—वल्लीवितानपरशुः परमारवंशे ।  
श्रीवैरसिंह इति दुर्धरसैन्यदन्ति-दन्ताप्रभिन्नचतुरर्णवकूलभित्तिः ॥ ४० ॥

तत्राऽभूद्वसतिः श्रियामपरया श्रीहर्ष इत्याख्यया,  
विख्यातश्चतुरम्बुराशिरसनादाम्नः प्रशास्ता भुवः ।  
भूपः खर्वितवैरिवर्गगरिमा श्रीसीयकः सायकाः,  
पञ्चेषोरिव यस्य पौरुषगुणाः केषां न लग्ना हृदि ॥ ४१ ॥

तस्योद्ग्रयशाः समस्तसुभटग्रामाग्रगामी सुतः,  
सिंहो दुर्धरशत्रुसिन्धुरतते श्रीसिन्धुराजोऽभवत् ।  
एकाधिज्यधनुर्जितादिवलयावच्छिन्नभूर्यस्य स—  
श्रीमद्राक्षपतिराजदेवनृपतिर्वाराग्रणीरत्रजः ॥ ४२ ॥

आकीर्णाङ्गुष्ठितलः सरोजकलशच्छत्रादिभिर्लोऽछनै—  
स्तस्याऽजायत मांसलायुतभुजः श्रीभोज इत्यात्मजः ।  
प्रीत्या योग्य इति प्रतापवसतिः ख्यातेन मुञ्जाख्यया,  
यः स्वे वाक्पतिराजभूमिपतिना राज्ये ऽभिषिक्तः स्वयम् ॥ ४३ ॥

देव्या विभ्रमसदा पद्मवसतेः, कर्मवतंसं क्षितेः,  
सौभाग्यप्रतिपक्षमिन्दुमहसः सर्गाङ्गुतं वेधसः ।  
धत्ते योऽवधिभूतमीक्षणहृतां नेत्राऽमृतं योषितां,  
रूपन्यककृतकाममद्वृतमणिस्तम्भाभिरामं वपुः ॥ ४४ ॥

आयाता शरदित्युदीर्य मुदितैर्दारैः पुरो दर्शिता—  
लीलोद्यानभवा नवाः सुमनसः सप्तच्छदक्षमारुहाम् ।

१ पञ्च इष्वो यस्य सः, “ सम्मोहनोन्मादनौ च, शोषणस्तपनस्तथा ।  
स्तम्भनश्चेति कामस्य, शराः पञ्च प्रकीर्तिः ” ॥ १ ॥

पीठिका.

५९

यत्सैन्यागमशङ्किनामसुहृदामाकृष्टगन्धा इव,

श्रासैः खेदनिरायतैर्विदधिरे सद्यः शिरोवेदनाम् ॥ ४५ ॥

श्रुत्वा यं सहसागतं निजपुरात् त्रासेन निर्गच्छतां,

शत्रूणामवरोधनैर्जललवप्रस्यन्दतिम्यत्पुटाः ।

शुभ्रे सद्यनि पल्लविन्युपवने वाष्यां नवाभ्योरुहि,

क्रीडादौ च मुहुर्मुहुर्विवलितश्रीवैर्विमुक्ता दृशः ॥ ४६ ॥

प्रासादेषु त्रुटितशिखरश्चभ्रलब्धप्रवैशौः,

प्रातः प्रातस्तुहिनस्तिलैः शौर्वरैः ऋषिपितानि ।

धन्याः शून्ये यदरिनगरे स्थाणुलिङ्गानि शाखा-

हस्तस्तैः कुसुमनिकरैः पादपाः पूजयन्ति ॥ ४७ ॥

येषां सैन्यभराहितोरगपतिश्रान्ति प्रयातां बहि—

र्जायन्ते स्थगिता हिमांशुमहसः श्वेतातपत्रैर्दिशः ।

आभान्ति प्रभवो नृणामितरवत्तेऽत्यागताः सेवया,

यस्याऽनेकजनाकुले निजवपुर्मात्राः सभामण्डपे ॥ ४८ ॥

न स्वप्रेऽपि समाश्रिता रिपुजनं म्लानि गता नोन्नतौ,

लग्ना साधुगुणद्विषां शुचितया कर्णे न दुष्टात्मनाम् ।

निर्दोषाहमनेन दिक्षु गमितेत्यात्मीयवार्तामिव,

व्याकर्तुं ब्रजति स्म यस्य तरसा कीर्तिः सुरेन्द्रालयम् ॥ ४९ ॥

निःशेषवाऽमयविदोऽपि जिनागमोक्ताः,

श्रोतुं कथाः समुपजातकून्हलस्य ।

तस्यावदातचरितस्य विनोदहेतो—

राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ ५० ॥

१ ग्रासादेषु—देवमन्दिरेषु । २ त्रुटितशिखराणां श्वश्राणि—महान्ति छिद्राणि तेषु लङ्घः प्रवेशो यैस्ते तथाभूतैः । ३ त्रुटितशिखरेष्विति सप्तम्यन्तपाठे इदं प्रासाद—विशेषणं योज्यं तदाऽभ्राणीत्यादिव्याख्येयम् । ४ स्थाणुलिङ्गानि—शङ्करलिङ्गानि ।

६०


तिलकमञ्जरी-

आसीद् द्विजन्माऽखिलमध्यदेशे, प्रकारयसाङ्काइयनिवेशजन्मा ।  
अलब्धदेवर्षिरिति प्रसिद्धिं, यो दानवर्षित्वविभूषितोऽपि ॥ ५१ ॥

शास्त्रेष्वधीती कुशलः कलासु, बैन्धे च बौघे च गिरां प्रकृष्टः ।  
तस्यात्मजन्मा समभून्महात्मा, देवः स्वयम्भूरिव सर्वदेवः ॥ ५२ ॥

तज्जन्मा जनकाङ्ग्रिपङ्कजरजःसेवाप्रविद्यालब्दो—

विप्रः श्रीधनपाल इत्यविशदामेतामवधनात्कथाम् ।  
अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने यः सर्वविद्याविधना,  
श्रीमुञ्जेन ‘सरस्वतीति’ सदसि क्षोणीभूता व्याहृतः ॥ ५३ ॥



१ यो देवऋषिः स दानवकृषिरितिविरोधस्तत्परिहारस्तु दानस्य वर्षितवेन किं  
वा देवर्षिरिति नाम्ना । २ बन्धे—ग्रन्थे । ३ बोधे—अवगमने । ४ सर्वदेवा-  
भिधः पुत्रः । पक्षे सर्वे देवा यस्य सः ।

५ पदे पदे चाहतार्थस्य दीव्या, वाक्ये वाक्ये मिष्ठान—इस्याश्वरम्या ।  
पत्रे पत्रे दृश्यते इस्या रसत्त्वं, पुष्टे पुष्टे निर्जीरा: सद्रसानाम् ॥ १ ॥  
रसन्युतेयं ‘तिलकादिमञ्जरी’—कथाऽखिला श्रोत्रसुधाप्रदायिनी ।  
पदे पदे नूतनभाववाहिनी, वागर्थगाम्भीर्यविराजमाना ॥ २ ॥  
रम्यं रम्यं वर्णनं यत्र तत्र, श्रुत्वा श्रुत्वा को न तृसि प्रयाति ।  
दृष्ट्वा दृष्ट्वा लङ्घतिभ्राजमानां, वाचमृद्धिं रज्यते सर्वलोकः ॥ ३ ॥  
यस्यां कासं कासदं चित्तहारि, श्रेयोमूलं सेवनीयं ‘चरित्रम् ।  
प्राचीनानां पावनं पावकानां, गीतं स्फीतं शुद्धमावोपपत्रम् ॥ ४ ॥  
लिङ्गधार्थेयं गद्यभूता प्रभूता, सत्काव्यानां भूरिभूषां विभर्ति ।  
यस्मात्सर्वः काव्यसंपादितोर्थं—व्याख्यातोऽस्यां वाग्विवित्रप्रभावः ॥ ५ ॥

सं० मुनिहेमेन्द्रसागरः

३  
द्वितीयं परिशिष्टम् ।  
४  
( जिनस्तुतेर्विंशिष्टपद्यानि )

श्रीशोभनमुनिप्रणीता सम्पूर्णा जिनचतुर्विंशतिका कृतिर्विविधज्ञन्दोऽलङ्कारवि-  
भूषितपद्याऽस्तिमिकाऽस्ति, तत्राऽपि प्रतिभाशालिनां चमत्कृतिकारकाणि कानिचिद्  
विशिष्टपद्यान्यत्र प्रदर्श्यन्ते—

( १ )

**श्रीऋषभजिनस्तुतिः ।**

भव्याम्भोजविवोधनैकतरणे ! विस्तारिकर्मावली—  
रम्भासामज ! नाभिनन्दन ! महानष्टापदाभासुरैः ।  
भक्त्या वन्दितपादपद्य ! विद्वुषां संपादय प्रोज्जिता—  
रम्भासाम ! जनाभिनन्दन ! महान्, अष्टापदाभासुरैः ॥ १ ॥  
शार्दूलविकीर्डितम् ।

( २ )

**श्रीरोहिणीस्तुतिः ।**

विशिखशङ्खजुपा धनुषाऽस्तसत—  
सुरभिया ततनुब्रमहारिणा ।  
परिगतां विशदामिह रोहिणी  
सुरभियाततनुं नम हारिणा      || २६ ॥  
द्रुतविलम्बितम् ।

( ३ )

**समस्तजिनवरप्रार्थना ।**

विधुतारा ! विधुताराः !  
सदा सदाना ! जिना ! जिताघाताघाः ? ।

जिनस्तुते-

तनुतापातनुतापा !

हितमाहितमानवनवचिभवा ! विभवा : ! ॥ १८ ॥

आर्यागीतिः ।

( ४ )

कालीदेवीस्तुतिः ।

नगदाऽमानगदा मा—

महो ! महोराजिराजितरसा तरसा ।

घनघनकाली काली

बतावतादूनदूनसत्रासत्रा ॥ २० ॥

आर्यागीतिः ।

( ५ )

श्रीसिद्धान्तस्वरूपम् ।

श्रान्तिच्छिदं जिनवरागममाश्रयार्थ—

माराममानम लसन्तमसङ्गमानाम् ।

धामाग्रिमं भवसरित्पतिसेरुमस्त—

माराममानमलसन्तमसं गमानाम् ॥ २३ ॥

वसन्ततिलका ।

( ६ )

श्रीजिनसमूहध्यानम् ।

ब्रजतु जिनततिः सा गोचरे ( रं ) चित्तवृत्तेः

सद्मरसहिताया बोधिका मानवानाम् ।

पदमुपरि दधाना वारिजानां व्यहार्षीत्

सद्मरसहिताया बोधिकामा नवानाम् ॥ २६ ॥

मालिनीछन्दः ।

विशिष्टपदानि:

६३

( ७ )

### सिद्धान्तस्तुतिः ।

सिद्धान्तः स्ताद् अहितहतये ऽख्यापयद् यं जिनेन्द्रः  
सद्राजीवः स कविधिषणापादनेऽकोपमानः ।  
दशः साक्षाच्छ्रवणचुलुकैर्यं च मोदाद् विहायः—  
सद्राजी वः सकविधिषणाऽपादनेकोपमानः ॥ ३१ ॥

मन्दाक्रान्ता ।

( ८ )

### श्रीजिनेन्द्राणां स्तुतिः ।

जिनवरततिर्जीवालीनामकारणवत्सलाऽ—  
समदमहिताऽमारा दिष्टासमानवराऽजया ।  
नमदमृतभुक्पङ्कत्या नूता तनोतु मति ममाऽ—  
समदमहितामारादिष्टा समानवराजया ॥ ४२ ॥

हरिणीछन्दः ।

( ९ )

### जिनभारत्याः स्वरूपम् ।

नित्यं हेतूपपत्तिप्रतिहतकुमतप्रोद्धतध्वान्तवन्धा—  
ऽपापायाऽसाद्यमानाऽमदन ! तव सुधासारहृद्या हितानि ।  
बाणी निर्वाणमार्गप्रणयिपरिगता तीर्थनाथ ! क्रियान् मे—  
ऽपापायासाद्यमानामदनत ! वसुधासार ! हृद्याहितानि ॥ ४७ ॥

स्वग्धरात्रत्तम् ।

( १० )

### समस्तजिनवराणां स्तुतिः ।

सदानवसुराजिता असमरा जिना भीरदाः,  
क्रियासु रुचितासु ते सकलभारतीरा यताः ।

६४

जिनस्तुति-

सदानवसुराजिता असमराजिनाभीरदा,  
क्रियासुरुचितासु ते सकलभा रतीरायताः ॥ ५० ॥  
पृथ्वीछन्दः ।

( ११ )

## श्रीचक्रधरायाः स्तुतिः ।

याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता हुतात्—  
समतनुभागविकृतधीरसमदैरिव धामहारिभिः ।  
तडिदिव भाति सान्ध्यघनमूर्धनि चक्रधराऽस्तु सा मुदेऽ—  
समतनुभा गवि कृतधीरसमदैरिवधा महारिभिः ॥ ७२ ॥

द्विपदीछन्दः ।

( १२ )

## श्रीकपर्दियक्षराजस्मृतिः ।

द्विपं गतो हृदि रमतां दमश्रिया  
प्रभाति मे चकितहरिद्विपं नगे ।  
वटाहये कृतवसतिश्च यक्षराट्  
प्रभातिमेचकितहरिद्वि विपन्नगे ॥ ७६ ॥

रुचिराछन्दः ।

( १३ )

## श्रीगोरीदेव्याः स्तुतिः ।

अधिगतगोधिका कनकरुक् तव गौयुचिता—  
ङ्गमलकराजि तामरसभास्यतुलोपकृतम् ।  
मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती  
कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ८० ॥  
तत्कृटकवृत्तम् ।

विशेषपदानि:

६५

( १४ )

## श्रीनेमिजिनस्तुतिः ।

चिक्षेपोर्जितराजकं रणमुखे यो लक्ष्यसंख्यं क्षणा—

दक्षामं जन ! भासमानमहसं राजीमतीतापदम् ।

तं नेमि नम नमनिर्वृतिकरं चक्रे यदूनां च यो

दक्षामञ्जनभासमानमहसं राजीमतीतापदम् ॥ ८५ ॥

शार्दूलविक्रीडितम् ।

( १५ )

## अम्बादेव्याः स्तुतिः ।

हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जनोऽभ्यागमद्

विश्वासेवितताम्रपादपरतां वाचा रिपुत्रासकृत् ।

सा भूतिं वितनोतु नोऽर्जुनरुचिः सिहेऽधिरूढोलसद्--

विश्वासे वितताम्रपादपरताऽम्बा चारिपुत्राऽसकृत् ॥ ८६ ॥

शार्दूलविक्रीडितम् ।

( १६ )

## श्रीपार्थनाथस्तुतिः ।

मालामालानबाहुर्दधदधरं यामुदारा मुदारा—

लीनाऽलीनामिहाली मधुरमधुरसां सूचितोमाचितो मा ।

पातात् पातात् स पार्थो रुचिररुचिरदो देवराजीवराजी—

पत्राऽपत्रा यदीया तनुरतनुरवो नन्दको नोदको नो ॥ ८७ ॥

समधरावृत्तम् ।

( १७ )

## जिनेन्द्राणां स्तुतिः ।

राजी राजीववक्त्रा तरलतरलसत्केतुरङ्गतुरङ्ग—

व्यालव्यालम्रयोधाचितरचितरणे भीतिहृद् याऽतिहृद्या ।

६६

जिनस्तुति-

सारा साऽरजिनानामलभमलमतेबोधिका माऽधिकामा—  
दृव्यादृव्याधिकालाननजनजरात्रासमानाऽसमाना ॥ ९० ॥

सम्बन्धरावृत्तम् ।

( १० )

जिनवाणीस्तुतिः ।

सद्योऽसद्योगभिद् वाग्मलगमलया जैनराजीनराजी—  
नूता नूतार्थधात्रीह ततहततमःपातकाऽपातकामा ।  
शास्त्री शास्त्री नराणां हृदयहृदयशोरोधिकाऽबाधिका वाऽस—  
देया देयाद् मुदं ते मनुजमनु जरां त्याजयन्ती जयन्ती ॥ ९१ ॥

सम्बन्धरावृत्तम् ।

( ११ )

श्रीवैरोद्ध्वादेव्याः स्तुतिः ।


याता या तारतेजाः सदसि सदसिभृत् कालकान्तालकान्ताऽ—  
पारि पारिन्द्रराजं सुरवसुरवधूपूजिताऽरं जितारम् ।  
सा त्रासात् त्रायतां त्वामविप्रमविषभृद्भूषणाऽभीषणा भी—  
हीनाहीनाह्यपत्ती कुवलयवलयश्यामदेहाऽमदेहा ॥ ९२ ॥

( २० )

श्रीवीरजिनस्तुतिः ।

नमदमरशिरोरुहस्तसामोदनिर्निद्रमन्दा—  
रमालारजोरञ्जितांहे ! धरीत्रीकृताऽ  
वन ! वरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्या—  
वलीलापदे हेक्षितामोहिताक्षोभवान् ।  
मम वितरतु वीर ! निर्वाणशम्राणि जातावतारो—  
धराधीशसिद्धार्थधाम्नि क्षमालङ्गुताऽ  
वनवरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्या—  
व ! लीलापदे हे क्षितामो हिताक्षोभवान् ॥ ९३ ॥

अर्णवदण्डकच्छन्दः ।


**तृतीयं परिशिष्टम् ।**

( महेन्द्रसूरिचरित्रगतोपयुक्तपद्मानि )

( १ )

तस्य श्रीसर्वदेवाख्यः, सूनुरन्यूनविक्रमः ।  
ब्राह्मणनिष्ठया यस्य, तुष्टाः शिष्टा विशिष्टया      || १० ||

( २ )

तस्य पुत्रद्वयं जड्ये विज्ञेशैरर्चितक्रमम् ।  
आद्यः श्रीधनपालाख्यो द्वितीयः शोभनः पुनः      || ११ ||

( ३ )

चत्वारिंशत्सुवर्णस्य, टंकलक्षा विनिर्येयुः ।  
हष्टेऽपि निःस्पृहोत्तंसः, सूरिः स्वोपाश्रयं ययौ      || २८ ||

( ४ )

श्रीमतः सर्वदेवस्य, श्रीमहेन्द्रप्रभोस्तथा ।  
दानग्रहणयोर्वादो वर्षं यावत्तदाऽभवत्      || २९ ||

( ५ )

अन्यदा सत्यसन्धत्वादू, ब्राह्मणः सूरिमाह च ।  
देयद्रव्येऽत्र ते दत्ते, स्वगृहं प्रविशास्यहम्      || ३० ||

( ६ )

सूरिः प्राहाभिरुचितं, ग्रहीष्ये वचनं मम ।  
भवतिवदं ततो मित्रं ! गृहाण त्वं द्विजोऽवदत्      || ३१ ||

६८

महेन्द्रसूरि—

( ७ )

सूरिराह सुतद्वन्द्वाद् देव्येकं नन्दनं मम ।  
सत्यप्रतिज्ञता चेत् ते, न वा गच्छ गृहं निजम् ॥ ३२ ॥

( ८ )

कार्येणानेन नो कार्यं, मम स्वरुचितं कुरु ।  
तातमित्यवमत्यामुं, स तस्मादन्यतो ययौ ॥ ४७ ॥

( ९ )

अश्रुपूरप्लुताक्षोऽसा, निराशो गुरुसङ्कटे ।  
यावदस्ति समायात् स्तावदागात् सुतोऽपरः ॥ ४८ ॥

( १० )

पृष्ठस्तेनाऽपि दैन्येऽत्र, निमित्तं स तदाऽदत् ।  
धनपालेन कुत्राऽपि, कार्यं प्रतिहृता वयम् ॥ ४९ ॥

( ११ )

भवान् बालस्ततः किन्तु, तत्र प्रतिविधास्यते ।  
गच्छ स्वर्कर्मभोक्तारो—भविष्यामः स्वलक्षणैः ॥ ५० ॥

( १२ )

निराशं वाक्यमाकर्ण्य, तत्पितुः शोभनोऽवदत् ।  
मा तात ! विहळो भूया मयि पुत्रे सति ध्रुवम् ॥ ५१ ॥

( १३ )

वेदस्मृतिश्रुतिस्तोम—पारगः पण्डितोऽप्रजः ।  
कृत्याकृत्येषु निष्णातः, स विवेकतु यथारुचि ॥ ५२ ॥

( १४ )

अहं तु सरलो बाल्या—देतदेव विचारये ।  
पित्रादेशविधेरन्यो न धर्मस्तनुजन्मनाम् ॥ ५४ ॥

चरित्रयतोपत्तुकपदानि ।

६३

( १५ )

अत्र कृत्यमकृत्यं वा, नैवाहं गणयाम्यतः ।

कूपे क्षिप निषादानां, मामर्पय वथारुचि ॥ ५५ ॥

( १६ )

श्रुत्वेति सर्वदेवश्च, तं बाढं परिष्वजे ।

मामृणात् मोचयित्वा त्वं, समुद्धर महामते ! ॥ ५६ ॥

( १७ )

ततः प्रागुक्तकार्यं तत्, श्रावितोऽसौ सुतोत्तमः ।

अतिहर्षात् ततः प्राह, कार्यमेतत्प्रियं प्रियम् ॥ ५७ ॥

( १८ )

श्रीजैना सुनयः सत्य-निधयस्तपसोऽज्ज्वलाः ।

तत्संनिधाववस्थानं, सद्गाम्यैरेव लभ्यते ॥ ५८ ॥

( १९ )

सूरयस्तमनुज्ञाप्याऽदीक्षयस्तं सुतं सुदा ।

तद्विनान्तः शुभे लग्ने, शुभग्रहनिरीक्षिते ॥ ५९ ॥

( २० )

ते विजहुः प्रभाते चा-ऽपभ्राजनविशङ्किताः ।

अणहिल्पुरं प्रापुर्विहरन्तो भुवं शनैः ॥ ६० ॥

( २१ )

एवं द्वादश वर्षाणि, श्रीभोजस्याऽऽज्ञया तदा ।

न मालवे विजहे तत्, श्रीसिताम्बरदर्शनम् ॥ ७३ ॥

( २२ )

चलन्तस्ते हि चक्षुष्या अचक्षुष्याः स्थिताः पुनः ।

तद्वर्णस्तद्रसा जीवास्तदा तेनेक्षिताः स्फुटाः ॥ ८९ ॥

( २३ )

अथ श्रीशोभनो विज्ञोऽभ्यातस्थौ गुरुबान्धवम् ।

आलिलिङ्गे च तेनासौ, सोदररनेह मोहतः ॥ ९७ ॥

७०

महेन्द्रसूति-

( २४ )

तेन चार्द्धासने दत्ते—इग्गेनोपाविशत् तदा ।

उच्चे च पूज्य एव त्वमसुं यो धर्ममाश्रयः ॥ १८ ॥

( २५ )

तसुवाच ततः श्रीमान्, धनपालः श्रियां निधिः ।

प्रतिपन्नो मया जैन—धर्मः सद्रुतिहेतवे ॥ १९ ॥

( २६ )

ततः श्रीमन्महावीर—चैत्यं गत्वा ननाम च ।

वीतरागनमस्कारं, श्लोकयुग्मेन सोऽब्रवीत् ॥ १११ ॥

( २७ )

अन्यदा पर्णिमासंध्या—समये नृपमब्रवीत् ।

जैनदर्शनसंचार—हेतवे देशमध्यतः ॥ ११५ ॥

राज्ञस्तव यशोज्योत्स्नाधवलाम्बरविस्तरः ।

प्रकटस्तमसो हन्ता, भूयादर्थप्रकाशकः ॥ ११६ ॥

( २८ )

एकदा नृपतिः स्मार्त—कथाविस्तरनिस्तुष्टः ।

वयस्यमवद्जैन—कथां श्रावय कामपि ॥ ११४ ॥

( २९ )

द्वादशाथ सहस्राणि ग्रन्थमानेन तां ततः ।

परिपूर्य ततो विद्वत्समूहैरवधारिताम् ॥ ११५ ॥

( ३० )

यथार्था काव्यदोषोद्घारिणीं तिलकमञ्जरीम् । (?)

रसेन कवितारूपचक्षुर्मैल्यदायिनीम् ॥ ११६ ॥

( ३१ )

विद्वज्जनास्यकर्पूर—पूरामां वर्णसंभृताम् ।

सुधीर्विरचयांचक्रे, कथां नवरसप्रथाम् ॥ ११७ ॥

त्रिभिर्विशेषकम् ।

चरि त्रगतोपयुक्तपद्यानि ।

७१

( ३२ )

अथासौ गूर्जराधीश—कोविदेशशिरोमणिः ।

वादिवेतालविशदं, श्रीशान्त्याचार्य माह्यत् ॥ २०१ ॥

( ३३ )

अशोधयदिमां चासावृत्सूत्राणां प्रस्तुपणात् ।

शब्दसाहित्यदोषास्तु, सिद्धसारस्वतेषु किम् ? ॥ २०२ ॥

( ३४ )

मूर्त्येव सरस्वत्या, नवहायनबालया ।

दुहित्रा मन्युहेतुं स पृष्ठस्तथ्यं यथाऽऽह तत् ॥ २१८ ॥

( ३५ )

उत्तिष्ठ तात ! चेद्राज्ञा, पुस्तकं पावके हुतम् ।

अक्षयं हृदये मेऽस्ति, सकलां ते ब्रुवे कथाम् ॥ २१९ ॥

( ३६ )

स्नानं देवार्चनं भक्ति, कुरु शीर्षं यथा तव ।

कथापीठं ददे हृष्टस्ततः सर्वं चकार सः ॥ २२० ॥

( ३७ )

कथा च सकला तेन, शुश्रुवेऽत्र सुतामुखात् ।

कदाचिन्न श्रुतं यावत् तावनास्याः समाययौ ॥ २२१ ॥

( ३८ )

इतश्च शोभनो विद्वान्, सर्वग्रन्थमहोदधिः ।

यमकान्विततीर्थेश—स्तुतिं चक्रेऽतिभक्तिः ॥ २१६ ॥

( ३९ )

तदेकध्यानतः श्राद्ध—गृहे त्रिर्भिक्षया ययौ ।

पृष्ठः शाविकया किन्तु, विरागे हेतुरत्र कः ? ॥ ३१७ ॥

( ४० )

स प्राह न स्तुतिध्यानाज्ञानेऽपश्यद्हो ! गुरुः ।

तत्काच्यान्यथ हर्षेण, प्राशंसत् तं चमत्कृतः ॥ ३१९ ॥

॥ अर्धम् ॥

( वसन्ततिलकावृत्तम् )

विद्वजनप्रथितकीर्तिकलाकलापं,  
 सद्विद्यया विदितवाग्मिवरप्रभावम् ।  
 निर्मानमोहरिपुजालमनन्यशोभं,  
 नित्यं सरामि मुनिशोभनमात्मनिष्ठम् ॥ १ ॥  
  
 कन्दर्पदर्पदलनैकसमुद्यतं तं,  
 विद्राविताऽशुभभयप्रदर्वर्खगम् ।  
 यत्पादपद्मनतमानवमुद्धरन्तं,  
 नित्यं स्मरामि मुनिशोभनमात्मनिष्ठम् ॥ २ ॥  
  
 दिग्देशवृन्दविदितोत्तमकाव्यशक्तिं,  
 विद्याविलासिजनताऽर्पितमोदराशिम् ।  
 सत्काव्यशोधनपरैः स्तुतमेकनादं,  
 नित्यं सरामि मुनिशोभनमात्मनिष्ठम् ॥ ३ ॥  
  
 यः पितृतुष्टिकरणाय वचस्तदीय,—  
 मङ्गीचकार जिनधर्मरतिं दधानः ।  
 दीक्षां ललौ च सुगुरोश्चरणारविन्दे,  
 तं नौमि शोभनमुनिप्रवरं सदाहम् ॥ ४ ॥

अर्थम् ।

७३

ग्रन्थाननेकविदितान् रचयन्ति लोके,  
 पाण्डित्यधारकजना जनतोषहेतोः ।  
 विद्वांस्तथाऽपि विदितोऽयमिति ग्रसिद्धं,  
 नित्यं नमामि मुनिशोभनमात्मनिष्ठम् ॥ ५ ॥

स्वर्गस्थशोभनमुने ! तव पादपद्मे,  
 शुद्धां समर्पयति सत्कृतिमुन्नतार्थाम् ।  
 हेमेन्द्रसागरमुनिष्ठनिर्धर्मनिष्ठः,  
 संशोध्य सद्गुरुकृपावशगोनितान्तम् ॥ ६ ॥

अर्ध्यं समर्पितमिदं मनसोज्ज्वलेन,  
 स्त्रीश्वरस्य चरणाम्बुजयोर्विशुद्धम् ।  
 विद्यावदातमनसो विबुधार्चितस्य,  
 सत्काव्यहेमनिकषोपलसंमितस्य ॥ ७ ॥

ग्रहादनपुरम् ( पालनपुर ) } ले० सं. मुनिहेमेन्द्रसागरः—  
 चैत्रशुक्रत्रयोदशी }



# महानस ( माणसा ) वर्णनम् ।

नमोऽस्तु देवदेवाय, सर्वतेजोऽभिभाविने ।

सर्वसिद्धिनिधानाय, कस्मैचिदीव्यतेजसे ॥ १ ॥

सर्व देवोना देव-अधिपति, सर्व तेजने पराजय करनार,  
अर्थात् सर्व तेजस्थि अधिक तेजस्वी अने सर्व सिद्धियाना  
क्षंडार इप एवा डोष्ट ही० तेजने नमन हो । १

परोपकारप्रवणैकचेतसं, सतां सदा वन्द्यतमकमाम्बुजम्

मोहाऽन्धकारक्षतिभास्वरप्रमं, नमाम्यहं सद्गुरुमीङ्गबोधनम् ॥ २ ॥

परोपकार करवामां ज्ञ प्रवीण छे भन जेमनुं, हमेशां सत-  
पुरुषेने लक्षितपूर्वक वंडनीय छे चरणुकमल जेमना अने भोड-  
रूपी अंधकारने हुरवामां विकस्तर छे कांति जेमनी तेमज द्युत्य  
छे तत्वणेाध जेमनो एवा सद्गुरुदेवने हु नभुं छु । २

श्रीगुर्जराख्योऽतिविभूतिभूषितो—विराजते विश्रुतदीव्यदेशः ।

सद्गर्मसन्नीतिगुणानुसारिणो—वसन्ति यस्मिन्नरदेवमानवाः ॥ ३ ॥

धन धान्यादि संपत्तिथी भरपूर अने सर्वत्र विष्यात गुर्जर  
( शुजरात ) देश उच्य प्रकारनी ज्याति धरावे छे, जे हेशनी  
अंदर उत्तम प्रकारनो धर्म अने उत्तम नीतिना गुणोने धारण  
करनार राज्यो तेमज उत्तम पुढेहो निवास करै छे । ३

देशोऽस्मिन्न विभाति भव्यमुनिभिः संसेवितः कोविदै—

श्चित्रोर्बीर्हवलिवृन्दकलितो दीव्यौषधिभ्राजितः ।

उच्चैः सानुशिखाभिरम्बरतलं स्पष्टुं समुत्कण्ठितः,

श्रीमत्तीर्थकरालयोर्जितविभः पुण्योऽर्बुदोर्बीधरः ॥ ४ ॥

बर्णनम्.

७५

वणी ને દેશની અંદર મહાન् પવિત્ર અર્થુદ્ધાયદ (આખું પર્વત) શોલી રહ્યો છે, જે પવિત્ર ગિરિરાજ શ્રીમાન् તીર્થંકર લગ્વાનના અદ્ભુત મહિદેશી અતિશય શોલા આપે છે, જેથી તત્ત્વજ્ઞાની અનેક મુનિવરો જેના દર્શન માટે વિચરિને જેની સેવા કરી રહ્યા છે, તેમજ જે ગિરિની અંદર અનેક પ્રકારના વૃક્ષો, દીવ્ય ઔષધિઓ અને વિચિત્ર વેદીઓ હુયાતી ધરાવે છે, તેમજ જે ગિરિ અતિ ઉન્નત શિખરોના અથવડે આકાશને સ્પર્શ કરવાને ઉત્કંઠા ધરાવતો હોય તેવો દેખાવ આપે છે. ૪.

શ્રીતારઙ્ગધરાધરો વિજયતે દેશં પુનાનઃ પુનઃ,  
સિદ્ધિસ્થાનમિમં પુરાતનમહાતીર્થેત્તમસ્તવं ગતઃ ।  
યસ્મિન् રાજતિ ભવ્યમૂર્તિરજિતસ્તીર્થઙ્કરઃ કામિતં,  
ભવ્યૈર્દર્શનતઃ શુભાશયજુષૈર્યસ્યાડનિશં લભ્યતે ॥ ૫ ॥

વળી ને ગુર્જર દેશને શ્રી તારંગાળ ગિરિરાજ હંમેશાં પવિત્ર કરી રહ્યો છે, જે ગિરિની અંદર સર્વ સિદ્ધિઓ નિવાસ કરે છે, પ્રાચીન તેમજ અતિ ઉત્તમ મહાન् તીર્થસ્થળ તરીકે જે ગિરિ સર્વત્ર પ્રસિદ્ધ છે, જેની અંદર લભ્ય લૂર્તિમય શ્રીમાન् અન્જિતનાથ લગ્વાનું વિરાજે છે, જેમના દર્શનથી શુલ આશયવાળા લભ્ય પુરુષોના મનોરથ હંમેશાં સિદ્ધ થાય છે. ૫.

સૌરાષ્ટ્રે સુપવિત્રસાધુનિકરૈઃ સંસેવિતો રૈવત,-  
કર્વાસુદ્વરમાનનીયમહિમા પુણ્યાર્થિનાં પાવનઃ ।  
દેવાનાં સ્પૃહણીયભૂરિવિભવો યાત્રાર્થિનાં શર્મદો-  
દીવ્યાનન્દમયઃ સદા વિજયતે શ્રેયોર્થિનાં શાન્તિદઃ ॥ ૬ ॥

તેમજ ને દેશના અંતર્ગત રહેલા સૌરાષ્ટ્ર(કાઠીયાવાડ)માં વિશુદ્ધ આશયવાળા પવિત્ર મુનિવરોથી સેવાયેદ રૈવતક (ગિરિનાર) ગિરિ મહા પવિત્ર હંમેશાં વિજ્યશાળી વર્તે છે, જેનો મહિમા સર્વ સ્થળો પ્રસિદ્ધ અને માનનીય છે, પુષ્યના અલિકાણી જનોને

૭૬

માણસા—

પવિત્ર કરે છે, જેના વૈલખને દેવતાએ પણ અહનિશ યાદ કરે છે,  
યાત્રા માટે આવતા જનોના અભિકાષ પૂર્ણ કરે છે, જેની અંદર  
દીઽય આનંદ વ્યાપી રહ્યો છે અને કુદ્યાણુની અપેક્ષાવાળા જનોને  
સુખશાંતિ સમર્પે છે. ૬.

શ્રીગુજરાતીલરાજ ઉવિતો વિભ્રાજતે યદ્રુવિ,  
નૈકે સિદ્ધગતિ ગતા મુનિવરા યસ્મિન् પવિત્રાશયાઃ ।  
શ્રીમાનાદિજિનેશ્વરાદિરનવસ્તીર્થઙ્કરૌઘઃ સદા,  
મૂર્ત્યા રાજતિ દીવ્યયા ચ શિવદો ભવ્યાત્મનાં ભાવિતઃ ॥ ૭ ॥

વળી જે દેશની સીમાઓં અતિ ઉત્તમતાને પ્રાપ્ત થયેલ શ્રી  
શન્તિઽય ગિરિરાજ દીઽય શોલા આપે છે, જેની અંદર વિશુદ્ધ  
આશયવાળા અનેક મુનિવરે ભોક્ષગતિ પાખ્યા છે. તેમ જ  
શ્રીમાન્ આદિનાથ લગવાન્ આદિ મહાન્ પવિત્ર અનેક તીર્થેંક-  
રોનો સમૂહ જેની અંદર દીઽય મૂર્ત્તિમય હુમેશાં વિરાને છે, જેમની  
ભાવનાથી ભવ્યાત્માએ શિવસુખ પ્રાપ્ત કરે છે. ૭.

સ્વચ્છાસ્વરૂપિ સુલીનમીનમકરાણ્યાબિભ્રતી વિસ્કુરત्—  
કલ્પોલૈશ્વકરમિત્રતા તટગતક્ષોળીરૂહશ્રેणિમિઃ ।  
કૂજત્પક્ષિગણામિરુત્તમજનૈવિભ્રાજમાનાડનિશં,  
યસ્મિન् સાબ્રમતી સતીવ વિમલા વિભ્રાજતે વાહિની ॥ ૮ ॥

જે દેશની અંદર સાબ્રમતી ( સાબ્રમતી ) નહી સતીની માઝેક  
વિશુદ્ધ શુણુમયી વહે છે, જે નહી મીન ( માઘલાં ) મધર વિગેરે  
જળજંતુઓથી વ્યાસ સ્વર્ણ જળને વહુન કરે છે, વળી મધુર નાદ  
કરતા અનેક પક્ષીએ જેમાં રહેલા છે એવા અજે કાંઠા ઉપર રહેલા  
સુંદર વૃક્ષાની શ્રેણીઓથી જે નહી શોલે છે, જેનું નિર્મણ જળ  
તરંગોથી ઉચ્છલતું દીઽય શોલા આપે છે, તેમ જ ઉત્તમ જનોવણે  
નિરંતર અહુલુત શોલા આપે છે. ૮.

वर्णनम् ।

७७

नानापक्षिगणैः सुनादिततटा नित्यप्रवाहोर्मयो—

राजन्ते रजनिकराभसलिला अन्या अपि क्षेमदाः ।

यत्राऽनेकतपस्विनः सुमनसः स्नानादिकां सत्क्रियां,

कुर्वन्तः कल्यन्ति भूतिमस्तिलां नद्यः पयोधिप्रियाः ॥ ९ ॥

वणी ने देशनी अंहर निरंतर प्रवाहमां उच्छिणता तरंगोने वहन करती अन्य नर्मदा निर्गेहे थीलु नहींयो। पणु प्राणीभान्नने सुखदायक वर्ते छे, जेमना कांडायो। उपर अनेक प्रकारना पक्षियोना। समूह मनोहर नाह करे छे, यंद्रना किरणु समान निर्मल जग्नियो। सर्वने तृप्त करे छे, तेम ज विशुद्ध भनवाणा अनेक तपस्वियो। जेमना शुद्ध जग्नमां स्नानादिक धार्मिक डियायो। करे छे, जेथी तेयो। सर्व समृद्धियोना पान अने छे, अने ते सर्व नहींयो। सागरने प्रिय थाय छे—अर्थात् अण्ठ प्रवाहथी सागरने भणे छे. ६.

विश्वोभं सरितां हरन् जलनिधिर्घटक्षिणस्यां दिशि,

रत्नानां निचयं सदा परिद्धद्रत्नाकरत्वं गतः ।

लोलङ्घन्तरङ्गराजिविलसन्मर्यादयासंस्थितो—

गर्जत्यात्मसमुन्नतिं बहुविधां सन्दर्शयन् संज्ञया ॥ १० ॥

ने देशनी दक्षिणु दिशामां सन्तितायोना प्रवहन इप विश्वालने शांत करतो। सागर, संकेतवडे विविध प्रकारनी पौतानी उन्नतिने जाहेर करतो। होय तेम गर्जना करे छे, वणी हमेशां ने समुद्र अभूद्य रत्नेने धारणु करवाथी ‘रत्नाकर’ यो नामथी प्रसिद्ध छे, अने ने भहासागरनी अंहर अण्ठ तरंगोनी ओणीयो। उच्छिणे छे छतां पौतानी भर्तां छेउतो। नथी, जेथी ते सागर क्षेवाय छे. १०.

मैनाकादिनगा यदीयशरणं भेजुः पुरा त्रासिताः,

देवेन्द्रेण गरुदणं क्षपयता दीव्यौषधियोतकाः ।

येनाऽत्रैव बसुन्धराऽस्वरवती प्राज्ञैः सदा गीयते,

विख्यातोऽत्रपरोपकारकरणे धौरेयभावं गतः ॥ ११ ॥

પ્રથમના સમયમાં પોતાની પાંખો કાપવાને તૈયાર થયેલા ઈક્રના ત્રાસથી અધીર થયેલા મૈનાક વિગેરે કેટલાક પર્વતો અનેક હીંય ઔષધિઓ સહિત સાગરને શરણુ રહ્યા છે. અર્થાતુ સાગરમાં વાસ કર્યો છે. વળી જે સાગરવડે આ લોકમાં વસુંધરા-પૃથ્વી વસ્ત્વવાળી છે એમ વિક્રાનો કહે છે. અર્થાતુ પૃથ્વીને વિટાધને સાગર રહ્યો છે. તેમજ જે સાગર આ હુનીયામાં પરૈપકાર કરવામાં મુખ્યપણું લોગવે છે એમાં કંઈપણ સદેહ નથી. ૧૧.

ગામ્ભીર્યેકગુણોડસ્તિ સાગરગતોનાન્યત્ર તલ્લક્ષ્યતે,

આસ્તે ચેન્ન તથાવિધા હૃપમિતિસ્તસ્યાસ્તિ વિરુલ્યાતિભાગ્ય ।

મર્યાદાપિ ન તાદૃશી સ્થિતવતી લોકેપુ સિદ્ધાસ્પદા,

તસ્માત્સાગર એવ સહૃદુણભૂતઃ પીયૂષવાન् કથ્યતે ॥ ૧૨ ॥

વળી ગંભીરતાને શુણું ખાસ સાગરમાં રહેલો છે. તેવી ગંભીરતા અન્ય વિષે દેખાતી નથી, કારણું ગંભીર્યની ઉપમા સાગરની જ અહુધા આપવામાં આવે છે અર્થાતુ તે બાબતમાં તે જ પ્રખ્યાતિ ધરાવે છે. તેમજ સિદ્ધસ્યાનને પ્રામ થયેલી મર્યાદા પણ તેના સરખી અન્યત્ર જોવામાં આવતી નથી, તેથી સહૃદુણોનો આધાર એક સાગર જ અમૃતનિધિ કહેવાય છે. ૧૨.

મહાનસં તત્ત્વ ચ પત્તનં શુભ્ય, નિષેવિતં ધર્મઘનૈર્વણિગ્રબ્ધૈः ।

રાજન્વદાહુઃ સકલાર્થસાધનં, ચતુર્વિર્ધેર્જાતિગણૈ: સમાકુલમ् ॥ ૧૩ ॥

વળી તે શુજ્રાત દેશના ભર્ય વિભાગમાં સર્વસંપત્તિઓના સ્થાનભૂત અને પુષ્ય ભૂમિડ્રષ્પ મહાનસ( માણુસા )નામે નગર શોલે છે, જેની અંદર સુષ્યત્વે કરી ધર્મને જ ધન ભાનનાર ઉત્તમ વણિક જનો નિવાસ કરે છે, તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષદ્રષ્પ ચારે પુરુષાર્થને સમાન લાવે સેવન કરનાર રાજીના આશ્રયથી જે નગર રાજન્વાનુ-ઉત્તમ ન્યાય નિષ્ઠ રાજ્યવાળું ગણ્યાય છે, તેમજ પ્રાક્ષણુ, ક્ષત્રિય, વैશ્ય અને શૂદ્ર એમ ચારે વર્ણુ પોતા-પોતાના અધિકાર પ્રમાણું પ્રવૃત્તિ કરવાને લીધે તે નગર અન્યની અપેક્ષાએ સમૃદ્ધિવાળું હીપે છે. ૧૩.

यदक्षतश्रीप्रथितप्रभावं, विराजते श्रेष्ठिवरप्रधानैः ।

निजेष्टधर्मानुगतस्वभावै—र्विनोददशिल्लैः समभावभावैः ॥ १४ ॥

निरंतर विलक्षी रही छे लक्षभी क्लेनी अने क्लेनो प्रभाव सर्वत्र प्रसिद्ध छे, तेमज विविध प्रकारनी उत्तम शोभाथी विभूषित अवृं ने नगर, पोतपेताना धृष्ट धर्मनी आराधना करवामां तत्पर छे स्वभाव क्लेनो, वणी आनंदमय प्रवृत्तिमां गृवन व्यतीत करनारा अने समभावानी भावनावाणा अर्थात् पक्षपात रहित अवा उत्तम श्रेष्ठी अने अन्य प्रधान ज्ञेनोपडे अहंकुत शोक्से छे. १४.

**भिषग्वरा यत्रविवादहीना—**

वसन्ति रुणाऽङ्गिरुजोऽपहारिणः ।

वैदेशिकाः स्वास्थ्यमवाप्य पीडिताः,

प्रयान्ति केऽप्यत्र ममागतात्र ॥ १५ ॥

जे नगरनी अंदर शास्त्र सिद्ध निहानपूर्वक रोगथी पीडाता हुःअी ज्ञेना रोगेने निर्भूल करनार अने भिथ्या विवादथी विमुक्त थेवेला उत्तम वैद्यो निवास करे छे, क्लेथी त्यां हेशविहेशथी आवेला रोगी ज्ञेना रोगथी मुक्ता धृष्ट पोतपेताना स्थानमां स्वस्थ थै चाल्या ज्य छे. १५.

**श्रीयुक्तादिजिनेश्वरादिविबुधश्रीवैष्णवानां महा—**

दीव्यानन्दमयानि मन्दिरवराण्याराधनीयान्यहो ।

राजन्ते रजनीकरप्रमितभा यस्मिन् पुरे चतरे,

सौम्याकारतयाऽल्लयाः सुविशदा देवीसुराणामपि ॥ १६ ॥

वणी जे नगरनी अंदर श्री ऋषभदेव आदिजिनेश्वरनां तेमज श्रीमान् वैष्णवेनां धणां म्लेटां अने विशाल ही०य आनंदमय आश्चर्य डारक भंडिरे आराधन करवा लायक विराजे छे, तेमज अंद्रनी कांति समान उज्ज्वल शोभावाणां, आकृतिथी अति भनेहर अने प्रभावशाली अवां अन्यदेवदेवीभ्यानां भंडिरे पण्य शोक्से छे. १६

आभात्युत्तमधर्मतत्त्वकलिता सत्कर्मकाराधना,  
 सत्पुण्योपचयेन शुद्धतपनं कुर्वन्ति शुद्धिप्रियाः ।  
 सद्गर्माध्वनिदेशना च रुचिरा पुण्यार्थिनां पुण्यदा,  
 तत्सर्वं हि सुधोपमं स्मृतमिदं सत्साधुसंचारतः ॥ १७ ॥

જે નગરમાં અતિ ઉત્તમ ધાર્મિક તત્ત્વ સહિત સત્ત કર્મની આરા-  
 ધના, શુદ્ધ આત્મ ઉપાસકોએ સત્ત પુણ્યની વૃદ્ધિવડે આચરેલી શુદ્ધ  
 તપશ્ચર્થી અને ધર્મ માર્ગ દ્વારનારી ધર્માર્થી જ્ઞાને પુણ્યદાયક મનો-  
 હુર ધર્મહેશના—ઉપદેશ પ્રવત્તે છે તે સર્વ ખરેખર સાધુ—સત્ત  
 પુરુષોના સંચારથી સાક્ષાત અમૃત સમાન દીપી રહ્યું છે. ૧૭.

રાજતયેતદ્વિવિધવિભવૈः સેવ્યમાનં ધનાઢ્યાઃ,  
 શ્રેણીવદ્ધૈરુચિતરસદૈબ્રહ્મજમાનં રસાલેઃ ।  
 હર્મયારૂઢાઽસ્તુમિતમનુજૈશ્રિન્યતે યત્ર તત્ત્વં,  
 તત્ત્વોપેતા વિશદમહસો નિશ્ચલાઃ સંવસન્તિ ॥ ૧૮ ॥

વળી અનેક વૈલબ્યશાલી ધનવંત જ્ઞાની ભરપુર અને અદ્ભુત-  
 સ્વાહિષ રસદાયક શ્રેણીઓંધ આઅવૃક્ષની ઘટાઓથી પર્યત લાગ જેના  
 દીપી રહ્યા છે એવું એ નગર શોલી રહ્યું છે. વળી જે નગરની અંદર  
 હુવેલીઓની ઉપર આઝી થયેલા આનંદ પામતા સત્પુરુષો ધર્મ તત્ત્વનું  
 ચિંતન કરે છે, તેમજ તે નગરની અંદર તત્ત્વાર્થીમાં મગ્ન થયેલા,  
 શુદ્ધ તેજસ્વી અને નિશ્ચલમનવાળા પુરુષો નિવાસ કરે છે. ૧૮.

શ્રદ્ધાક્રાન્તાઽખિલજનતતિનૈવચિદ્વિષ્ટભાવા,  
 શુદ્ધસ્વાન્તાઽવનિપતિરતિ વિભ્રતી તદ્ગુણજ્ઞા ।  
 સંપત્તીનાં સમુદ્યવતી ધામ વિશ્રામહેતુઃ,  
 સદ્વિદ્યાભિર્વિનયવશતો બ્રાજતે બ્રાજમાના ॥ ૧૯ ॥

જે નગરમાં પરમ શ્રદ્ધાલુ, શુદ્ધ અંતઃકરણ છે જેનું એવા  
 ભૂપતિ ઉપર પ્રેમને ધારણ કરનાર અને તેમના શુણેને જાણુનાર

बर्णनम्.

४१

श्रद्धालु सभस्त जनसमाज परस्पर-चेक धीनपर स्नेह राखे छे.  
जेथी सर्वथा उदय लोगतो ते समाज सर्व संपत्तिएानु विश्रांतिना  
कारणुभूत स्थान गण्याय छे, अने सद्विद्यानो आश्रय करवाथी  
विनयने दीधे ते समाज आभूषणुनी शोला समान हीधे छे. १६.

तपसा बृहता विराजितः, शुभचारित्रविभाविभासमानः ।  
रविसागर इष्टदायको—यदलं पावयति स्म पुण्यराशिः ॥ २० ॥

( वैतालीयम् )

महान् तपश्चर्याथी अहभूत तेजस्वी, उत्कृष्ट चारित्र॒३४ संपत्ति-  
वडे शोकता, मुनिएामां चूडामणि समान, धृच्छित भनोरथेन  
पूर्णु ३२नार अने साक्षात् पुण्यभूर्ति एवा मुनि महाराजश्री  
रविसागर महाराजे जे नगरने सारी रीते पवित्र करेकु छे. २०.

श्रीमत्सञ्जनसिंहभूपविबुधश्रापोत्कटंभूषयन्,  
वंशं वंशशिरोमणिर्विजयते नीत्या प्रजाःपालयन् ।  
धर्माऽध्वप्रतिपालकोऽत्र विबुधैः संमाननीयः सदा,  
सर्वाऽनर्थविदारणप्रबलधीः सत्कर्मकेलिप्रियः ॥ २१ ॥

जे नगरमां चापेत्कट—चावडा नामे वंशने शोकावनार, पोताना  
कार्यमां विद्वान्, कुलकभूती चालु वंशमां शिरोमणि समान; ३४-  
नीतिथी प्रजानु पालन ३२नार, धर्मभार्णनी प्रवृत्ति ३२नार, हुमेशां  
सत्पुरुषोने भानवा लायक, सर्व अनर्थ कार्यने हूर करवाभां अस्ता-  
धारणु भुद्धिमान अने सत्कार्यना आचरणमां जेण्ये कीडा भानी छे  
एवा श्री सञ्जनसिंह नामे राजा राज्य करे छे. २१.

राज्यश्रियं यः समवाप्य शश्वत्, विभ्राजतेऽसद्यवरप्रतापः ।  
यशोधनः स्वामिगुणोपपन्नो—जयश्रियाऽश्शिष्टवपुर्विधिज्ञः ॥२२॥

असद्य छे उत्कृष्ट प्रताप जेनो, यशाङ्की छे धन जेनु, सर्व  
स्वाभीना शुण्याथी सुकृत, विजयलक्ष्मीये जेना शरीरने आश्रय

४२

माणसा-

लीधि छे अने शास्त्रोङ्गत विधिना अणुकार अेवा ने नरेश  
राज्यशीने अंगीकार करी हुमेशां विराने छे. २२.

तस्याऽनुजो विश्रुतभव्यकीर्ति—दिग्बन्तरालप्रथितप्रभावः ।

समस्ति यः सद्गुणवर्मभाजां, प्रशंसनीयः सुधियां समाजे ॥२३॥

यश्ववन्तसिंहोऽभिधयाऽस्य राज्ये, करोति कार्याण्यखिलानि सम्यक् ।  
सत्यार्थवादी नयमार्गदक्षो—नृपप्रजामण्डलशर्मदायी ॥ २४ ॥

( बुगम् )

तेमना अनुज—नानालाई यशंवनसिंह नामे युवराज, तेमना  
राज्यनां समस्त कार्य सारी रीते करे छे, क्षेमनी उत्तम कीर्ति  
प्रसिद्धि पामेली छे, जेमनो प्रभाव दिशाओंना भैयमां डीडा करे छे.  
वणी ने युवराज उत्तम शुणुइपी भाष्टरने धारणु करता भुद्धिमान्  
पुढेहाना समाजमां प्रशंसापात्र छे, तेमज सत्यवादमां प्रीति धरावे छे,  
नीतिमार्गमां दक्ष अने राज तथा प्रजामंडलने सुखदायी छे. २३-२४.

यो वत्सलो आत्रजने नितान्तं, साहित्यशास्त्रेषु च मोदमानः ।

राज्यश्रियं वर्द्धयिता निकामं, विशेषतो रज्जयिता प्रजानाम् ॥२५॥

वणी राज्यकारकार कर्ता ने युवराज अंधुजन विषे अहुज  
स्नेह धरावता, तेमज साहित्य शास्त्रोना अवलोकनमां आनंद  
मानता, अने विशेषे करी प्रजामंडलने रंजन करता राज्य संपत्ति  
ओने अतिशय पद्धवित करे छे. २५.

कीर्तिः स्फीताऽस्खलितगमनोत्कण्ठते संश्रयाय,

यस्याऽनन्यक्षितिधरधियः सेवघेः सद्गुणानाम् ।

धर्मारामाम्बुद इव सदा शिष्टचित्ताऽनुसारी,

दान्तःळः क्षान्तोऽविषमवचनो यः सदाचारचारी ॥ २६ ॥

\*यः स्वदारेषु सन्तुष्टः, परदारपराह्मसुखः ।

स गृही ब्रह्मचारित्वात् यतिकल्पः प्रकल्प्यते ॥ ९ ॥

( कुमारपालप्रबन्धे पृ. ८४. )

वर्णनम्.

८३

वणी उज्ज्वल अने अस्पृशित संचार करती कीर्ति, राज्य संभंधी कार्योभां असाधारणु भुद्धिमान् अने सहगुणेना निधान इप जे युवराजना आश्रय माटे उत्साह धरावे छे. तेमज जे राजकुमार धार्मिक कार्यइप उद्यानने विकसित करवाभां वृष्टि समान, हुमेशां सज्जनोना आशयने अनुसरनार, ईद्धियोने नियमित करवाभां स्वतंत्र, चौर्य स्थाने क्षमावान्, हुःभजनक वयनोनो परिहार करनार छे अने सत्पुरुषेना आचारने रैआ सात्र पणु ऐणांधता नथी. २६.

महालायनामाडत्र सरोविशालं, विशालपद्मावलिसंपदाढ्यम् ।

अदीनमीनालय आश्रितानां, प्रभाविकं तीर्थमिव प्रधानम् ॥ २७ ॥

वणी आ नगरनी सभीपभां झुलाय नामे विशाल सरोवर शोले छे, जेनी अंदर उत्तरवानां पगथीयांनी श्रेष्ठिअंध अहलुत संपत्ति हीपी रही छे, जेनी अंदर रहेला मत्स्य-माछला विगेरे जलजंतुओ हीनता लोगवता नथी. तेमज ते सरोवर अन्यनी अपेक्षाए प्रभाविक छोवाथी अथपद लोगवे छे. ऐट्हुं ज नहि पणु आगंतुक जनोने तीर्थ समान आनंद आपे छे. २७.

सरोवरं यद्विमलं वचस्विभिर्निषेवितं मज्जनकर्मकर्मठैः ।

मन्त्रोपमन्त्रार्थविचक्षणैः सदा, विभ्राजते भ्राजितकण्ठदेशम् ॥ २८ ॥

निर्मण जपथी भरेलुं जे सरोवर, सनानहियाभां कुशण ऐवा सत्यवाही पुरुषोवडे सेवायेलुं छोय छे तेमज मंत्र अने उपमंत्रोना अर्थशा पुरुषोथी जेनो सभीप भाग अहलुत शोले छे. २८.

कापेयं यच्छुचि जलमलं रुष्णया पीड्यमानं,

पीत्वा पीत्वा परमसुखदं क्रीडते मोदमानम् ।

दर्श दर्श विमलजलगं विम्बवृन्दं स्वकीयं,

तत्रस्थानां हरति हृदयं मानवानां विकुर्दत् ॥ २९ ॥

तुषाथी पीडतां वांदराओनां टोणां, परम सुभकारी जे सरो-

वरनुं निर्भयं जग्नि तुसि पर्यंतं वारंवारं पानं करी अहु आनंदथी  
कीडा करे छे, वणी कांडा उपर घेलतां ते टोणां स्वच्छं जग्नमां  
पडेलां चोतानां प्रतिभिंभ जेई जेईने कुहाकुह करतां त्यां रहेलां  
मनुष्येना वित्तने हरी ले छे. अर्थात् आनंद आपे छे. २६.

यत्तीरहेशो च विभाति मन्दिरं, सीतापतेर्दीव्यविभाविभास्वरम् ।  
विकारभाजामपि मानसानि वै, भवन्ति भव्यानि यदीयदर्शनात् ॥ ३० ॥

जे सरैवरना सभीप लाग्नमां रामचंद्रं लगवाननुं ही०य शोला  
आपतुं सुंदर मंहिर शोले छे, जे प्रखुना हर्षनथी विकारवान्  
मनुष्येनां अंतःकरणु पथु भरेखर शुद्ध थाय छे. ३०.

ततोऽन्यदेकं विकसत्रभावं, तत्राऽस्ति दीव्यं मरुतः सुतस्य ।  
सन्मन्दिरं पौरजनस्तुतस्य, श्रीरामचन्द्रकमसेवकस्य ॥ ३१ ॥

वणी त्यां आगण श्रीरामचंद्रना भूण उपासक अने नागरिक  
जनोथी स्तुति करायेल पवनसुत-श्री हनुमानलुनुं तेनी नलुकमां  
ज धीनुं एक प्रलाविक ही०य सुशेलित मंहिर छे. ३१.

तीरोपान्ते विमलरमया राजमानं विमानं,  
शैवं यस्य प्रशमजनकं मन्दिरं मन्दराभम् ।  
दीव्यानन्दप्रदमनुदिनं प्रेमतो भक्तिभाजा—  
मारामश्रीपरिगतमलं ध्राजते भव्यशोभम् ॥ ३२ ॥

जे सरैवरना सभीप लाग्नमां जनोहुर लक्ष्मीथी ही०पतुं,  
विशाल देखाव आपतुं, शांतिजनक अने मंदराचल समान उन्नत  
महादेवनुं मंहिर अहखुत शोला आपे छे, वणी तेनी नलुकमां  
सुंदर शोला आपतो विविध वृक्षोथी लरभूर अणीचा हंमेशां प्रेम  
पूर्वक लक्ता जनोने आनंद आपे छे. ३२.

यत्रत्यानतिभक्तिभासुरमतीन् भव्यात्मनो योगवि—  
दध्यात्मप्रतिभाप्रभावकलितः सर्वोपकारक्षमः ।

वर्णनम्.

४५

**बुद्ध्यविद्वचनामृतै रसभृतैः सूरित्रिया राजितो—**

**ग्रन्थश्रेणिविधानदक्षधिषणः सद्बोधयामासिवान् ॥ ३३ ॥**

ने नगरमां वास करता श्रद्धालु ज्ञेने, योगनिष्ठ श्रीमह अुद्धितसागरसूरीधरे भक्ति विग्रहे शांत रसथी अरपुर वचनामृत-वडे सहजेध आपी कृतार्थ कर्या छे, वणी ने आचार्य महाराज सर्वथा सर्वत्र परोपकारमां ज सभय व्यतीत करता हुता, वणी नेहेयेनाना प्रकारना संस्कृत गुजराति प्रभांध रची उत्कृष्ट अुद्धितुं चरितार्थपाणुं प्रगट कर्या छे, नेथी हालमां पण नेमना अंथाव-द्वेषकनथी लव्यात्माए। तेमनुं स्मरणु भूलता नथी. ३३.

**वरमुनिरजिताविद्यः सूरिमान्यः समेतो—**

**इकलुषितवचनालया वेदितात्मप्रभावः ।**

**विरचितनवकाव्यो धर्मनिष्ठान् कुलीना—**

**नधिगतशुभतत्वः सोऽकरोद्यत्र विज्ञान् ॥ ३४ ॥**

श्रीमत सूरीश्वरना पट्टधर श्रीमह-अजितसागरसूरि, आचार्य गुण संपन्न अने नेमनी भधुर वाणीथी देवाकमान्य हुता. वणी आत्मनिष्ठ अने महा प्रभावशाणी हुता, तेमन नवीन डाव्य दयवामां दक्ष हुता, ते पेते सम्यक्तत्वना संपूर्ण वेता लेवाथी धर्मनिष्ठ कुलीन ज्ञेने उत्तम योध आपी कृतार्थ कर्या छे. ३४.

**ईशिनिंध्यङ्कूधरान्वित—वैक्रमसंवत्सरे सुपौषे च ।**

**श्रवणे शुद्धतृतीयादिने शशाङ्के प्रगीतमिदम् ॥ ३५ ॥**

**अजिताविद्यसूरिपुङ्कव—पादाम्बुजरेणुचञ्चरीकेण ।**

**हेमेन्द्रसागरेण, क्षमिणा जनताहिताऽप्रमादेन ॥ ३६ ॥**

श्रीमह अजितसागर सूरिणा चरणुकमदना रेणुमां अमर समान (शिष्य) अने जगत्तुल्योना छितमां प्रभादरछित हेमेन्द्रसागर मुनिए विडम संवत् १६६१ पौष मास शुक्ल तृतीया श्रवण नक्षत्र अने सोमवारे आ वर्षानि कर्या छे. ३५-३६.

## विषयानुक्रमः ।

विषयः	पृ०	विषयः	पृ०
प्रस्तावनायाम् ।		अर्ध्यम्	७२
निनेहन अने आलार दर्शन ६		महानस ( माणसा ) वर्णनम् । ७४	
ઇઝીશ પ્રસ્તાવના	६	મૂલ ગ્રન્થે ।	
ગુજરાતી પ્રસ્તાવના		શ્રીક્રિષ્ણમજિનસ્તુતિઃ	१
( મહુકવિ શોભનમુનિ અને તેમની કૃતિ )	१३	સમસ્તજિનેન્દ્રસ્તુતિઃ	५
આચાર્યશ્રી અન્જિતસાગરસૂરી- શ્વરળુના લુલના સંક્ષિપ્ત ઝપ્રેખા	२८	જિનપ્રવચનસ્તુતિઃ	६
શ્રીસદગુરુસ્મરણમ्	३२	શુતદેવતાસ્મરણમ्	८
સંસ્કૃતપ્રસ્તાવના	३३	શ્રીઅજિતજિનસ્તુતિઃ	९
જૈનાચાર્યશ્રીમદજિતસાગરસૂરી- વૃત્તાન્તમ्	४५	જિનસમૂહસ્તુતિઃ	११
પરિશિષ્ટમ् ( ૧ )		જિનમતવિચારઃ	१३
( તિલકમજરીપીઠિકા )	५०	માનસીદેવીપ્રાર્થના	१४
દ્વિતીયપરિશિષ્ટમ् ( ૨ )		શ્રીસંમબજિનસ્તુતિઃ	१५
( જિનસ્તુતેર્વિશિષ્ટપદ્યાનિ )	૬૧	શ્રીજિનકદમ્બકસ્તુતિઃ	१૭
દૂરીં પરિશિષ્ટમ् ( ૩ )		જિનપ્રવચનસ્તુતિઃ	૧૮
( શ્રીમહેન્દ્રસૂરિચિત્રગતો- પશુકૃતપદ્યાનિ )	૬૭	શ્રીવજ્ઞગૃહલાપ્રણામઃ	૧૯
		શ્રીઅમિનન્દનજિનસ્તુતિઃ	૨૦
		સકલજિનેશ્વરાણામભ્રથના	૨૨
		આગમસ્તુતિઃ	૨૩
		શ્રીરોહિણ્યે નમઃ	૨૫
		શ્રીસુમતિજિનસ્તુતિઃ	૨૬

विषयानुक्रमः ।

८७

विषयः	पृ०	विषयः	पृ०
समस्तजिनवरप्रार्थना	२८	जिनेन्द्राणां तल्लक्षणा-	
सर्वज्ञसिद्धान्तस्मरणम्	२९	न्वितस्तुतिः	६३
कालीदेवीप्रार्थना	३१	जिनागमस्तुतिः	६५
श्रीपदप्रभजिनस्तुतिः	३२	महाकालीदेव्या विजयः	६७
समस्तजिनेन्द्रस्तुतिः	३४	श्रीवासुपूज्यजिनस्तुतिः	६८
श्रीसिद्धान्तस्वरूपम्	३६	जिनसमूहप्रार्थना	७१
गान्धारीदेवीस्तुतिः	३७	जिनभारतीस्वरूपम्	७२
श्रीसुपार्श्वजिनस्मरणम्	३९	श्रीशान्तिदेवीस्तुतिः	७५
जिनराजीध्यानम्	४०	श्रीविमलजिनस्तुतिः	७६
श्रीजिनमतप्रशंसा	४२	समस्तजिनेश्वरस्तुतिः	७८
महामानसीस्तुतिः	४३	जिनवचनप्रणामः	८०
श्रीचन्द्रप्रभजिनस्तुतिः	४४	श्रीरोहिणीविनतिः	८२
श्रीजिनेश्वराणां प्रणतिः	४६	श्रीअनन्तनाथजिनस्तुतिः	८३
सिद्धान्तस्तुतिः	४८	जिनसमूहाभ्यर्थना	८५
वज्राङ्गुशीस्तुतिः	४९	आगमस्तुतिः	८६
श्रीसुविधिनाथस्तुतिः	५१	(द्वादशाङ्गादीनां पदसंख्या)	८७
जिनेश्वराणामभ्यर्थना	५३	अच्युतायाः स्तुतिः	८९
जिनवाणीस्तुतिः	५४	श्रीधर्मनाथजिनस्तुतिः	९०
ज्वलनायुधादेवीप्रार्थना	५५	जिनसमूहस्तुतिः	९२
श्रीशीतलनाथजिनस्तुतिः	५६	भारतीस्मरणम्	९३
श्रीजिनेन्द्रस्मृतिः	५७	प्रज्ञसिद्धेवी स्तुतिः	९४
सिद्धान्तस्वरूपम्	५९	श्रीशान्तिनाथजिनस्तुतिः	९५
मानवीदेवी स्तुतिः	६०	जिनेश्वराणां विजयः	९९
श्रीश्रेयांसनाथस्तुतिः	६१	जिनशासनस्तुतिः	१०१
		श्रीब्रह्मशान्तियक्षस्तुतिः	१०२

विषयः	पृ०	विषयः	पृ०
श्रीकुन्थुनाथजिनस्तुतिः	१०४	जिनेश्वराणां विजयः	१३३
समस्तजिनवराणां नमस्कृतिः	१०६	सिद्धान्तमहिमा	१३४
सिद्धान्तस्मरणम्	१०७	कालीदेवीस्तवनम्	१३६
श्रीपुरुषदत्ताप्रार्थना	१०९	श्रीनेमिजिनस्तुतिः	१३७
श्रीअरजिनस्तुतिः	१११	जिनसमुदायस्तुतिः	१३९
जिनवराणां प्रणमनम्	११३	जिनवाणीमहस्त्रम्	१४१
जिनागमप्रणमनम्	११४	अस्त्रिकादेवीस्तुतिः	१४३
श्रीचकधरादेवीस्तुतिः	११६	श्रीपार्वनाथजिनस्तुतिः	१४४
श्रीमल्लिनाथजिनस्तुतिः	११८	जिनन्द्राणां स्तुतिः	१४६
जिनेश्वराणां स्तुतिः	१२०	जिनवाणीस्मरणम्	१४८
सिद्धान्तवर्णनम्	१२१	वैरोङ्ग्यादेवीस्तुतिः	१५०
कपर्दीयक्षराजस्मृतिः	१२२	श्रीवीरजिनस्तुतिः	१५२
श्रीमुनिसुब्रतजिनस्तुतिः	१२५	श्रीजिनसमूहस्तुतिः	१५६
जिनसमूहस्य प्रणतिः	१२६	श्रीभारतीदेवीप्रार्थना	१५८
सिद्धान्तसंस्तवनम्	१२८	श्रीअस्त्रिकादेव्याः स्तुतिः	१६१
श्रीगौरीदेवीस्तुतिः	१२९	श्रीकाकारप्रशस्तिः	१६३
श्रीनेमिजिनस्तुतिः	१३१	श्रीऐन्द्रस्तुतयः(परिशिष्टम्)	१६५
		सुभाषितम्	१९२

॥ ॐ अर्हम् ॥

मुनिपुरन्दरायमाणश्रीशोभनमुनीश्वरप्रणीता—

## स्तुति-चतुर्विंशतिका

( श्रीमदजितसागरसूरिविरचितसरलाङ्गुल्यटीकया समलङ्घाता )

१—श्रीक्रष्णजिनस्तुतिः

अथश्रीनाभिनन्दनस्तुतिः

भव्याम्भोजविदोधनैकतरणे ! विस्तारिकर्माचली—

रम्भासामज ! नाभिनन्दन ! महानष्टापदाभासुरैः ।

भक्त्या वन्दितपादपद्म ! विदुषां संपादय प्रोज्जिता—

रम्भासाम ! जनाभिनन्दन ! महानष्टापदाभासुरैः ॥१॥

शार्दूलविकीडितवृत्तम्.

विवृतिः—

श्रीसौभाग्यनिदानधामनिकरप्रत्यायनैकप्रसुं,

दुर्ध्यानप्रबलप्रभूततिमिरप्रधर्वसनोष्णप्रभम् ।

सद्भक्त्या भुजगाधिपेन फणया संभूषितामस्तकं,

वन्देऽहं प्रभुपार्थनाथमनिशं प्रहादनाहं जिनम् ॥ १ ॥

( २ )

विप्रः शुद्धकुलोऽङ्गवः समभवत्पुरुज्जयिन्यां पुरा,  
 सदिद्यानिधिरिष्टसिद्धिरमलः श्रीसर्वदेवाऽभिधः ।  
 तत्क्षत्रुः सुधियां वरः सुविदितः श्रीशोभनाख्यो मुनि—  
र्यद्वन्धुर्धनपाल इत्यभिधया ज्येष्ठोऽभवत्ख्यातिभाक् ॥२॥  
महेन्द्रस्त्रीश्वरपादसनिधौ, स पण्डितः स्वरिपदं प्रपन्नः ।  
श्रीशोभनाख्यस्तुतिमङ्गुतामिमां, विशुद्धभक्त्या व्यरच्छिनानाम् ॥  
श्रीमन्महाबीरसुशासनस्य, धुरन्धरोऽभूदणभृद्वरेण्यः ।  
सुधर्मनामाऽक्षयलब्धिपात्रं, सुराऽसुरेन्द्रेन्तपादपद्मः ॥ ४ ॥  
 परम्परातस्तदनुप्रज्ञे, श्रीहीरस्त्रिर्जगदेकपूज्यः ।  
क्रमेण तत्पद्मसुमेरुशृङ्गं, विभूषयामास स्वरिप्रधानः ॥ ५ ॥  
बुद्ध्यविध्वस्त्रिर्विदुषां वरेण्यो—योगीन्द्रचूडामणिरिद्वशासनः ।  
 तत्पादपद्मभ्रमरायमाणो-जिताविध्वस्त्रिप्रिवरोऽतिबुद्धिमान् ॥६॥  
लाटाऽनुप्राससयमका—द्युलङ्घारैविभूषिताम् ।  
चतुर्विशतिकां हृद्यां, जिनानां परिभाव्य सः ॥ ७ ॥  
तटीकां सरलां चक्रे, स्पष्टमूलार्थबोधिनीम् ।  
मन्दबुद्धिहितार्थाय, संक्षेपात्सारसंग्रहाम् ॥ ८ ॥ चतुर्भिः कलापकम्

इह हि ग्रन्थादौ ग्रन्थचिकीर्षुविम्बविधाताय विशिष्टशिष्टाचार-  
 परिपालनार्थम् स्वेष्टदेवतास्तुतिरूपमङ्गलं विधेयम्—यतः

“ शिष्टाः शिष्टत्वमायान्ति, शिष्टमार्गाऽनुपालनात् ।  
 तत्पद्मनादशिष्टत्वं, तेषां समनुपद्यते ” ॥ १ ॥

इति श्रुतिबोधितकर्त्तव्यतापूर्वकं तदाह—

भव्याम्भोजेति । ‘ भव्याम्भोजविबोधनैकतरणे ! ’—भव्या—  
 मुक्तियोग्या देहिनस्त एवाऽम्भोजानि—अम्भसि जातानि अम्भो-

( 3 )

जानि—कमलानि तेषां विबोधने—बोधप्रदाने, एकश्चासौ तरणि-  
रिवतरणिरद्वितीयभानुस्तत्सम्बुद्धौ हेभव्याम्भोजविबोधनैकतरणे ?  
“ तरणिस्तरणेऽर्केऽशौ, कुमार्योषधिनौकयोः ” । इतिैमः यथा  
तिग्मरस्त्रिमस्तमोभरं विनाश्य पद्मानि प्रबोधयति तथा सार्वज्ञोऽपि  
मिश्यात्वमपनीय स्ववचनैर्भव्यान्प्रबोधयतीतिभावः । ‘ विस्तारि-  
कम्मावलीरम्भासामज ? ’ विस्तारिणी—विस्तरणशीला या—कम्मणां  
ज्ञानावरणीयादीनामावली—श्रेणिः सैव रम्भा—कदली तस्यां—तस्याचा  
प्रमर्दनहेतुत्वात् सामज इव सामजोगजस्तसंबोधनम् ! “ साम-  
वेदाज्ञातः सामजः ” इतिनिरुक्तिः । “ सामानिगायतो ब्रह्मणः  
करादश्टौ गजाः समुत्पन्नाः ” इतिश्रुतेः । “ सामजः सामसंभूते,  
वाच्यलिङ्गः पुमान् गजे ” इति मुक्तावल्याम् । महानष्टपत् ?  
महत्योनष्टाः प्रणष्टा आपदोविपत्तयो यस्माद्यस्यवा तत्संबोधनम् ।  
‘ प्रोज्ज्ञितारम्भ ! ’ प्रोज्ज्ञिताः प्रकर्षेण त्यक्ता आरम्भाः सावद्या  
व्यापारा—हिंसात्मका दर्पा येनेति बहुत्रीहिंसत्संबोधनम् । “ आरम्भ  
उद्यमे दर्पेण, त्वरायाङ्ग वधेऽपि च ” इति विश्वलोचनः । ‘ असाम ? ’  
आसैः रोगैः सह वर्त्तत इति सामः, सामोनभवतीत्यसामस्तसम्बो-  
धनम् । “ आम आमय आकल्यमुपतापोगदः समाः ” इतिैमः ।  
‘ जनाऽभिनन्दन ? ’ जनानभिनन्दयति—प्रमोदमुत्पादयतीति तत्सं-  
बोधने जनाभिनन्दन ? ‘ नन्दिग्रहादीति युप्रत्यये युवोरनाकावित्य-  
नादेश ’ स्तसम्बोधनम् । ‘ हे अष्टापदाभ ? ’—अष्टापदं—सुवर्णं तद्व-  
दाभा—आसमन्तादीमिर्यस्थतत्सम्बोधनम् । “ रुक्मिंजाम्बूनदमष्टाप-  
दोऽख्याम् ” इत्यमरः । “ अष्टापदं शारिफले, ह्लीबमस्तीतु काङ्गने ।  
शरभे मर्कटे पुंसि, चन्द्रमल्लयां ख्यामपि ॥ ” इति विश्वलोचनः ।  
“ आभारादाविभूषाश्री—रभिख्याकान्तिविभ्रमाः । लक्ष्मीश्छायेति  
हैमः । ” तप्तजात्यसुवर्णसमानवर्णत्वाद्गवतः । ‘ आभासुरैः ’ आ

( ४ )

समन्तान् भासन्त इत्येवंशीला आभासुरास्तैर्भास्वरस्वरूपैः । आसुरैः  
 ( असुरैः ) भुवनवासिदेवविशेषैः, आ ईष्टसुराऽपेक्षया भासुरैर्दी-  
 प्यमानैरिति वा । “ आडीपदर्थेऽभिव्याप्तौ, क्रियायोगेऽवधावपि ।  
 आस्यादवृत्तिस्मृत्यो—राः सन्तापप्रकोपयोः ” इतिैैः । “ असुरो-  
 दानवे सूर्ये ” इति विश्वलोचनः । ‘ भक्त्या, ’ आन्तरचित्तप्रतिब-  
 न्वेन, ‘ वन्दितपादपद्म ! ’ वन्दिते नमस्कृते पादावेवपद्मे—कमले  
 यस्येति तत्सम्बोधनम् । पद्मे—यस्मैङ्गहमीरितिपद्मम् । “ वापुंसिपद्म-  
 नलिन—मरविन्द महोत्पलम् । ” ‘ नाभिनन्दन ! ’ नाभेनन्दनःसूनु-  
 स्तसम्बोधनम् । ‘ विदुषां ’—विद्वज्जनानाम् । ‘ महानु’सवान् “ मह-  
 उत्सवतेजसोः ” “ उत्सवोमहउत्सेध—इच्छाप्रसरकोपयोः ” इति  
 विश्वलोचनः । त्वं, सम्पादय—वितर, सम्पूर्वकात् ‘ पद् ’ गतौ धातो-  
 र्बिप्रत्ययान्तादाशीः प्रेरणयोःपरस्मैपदे मध्यमपुरुषैकवचनम् ॥ १ ॥

शार्दूलविक्रीडितं वृत्तमिदं, तङ्गक्षणञ्च—सूर्याऽश्वैर्मसजस्तताः स  
 गुरवः शार्दूलविक्रीडितम् ॥

“द्वेषाकार्थ—अन्यात्मदृप कभद्रोने विकास करवामां अद्वितीय-  
 सूर्यसमान ! विस्तार पामेली ज्ञानावशरणीयाहि कर्मोनी श्रेष्ठी-  
 पञ्चितदृप डेगने लेहवामां हृस्तीसमान !, कांतिना समूहुथी सर्व  
 खाणु प्रकाशमान असुरैना समुदाये लक्षितथी पूज्या छे चरण  
 कभल जेना, वर्णी सर्वथा त्याग कर्या छे पाप कर्मना आरंहो  
 जेण्ये, तेमज रोगरहित !, मनुष्योने आनंद आपनार, सुवर्ण-  
 समान कांतिवाण ! अने श्री नाभिराजना उत्र ! ऐवा ( हे प्रथम  
 जिनेश्वर ! ) ऋषकहेव प्रभु ! तमे विद्रोनेने उत्सवो—आनंदने  
 आपो ॥ १ ॥ आ वृत्त शार्दूलविक्रीडित नामे छे तेमां, भगणु,  
 सगणु, जगणु, सगणु, तगणु, तगणु ए छ गणु अने छेवटने  
 एक शुद्ध छाय छे. तेमज खार अने सात अक्षरे विराम डाय छे.

( ५ )

## समस्तजिनेन्द्राणां स्तुतिः ।

ते वः पान्तु जिनोत्तमाःक्षतरुजो नाचिक्षिपुर्यन्मनो—  
 दारा विभ्रमरोचिताः सुमनसो मन्दारवा राजिताः ।  
 यत्पादौ च सुरोज्जिताः सुरभयाश्वकुः पतन्त्योऽम्बरा—  
 दाराविभ्रमरोचिताः सुमनसो मन्दारवाराजिताः ॥ २ ॥

तइति—‘यन्मनः’ येषां मनोयन्मनश्चेतः । ‘विभ्रमरोचिताः,’ विभ्रमैर्भ्रूसमुद्धैर्विर्लासैः—हावभावादिकटाक्षाक्षेपैः, रोचिताः—शोभिताः । यदुक्तम्—“हावोमुखविकारः स्या—द्वावश्चित्तसमुद्धवः । विकारोनेत्रजोहेयो—विभ्रमोभ्रूसमुद्धवः ।” इतिकेचित्, योषितां यौवनजोविकारोविभ्रमइत्यन्ये, मदहर्षरागजनितो विपर्यासो विभ्रम-इत्यपरे । ‘सुमनसः,’ सुष्टुमनोयेषां ते सुमनसः—शोभनहृदयाः । ‘मन्दारवाः,’ मन्दः आरवः—येषां ते मन्दारवाः—मृदुरवाः । ‘राजिताः,’ विभ्राजिताः । ‘दाराः,’ दारयन्ति, दीर्घन्ते एभिरितिवा दाराः, दारशब्दः पुंसिवहुवचनान्तः । “भार्याजायाऽथ पुंभूम्नि, दाराः—स्यात्तुकुदुम्बिनी ।” इत्यमरः । क्वचिदावन्तोऽपि प्रयुक्तः । “क्रोडा हावा तथा दारा, त्रयएते यथाक्रमम् । क्रोडे हावे च दारेषु, शब्दाः प्रोक्ता मनीषिभिः ॥” वनिताः, कर्तृरूपाः । ‘न’—नैव, ‘आचिक्षिपुः’—क्षोभयामासुः । ‘यत्पादौ च,’ येषां पादौ यत्पादौ—जिनचरणौ । ‘सुरोज्जिताः,’ सुरैरमरैरुज्जिता—उत्सृष्टाः । ‘अम्बरात्,’ नभसः । पतन्त्यः। ‘आराविभ्रमरोचिताः, आराविणः’ शब्दायमाना ये भ्रमराः—षट्पदास्तेषामुचिता—योग्याः । अनेन सौरभाऽतिशयःसूचितः । ‘मन्दारवाराजिताः,’ मन्दाराणां—देवतरुक्षुमानां वारैः—समूहरजिता—अनुलङ्घनीयाः, “पञ्चैते देवतरवो—मन्दारः पारिजातकः । सन्तानः कल्पवृक्षश्च, पुंसिवाहरिचन्दनम्” ॥ इत्यमरः । “समूहवाचको-

( ६ )

वारो—वारोवेश्यागणः स्मृतः ॥”। इतिसुभूतिः । ‘सुमनसः,’ पुष्पाणि । ‘सुरभयाद्वकुः,’ सुगन्धयामासुः सुरभीकुर्वन्तीत्यर्थः । ‘क्षतरुजः,’ क्षताः रुजोयेषां येभ्योवा क्षतरुजः—क्षीणव्याधयस्तथाभूताः । ‘ते,’ जिनोत्तमाः, जिनेषु—सामान्यकेवलिषु, उत्तमाः जिनवराः । ‘वः,’ युष्मान् । ‘पान्तु’—रक्षन्तु, पालयन्त्वत्यर्थः ॥ २ ॥

**श्वेआकार्थ**—हावलानाहि विदासेवडे सुशोलित, भृहु अवाज्व-  
वाणी, विभूषणोथी विभूषित, तेमज्ज सुंदर हृदयवाणी ( देवता-  
ओनी ) वनिता—खीओ ( पशु ) जे जिनेश्वरैना भनने श्वेआ  
पमाडी शक्ति नहीं नहीं तेमज्ज हैवेओ ईंकेलां—आकाशभांथी ( सभव-  
सरणुभां ) पडतां, तथा शुंजस्व करता अमराओने ( पराग अहुणु  
करवा भाए ) योग्य, अने भंदार—कटपवृक्ष ( विगेरे ) पुष्पोना  
सभूहवडे नहि श्रुतायेलां पुष्पोवडे सुर्गाधित थया छे चरणु  
जेभना ओवा ते जिनेश्वरै तभाकु संरक्षणु करै ॥ २ ॥

## जिनप्रवचनस्तुतिः ।

शान्तिं वस्तनुतान्मिथोऽनुगमनाद् यन्नैगमाद्यैनयै—

रक्षोभं जन ? हेऽतुलां छितमदोदीर्णाङ्गजालं कृतम् ।

तत्पूज्यैर्जगतां जिनैः प्रवचनं हृष्ट्यकुवाद्यावली—

रक्षोभञ्जनहेतुलाञ्छितमदो दीर्णाङ्गजालङ्कृतम् ॥ ३ ॥

शान्तिवस्तनुतादिति । ‘नैगमाद्यैः,’ नैगमः—गम्यतेऽनेनेति गमः—  
पन्थाः, नैके गमा यस्यासौ नैकगमः, निरुक्तविधिना ककारलोपात्,—  
नैगमः, “नैगमोनयपौरोप—निषदृतिषु वाणिजे ।” इतिहैमः । स  
च आद्यो येषां तैर्नैगमाद्यैनैगमसंग्रहप्रभृतिभिः सप्तभिर्नैयैः, अने-  
कान्तात्मके पदार्थे, एकांशपरिच्छेदात्मका नयासैहेतुभूतैः ।, अक्षोभं,

( ७ )

अचलं—परवादिभिरजेयमित्यर्थः । ‘छितमदोदीर्णाङ्गजालं,’ छितमदं—भिन्नदर्प, उदीर्णमुच्छ्रुतमङ्गानामाचाराङ्गादीनां जालं—कदम्बकं—समूहो यस्मिस्तत् । “ समवायोनिकुरम्बं, जालंनिवहसञ्चयौ ” इति हैमः । ‘जगतां,’ लोकानां, पूज्यै—रचनीयैः, ‘जिनैः,’ अर्हद्विः, ‘यत्,’ कृतं, विनिर्भितम्, अर्थतस्तैरेवभाषितस्त्वात् । तथा चोक्तम्—“ अत्थं भासइ अरहा, सुत्तंगंथंति गणहरानिउण् ” इत्यावश्यके । ‘दृष्ट्यत्कु-वाद्यावलीरक्षोभज्ञनहेतुलाभिछतं,’ दृष्ट्यन्ती—दर्पं प्राप्नुवन्तीया कुवा-दिनामावली—त्रेणिः सैवकूरात्मकत्वादक्षो—राक्षसः, ‘अत्र लिङ्गभेदो न दोषाय’, “ लिङ्गभेदं तु मेनिरे ” इति वचनस्य प्रामाण्यात् । तस्य भज्ञनैर्भज्ञकारिभिर्हेतुभिः, लाभिछतं—चिह्नितं—मणितं वा । दीर्णाङ्गजालङ्कृतं, दीर्णः अङ्गजः—कामोयैस्तैः शीर्णमदनैः—श्रमणादिभि-रलङ्कृतं—विराजितम् । अदः, प्रत्यक्षदृश्यम् । “ इदमः प्रत्यक्षगतं, समीपतरवर्त्तिचैतदो रूपम् । अदसस्तु विप्रकृष्टे, तदिति परोक्षे विजानीयात् ” ॥ १ ॥ ‘तत्,’ ‘प्रवचनं,’ शासनं—मतं, “ प्रवचनं वेदे (आगमे) प्रकृष्टवचनेऽपि च ” इति मुक्तावल्याम् । ‘हे जन !,’ हे लोक !, वः, युष्माकम् । अतुलां, अप्रमेयां । ‘शान्तिं,’ कुशलं, मोक्षं, उपशमं वा । तनुतात्, प्रथयतु, ‘ तुहोस्तातडाशिष्यन्यत-रस्यामिति ’ तातडादेशे तनुतादिति सिद्धम् ॥ ३ ॥

जैन आगम भ्रशंसा.

**१. लोकार्थ—** ने सिद्धान्त परस्पर संगत—बधं घेसते । ( अर्थात् युक्तिथी अविरुद्ध तेमज धृष्ट अर्थने ज्ञाननार ) डोखाने लीघे नैगम आहि नयेअे करीने अभंडित छे, वणी जेणे ( वाढी-आने ) गर्व तेडी नाख्येअे छे, जेमां ( आचार आहि ) अंगेने समूह वर्णवेदो छे, ने भद्रोन्मत्त भिथ्यावाहीजनेनी पंकितदृप राक्षसने नसाइनारी ( अर्थात् नाश करनारी ) युक्तिअथी युक्त

( ८ )

છે, અને કામહેવને વશ કરનારા ( મુનિવરો ) થી જે અલંકૃત  
છે ( અર્થાત् જેનો શ્રમણુ પુરુષેએ સ્વીકાર કરેલો છે ) તે,  
વિશ્વને વંદનીય એવા જિનવરોએ રચેલ ( દ્રાદશાજીરૂપ ) સિદ્ધાન્ત,  
હે ( ભીંય ) લોક ! તમારી અનુપમ શાંતિનો વિસ્તાર કરો ॥ ૩ ॥

## શ્રુતદેવતાસ્મરણમ् ।

શીતાંશુત્વિષિ યત્ર નિત્યમદધ્રુનન્ધાદ્વધ્યધૂલીકળા—

નાલીકેસરલાલસા સમુદ્રિતાઽશુ બ્રામરીભાસિતા ।

પાયાદ્વઃ શ્રુતદેવતા નિદધત્તી તત્ત્વાઽબ્જકાન્તી ક્રમૌ,

નાલીકેસરલાલસા સમુદ્રિતા શુભ્રામરી ભાસિતા ॥ ૪ ॥

શીતાંશુત્વિષિતિ—‘કેસરલાલસા,’ કેસરેષુ—પદ્મગર્ભપક્ષમસુ બકુ-  
લેષુ વા લાલસા—તૃણાઽતિરેક ઔત્સુક્યં વા યસ્યાઃસેતિ બહુત્રીહિ:  
‘કેસરો નાગકેસરે । તુરઙ્ગસિહયો: સ્કન્ધ-કેશેષુ વકુલદૃષ્ટિમે । પુત્રાગવૃદ્ધે,  
કિર્જલકે સ્યાત્કેસરં ‘તુ’ હિઙ્ગુનિ” ॥ ૧૧૧૪ ઇતિ—અનેકાર્થસંગ્રહઃ ।  
કેસરશબ્દોઽત્ર દન્ત્યમધ્યઃ કચિત્તાલદ્વયમધ્યોઽપિ । “ આન્દોલ  
કુસુમકેશરશરેણ તન્વી,” ઇતિ વાસવદત્તાયાંદર્શનાત् । “ તૃણા-  
તિરેકે ઔત્સુક્યે, લાલસાલોલયાઙ્ગયો: ” ઇતિ વિશ્વઃ । કેસરેષુ લા-  
લસા—લઘ્પટેતિ તત્પુરૂષો વા । ‘આશુ’ શીઘ્રમ् । ‘સમુદ્રિતા’  
મિલિતા । ‘ઇભાસિતા’ ઇમેષુ—ગજેષ્વાસિતા—સ્થિતા મદલામ્પણ્ણાત्,  
અથવા, ઇભવદસિતા—ઇયામા । ‘બ્રામરી’ બ્રમરસ્યેયં બ્રામરી—ષટ્ઠ-  
પદ્સમ્બન્ધિની । ‘આલી’ પંક્તિઃ । ‘શીતાંશુત્વિષિ’ શીતાઃશીતલા  
અંશવો યસ્ય સ શીતાંશુસ્ત્રદ્વત્ત્વિટ્—કાન્તિર્યસ્ય તસ્મિશ્રન્દ્રવચ્છુભ્રે ।  
‘યત્ર’ યસ્મિન् કમલે । ‘ગન્ધાદ્વધ્યધૂલીકળાન्’ ગન્ધેન આદ્વયા—  
યુક્તા યે ધૂલ્યા—રજસઃ કળાન—પરાગવિન્દૂન् । ‘નિત્યં’ સતતં,  
‘અદ્ધત्’, અવિત્ત । ‘તત્ર’ તસ્મિન् । ‘નાલીકે’—સરોજે—

( ९ )

पक्षजे । ‘अब्जकान्ती’ अब्जवत्कान्तिर्योस्तौ—पद्मद्वयती । ‘क्रमौ’ पादौ । ‘निदधती’ स्थापयन्ती । ‘सरला’ अकुटिला । ‘अलसा’ मन्दगतिर्वशवधा, अतिसुकुमारत्वात् । ॐ ‘समुदिता’ मुदितेन—हर्षितेन सह वर्तते या सा सहर्षा । ‘शुभ्रा’ श्रेतवर्णा । ‘अमरी-भासिता’ अमरीभिर्द्वाऽङ्गनाभिर्मासिता—शोभिता । यद्वाऽमरीणां भा-तया सिता—बद्धा “कीलितोयन्त्रितः सितः” “सितस्त्ववसिते बद्धे वर्णे ईत्युभयत्राऽपि हैम । एतादृशी, ‘श्रुतदेवता’ शासनाऽधिष्ठायिका—वामदेवी ‘बो’ युष्मान् । ‘पायात्’ रक्षतु ॥ ४ ॥ अत्रवृत्तचतुष्टये मध्यात्पद्यमकाऽलङ्कारः ॥

**१. लेखाकार्थ**—डेसरायेने विषे लंपट—आसङ्गत, शीघ्रताथी ऐक-चित्त थयेली, हुथीना वर्षुसमान श्यामवर्षुवाणी, ( अथवा गव्य-द्रना गंउस्थल उपर महतुं प्राशन करवा भाटे लुण्ठ थैंने ऐडेली, अथवा तेजस्वी भ्रमरौनी पंक्तिअंग, यंद्रसमान कमनीय—सुंदर, कम-णेना परिभूषणी सर्वदा परिपूर्ण अेवा जेना परागक्षेत्रातुं पान कर्युं छे, तेवा कमण उपर कमणसमान कांतिवाणा अनेणुने स्थापन करेती, सरला—कंपटरहिता, तेमज अलसा अर्थात् अति-सुंहर सुकुमार छावाने लीघे शीघ्रगमनाहिकमां भंहताने धारणु करती, तेमज हर्षित तथा हेहीभ्यमान हेवांगनाम्याथी ( परिवृत छावाने लीघे ) शोभायमान अने कमणसमान कांतिवाणी क्षुत-देवता ( छे लव्य शुवे ! ) तमाइं परिपालन करै ॥ ४ ॥

## २ श्रीअजितजिनस्तुतयः ।

तमजितमभिनौमि यो विराजद्—

वनघनमेरुपरागमस्तकान्तम् ।

निजजननमहोत्सवेऽधितष्ठा—

वनघनमेरुपरागमस्तकान्तम् ॥ ५ ॥

पुष्पिताग्रावृत्तम् ।

( १० )

तमिति । ‘यो’ भगवान् । ‘निजजननमहोत्सवे’ निजस्य-  
स्वस्य जननं-जन्म, तस्य महोत्सवे-महामहे । ‘अनघनमेहुपरागं’  
अनधाश्च ते नमेरवश्च देववृक्षविशेषास्तेषां परागो-रेणुर्यस्मिन् तं,  
“नमेसु सुरपुत्रागः” इत्यमरः । “शिश्रुगेरुनमेवादय इति (उणा०  
८११) सूत्रेण नमेनच्चपूर्वस्य मय्यतेर्वा एच्चान्तः रुप्रत्ययान्तोनमेशु-  
द्वौनिपात्यते ” । ‘अस्तकान्तं’ अस्तगिरिर्मन्दरस्तद्वत्कान्तं मनोहरं,  
“अस्तम्तु चरमः क्षमाभृत्” इत्यमरः । अथवा जिनविशेषणमे-  
तत्, अस्ता-निरस्ताः कान्ता-वनिता येन तं । अथवा अस्तं-स्वर्णं  
तद्वत्कान्तोरम्यस्तं । “अस्तं स्वर्णसुमाऽस्मसः” इत्यनेकार्थः “अस्तं  
सुवर्णं वनोपान्ते ” इतिठ्याडिः ‘विराजद्वनघनमेहुपरागमस्तकान्तं’  
विराजद्विः-शोभमानैर्वन्यन्ते वर्षादित्वादल् वनन्ति वा वनानि-  
तै-वैनैः-काननैर्वनोनिरन्तरोमेरुलक्षणोयः परागः, परः-प्रधानः, अगो-  
गिरिस्तस्य मस्तकाऽन्तं, मस्तकस्य-शिखरस्य, अन्तमग्रम् । अथवा  
विराजन्ति-शोभमानानि वनानि-जलानि येषु तथाविधा घना-मेघा  
यस्मिन् स चाऽसौ मेहुपरागोमेहुरिति परमपर्वतस्तस्य शिखराऽग्रम्,  
‘वनं बु कानने नीरेऽप्युत्से वास-प्रवासयोः’ इति श्रीधरः-। ‘अधि-  
तष्टौ’ अधिष्ठितवान् । ‘तं’ तथाभूतम् । ‘अजितं’ गर्भस्थेऽस्मिन्  
शूते राज्ञा जननी न जीतेस्यजितः, यदा परीष्वहाऽदिभिर्न जितस्तम-  
जिताऽभिषेय द्वितीयं जिनेश्वरं । ‘अभिनौमि’ अभिष्टुवे-‘ए रुतौ’  
धातोवर्त्तमाने लट् ॥ ९ ॥ पुष्पितामा वृत्तं तलक्षणञ्च—

“अयुजि नयुगरेफकोयकारो, युजि तु नजौ जरगाश्च पुष्पितामा ॥

‘द्वैकार्थः’—पैताना जन्म ( कृत्याणुक ) ना भेषात्सवसमये  
पवित्र नमेऽ ( देववृक्षविशेष ) ना पराग जेमां रहेता छे, तेभन  
अस्ताच्यतपर्वत समान भनेहर, वाणी विराजमान वनोवडे निषिद-  
धाठ ( अथवा शोभायमान छे जणथी भरेता भेद बेनी अंहर  
अथवा प्रदाशित छे वन अने वाढणां जेमां ) अेवा भेद् नामना श्रेष्ठ

( ११ )

ਪર्वतना ( ઉપરैક्षत એ વિશેષખેણી ચુક્ત ) શિખરના અયોગ  
ઉપર, જેણે અધિક્ષાન કર્યું છે તે ( કોઈ પરીષહાદિથી નહિ  
જીતાયેલા ) એવા શ્રીઆજિતનાથ ( કે કેણે પ્રમઠાનો—ખીનો  
ત્યાગ કર્યો છે, અથવા સુવર્ણસમાન કાંતિવાળા ) ભગવાનને હું  
સ્તવું છું.

આ પુણિતાથા નામનું વૃત્ત છે. તેનું લક્ષણ નીચે મુજબ—

પ્રથમ અને તૃતીય યરણુમાં યાર યાર અક્ષરો છે, અર્થાતું  
પ્રથમ અને દ્વિતીય યરણુમાં ન, ન, ર, અને યગણુ એમ યાર  
ગણો છે. તેમજ બીજા અને ચોથા યરણુમાં તેર તેર અક્ષરો છે,  
અર્થાતું બીજા અને ચોથા યરણુમાં ન, જ, જ, અને રગણુ—એમ  
યાર ગણુ છે અને તે ઉપરાંત અંત્ય અક્ષર ચુડ છે. આ પણીના  
ત્રણુ ક્ષેત્રોમાં પણ પુણિતાથાવૃત્ત છે. ॥ ૫ ॥

## जिनसमूहस्तुतिः ।

स्तुत जिननिवहं तर्मितप्रा-

ध्वनदसुरामरवेण वस्तुवन्ति ।

यममरपतयः प्रगाय पार्श्व-

ध्वनदसुरामरवेणव स्तुवन्ति ॥ ६ ॥

પુણિતાથા ।

स्तुतेति । ‘પार्श्वध्वनदसुરामरवेणवः’ પાર્શ્વેષુ—સમીપેપુ ધ્વનન્તો  
નદન્તઃ, અસુરાડમરાણાં વેળવો વંશ યેપાં તે તથોક્તાઃ, “ દ્વયત્યયે  
લુગ્વા ” (હૈમવ્યા ० १-३-५૬) ઇતિ રેફસ્ય લુકિ વેળવ ઇતિ સિદ્ધમ् ।  
‘અમરપતયः’ સુરેન્દ્રાઃ । ‘અર્તિતપ્રાધ્વનદસુરામરવેણ’ અન્યા—પીડયા  
તપ્તાનાં શૈત્યાધાયકતયા સાક્ષાત्, અધ્વનદः—માર્ગહદઃ યઃ સુરામઃ—  
સુષ્ટુ રામો મનોજો યો રવઃ—શચ્ચદસ્તેન કરણમૂતેન । “ રામઃ  
પશુવિશોપે સ્યાત्, જામદગ્ન્યે હલાયુષે । રાघવે ચાડસિતશ્વેતમનોજ્ઞપુ  
ચ વાચ્યવત् ” ॥ ૧ ॥ ઇતિ વિશ્વઃ । ‘વસ્તુવન્તિ’ વસ્તુ—ચછન્દોજાતિ-

( १२ )

विशेषस्तद्वन्ति, तल्लक्षणनिवदम्—“ चौ लान्ततौ चौ तो वस्तुकम् ”  
 चौ ( चगणद्वयं ) ततो लध्वन्तौ द्वौ तगणौ, पुनः चौ ( चगणद्वयं )  
 तगणः, एते पादे चेद्रस्तुनामकच्छन्दश्चतुर्भिः पादैः । चतस्रभिर्मात्रा-  
 भिश्चगणः । स च पञ्चधा—चतुर्भिर्लघुभिरेकः, आद्यलघुद्वयगुर्वन्तो  
 द्वितीयः, आद्यन्तलघुर्मध्यगुरुस्तुतीयः, आद्यगुरुर्लघुद्वयाऽवसानश्च-  
 तुर्थः, गुरुद्वयःपञ्चमः । त्रिमात्रकस्तगणस्त्रिधा—आद्यलघुर्गुर्वन्त एकः,  
 आद्यगुरुर्लघ्वन्तो द्वितीयः, लघुभिस्त्रिभिस्तुतीयः । ” इति छन्दोऽ-  
 नुशासनम् ( गीतानि ) ‘ प्रगाय ’ प्रकर्षेण गीत्वा । ‘ यं ’ ‘ जिने-  
 न्द्रसमूहं ’ जिनेन्द्राणां—तीर्थक्षराणां समूहो निवहस्तम् । “ समूहो-  
 निवहव्यूह—सन्दोहविसरब्रजाः ” इत्यमरः । ‘ जिननिवहं ’ जिन-  
 वृन्दं, ( भो भव्याः ! ) स्तुत—प्रणुत । अथवाऽर्त्तितपा इति सम्बो-  
 धनम् । ध्वनन्—ननार्थादध्वनितात् कुर्वन् असून्—प्राणात् रामयति  
 असुरामस्तथाभूतोयोरवस्तेन वस्तुवन्ति—अर्थवन्ति प्रगायेतिवाव्या-  
 ख्येयम् ॥ ६ ॥

### जिन समूहनी स्तुति.

**९ लोकार्थ—**जेती आजुआजुमां हेवो अने दानवोनी वांस-  
 जीओ वाणी रही छे अन्ना सुरेंद्रो, तृष्णा अने परिश्रमनी भीडाथी  
 तस थयेदा ज्ञोने ( शांति आपनामां ) मार्गहुद्ध—धराना जेवा  
 भनेठर सुस्वरवडे, **१ वस्तु नामक** छ होथी युक्त ( गीतो । ) गाइने

१ आ वस्तुच्छंहमां हरेक पादमां ( २५ ) भान्नाओ छे, तेभां ऐ ( यगणु )  
 त्यारपछी त्रिषु प्रक्षरना तगणुमांथी अंत्यस्त्रियाणा ऐ तगणु पक्ती ऐ  
 ( यगणु ) अने छेड्यो ऐ ( तगणु छे, तेनुँ उदाहरणः—

‘ सुरवहुमहुअरिपंतिपिअगुणपरिमलज्ञालहं,  
 नभमणिकिरणकलावचारुकेसरनिवहमरालहं ।  
 पत्युअवत्युअगीतिचारुमुणिनिवहमरालहं,  
 तिहुअणसिरिकुलहरहं नमहु जिणपहपयकमलहं ॥ १ ॥’

( १३ )

એ તીર્થિકર સમુદ્ધાયની સ્તુતિ કરે છે તેનિ હે ભવ્યકોણો । તર્મે  
ઉપરેઅત સુંદર સ્વરવણે સ્તુતિ કરે ॥ ૬ ॥

## जिनमतविचारः ।

प्रवितर वसति त्रिलोकबन्धो !  
गमनययोगताऽन्तिमे पदे हे ! ।  
जिनमत ! विततापवर्गीथी—  
गमनययो ! गततान्ति मेऽपदेहे ॥ ७ ॥

पुष्पिताग्रा ।

प्रवितरेति । ‘त्रिलोकबन्धो !’ त्रयाणां लोकानां—स्वर्गमृत्यु-  
पाताललक्षणानां बन्धुस्तत्सम्बोधने हे जगत्त्रयीबान्धव ! । ‘गम-  
नययोगतत !’ गमाः—सदशपाठाः “गमः सदशपाठे स्याद्—गमस्तु  
गमने स्मृतः” इति नानार्थः । नयाः नैगमादयस्तैर्योगः—सम्बन्ध-  
स्तेन ततो विस्तीर्णस्तत्सम्बोधनम् । ‘वितताऽपवर्गीथीगमनययो !’  
वितता—विस्तृता या अपवर्गस्य—मोक्षस्य वीथी—पदवी तस्यां गमनं-  
यानं तस्मिन् सुखप्रापकत्वाद् ययो ! तुरङ्गम ! । “ययुरश्वोऽश्वमे-  
धीयः (क्रतुहये) ” इति हैमः । यथा ययुना स्वस्वामी समीहितं पदं  
नीयते, तथा जिनागमेनाऽपि श्रद्धाऽध्ययनाऽध्यापनश्रवणाऽसक्तो जनो  
मोक्षं प्राप्यते इति भावः । “वीथी वर्तमनि पङ्कतौ च, गृहाऽङ्गे नाट्य-  
रूपके” इत्यनेकार्थः । हे जिनमत ! सर्वज्ञाऽऽगम ! । ‘गततान्ति’  
गता तान्तिगर्लानिर्यस्मिन् कर्मणि यथास्यात्तथा तत्, इति क्रिया-  
विशेषणं, ‘तमुग्लानौ’ इतिधातोः स्त्रियांकितनितिभावे कितन् प्रत्य-  
ये तान्तिरितिसिद्धम् । जिनमतस्य संबोधनं विशेषणं वाऽपि युज्यते-  
एव । ‘मे’ महां । ‘अपदेहे’ अपगता देहाः—‘धातुंभिर्दिव्यते देहः  
पुंछीबलिङ्गे’ शरीराणि यस्मिन् तथा भूते । ‘अन्तिमे पदे’ चर्तु-

( १४ )

दीशरज्जुप्रमाणस्य लोकस्याऽन्तेरिष्ठते—मोक्षभूते, पदे—स्थाने । ‘वस-  
ति’वासं, “वसतिः स्यादवस्थाने निशायां सदनेऽपि च ॥” इति  
‘हैमः’ । ‘प्रवितर’ देहि, प्रपूर्वक‘तृष्णवनतरणयो’रितिभातो  
राशीः—प्रेरणयोरितिमध्यमपुष्टवस्त्रैकवचनम् ॥ ७ ॥

### जिन प्रवचन विचार.

**लेकार्थः**—हे लेकार्थ ! हे आलापड ! (आलावा)  
तथा नयेना संबध्यी विस्तार पामेल (अथवा आलापड !  
हे नैगमादि) नयेना संबध्यी विस्तार पामेल ! विशाल ऐवा  
शिवमार्गे (सुखपूर्वक) ज्वामां अध्यसमान हे बैन सिद्धान्त !  
तभे, हेहुक्त अर्थात् ज्यां शरीर नथी ऐवा अंतिम पदमां  
अर्थात् लोकांतमां रहेकी माक्षपुरीमां भुारी ज्वानि—ऐह नाश  
थाय तेवी रीते झुने निवास आये ॥ ७ ॥

### मानसीदेव्याः प्रार्थना ।

सितशकुनिगताऽशु मानसीद्वा—  
अत्ततिमिरंमदभा सुराजिताऽशम् ।  
वितरतु दधती पविं क्षतोद्यत्—  
तत्तिमिरं मदभासुराजिता शम् ॥ ८ ॥

पुष्पिताम्रा ।

सितशकुनिगतेति ‘सितशकुनिगता’ सितः—श्वेतः स चाऽसौ  
शकुनिश्च पक्षी हंस इतर्थ; तं गता—अधिरूढा । “विहगो विहङ्गम-  
खगौ पतगो विहंगः, शकुनिः शकुनिंशकुनौ वि—वयः—शकुन्ताः”  
इति हैमः । ‘इरंमदभा’ इरंमदो मेघज्योतिस्तद्वद्भा—दीपिर्यस्याः  
सा तथाभूता “मेघवहिरिरंमदः” इति हैमः । ‘मदभासुराजिता’  
मदेन—दर्पेण भासुरै रौद्रैरजिता—अनभिभूता । ‘मानसी’ देवी ।

( १५ )

‘ इद्धाऽन्ततर्ति ’ इद्धा—दीपा, आत्ता—गृहीता, ततिविर्वस्तुतिर्येन तं ।  
 सुराजिताऽशं सुष्टु राजिताः—प्रकाशिता आशा दिशो येन तं, “काष्ठा-  
 ऽशा दिग् हरित् कक्षपू” इति हैमः । क्षतोद्यन्तततिमिरं क्षतं—हतं,  
 उद्यदुद्यच्छत्, ततं—व्याप्तं, तिमिरं—तमो येन तं तिम्यतीव तिमिरं  
 पुण्डीबलिङ्गे “शुष्ठि” (उणा—४१६) इत्यादिना इरः कित् ॥ १ ॥  
 एता-  
 दृशं, ‘ पवि ’ वज्रं । ‘ दधती ’ धारयन्ती । मानसी देवी ‘ शं ’  
 सुखं । ‘ आशु ’ अञ्जसा । केषामित्याकांक्षायां तु भव्यानां युष्मा-  
 कमस्माकं वेत्युत्तरं, ‘ वितरतु ’ ददातु ॥ ८ ॥

### भानसीहेवीनी भार्थना.

**‘ लोकार्थः—**—राज्ञसं उपर आदृद धयेली, विजयी सरभी  
 प्रकाशमान, तेभै गर्वथी असुरे। वडे नहि लुतायेली, वणी अहशु  
 कर्यो छे हेहीभ्यमान विस्तार नेहे, सारी रीते प्रकाशित करी छे  
 हिशाच्चा नेहे अने नाश कर्यो छे उद्य पामतो। गाढ अंधकार  
 नेहे अवा वज्रने धारणु करती मानसीहेवी जलही (लव्यजनोने)  
 सुभ आपो ॥ ८ ॥

### ३ श्रीशंभवजिनस्तुतयः ।

निर्भिन्नशत्रुभवभय !  
 शं भवकान्तारतार ! ममारम् ।  
 वितर त्रातजगत्वय !  
 शंभव ! कान्तारतारममारम् ॥ ९ ॥

आर्यागतिः ।

निर्भिन्नेति । ‘ निर्भिन्नशत्रुभवभय ! ’ निर्भिन्नं—नाशितं शत्रुभवं—  
 रिपूद्धूतं भवं येन, यद्वा शत्रवो—वैरिणो भवः—संसारो—भवं—भीतिश्च  
 येन, यद्वा निर्भिन्नं शत्रुरूपस्य भवस्य—संसारस्य भवं येन स तत्संबोध-

( १६ )

नम्, भवस्य शत्रुरूपत्वं युक्तमेव, दुःखदायित्वात्तस्य । भवकान्तार-  
तार !' भवः—संसारः स एव कान्तारमरण्यं, हृदत्वाद् दुःखेनाऽवगाहा-  
त्वाच, तस्य तस्माद्वा तारक ! । 'त्रातजगत्त्रय !' त्रातं-रक्षितं जगतां  
—भुवनानां त्रयं येन तत्सम्बोधने हे रक्षितत्रैलोक्य ! । 'कान्तार-  
तारत !' कान्तानां—योषितां रतेषु—सुरतेषु, अरतः—अनासक्तस्त-  
त्सम्बोधनं हे योषिन्मैथुनपराङ्गमुख ! “रतं सुरतगुण्योः” इति  
विश्वः । ‘हे शंभव !’ शं—सुखं भवत्यस्मिनस्तुत इति शंभवः ।  
शमिधातोः ‘संज्ञायां’ इत्यच्चप्रत्यये शम्भव इतिसिद्धम्, द्वितीय-  
जिनेन्द्र ! । “शंभवे समंबोऽपि च” इति शब्दरत्नाकरः  
‘अरममारं’ न रमत इत्यरमो मारः—कामो यस्मिस्तत्, अविषय-  
द्वारकम्, “मदनो मन्मथोमारः” इत्यमरः । “मदनो जरा-  
भीहरनङ्गमन्मथौ” इति हैमः । ‘शं’ शाश्वरं—सुखं । ‘अरं’  
झटिति । ‘मम’ ‘वितर’ देहि । अत्र स्तुतिचतुष्के आर्यागीतिवृत्तं,  
तलक्षणम्—आर्याप्राग्दलमन्तेऽधिकगुरु तादृग् परार्धमार्यागीतिः ॥१॥

### श्री शंभवनाथनी स्तुति.

**श्वेषाकार्थ—**( आठकर्मदृप ) शत्रुओ तरक्षी उत्पन्न थता  
लयनो नाश कर्या छे नेखे, संसारदृप जंगलमां ( लभ्यनोने )  
तारनार, त्रणे वेष्ट ( जगत् ) तुं रक्षण्य कर्या छे नेखे, कामि-  
नीन्योने विषे कीडा करवामां अनासक्त ! अने सुखनी उत्प-  
त्तिना स्थानदृप येवा हे शंभवनाथ लगवान् ! तमे भने नेनी  
अंदर कामहेव कीडा करतो नथी येवा अर्थात् शाश्वतसुखने  
विद्यं भरहित आपो ॥६॥

अहिं चारे श्वेषेभामां आर्यागीति छन्द हे. तेनुं लक्षणु—प्रथम  
अने तुलीय चरणुमां यार यार मात्रायो हे, तेमज धीज  
तथा योथा चरणुमां वीस वीस मात्रायो हे.

( १७ )

## श्रीजिनवरकदम्बकस्तुतिः ।

आश्रयतु तव प्रणतं  
विभया परमा रमाऽरमानमदमरैः ।  
स्तुत ! रहित ! जिनकदम्बक !  
विभयापरमार ! मारमानमदमरैः ॥ १० ॥

आर्यांगीतिः ।

आश्रयत्विति । ‘अरं’ शीर्चं । ‘आनमदमरैः’ आनमन्तश्च  
ते अमराश्च देवास्तैः । ‘स्तुत !’ बन्दित ! । ‘विभय !’  
विगतं भयं यस्मात्तस्य सम्बोधनं हे विभय ! । ‘अपरमार !’  
न परान्प्राणिनः रिपून्वा मारयति यस्तस्य सम्बोधनं हे प्राणिरक्षक !  
“शत्रौ प्रतिपक्षः परो रिपुः । शात्रवः प्रत्यवस्थाता” इति हैमः ।  
‘मारमानमदमरैः’ मारश्च-कामः मानश्च मदश्च-गर्वः मरश्च-  
मृत्युस्तैः । ‘रहित !’ त्यक्त ! । ‘जिनकदम्बक !’ जिनानां कद-  
म्बकं-समूहस्तसम्बोधने हे तीर्थकृत्समूह ! “कदम्बमाहुःसिद्धार्थं,  
नीपेऽपि निकुरम्बके” इति विश्वः (सिद्धार्थनीपयोः पुमान्) ।  
‘तव’ प्रणतं नतं जनं । ‘विभया’ कान्त्या । ‘परमा’  
उत्कृष्टा । ‘रमा’ लक्ष्मीः । ‘आश्रयतु’-आ समन्तान् श्रयतु-  
भजतु ॥ १० ॥

**श्लोकार्थ—**सत्वर-ऐक्षाथै वंहन उरता देवोवडे स्तुति  
उरायेल ! वणी अथरहित ! सर्वशुद्धाना संरक्षणु उरनार ! आम-  
अनंग, भान, गर्व अने मृत्युथी रहित ! ऐवा हे ! शुनेंद्र  
समूह ! कांतिवडे उत्कृष्ट ऐवी लक्ष्मी हेवी तमने प्रणाम उरनार  
प्राणिउम्बाने जलही आश्रय आपो अर्थात् तमारा (जिनेन्द्राना)  
सेवकेने धनवान् उरो ॥ १० ॥

( १८ )

## जिनप्रवचनस्तुतिः—

**जिनराज्या रचितं स्ता—**

**दसमाननयानया नयायतमानम् ।**

**शिवशर्मणे मतं दध—**

**दसमाननयानयानया यतमानम् ॥११॥**

**जिनराज्येति—** ‘असमाननयानया’ असमाने—अनुपमे, आननं मुखं, यानं—गमनक्र ते यस्यास्तया—अद्वितीयमुखगमनया । ‘अयानया’ न विद्यते यानं—वाहनं यस्यास्तया । अवाहनन्त्वञ्चाऽस्याः सर्वपरिप्रहपरित्यागादुचितमेव । ‘जिनराज्या’ जिनानां राजिः पङ्क्षिस्तया—जिनकदम्बकेन । ‘रचितं’ निर्मितं । ‘आयतमानं’ आयतमल्लयु, मानं—प्रमाणं—पूजा चा यस्य तत्—बृहत्प्रभार्ण “मानं प्रमाणे पूजादौ, मानश्चित्तोन्नतौ गृहे” इतिविश्वः । ‘असमाननयान्’ असमानाः—असद्वशाः ये नथा—नैगमप्रभृतयस्तान् । ‘दधत्’ दधातीतिदधद्—विभ्राणम् । ‘यतमानं’ प्रयत्नं कुर्वण्म् । ‘मतं’ प्रवचनम्—दर्शनम् । ‘नः’ अस्माकम् । अस्मच्छब्दस्य पष्ठीबहुवचनान्तम् ‘रोर्यः’ इतिसूत्रेण यत्वे कृते लोपे च सिद्धम् (सि० ३१—३—२६) । ‘शिवशर्मणे’ मोक्षसुखाय ‘स्तात्’ भवतु ॥ ११ ॥

## जिनप्रवचन स्तुति—

**श्लोकार्थ—** निःपम—उपभा रहित छे मुण अने गमन केनां, तेभज ( अथ वर्णेर ) वाहन रहित, एवी जिनेद्र श्रेष्ठिये रथेदो, वजी गडु छे भान वेनुं, अथवा विश्वीर्णु विशाल छे प्रभाणु वेनुं, तथा असाधारण नयोने धारणु ३२नार, अने प्रयत्न इरतो एवो (जैन) मत—सिद्धान्त, अभावा भोक्षसुण भाटे थाए ॥ ११ ॥

---

( १९ )

## वज्रशृंखलायै प्रणामः—

शृङ्खलभृत्कनकनिभा—

या तामसमानमानमानवमहिताम् ।

श्रीवज्रशृङ्खलां कज—

यातामसमानमानमानवमहिताम् ॥ १२ ॥

शृङ्खलभृदिति । ( भो भन्यप्राणिन् ! त्वं ) ‘शृङ्खलभृत्’ शृङ्खल-  
माभरणं विभर्ति सा शृङ्खलधारिणी । ‘कनकनिभा’ कनकस्य—हाटक-  
स्य नियतं भाति—निभा—तुल्या सुवर्णवर्णा, कनकस्य—सुवर्णस्येव निभा  
साहश्चयं यस्याः सेति वा, कान्तिसाम्यात् । “कल्याणं कनकं महा-  
रजतरेणगङ्गेय स्कमाण्यपि” इति हैमः । ‘या’ देवता, अस्ति । अस्मि-  
न्वाक्येऽस्तीत्यध्याहित्यते, येन विना यदनुत्पद्यते तत्त्वैवाऽक्षिप्यते,  
तथा च—“अहा विना न सूर्यः, सूर्यविदीनश्च वासरोनाऽस्ति । “कर्तृ-  
क्रिये तथैव हि संपृक्ते सर्वदा भवतः” इति वचनात् । ‘तां’ तथोक्ता  
‘असमानमानमानवमहितां’ असमानोऽसाधारणो मानः—पूजा बोधो  
वा येषां ते असमानमानाश्रते मानवाश्च तैर्महितामर्चिताम् । ‘कजयात्’  
कजं—पङ्कजं याता—प्राप्ता तां कमलगतां । ‘अनवमहितां’ अवमं—  
पापं तन्नविद्यते येषां तेऽनवमाः पापरहितास्तेभ्योहितां—हितकारिणीम् ।  
अथवा असमानौ—असदृशौ, आनमानौ—प्राणाऽहङ्कारौ येषां तेऽसमा-  
नमानास्ते च ते मानवाश्च तैर्महिता—पूजिता ताम् । ‘श्री वज्रशृङ्खलां’  
श्रिया सहितां, “श्रीशब्दो महत्वप्रतिपादकः पूज्यनामादौ प्रयुज्यते,”  
श्रीवज्रशृङ्खलां देवीं । ‘असमानं’ समानं न विद्यते यस्मिन्कर्मणि  
यथा स्यात्—असाहङ्कारं । ‘आनम्’ प्रणामं कुरु ॥ १२ ॥

श्री वज्रशृंखलाने प्रणाम—

“देवाकार्थ—जे देवी शृंखला ( रथा आभूषण ) ने धारणे करे

( २० )

છે, વળી સુવર્ણ સમાન સુશોલિત છે, તેમજ અસાધારણ છે યોધ  
નેમને એવા મનુષ્યો વડે કે પૂજાયેવી છે, કમગપત્ર પર નિવાસ કરે  
છે, વળી પાપરહિત ( ગ્રહને ) કલ્યાણકારી છે, તે હેવીને ( હે ભર્ય  
જન ! ) તું ગર્વ ત્યજ દઈને નમસ્કાર કર ॥ ૧૨ ॥

---

### શ્રીઅભિનંદનજિનસ્તુતયઃ—

ત્વમશુભાન્યભિનન્દન ! નન્દિતા—  
સુરવધૂનયન : પરમોદર : |  
સ્મરકરીન્દ્રવિદારણકેસરિન !  
સુરવ ! ધૂનય ન : પરમોદર : ॥ ૧૩ ॥

દુતવિલમ્બિતમ् ।

ત્વમિતિ—‘ સ્મરકરીન્દ્રવિદારણકેસરિન ! ’ કરિણાં ગજાના-  
મિન્દ્રાસ્વામી કરીન્દ્રાઃ, સ્મરઃ—કામએવ કરીન્દ્રસ્તસ્ય વિદારણે—વિના-  
શને કેસરિન ! સિહ ! । ‘સુરવ ?’ સુષ્ઠુ રવો—ધ્વનિર્યસ્યસ તત્સંબો-  
ધને હે ચારુધ્વને ! હે ‘ અભિનન્દન ! ’ અભિનન્દયે—સ્તૂયતે દેવે-  
ન્દ્રાયૈરિત્યભિનન્દનઃ । “ ભુજિપત્યાદિભ્યઃ કર્મણપાદાને ” ( સિ ૦ ૫-  
૩-૧૨૮ ) ઇતિ સ્તુતે કર્મણનટ યદ્વા ગર્ભાત્પ્રભૃત્યેવ અમીક્ષણ દેવે-  
ન્દ્રેણાઽભિનન્દનાદ—અભિનન્દનસ્તત્તસ્મોધનમ् । ચતુર્થજિનેશ્વર !  
‘ નન્દિતાઽસુરવધૂનયન ! ’ નન્દિતાનિ—પ્રીણિતાનિ, અસુરણાં—રક્ષસાં  
વધો ભાર્યાસ્તાસાં નયનાનિ—ચક્રાંશિ યેન સઃ નન્દિતાઽસુરવધૂનયન : ।  
અથવા નન્દિતાસુઃ અવધૂનયન : ઇતિ પદદ્વયમ् । ધર્મધર્મિણોરભેદાદ-  
સુશબ્દેનાઽસુમન્ત એવોચ્યન્તે, તથા ચ—નન્દિતાઃ—પ્રીણિતાઃ અસવઃ  
પ્રાણાઃ—પ્રાણિનો યેન સઃ, અવધૂનયન : ન વિદેતે વધૂપુનયને લોચને  
યસ્ય સોઽવધૂનયન : । “ દારાઃ ક્ષેત્ર વધૂર્ભાર્યા ” ઇતિહૈમઃ । બ્રહ્મચા-

( २१ )

रित्वेन स्त्रीणां निभालने पराङ्मुखत्वात् । 'परमोदरः' परेभ्य आ-  
त्मनः प्राणिभ्योमोदं-हर्षं राति-ददातीति परमोदरः, अन्यहर्षदायकः,  
अथवा परम उत्कृष्टः, तथा-अदरश्च न विद्यते दरणं दीयते वा दरो—  
भयं यस्य यस्माद्वा निर्भयः, अथवा परमः—अदर इति पृथक्पदे ।  
“ दरोऽस्त्रीभीतिगर्त्तयोः । दरीस्यात्कन्दरे स्त्री तदीषदर्थेदरोऽव्यम् ”  
इति मुक्तवल्याम् । यद्वा परममुत्कृष्टमुदरं—जठरं यस्य स उत्कृष्ट-  
जठरः । अत एव केसरी, सुरवः, परमोदरश्चेति विशेषणानि । एता-  
दृशस्त्वं । ‘ नः ’ अस्माकं । ‘ अशुभानि ’ अमङ्गलानि—अशिवानि—  
अपुण्यानि वा ‘ धूनय ’ कम्पय, लक्षणया दूरीकुरुष्वेत्यर्थः ॥ १३ ॥

दत्तविलम्बितवृत्तमिदं तद्वक्षणश्च—‘दुतविलम्बितमाह नसौ भरौ’ ॥

### अभिनंदन जिनने भार्थना-

**श्लोकार्थ**—कुंदपूर्णीगजराजनो संहार करवामां सिंह समान,  
मधुर ध्वनिवाला ( अतुर्थं तीर्थं ३२ ! ) हे अभिनंदन जिनेंद्र !  
प्राणुने अर्थात् प्राणीयोने प्रभुहित करनार, तेमज जेनी दृष्टि  
स्त्रीयो तरङ्गे ऐंचाती नथी, अथवा आनंदित कथां छे असु-  
रोनी अणलायेनां नेत्र जेणे, वणी सर्वेतकृष्ट छे उद्दर जेनुं,  
अथवा लुवोने आनंद आपानार, अने श्रेष्ठ तथा निर्लय अेवा  
तमे अमारां पापोनो—अभंगदकारी कर्मेनो नाश करे ॥ १३ ॥  
आ श्लोकमां अने आ पठीता गणु श्लोकामां, दुतविलम्बित  
नामे वृत्त छे. दुतविलम्बित वृत्तनुं लक्षण आ प्रभाणु छे. आ  
वृत्तमां “ नगणु, लगणु, अगणु अने रगणु योम चार गणु अटवे  
बार अक्षर छे. ”

( २२ )

## सकलजिनेश्वराणामभ्यर्थना—

जिनवराः ! प्रथतध्वमितामया—  
 ममतमोहरणाय महारिणः ।  
 प्रदधतो भुवि विश्वजनीनता—  
 ममतमोहरणा यमहारिणः ॥ १४ ॥

जिनवरा इति । ‘हे जिनवराः !’ जिनेषु—सामान्यकेवलिषु वराः श्रेष्ठास्तत्सम्बोधनं हे सामान्यकेवलिष्ट्रेष्टाः । ‘इतामया : !’ इताः—गता आमया रोगा येषां येभ्योवा तत्सम्बोधनं, हे गतरोगाः ! ‘महारिणः !’ महान्ति—तेजोवन्ति, अरीणि—चक्राणि—धर्मचक्रलक्षणानि येषां ते धर्मचक्रवर्त्तिनस्तेषामग्रे धर्मचक्रचालनादिति भावः । “अरं शीघ्रं च चक्राऽङ्गं, शीघ्रगे पुनरन्यवत्” इति विश्वः । ‘भुवि’ पृथिव्यां । ‘विश्वजनीनतां’ विश्वेभ्योजनेभ्यो हितस्तद्वावस्ताम् । ‘प्रदधतः’ धारयन्तः । ‘अमतमोहरणाः !’ मोहश्चरणश्च मोहरणौ न मतौ मोहरणौ—अज्ञानसंप्राप्तौ येषां ते अमतमोहरणाः ! । “अस्त्रियां समराऽनीक—रणाः कलहविग्रहौ” इत्यमरः । ‘यमहारिणः यमं—मृत्युं हरन्ति इत्येवं शीलास्तत्सम्बोधनं हे मृत्युहरणशीलाः !’ “यमः कृतान्तः पितृदक्षिणाशाः प्रेतात्पतिः” इति हैमः । अथवा मतस्य मोहो मतमोहो—दर्शनमूढत्वं तस्माद् रणः कलहो वादलक्षणो न विद्यते येषां ते अतमोहरणाः । ‘यमहारिणः’ यमाः—अहिंसा सत्याऽस्तेयत्रहचर्याऽपरिग्रहलक्षणाः पञ्च ते हारिणो—मनोहरा येषां ते यमहारिणः । ‘मम’ मे । ‘तमोहरणाय’ तमसोऽज्ञानस्य हरणं—विनाशस्तस्मै अज्ञानविनाशाय । ( यूं ) ‘प्रयतध्वं’ प्रयत्नं कुरुध्वम् । ‘यती’ प्रयत्ने धातोराशीः प्रेरणयोरितिसूत्रेणाऽस्तमनेपदे मध्यमपुरुषवहुवचनम् ॥ १४ ॥

( ५३ )

## समस्त जिनेश्वरोने प्रार्थना.

**श्लोकार्थः**—हूर गया छे रोगो जेमना अथवा जेमनाथी, वणी जेमनी पासे धर्मयुक्त रहेहुं छे, पृथ्वीने विषे समस्त मानव-ज्ञतिना हितने धारणु करनारा—अर्थात् समस्त अक्षांडना खांधु, तेमज अमान्य छे भोह अने संआम जेमने, अथवा अविद्यमान छे दर्शननो भोह (भिथ्यात्वलिनिवेश) ने लही थतो (वादडपी) कलह जेमने विषे, अथवा असंभत छे स्नेहनो संआम जेमने अने भृत्युनो अंत करनारा (अथवा भद्राप्रता-हिक (नी पालना वडे) भनेहर येवा हे जिनेश्वरे ! तमे भद्रारा अज्ञानने दूर करवा प्रयत्न करो. ॥ १४ ॥

---

## आगमस्तुतिः ।

असुमतां मृतिजात्यहिताय यो—  
जिनवरागम ! नोभवमायतम् ।  
प्रलघुतां नय निर्मथितोद्भूता—  
अजिनवरागमनोभवमायतम् ॥ १५ ॥

असुमतामिति—‘निर्मथितोद्भूताऽजिनवरागमनोभवमाय !’ उद्भूतश्चासौ आजिभ्यसंग्रामः—उद्भासंग्रामः, नवश्चासौ रागश्च नूबनो द्रव्यादौ भनोरथः, भनसि—चेतसि भवति—जायते भनोभवोऽनङ्गः, माया—परवश्चनं च, ता निर्मथिता—निवासिता येन, अथवा उद्भूताऽजै—उत्कटसंग्रामे नवरागं—नवो रागो यस्य तत्, भनस्तस्मिन् भवा या माया सा निर्मथिता येन तस्य सम्बोधनम् । “आजिः स्त्री समभूमौ स्थान् संग्रामेऽपि क्षणेऽपि च” इति नाममाला । इदं व्याख्यानद्वय-मणि लोकयुत्त्यनुसारेण घटत एव । अथवा ‘उद्भूताऽजिनः’—उत्क्ष-तुचर्मा ‘करागमनाः’ वरश्चासावगच्छ—प्रधानगिरिर्थात् कैलास-

( २४ )

स्त्र मनो यस्य स, एतादृशो यो भवः—शङ्करस्तस्य माया—संसार-  
लक्षणा सा निर्मथिता येन तत्संबोधने निर्मथित ० अस्मिनपक्षे भवस्तु  
सत्यकिनामा पुरुषविशेषोद्देशः, तस्यसंसारनिर्मथनं तु भगवदागम-  
श्रवणमहिन्ना भविष्यति, भाविनि भूतोपचाराद्भूतमेवेति युक्तमेव ।  
“भवः सत्ताऽप्सिजन्मसु, रुद्रे श्रेयसि संसारे,” इति हैमः । ‘जिनव-  
रागम !’ हे अहंत्रप्रवचन ! आगम्यन्ते मर्यादया परिज्ञायन्तेऽर्था-  
अनेनेत्यागमः “ राघसिद्धकृतेभ्योऽन्त—आसोक्तिः समयाऽऽ-  
गमौ ॥ इति हैमः ” । ‘असुमतां’ असवः—प्राणाः सन्त्येषां  
तेषां प्राणिनां । ‘मृतिजायहिताय’ मृतिश्च मरणं, जातिश्च जन्म,  
मृतिजाती—मरणजन्मनी त एव अहितमपर्यं तस्मै । चतुर्थ्यत्र  
तादर्थे ज्ञेया । ‘यः’ विद्यते, इति क्रियाऽध्याहारः । उक्तच्छ—  
“ कर्तृकर्मक्रियादीनामवकाशो न चेद्यदि । अध्याहारस्तदाकार्ये—  
मुख्याऽर्थप्रतिपत्तये ” ॥ १ ॥ ‘तं’ तथाभूतं । ‘नः’ अस्माकं ।  
‘आयतं’ दीर्घं । ‘भवं’ संसारं । ‘प्रलघुतां’ हसीयस्त्वं, नीधातो-  
द्विकर्मकत्वाद्भूतं प्रलघुतामिति कर्मद्वयम् । ‘नय’ प्रापय ॥ १५ ॥

### आगम प्रशासा—

**क्लेकार्थ**—उद्धत ( मनुष्ये ) साथे विश्वहनो, द्रूप्यादिक उपर  
उत्पन्न थता नवीन भनेत्रथनो, भद्रन अने भायानो नाश कर्ये छे  
जेष्ठे अंश्ववा उद्भाब—लयं कर संथ्राम करवाभां नवीन अभिलाशयुक्त  
अेवा भनभां प्रगट थती भायानो विनाश कर्यो छे जेष्ठे, अेवा हे  
प्रवयन ! हे जिनेश्वरना आगम ! जे ( संसार ) प्राणीज्ञेना मृत्यु  
अने जन्म उप अडित भाटे थाय छे ते अमारा हीर्घाभव ( संसार )  
ने तु अत्यंत अहं—दुडे कर, अर्थात् अमारा जन्मन्त्रणुने । अंत  
लावी तु मुक्ति अर्पणु कर ॥ १५ ॥

( २५ )

## श्रीरोहिण्यै नमः ।

विशिखशङ्खजुषा धनुषाऽस्तसत्—  
 सुरभिया ततनुन्महारिणा ।  
 परिगतां विशदामिह रोहिणीं,  
 सुरभियाततनुं नम हारिणा ॥ १६ ॥

विशिखशङ्खेति—‘विशिखशङ्खजुषा’ विशिखश्च शरः, शङ्खश्च  
 तौ जुषे—जोषते भजते वा तेन शरकम्बुभाजा । ‘अस्तसत्सुरभिया’  
 अस्ता-विनाशिता, सन्तश्चते सुराश्चसत्सुरा इति कर्मधारयस्तेषां सत्सु-  
 राणामुक्तमाऽमराणां भीर्येन तत्तेन । ‘ततनुन्महारिणा’ तता—विस्तृताः  
 नुन्नाः—प्रेरिताः=निर्मूलिताः महान्तोरयोवेगाः, अरयोवैरिणो वा  
 येन तत्तेन । ‘हारिणा’ भव्येन । ‘धनुषा’ धन्यतेऽर्यते, धनति—  
 शब्दायते ज्याघातेन वा धनुः । “रुद्यर्त्तिजनितनिधनिमनिग्रन्थिपृत-  
 पित्रपिवपियजिप्रादिवेपिभ्य उस्” (सि० उ० ९९७ ।) इत्युस्  
 प्रत्ययो भवति तेन कार्मुकेण । ‘परिगतां’ मण्डितकरां । ‘विशदां’  
 शुभ्रवर्णा निर्मलां वा, शरीरमनसोर्निर्मलत्त्वात् । ‘सुरभियाततनुं’  
 सुरभि—कामधेनुं याता—प्राप्ता तनुदेहोयस्यास्तां । सुष्टु रभते सुरभिः  
 “पदिपठि—” (सि० उणा ६०७) इति इः” “सुरभिर्गवि च  
 स्त्रियाम्” इत्यमरः । चकाराद्वसन्तजातीफलचम्पकेषु ना । सुगन्धि-  
 मनोज्ञयोस्त्रिषु । सुवर्णेपङ्कजे च क्लीबम् । “सुरभिश्चम्पके चैत्रे,  
 वसन्ते गन्धके कवौ । स्वर्णे जातीफले चाऽव्वजे, त्रिषु मद्यसुगन्धयोः ।  
 रुद्याते च रुद्धी तु शङ्खक्यां, सुरभी मातृभेदयोः ॥” इति मुक्ताव-  
 ल्याम् । ‘रोहिणीं’ रोहत्यवश्यं रोहिणी तां—देवीं । ‘इह’ अ-  
 स्मैङ्गोके । ‘नम’ प्रणिपत, ‘णमु’ प्रहीभावे, इत्युकारेत्संज्ञिक

( २६ )

णमधातोरादे—‘णो नः’ (पा० ६—१—३६) इति सूत्रेणणस्य नत्वे कृते, आशीः प्रेरणयोरिति लोटि मध्यमपुरुषस्यैकवचनम् ॥ १६ ॥

**श्लोकार्थ—**आणु अने शाख्यथी युक्त, हूर कर्त्ते छे सञ्जन अने सुर (देवो) ने अथ लेणे अथवा हूर करी छे सत्-उत्तम देवाना लीति लेणे, तेमज विस्तार पार्गेला तथा भारी डडाव्या छे झेटा वेग अथवा हुशमनो लेणे अने भनोहुर एवा धनुष्यवडे (अकंकृत छे हुस्त लेने) एवी, श्वेतवणी (अथवा निर्भणी), तेमज धैतु-गाय उपर ऐसनारे छे हेहु लेने। अने आ जगतभां रैखिणी नामे प्रण्यात (अथवा परिज्ञनथी परिवृत-वीटयेकी) एवी देवीने (हे अव्यञ्जन ! तु नमन कर ॥ १६ ॥

## ५ सुमतिजिनस्तुतयः ।

मदमदनरहित ! नरहित !,  
सुमते ! सुमतेन ! कनकतारेतारे ! ।  
दमदमपालय ! पालय,  
दरादरातिक्षतिक्षपातः पातः ! ॥ १७ ॥

आर्यगीति:

**मदमदनेति—**‘मदमदनरहित !’ मदश्चाऽहङ्कारो जात्यादिभेदा-दृष्टविधोमदः, मदनश्च—कामस्ताभ्यां रहितो विमुक्तस्तस्य सम्बोधनम्। हे अहङ्कारकामविमुक्त ! । “जातिः कुलं बलश्चैव, रूपमैश्वर्यमेव च । तपः श्रुतं तथा लाभो—मदोहाष्टविधः स्मृतः ॥ १ ॥” ‘नरहित !’ नरेभ्योहितो—हितकरस्तत्सम्बोधने, हे जनहितकर ! सुमतेन ! शोभनं मतं—प्रवचनं येषां ते सुमता मुनयस्तेषां, यद्वा सुमतस्य—सदागमस्य इनः—स्वामी, तस्य स्वातन्त्र्येण प्रणेतृत्वात्तसम्बोधने हे सदागमेन ! (अथवा सुमतेन करणभूतेन स्वामिन् !) “इनः

( २७ )

पत्यौ नृपे सूर्ये” इति मुक्तावल्याम् । ‘कनकतार !’ कनकवत्तारः—  
तपनीयोज्ज्वलस्तसम्बोधनम् । ‘इतारे !’ इताः—गताः अरयः—  
शत्रवो यस्य यस्माद्वा तस्य सम्बोधनं हे विगतशत्रो ! । ‘अपाऽल्लय !’  
अपगत आलयो गृहस्थाश्रमो यस्य यस्माद्वा तस्याऽमन्त्रणम् ।  
‘अरातिक्षतिक्षपातः’ अरातिभ्यः—शत्रुभ्यः क्षतिरुपर्मदः सैव  
रौद्राऽत्मकत्वात् क्षपा—रात्रिस्तस्याः सकाशात्, “निशा निशिधिनी  
रात्रिः, शर्वरी क्षणदा क्षपा” ॥ इति हैमः । ‘पातः’ रक्षक ! ।  
‘हे’ सुमते ! पञ्चमजिनवर ! । ‘दरात्’ त्रासात्—संसारभयादिति  
यावत् । “आतङ्कस्तु दरत्रासौ, भीतिर्भीः साध्वसं भयम्” इतिवैज-  
यन्ती । ‘दमदं,’ दममुपशमं ददाति तं शान्तिदायकं अर्थान्मुनिजनं ।  
श्रमणश्रमणीनां बहुत्वेऽपि जात्यपेक्ष्यैकवचनम् । दमःस्यास्कर्दमे दण्डे,  
दमने दमथेऽपि च ” इति हैमः ‘पाल्य’ रक्ष ‘पाल’ पालने चुरा-  
दिगणस्थस्तम्याऽशीः प्रेरणयोरितिमध्यमपुरुषैकवचनम् ॥१७॥

“आर्यापूर्वार्थं यदि, गुरुणैकेनाऽधिकेन निधने युक्तम् ।  
इतरत् तद्विविलं, दलं यदीयमुदितैव—मार्यागीतिः ॥ ”

( वृत्तरत्नाकरे )

### सुभतिनाथ स्तुति-

**श्लोकार्थ**—दर्प—गर्व अने कंदर्पथी रहित एवा ( पंचम  
तीर्थं कर ! ) भनुष्येनाना हितकारी ( हे शुनेश्वर ! ) उत्तम प्रवयन छे  
ज्ञेमनुं एवा मुनिएना तेमज सिद्धान्तना ( प्रझपक हेवाथी  
तेना ) स्वाभिन् ! सुवर्ण समान उज्ज्वल ( प्रलो ! ) नष्ट  
थया छे हुशमने ज्ञेना एवा ( हे हेवाधिदेव ! ) त्याग कुर्या छे  
गृहनो ( अर्थात् गृहस्थाश्रमनो ) ज्ञेषु एवा ( हे धर्श ! ) शत्रुए  
तरक्षथी थता उपद्रव दृपी रात्रिथी रक्षणु करनार ( हे परमेश्वर ! )  
अने ( शोक्षन भतिवाणा ) हे सुभतिनाथ ! तमे प्रशमने आपनारा

( २८ )

( मुनिपरने ) भयमांथी भयावो ॥ १७ ॥ आ ९वेऽमां तथा ते  
पठीना त्रणु ९वेऽमां आर्याणीति नामनो छंद है. तेनुं लक्षणु-  
आर्यना पूर्वधीना अंतमां एक शुद्ध उभेरवो वगी उत्तराद्व पथु  
तेज प्रभाषे होय है.

---

## समस्तजिनवराणां प्रार्थना—

विधुतारा ! विधुताराः !  
सदा सदाना ! जिना ! जिताघाताघाः ! ।  
तनुतापातनुतापा !  
हितमाहितमानवनविभवा ! विभवाः ! ॥१८॥

विधुतारेति—‘विधुताराः !’ अरीणां—रिपूणां, समूह आरं,  
समूहार्थेऽण् प्रत्ययः, विधुतं—निरस्तमारं यैस्ते, अत्राऽरपदेनेन्द्रिय-  
रूपाः शत्रवोप्राद्यास्तेषां दुर्जयत्त्वात् । अथवा अरणमारं—भ्रमणं  
संसारेऽटनं, विधुतं निवारितं यैस्ते तथा भूताः । ‘विधुताराः’  
विधुः शशाङ्कस्तद्वत्तारा उज्ज्वलाः ! सर्वथा कर्ममलविगमात् ‘सदा’  
निरन्तरं । सदानाः ! दानेन सहिताः ! सांवत्सरिकदानदायित्त्वात्  
“तिन्नेव य कोडिसया, अट्टासीई य हुंति कोडीओ । असिइं च सय-  
सहस्रं, एवं संतच्छरे दिनं ॥ १ ॥ सर्वेतीर्थकृतोदीक्षाकालात्प्राक्-  
प्रत्यहं सूर्योदयादारभ्याऽभोजनमष्टलक्षाऽधिकैककोटीं सुवर्णटङ्कानां  
याचकेभ्योऽनिवारितमुद्धोपणापूर्वकं वितरन्ति, वार्षिकब्रतदानमष्टा-  
शीत्यधिकशतत्रयकोल्पशीतिलक्षप्रमितं भवति । ‘जिताघाताघाः !’  
जितं पराजितमघातं घातवर्जितमघं पापं यैस्ते । ‘अपातनुतापा : !’  
अपगतोऽतनुर्महान् तापः सन्तापो येषां तत्सम्बोधनम् । ‘आहि-  
तमानवनविभवाः !’ आहितः—प्रकटीकृतो मानवानां नवः प्रत्यग्रो

( २९ )

विभवः ऐश्वर्यैस्ते तत्सम्बोधनम् । ‘ विभवाः ! ’ विगतो—विनष्टो  
भवः—संसारो येषां येभ्यो वा तत्सम्बोधनम् । तथाभूता हे जिना ;  
जिनवराः ! जयन्ति रागद्वेषानिति जिनाः । ( प्राणिनां ) ‘ हितं ’  
पद्यं । ( यूयं ) ‘ तनुत ’ विस्तारयत ॥ १८ ॥

### सभस्त जिनेश्वरेने विनति—

‘**दोकार्थ**—नाश कर्त्ता हे शत्रुओंनो समूह वेभणे, अथवा  
अंत आण्येहा छे (संसारभ्रमणुनो वेभणे) अेवा हे जिनेश्वरे !,  
अंद्र समान उन्नत अंतिवाणा ( तीर्थकरे ! ) वगी त्याग  
सहित ! अर्थात् दीक्षा सभये सांवत्सरिक दान (३८८-८००००००)  
हेनार ( तीर्थपतिअंगो । ) श्रुत्यां छे धातवर्जित पापो वेभणे अेवा  
( हे जिनेश्वरे ! ) नष्ट थयेहा छे महान् संताप वेभनो, अथवा वेभ-  
नाथी अेवा ( हे जिनवरे ! ) विस्तार कर्त्ता हे भनुपतिना नवीन  
अंश्वर्यनो वेभणे अेवा ( हे परमेश्वरे ! ) अंत आण्येहा छे  
संसारनो ( अर्थात् जन्म जरा भरणुनो ) वेभणे अेवा ( हे  
जिनपतिअंगो ! ) हे जिनेंद्रा ? तमे निरंतर सर्व प्राणीवर्गानुं  
हित करे—अर्थात् कल्याणुनो विस्तार करे ॥ १८ ॥

### सर्वज्ञसिद्धान्तस्मरणम्—

**मतिमति जिनराजि नरा—**

इहितेहिते रुचितरुचि तमोहेऽमोहे ।

**मतमतनुनं नूनं—**

सरासराधीरधीरसुमतः सुमतः ॥ १९ ॥

**मतिमतीति—**‘मतिमति’ मतिविच्चतेऽस्येति, “नित्ययोगा-  
दावयं” मतुप्रत्ययः, गर्भवासादिष्वप्यवस्थासु साऽतिशयमतियुक्ते ।

( ३० )

‘नराहितेहिते’ नराणामाहितं पूरितमीहितं—चेष्टितं वाङ्छितं येन संतस्मिन्,—जनकृतसमीहिते। ‘हचितरुचि’ रुचिता—अभीष्टा रुक्ष कान्तिर्यस्य तस्मिन्। ‘तमोहे’ तमो—मोहं हन्तीति तमोहस्तस्मिन्—अज्ञानवातिनि। ‘अमोहे’ न विद्यते मोहो यस्य तस्मिन् मोहरहिते “मोहोमौढ़यं चिन्ताध्यानं” इति हैमः। ‘जिनराजि’ जिनाः सामान्यकेवलिनस्तेषु राजते जिनराट् तस्मिन् जिनराजि—जिनेन्द्रे। अत्रयत्तदोरध्याहारं विधाय व्याख्या कार्या, ( यत् ) ‘अतनून्’ ततु च ऊनं च यन्नभवतितत्। यद्वा ततु—तुच्छं परैर्हापयितुं शक्यं ऊनं परमताऽपेक्षया सकलार्थाऽप्रकाशकंयनास्ति किन्तु परैर्हापयितुमशक्यं यावदर्थप्रतिपादकग्रेति भावः। ‘मतं’ दर्शनं ( अस्ति ) तत्—अर्थात् जिनेन्द्ररचितं सिद्धान्तम्। ( हे भव्य जन ! ) ‘अस्मराधीरधीः’ न विद्यते स्मरेण—कामेन अधीरा—अस्थिरा धीरुद्दिर्यस्य तथा भूतः। किंच ‘असुमतः’ जातित्वादेकवचनं, जनस्य। ‘सुमतः’ रक्षणक्रियायां सम्यगभिग्रेतस्त्वं ‘नूनं’ सर्वथा। ‘स्मर’ चिन्तय, ‘स्मृ’ चिन्तायां धातोराशीः प्रेरणयोर्मध्यमपुरुषस्यैकवचनम् ॥ १९ ॥

### सर्वज्ञना सिद्धान्तनुं स्मरण—

‘स्वेकार्थ—( हे लविक्जन ! ) स्मरणुने विषे अस्थिर नथी युद्धि जेनी अथवा कामवडे अधीर नथी युद्धि जेनी अने जनसमाजमां अत्यंत भान्य एवो तुं. युद्धिमान् अर्थात् सातिशय शानयुक्त, वणी पूर्णु कर्यां छे भनुष्येनां भनोवांछित जेण्ये, तथा ( अन्य जनोने प्रभोहकारी छावाने लीघे ) पसंह पडी छे कांति जेनी, तेमज अज्ञाननो नाश करनार अने मोह रहित एवा जिनेश्वरने विषे ( अर्थात् जिनेश्वरै प्रदेशा ) तेमज नहिं तुच्छ डे नहिं अपूर्णु एवा सिद्धान्तने निश्चयथी तुं याद कर. ॥ १६ ॥

( ३१ )

## ५—कालीदेवये प्रार्थना—

नगदाऽमानगदा मा—

महो ! महोराजिराजितरसा तरसा ।

घनघनकाली काली—

बतावतादूनदूनसत्रासत्रा ॥ २० ॥

नगदेति—‘ नगदा ’ नगान्=गिरीन् द्यति—खण्डयतीति नगदा-पर्वतभेदिनी । ‘ अमानगदा ’ अमाना—प्रमाणहीना गदा—प्रहरण-विशेषो यस्याः सा । ‘ अहो ! ’ इत्यामन्त्रे विस्मये वा निपातः । “ अहो बताऽनुकम्पायां, खेदाऽमन्त्रणयोरपि ” इति हैमः ।

‘ महोराजिराजितरसा ’ महसां—तेजसां राजिभिः—श्रेणिभिः राजिता-शोभिता रसा—भूमिर्यथासा, “ राजिलेखाततिर्वीथी, मालाऽस्त्वयावलिपङ्क्षयः ” । इति हैमः । “ सर्वसहा रत्नगर्भा, जगती मेदिनी रसा ” । इति हैम्याम् । ‘ घनघनकाली ’ घनाः—सान्द्रा ये घनाः—जीमूतास्तद्वत् काली-इयामा । ‘ ऊनदूनसत्रासत्रा ’ ऊनाः-संपदादिभिः स्तोकाः दूनाः—परितप्ताः सत्रासाः—भयसहिताश्च ये प्राणिनस्ताँश्चायते—पालयति सा । ऊना अपूर्णा धनैरितिशेषः, अतएव दूना दुःखितास्त एव सत्रं—धनं यस्याः सा, सत्रा सुशीलेति वा । “ सत्रं गृहं धनं सत्रं, सत्रं दानमिहेरितम् । सत्रं नाम वनं सत्रं, सत्रं सञ्चरितं मतम् ” ॥ १ ॥ इत्यनेकार्थः । ‘ काली ’ कालीनाम्नी देवी । ‘ मा ’ ‘ बत ’ इति विस्मये “ बत खेदे कृपानिन्दा—सन्तोषाऽमन्त्रणाऽच्छुते ” । इति विश्वलोचनः । ‘ तरसा ’ वेगेन वलेन वा ‘ अवतात् ’ रक्षतु, अत्रववयोरैक्यन्तु यमकवशादवसेयम् । “ यमकश्लेषचित्रेषु, बवयोर्डलयोर्न मित् । नाऽनुस्वारविसर्गी च, चित्रभङ्गाय सम्मतौ ॥ १ ॥ ” इति वचनात् ॥ २० ॥

( ४२ )

## કાલીદેવીની પ્રાર્થના—

**ક્ષેત્રાકાર્થ**—અહો ? પર્વતોને લેદનારી, અસાધારણું અથાતું નિરૂપમ સામર્થ્યવાળી ગદ્દા છે જેની, ( પોતાની ) પ્રલાવડે પ્રકાશિત કરી છે પૃથ્વી જેણીએ, નિભિટ અર્થાતું જલથી પરિપૂર્ણ એવા મેઘના જેવી શ્યામ વર્ણવાતી, તેમજ ધનાદિકથી હુંએ થયેલા, રૈણાદિકથી પીડાયેલા અને ( શત્રુઓથી ) લય પામેલા જીવોનું રક્ષણું કરનારી ( અર્થાતું દ્વાખું સુશીલા એવી કાલીદેવી ) માર્દ સતત-વિલંબ રહ્યા હતા પરિપાલન કરે। ॥ ૨૦ ॥

---

## ૬—શ્રીપદ્મપ્રભાજિનસ્તુતયઃ ।

**પાદદ્વયી દલિતપદમૃદુઃ પ્રમોદ—**

**મુન્મુદ્રતામરસદામલતાન્તપાત્રી ।**

**પાદપ્રભી પ્રવિદ્ધાતું સતાં વિતીર્ણ—**

**મુન્મુદ્રતામરસદા મલતાન્તપાત્રી ॥ ૨૧ ॥**

( વસન્તતિલકા ૬-૮ )

**પાદદ્વયીતિ—**‘ દલિતપદમૃદુઃ ’ દાનિ સંજાતાન્યસ્યેતિ દલિતં-વિકસિતં યત્પદ્મં-અચ્છં તદ્વન્મૃદુઃ કોમલા । “ સ્વરાદુતો ગુણાદખરો: ” ( સિ ૦ ૨-૪-૩૫ ) ઇતિ સૂત્રેણ પાઞ્ચિકડી-પ્રત્યયાભાવે મૃદુરિતિજ્ઞેયમ् । “ દલિતં સ્ફુરિતં સ્ફુરં ” ઇતિ-હૈમઃ । ‘ ઉન્મુદ્રતામરસદામલતાન્તપાત્રી ’ ઉદ્રતા મુદ્રા-મુદ્રણ યેભ્યસ્તાનિ ઉન્મુદ્રાણિ-વિકસિતાનિ યાનિ તામરસાનાં કમલાનાં દામાનિ-માલાઃ, લતાન્તાનિ પુષ્પાણિ ચ તેપાં પાત્રી-ભાજનમ । સુરાસુ-રાદિમિઃ કમલપુષ્પાદિમિઃ પૂજિતસ્વેન પ્રમોઃ ક્રમદૃગ્યાં તામરસાદીનાં સદાસત્ત્વાદિતિભાવઃ ( અથવા ઉન્મુદ્રતામરસદામાન્યેવ પ્રલમ્બત્વાલ-

( ३३ )

तास्तासामन्तपात्री—सभीपभाजनम् ) कदाचिन्, उन्मुद्राणि—अपर्यन्तानि तामरसानि—देवनिर्भितानि रेखात्मकानि वा दय ते—धारयतीति, उन्मुद्रतामरसदा । यदिवा—उन्मुद्—उद्रुतहर्षं यद् रत्नं तस्मिन् आमः—प्रत्यग्रो योरसोऽभिलाषस्तं घटीति, उन्मुद्रतामरसदा । ‘आमलतान्तपात्री’ आमलता—रोगलता तस्या अन्तो—विनाशस्तस्य पात्री—भाजनम् । “योग्यभाजनयोः पात्रम्” इत्यमरः । ‘पात्रं तु कूलयोर्मध्ये, पर्णे नृपतिमन्त्रिणि । योग्यभाजनयोर्यज्ञभाण्डे नाळ्याऽनुकर्तरि ॥ इति हैमः सतां’ साधूनाम् । ‘वितीर्णमुद्’ वितीर्ण—दत्ता मुत्—प्रीतिर्यथा सा दत्तप्रीतिः । ‘मुद्रतामरसदा’ मुदा—हर्षेण रता अमरसदा:—सुरसभा यस्यां सा । ““समाजः परिष्वत्सदः” इति हैमः । ““स्त्रीनपुंसकयोः सदः” इत्यमरः । ‘मलतान्तपात्री’ मलेन—कर्मणा तान्तान् पीडितान् पाति—रक्षतीत्येवंशीला मलतान्तपात्री (अथवा मलताया—अन्तो नाशस्तस्य पात्री—भाजनम्) ““मलस्त्वधे किटे कदर्ये विष्टायां” इति हैमः” । ‘पाद्मप्रभी’ पद्मप्रभस्येयं पाद्मप्रभी—पद्मप्रभजिनसम्बन्धिनी ‘पादद्वयी’ चरणद्वितयी । ‘प्रमोदं’ आनन्दं । ‘प्रविदधातु’ करोतु ॥ २१ ॥

वसन्ततिलकावृत्तम्—“उक्ता वसन्ततिलका तभजा जगौ गः” ॥

### श्री पद्मप्रभने विनति—

‘द्वेषाकार्थ—विक्षित पद्मसभान सुडोभल, तेभज भीवेदां लाल कभद्रेणी भाणा अने पुण्येना पात्रदृप, अथवा विक्षिप्त पामेवां लाल कभद्रेणी भालाङ्गी लताना सभीप भाजनदृप, अथवा हुर्षपूर्वक मैथुनदृपी नवीन रसने नष्ट करनार, अथवा अपूर्व शोलावणां पद्मोने धारणु करनार, वणी शोणदृपी वेदने अंत—नाशना पात्रदृप, सज्जनोने समर्पणु कुये । छे आनंद क्षेत्र, (अथात् सत्पुडेने आनंदहायक) तेभज हुर्षमां लीन छे देवोनी

( ३४ )

સભા કેને વિષે ( અથવા હર્ષથી રમે છે સુર સભામાં રહેતા સબ્ધોનું મન કેને વિષે, (કર્મદ્વિપી) મલથી પીડાયેલ લુચોનું રક્ષણું કરનાર, (અથવા મલિનતાના વિનાશના લાજનિઃપ્ર) પદ્મપ્રલ પ્રલુલું અરણ્યયુગલ સત્પુરુષોના આનંદને ઉત્પન્ન કરે। ॥ ૨૧ ॥ આ શ્લોક તથા આ પદ્ધીના ત્રણ શ્લોકામાં વસંતિલકાવૃત છે—આ વૃત્તમાં ત-લ-જ અને જગણું એમ ચાર ગણ્ણો છે અને છેવટના એ શુરૂ છે એટલે આ વૃત્તમાં એકંદર ચૌદ (૧૪) અક્ષર છે. આઠમે અને ચૌદમે અક્ષરે ( યતિ ) વિરામ છે. આ વૃત્તને સિંહાંક્ષતા, સિંહાંત્રતા, ઉદ્ધર્વિષી, ઈદુવદના વિગેરે નામોથી કહે છે.

## સમસ્તજિનેન્દ્રાણાં સ્તુતિઃ ।

સા મે મતિં વિતનુતાજ્ઞિનપદ્ધિકરસ્ત—

મુદ્રાઽગતા�મરસભાઽસુરમધ્યગાઽદ્યામ् ।

રત્નાંશુભિર્વિદ્ધતી ગગનાન્તરાલ—

મુદ્રાગતામરસભાસુરમધ્યગાદ્યામ् ॥ ૨૨ ॥

સા મે મતિમિતિ—‘રત્નાંશુભિઃ’ રત્નાનાં—મુકટાદ્યલઙ્કારસ્થિતાનાં દીપ્રમણીનામંશવો—મયૂલાસ્તૈર્મળિમયૂખૈઃ । ‘ગગનાન્તરાલં’ ગગનસ્ય—નભસો�ન્તરાલં—મધ્યભાગમ् । “દ્વ્યોમાન્તરિક્ષિં ગગનં ઘનાશ્રય:” ઇતિહૈમઃ । ‘ઉદ્રાગતામરસભાસુર’ ઉદ્રાગં—ઉદ્રતરાગં વિકસિતં યત્તામરસં—કમલં તદ્વદ્ભૂતાસુરં-પ્રદીપમ् । ‘વિદ્ધતી’ કુર્વાણા । ( સ્વર્ગતઃ ) ‘આગતા’ આયાતા । ‘અસુરમધ્યગા’ અસુરાણા—ભવનપતિદેવવિશેષાણાં મધ્યે વિચાલે ગચ્છતિ યા સા મુક્તબૈરણીત્યર્થઃ । ‘અસ્તમુદ્રા’ અસ્તા—વિગતા મુદ્રા—પ્રમાણ—ઇયત્તા યસ્યાઃ સા । “મુદ્રા સ્યાદાકૃતૌ મુદ્રા, મુદ્રા માનેઽઙ્કુલીયકે | પિધાનેઽપિ ભવેન્સુદ્રા, મુદ્રા કર્ણવિભૂષણે” ॥ ૧ ॥ ઇતિનાનાર્થઃ । ‘અમરસભા’ અમરાણા—દેવાનાં સભા । “સભા સમ્યેષ શાલાયાં, ગોષ્ઠયાં દ્યૂતસ-

( १५ )

मूर्हयोः । इति हैमः । 'यामाद्यां' पूज्यतया प्रथमां यां (जिनपङ्क्ति) 'अध्यगात्' प्राप्तवती । 'सा' (तीर्थकुच्छेणि:) 'मे' मम । 'मति' बुद्धि । वित्तनुतात् विस्तारयतु । अथवा 'असुरमध्यगाद्यामित्येकं पदं जिनपङ्क्तेविशेषणं, तथा—असुरमध्यचारिष्वाद्यां—प्रथमाम् । यदाऽकारप्रश्नेषो न क्रियते लदा सुरमध्यगाद्यामिति विशेषणमपि सयुक्तिकम् । 'यां' (जिनपङ्क्ति) 'अमरसभा' देवसभा । 'गता' प्राप्ता । अध्यगाच्च—आश्रितवती । 'सा' 'अस्तमुद्रा' अपर्यन्ता । 'रत्नांशुभिः' मणिरद्विमभिः । "किरणोस्मयूखांशु—गमस्ति धृणिरइमयः" इत्यमरः । "रोचिरुस्रुचिशोचिरंशुगो—ज्योतिरार्चि-रूपधृत्यभीशवः" इति हैमः । 'गगनान्तरालं' आकाशस्थोदरं । 'उद्रागतामरसभासुरं' विद्वती—कुर्वाणा जिनपङ्क्तिर्मे—मम मतिं वित्तनुतात् । "आशिषि तु ह्योस्तातङ् (सि० ४-२-११९) सूत्रेण तातडादेशो प्रथमपुरुषैकवचनम् ॥ २२ ॥

### सभय जिनेश्वरेन्नी स्तुति—

**श्लोकार्थ—**( रत्नजडित आभूषण संभाषी ) रत्नेना किरणेणावडे; आकाशना भृथ्यलागने, उत्तम—अति रक्त—लाल कमल समान, हेतीभृथमान करती, तेमज्ज प्रभाणु—परिभाणु रहित, ( स्वर्गमांथी ) प्राप्त थयेली, वर्णी असुरेनी वच्ये रहेनारी ( अर्थात् शत्रुघ्ने साथे पथु भित्रता राखनारी ) एवी हेवेनी सला, ( पूज्यतानी अपेक्षाए ) वे पूज्यताथी प्रथम रहेली जिनेंद्रश्रेष्ठीने प्राप्त थर्य नमन करती हुती ते जिनश्रेष्ठी भृतारी भतिनो अधिक विस्तार करै। अथवा असुरेना भृथ्य लागमां जनाराश्चामां प्रथम एवी वे जिनश्रेष्ठी अत्ये सुरेनी सला जली हुती, तेमज्ज नेनो आश्रय देती हुती, ते परिभाणु—प्रभाणु रहित, तेमज्ज रत्नेना किरणेणावडे आकाशना भृथ्य लागने अल्यंत लाल कमल समान प्रकाशित—तेजस्वी करती ते जिनश्रेष्ठी भृतारी भतिनो विशेष विस्तार करै ॥ २२ ॥

( ३६ )

## श्रीसिद्धान्तस्वरूपम्—

श्रान्तिच्छिदं जिनवरागममाश्रयार्थ—  
 माराममानम् लसन्तमसङ्गमानाम् ।  
 धामाग्रिमं भवसरित्पतिसेतुमस्त—  
 माराममानमलसन्तमसं गमानाम् ॥ २३ ॥

**श्रान्तिच्छिदमिति**—‘श्रान्तिच्छिदं’ श्रान्तिं—श्रममर्थात्संसार-खेदं छिनत्ति—नाशयतीति श्रान्तिच्छिदत्तम् । ‘असङ्गमानां’ नास्ति सङ्गमः—भवसंबन्धो येषां तेषां मुनीनां । ‘आश्रयार्थ’ संश्रयहेतोः । ‘आरामं’ आराममिवाराममुद्यानम् । “आरामः स्यादुपवनं” कुत्रिमं वनमेव यत्” इत्यमरः । ‘लसन्तं’ शोभमानं । ‘गमानां’ पूर्वोक्तलक्षणानां—सदृशपाठानामालापकानामितियावत् । ‘अग्रिमं—प्रधानं सर्वोत्कृष्टत्वात्’, ‘धाम’ स्थानं गृहं वा । “धाम देहे गृहे रथमौ स्थाने जन्मप्रभावयोः” इतिमेदिनी ‘भवसरित्पतिसेतुं’ भवः-संसारः स एव सरित्पतिः—सागरस्तस्योत्तरणे सेतुं—पद्माभूतम् । “सेतौ पाल्यालिसंवरा:” इतिहैमः । ‘अस्तमाराममानमलसन्तमसं’ मारश्च कामः, आमश्च रोगः, मानश्च गर्वो मलश्च कर्ममलस्त एव मलीमसात्म-कत्वात् सन्तमसं ध्वानं, तद् अस्तं—निरस्तं येन तम् । “मदनो-मन्मथोमारः, प्रद्युम्नोमीनकेतनः” इत्यमरः । “मधुदीपमारौ मधु-सारथिः स्मरः” इतिहैमः । “आम आमय आकल्यमुपतापोगदः समा:” इतिहैमः । ‘जिनवरागमं’ जिनवराणां—तीर्थकराणामागमस्तं—जिनेन्द्रियसिद्धान्तं ‘आगमः—शास्त्र आयतो’ इति विश्वः ‘आनम’ प्रणम—प्रणामं कुर्वित्यर्थः ॥ २३ ॥

## श्री सिद्धान्त स्व३५—

**श्लोकार्थ—**( अनाहि काणथी लवभ्रभाषु कृत्वा वउ उत्पन्न

( २७ )

थर्येला ) श्रमनो नाश करनार, तथा अनंग-व्रति अथोत् संसा-  
रना संगरहित-अवा मुनिवरेने आश्रय करवा भाटे अगीचा  
समान, शोभायमान, तेमज्ज समान पठोना मुण्य स्थानइप,  
संसारसमूद्रने उद्धुंधन करवामां सेतु-भूल समान अने नाश कर्यो  
छे काम, दैष, गर्व, अने ( अष्ट कर्मइप ) भवइपी गाठ अंधकार  
क्षेत्रे अवा जिनेश्वरेना आगमने ( छे जन समूह ! ) तुं नभ-  
क्षार कर ॥ २३ ॥

### गान्धारीदेवीस्तुतिः ।

गान्धारि ? वत्रमुसले जयतः समीर-  
पातालसत्कुवलयावलिनीलभे ते ।  
कीर्तीः करप्रणयिनी तव ये निरुद्ध-  
पातालसत्कुवलया बलिनी लभेते ॥ २४ ॥

गान्धारीति—( हे ) ‘ गान्धारि ? ’ गां-भूमि धारयतीति  
गान्धारी, पृष्ठोदरादित्वात्साधुः तत्संबोधने गान्धारीनामिके !  
देवि ! ‘ ये ’ ( वत्रमुसले ) ‘ तव ’ भवत्याः । ‘ करप्रणयिनी ’  
करे—हस्ते प्रणयः—सौहार्दं परिचयो वा विद्यते ययोस्ते हस्तस्थिते ।  
प्रणयःस्यात्परिचये, याच्चायां सौहडेऽपि च ” इति यादवः ।

“प्रणयः प्रश्रये प्रेमिण, याच्चावि विश्रम्भयोरपि । निर्वाणेऽपि—”  
इतिमेदिनी । ‘ बलिनी ’ बलं—सारं विद्यतेऽनयोरिति बलिनी ।  
सारसमन्विते—पराकमयुत इतियावत् । ‘ अत इनिठनौ ’ ( पा०  
५—२—११५ ) इत्यनेन प्रशंसायामिनिः । उक्तव्व—“ भूमनिन्दा  
प्रशंसासु, नित्ययोगेऽतिशायने । संसर्गेऽस्ति विवक्षायां, भवन्ति  
मतुबादयः ॥ १ ॥ ”

( ३८ )

“बलं गन्धरसे रूपे, स्थामनि स्थौल्यसैन्ययोः” इति मेदिनी ।  
 ‘निरुद्धपातालसत्कुवलयाः’ निरुद्धं-आवृतं पाताले सीदन्ति तेषां  
 पातालसदां-रसातलवासिनां, कुवलयं-कोः बलयं कुवलयं पृथ्वी-  
 मण्डलं-पातालरूपं याभिस्ताः, यदा निरुद्धं पातालं सत्-शोभनं  
 कुवलयं-भूमण्डलञ्च याभिस्ताः । “जया कुर्वसुमती मही” इतिहैमः ।  
 ‘कीर्तीः’ साधु वादरूपाणि-यशांसि । “कीर्तिर्यशसि विस्तारे,  
 प्रसांदे कहमेऽपि च” इति हैमः । ‘लभेते’ प्राप्नुतः । ‘ते’ प्रहरण-  
 विशेषौ ‘समीरपातालसत्कुवलयावलिनीलभे’ समीरस्यपातेन-  
 वायुप्रेष्टोलनेन, आसमन्तात् लसन्ती-दोलायमाना या कुवलयानां-  
 कैरवाणामावलिः-पङ्क्षिस्तद्वनीला भा-द्युर्तिर्ययोस्ते, । बवयोरभेदस्तु  
 यमकवशात् “स्यादुत्पलं कुवलय-मथ नीलाम्बुजन्म च । इन्दीवरं-  
 च नीलेऽस्मिन्” इत्यमरः । ‘वज्रमुसले’ आयुधविशेषौ । ‘जयतः’  
 जयमनुभवतः ॥ २४ ॥

### गांधारीटेवीनी स्तुति—

श्वेताकार्थ—हे गांधारी हेवी ! जे वज्र अने भुजल अने  
 आयुध त्तारा हस्त तरइ स्नेह धरावे छे ( अर्थात् जेमने तुं  
 निरंतर हस्तमां धारणु करे छे ) तेमज वणी निरेध कर्यौ छे  
 पाताल तथा सुशोभित भूमंडलने। जेमणे ( अथवा आवरणु  
 कर्यु छे पातालवासी हेवोना पृथ्वीमंडलनु जेमणे (अर्थात् द्वि-  
 शाश्वेना छेडा सुधी व्यापी गयेवी ) ऐवी शीर्तिश्वाने जेमणे  
 संपादन करी छे, तेमज वणी जेम्या श्रेष्ठ अलवान् छे ते अने  
 वज्र अने भुजल डे जेमनी कांति वायुना यालवाथी अस्यांत  
 शोलता कम्लेनी माला समान नीलवण्णी छे ते अने आयुध विशेष  
 ज्यवंत वर्ते छे ॥ २४ ॥

---

( ३९ )

## श्रीसुपार्श्वजिनस्मरणम्—

कृतनति कृतवान् यो जन्तुजातं निरस्त--  
 स्मरपरमदमायामानवाधाय शस्तम् ।  
 सुचिरमविचलत्वं चित्तवृत्तेः सुपार्श्व,  
 स्मर परमदमाया मानवाधाय शस्तम् ॥ २५ ॥

मालिनी ( ८-७ )

‘कृतनतीति—‘यः’ स्वामी । ‘जन्तुजातं’ जन्तूनां—  
 प्राणिनां जातं—समूहं । “जातं जात्योधजनिषु” इति हैमः ।  
 ‘कृतनति’ कृता—विहिता नतिः—प्रणामो येन यस्मै वा तत् ।  
 ‘निरस्तस्मरपरमदमायामानवाधायशः’ स्मरश्वकामः परे च शत्रवः  
 मदश्व जात्याद्यष्टविधोगर्वः माया च कापङ्गं मानश्चाहङ्कृतिः वाधा  
 च पीडा अयशश्चापकीर्तिस्तानि निरस्तानि—ध्वस्तानि यस्य येन वा  
 तत् । ‘कृतवान्’ चकार । कृधातोः ‘कक्षकवत् निष्ठा, ( पा०  
 १—१—२६ ) इति सूत्रेण भौतकालिकक्षकवतुप्रत्यये प्रथमैकवचनम् ।  
 ‘तं’ तथाभूतं । ‘शस्तं’ प्रशस्तं । ‘सुपार्श्व’ शोभनौ पार्श्वावस्थ्य  
 सुपार्श्वः, यद्वा गर्भस्थे भगवति जनन्यपि सुपार्श्वाऽभूदिति सुपार्श्व-  
 नामानं प्रभुं । “अस्मिन् गर्भस्थिते माता, सुपार्श्व समभूद-  
 यतः । ततः सुपार्श्व इत्याख्यां, करोतिस्म पिता प्रभोः ॥ ”  
 ‘हे मानव !’ मनुज ! ववयोरैक्यन्तु यमकवशात् ‘परमदमायाः’  
 परमोदमः—इन्द्रियाणां निप्रहो यस्याः सा तस्याः । ‘चित्तवृत्तेः’  
 मनोऽयापारस्य ‘अविचलत्वं’ एकाग्रताम् । ‘सुचिरं’ प्रभूतकालं  
 यथास्थात्तथा तत् । ‘आधाय’ विधाय । आङ् पूर्वकात् ‘धा’  
 धातोः ‘समानकर्तृकयोः पूर्वकाले’ ( पा० ३—४—२१ ) इति  
 सूत्रेण त्वाप्रत्ययस्य स्थाने ‘समासेऽनञ्ज् पूर्वे क्त्वोत्यप् ( पा०

( ४० )

७-१-३७) इति स्यवादेशोऽव्ययस्त्वाद्विभक्तिओपे सिद्धम् । ‘सर’ चिन्तय, ‘स्मृ’ चिन्तायां धातोराशीः प्रेरणयोर्मध्यमपुरुषस्यैकवचनम् । त्वमितिशेषः ॥ २५ ॥ अस्मिन् पदे मालिनीवृत्तम् “ननमययुतेयं मालिनी भोगिलोकैः” ॥ इति लक्षणात् ।

### श्री सुपार्थ्नाथनुं स्मरणे

१६६०—ने सुपार्थ्नाथ प्रभुओ प्रणाम करनार ग्राण्डी-वर्गने, महन-काम, हुश्मन, मह, माया, पीडा, अने अपकृतिर्थी द्वार कर्त्ता छे, प्रथं साने पामेला अने सुंदर छे उने पार्थ्नाग जेमना एवा ते सुपार्थ्नप्रभुनुं, हे मानव ! तु, उत्तम छे उपशम जेमां एपी भनेवृत्तिनी अच्यवताने लांगा वणतसुधी प्राप्त करीने (अर्थात् भनने सर्वथा वश करीने) स्मरणे कर ॥२५॥ आ १६६१ तथा पठीना त्रणु १६६२मां भालिनीवृत्त छे, तेनु लक्षणु नीचे प्रमाणे—आ वृत्तमां न, न, म, य, अने य, एम पांच गणु छे, एटले एकंदर एक एक पादमां पंदर (१५) अक्षरे छे. विशेष एटलुं ने आठमा अक्षरे अने सातमा अक्षरे विराम (यति) छे ॥

### श्रीजिनराज्या ध्यानम्—

ब्रजतु जिनततिः सा गोचरे (रं) चित्तवृत्तेः,

सदमरसहिताया वोधिका मानवानाम् ।

पदमुपरि दधाना वारिजानां व्यहार्षीत्,

सदमरसहिता या वोधिकामा नवानाम् ॥ २६ ॥

ब्रजत्विति—(भो भव्याः! ) ‘या’ (जिनततिः) ‘वोधिकामा’ वोधिः—सम्यक्त्वं—धर्मप्राप्तिस्तत्र कामोऽभिलाषो यस्याः सा । स्वयम-वासवोधित्वात् परेषां वोधिज्ञानं तत्र कामोऽभिलाषोयस्याः सेति वा, “सहेवे सुगुरौ शुद्ध-धर्मे या वासना स्थिरा । सम्यक्त्वं तदिदं सम्यग्, मिद्यात्वं तदूव्यतिक्रमात्” ॥ (पद्मा० स. ४-२२४—) “वोधिवैद्व-समाधौ चाऽर्हद्वर्मासौ च पिप्पले” इति हैमः । ‘सदमरसहिता’ सद्गः—

( ४१ )

शोभनैरमरैदैवैः सहिता—समन्विता । ‘नवानां’ नवत्वसंख्यावतां, नूतनानां वा । ‘वारिजानां’ वारिणि जातानां—कमलानां सुरनिर्मितानां । ‘उपरि’ अग्रभागे । ‘पदं’ पादप्रक्षेपं—चरणन्यासम् । ‘दधाना’ कुर्वाणा । यतश्चोक्तमादीश्वरचरित्रे—“सहस्रपत्राण्यबजानि, सौवर्णानि तदा नव । विद्धुर्निर्दधुश्चाग्रे, क्रमेण स्वामिनः सुराः ॥ विदधे तेषु च स्वामी, पादन्यासं द्वयोर्द्वयोः । पुरः सञ्चारयामासु—राशु शेषाणि नाकिनः ” ॥ ( स० ३—४६०—४६१ ) ‘व्यहार्षत्’ विचरति स्म । ‘सा’ ‘मानवानां’ मनुष्याणां, निर्धारणे षष्ठी । ‘अधिका’ उत्कृष्टा । ‘जिनततिः’ जिनेन्द्राणां श्रेणिः । ‘वः’ युष्माकं । ‘सदमरसहितायाः’ सह दमरसेन—इन्द्रियनिग्रहाऽध्यवसायेन वर्तन्ते ये तेषां तेभ्यो वा हितायाः—हितविधायिन्याः । ‘चित्तवृत्तेः’ स्मृतेः । ‘गोचरे’ ( गोचरं ) विषये । ‘ब्रजतु’ गच्छतु ॥ २६ ॥

### श्री जिनेश्वरेन्द्रनु ध्यान

**श्लोकार्थ—**( पैताने सम्यक्त्व प्राप्त थेलुं होवाथी अन्य लुवोने पथु ) सम्यक्त्व संपादन कराववानी अलिलाषा राखती, तेमજ सञ्जनो तथा हेवाथी युक्त अथवा उत्तम हेवाथी परिवृत नवीन अथवा नव ( सुवर्णुना ) कमलो उपर चरणुने धारणु करती एवी वे जिनेद्र श्रेणी न्यां न्यां विहार करती हुती, ते मनुष्यज्ञतिमां सर्वेतत्म एवी जिनश्रेणी उपशम रसे करीने युक्त एवा जनेने हितकारी एवी तम्हारी भनेवृत्तिना विषयलूत थाए ॥ २६ ॥

( ४२ )

## जिनमतप्रशंसा—

**दिशदुपशमसौख्यं संयतानां सदैवो—**

**रु जिनमतमुदारं काममायामहारि ।**

**जननमरणरीणान् वासयत् सिद्धं ( सिद्धि ) वासे—**

**अरुजि नमत मुदारं काममायामहारि ॥ २७ ॥**

**दिशदिति—‘संयतानां मुनीनां सदैव नित्यमेव । ‘उरु’ बृहत् ।**

‘उपशमसौख्यं’ प्रशमसुखम् । ‘दिशत्’ ददत् । ‘उदारं’ उदात्तं ।

“महेच्छे तद्वटोदारोदात्तोदीर्णमहाशयाः । महामना महात्मा च” इति

हैमः । “अथोमहेच्छेऽनुदार उदारोदातकावपि ॥” शद्ग रत्ना०

‘कामं’ अत्यर्थम् । “काममसूयाऽनुगमे, प्रकामेऽनुमतावपि”

इति हैमः । ‘आयामहारि’ आयामेन आयतत्त्वेन हारि—मनोह-

रम् । “दैर्घ्यमायाम आरोहः, परिणाहोविशालता” इत्यमरः ।

‘जननमरणरीणान्’ जननं च मरणश्च ताभ्यां रीणान्—खिन्नान् (जीवा-

नित्यर्थः) । “स्यन्ने रीणं स्नुतं स्नुतम् ।” इति हैमः । ‘अरुजि’

रोगरहिते, ‘सिद्धं ( द्वि ) वासे’ सिद्धिरेववासस्तस्मिन् सिद्धिस्थाने ।

‘वासयत्’ वासं कारयत् । ‘काममायामहारि’ कामश्च माया च तयोर्म-

हारिर्महाशत्रुरिव महाचक्रमिव वा, महावैरीभूतम् । अथवा काममाया-

महारि, कामश्च माया च आमोरोगश्च तान् हरतीत्येवं शीलं । ‘जिन-

मतं’ अर्हतिसद्वान्तं, “मतं स्यात् संमतेऽर्चिते” इति हैमः । ‘मुदा’

हर्षेण । ‘अरं’ शीघ्रं । काममत्यर्थं सदैव—नित्यं । ‘नमत’ नम-

स्कारं कुरुत । अत्र सदैव काममरमिति क्रियाविशेषणेऽपि योज्यन्ते । २७

## जिनमत प्रशंसा

**श्लोकार्थ—संयमि श्वेते हुमेशां उत्तम प्रकारतुं उप-**

**शम सुख आपनार, तेभज (अनेक विषयोना विवेचनथी उत्तमपूर**

( ૪૩ )

હેવાને લીધે) અત્યંત આચામ—દીર્ઘતાવડે શોકતા ( અથવા મદન—  
કામ, માયા અને રોગને નષ્ટ કરનાર, જન્મ અને ભરણુથી એક  
પામેદા જીવાને, રોગ રહિત એવા સિદ્ધ (શિવાદ્ધી) વાસમાં જલદી  
નિવાસ કરાવનાર અને કામ તથા કાપટના મહા શત્રુ એવા જિનેં દ્વ-  
ભતને ( હે લબ્ધ્યજનો ! ) તમે હૃદાથી હુંમેશાં નમન કરો. ॥ ૨૭ ॥

---

## મહામાનસ્યાઃ સ્તુતિઃ ।

દ્વધતિ ? રવિસપતનં રત્નમાભાસ્તભાસ્વત-  
નવઘનતરવારિં વા રણારાવરીણામ् ।  
ગતવતિ ! વિકિરત્યાલીં મહામાનસીષ્ટા-  
નવઘનતરવારિં વારણારાવરીણામ् ॥ ૨૮ ॥

દ્વધતીતિ । ‘ રવિસપતનં ’ રવે:-સૂર્યસ્ય સપતનં—શત્રુભૂતમ्,  
પ્રભાઽધિક્યાત् । ‘ રત્નં ’ મણિ, “ રત્નં સ્વજાતિશ્રેષ્ઠોऽપि,  
મગાવપિ નપુંસકં ” ઇતિ મેદિની । ‘ આભાસ્તભાસ્વન્નબઘનતરવારિં ’  
આભયા—કાન્ત્યા અસ્તઃ—આક્ષિપઃ ભાસ્વાન् સુર્યો યેન સચાસો નવ-  
શ્રાસો ઘનશ્રી—મેઘસ્તદ્વદ્દિતિશયેન વારિ—જલં=તેજસ્તીદ્ધગતા યરસ્મિન्,  
‘ ઘન તરવારિં ’ ખજ્ઞમ् । “ તરવારિમતઃ ખજ્ઞઃ ” ઇતિ ધરણિઃ ।  
“ અથ ચન્દ્રહાસઃ, કરવાલનિખિશકૃપાણખજ્ઞાઃ । તરવારિકૌક્ષેયક-  
મણ્ડલાપ્રા—અસિર્કષ્ટિ—રિષ્ટી ” ॥ ઇતિ હૈમઃ । વા ચશબ્દાર્થે ।  
‘ દ્વધતિ ? ’ ધારયમાણે ? । ‘ અરીણાં ’ વૈરિણાં । ‘ રણારાવ-  
રીણાં ’ રણસ્ય—સંગ્રામસ્ય સમ્વન્ધિના આરાવેણ—ધ્વનિના । ‘ રીણાં ’  
ખિન્નામ । ‘ આલીં ’ શ્રેणિમ् । “ આલિઃ સર્વયાવલીસેત્વનર્થેષુ  
વિશદાઽશયે ” ઇતિ હૈમઃ । ‘ વિકિરતિ ! ’ વિક્ષિપતિ ! ।  
અથવા સિંહસ્ય વિશોષણમેતત્તુ ‘ વારણાઽતૌ ’ વારણાનાં—ગજાનાં,

( ४४ )

अरिस्तस्मिन्—मृगेन्द्रे । ‘ गतवति ! ’ आरुढे ? । ‘ महामानसि ? ’  
 महामानसीयभिधाने ! देवि ! ‘ इष्टान् ’ अभिमतान् (मानवान्)  
 ‘ अब ’ रक्ष । अथवा रविसपत्नं, रत्नं घनतरवारिश्चोभयमपि,  
 दधति ? अथवा ‘आभास्तभास्वन्नवघनतरवारिं’ आभया-तेजसा अस्तः  
 भास्वान्—भानुर्दीप्यमानश्चासौ नवमेघश्च वा घनःसान्द्रस्तरवारिः  
 खड्गश्च येन तत् । रवेःसपत्नं, घनतरवारिं, घनतरमतिशयितं वारि—  
 पानीयं—तेजोयस्य तदितिविशेषणत्रयविशिष्टं रत्नं, दधति ? (देवि ?)  
 अरीणां, रणाऽरावरीणां, ‘आलीं,’ विकिरति ? वारणारौ, गतवति ?  
 महामानसि ?, इष्टान्, अब ॥ २८ ॥

### महामानसी देवीनी स्तुति—

**‘क्लैकार्थः—**( अधिक तेज अने गोणाकार होवाथी ) सूर्यना  
 शत्रुघ्नप तेभज कांतिवडे परास्त कर्यां छे सूर्य अथवा प्रकाशित नवीन  
 भेद अने तस्वार नेहें, तेभज अतिशय तेजस्वी त्रणु विशेषणु  
 सहित अवा रत्नने, तेभज प्रकाशवडे परास्त कर्यां छे सूर्यने नेहें  
 अवा नवीन भेदनी नेभ अस्यांत पाणिवाली निर्भिड—प्रथंड तस्वारने  
 धारणु कर्ती हो हेवी ! युद्धना शण्ठदथी ऐह पामेली शत्रुघ्नानी  
 पंक्तिने हूर ईंकनारी, हो विद्याहेवी ! अथवा शत्रुघ्नानी शेषीने  
 हूर ईंकनार अवा सिंह उपर ऐठेवी अवी हो महामानसी देवी !  
 तु अखीष्ट—अवा भतुघ्नेतु ( सभ्यकृ रीते ) पालन कर ॥ २८ ॥

### श्रीचन्द्रप्रभजिनस्तुतयः ।

तुभ्यं चन्द्रप्रभ ! जिन ! नमस्तामसोज्ञमितानां,  
 हाने कान्तानलसम ! दयावन् ? दितायासमान ! ।  
 विद्वत्पङ्क्त्या प्रकटितपृथुस्पष्टदृष्टान्तहेतू—  
 हानेकान्तानलसमदया वन्दितायासमान ! ॥ २९ ॥

मन्दाकान्ता [ ४-६०७ ]

( ४५ )

तुभ्यमिति—( हे ) ‘चन्द्रप्रभ ! ’ चन्द्रस्येव प्रभा—दीपि-  
 यस्येति बहुत्रीहिस्तत्सम्बोधनम् । गर्भस्थेऽस्मिन् मातुश्चन्द्रपानदो-  
 हदोऽभूदितिचन्द्रप्रभनाम । जिनचरितेऽपि—“ गर्भस्थेऽत्राभवन्मातु—  
 अन्दपानाय दोहदः । चन्द्राभश्चायमित्याह—दमुं चन्द्रप्रभं पिता ”  
 ‘जिन ! ’ जिनेन्द्र ! । ‘ तामसोज्ञमितानां ’ तामसानि—तमः  
 सम्बन्धीनि यानि उज्जृमितानि—प्रकटितानि तेषाम् । ‘ हाने ’  
 त्याजने । ‘ कान्ताऽनलसम ! ’ कान्तश्चासावनलश्च तेन समस्तत्स-  
 स्म्बोधने हे स्तिरधाग्निसदृश ! । ‘ दयावन ! ’ दयाऽस्याऽस्तीति  
 तदामन्त्रणम् । ‘ दितायासमान ! ’ दित आयासस्य खेदस्य  
 मानो—दर्पो येन सः ( अथवा दितौ खण्डतावाऽयासश्च  
 मानश्च तौ येन स तदामन्त्रणम् । ) ‘ प्रकटितपृथुस्पष्टदृष्टान्त-  
 हेतूहानेकान्त ! ’ पृथवो—वितताः स्पष्टाः—स्फुटाः दृष्टान्ताः—निर्दर्श-  
 नानि हेतवः—कारणानि, ऊहा—वितर्काः, अनेकान्तः—स्याद्वादः,  
 पृथवः स्पष्टाः, दृष्टान्तहेतूहा यस्मिन्, स चासावनेकान्तश्च प्रकटितः  
 पृथुस्पष्टदृष्टान्तहेतूहानेकान्तो येन तस्य सम्बोधनम् । यथा पर्वतो  
 वह्निमानिति निश्चयार्थं महानसमिति दृष्टान्तः । धूमादिति हेतुः ।  
 स्थाणुर्वा पुरुषोवेति संशयाऽस्तमक उहः । एकस्मिन् वस्तुनि विविधा-  
 पेक्षया विरुद्धवर्माणामप्यविरुद्धतया स्वीकरणमनेकातन्तवादः ।  
 ‘असमान ! ’ अनन्य—सदृश । ‘ अनलसमदया ’ अलसश्च—आलस्यं  
 मदश्च जात्यादिस्मयो न विद्येते यस्याः सा, अनलसमदा तया, अत्र  
 यद्यपि अलसशब्देन धर्मी, आलस्य शब्देन च धर्मः, यदाह—“ आलस्यः  
 शीतकोऽलसोऽनुष्णः ” इत्यमरः । तथा—आलस्यतन्द्राकौसीद्यमिति  
 हैमवचनाच । तथाऽपि धर्मधर्मिणोः कथञ्चिदभेदादलसशब्देनाऽ-  
 प्यालस्यमेव प्रतिपाद्यमिति सर्वं समञ्जसम् । अथवा न विद्येते लस-  
 मदौ यस्मिन्निति सं० या—लक्ष्मीस्तया वन्दिताय स्तुतायेति तुभ्यमि-  
 त्यस्य वि० ‘ विद्वत्पङ्क्त्या ’ विदुषां श्रेण्या । ‘ वन्दिताय ’ स्तुताय

( ४६ )

। ‘ तुम्हर्यं ’ ते । ‘ नमः ।’ नमोऽस्तु ‘ शक्तर्थवधूनमः ।’ इति नमो  
योगे चतुर्थी ॥ २९ ॥ अस्मिन् पदे मन्दाक्रान्तावृत्तम् । “ मन्दाक्रा-  
न्ता जलधिषड्गैम्भै नतौ तादुरु चेत् । इति लक्षणात् ।

**श्लोकार्थ—**धवलताने लीघे अथवा सौभ्यताने लहने सोभ-  
यंद्र समान प्रला-कांति छे जेनी एवा हे यंद्रप्रल ! अष्टम तीर्थं कर !  
वणी गाठ अंध काररूपी अज्ञानां स्कुरण्यानो नाश करवामां प्रकाश-  
वाणा अभि समान ! ( हे देवाधिदेव ! ) हे कृपावन् ! भगवन् ! छेही  
नाख्यां छे ( संसार भ्रमणुरूपी ) प्रयास अने अलिमान अथवा  
प्रयासनो अलिमान जेणु एवा हे प्रस्तो ! विद्वानेनी श्रेष्ठीद्वारा  
प्रगट कर्या छे विशाल, स्पष्ट एवां उदाहरण्या, युक्तिएवा, तर्ती अने  
अनेकान्त-स्याद्वाद जेणु एवा हे नाथ ! -अनुपम परमेश्वर !, अवि-  
धमान छे आलस्य अने अलिमान जेने विषे एवी विद्वानेनी  
श्रेष्ठिवडे वंदन करायेला अथवा अविधमान छे आलस्य अने  
गर्व जेने विषे एवा ( हे जिनेश्वर ! ) अने लक्ष्मीवडे पूजा-  
येला एवा हे जिनेंद्र ! तमने भृत्यो नमस्कार होव ॥ २६ ॥

आ श्लोक तथा आ पठीना वाणु श्लोकेमां भंदाकांता नामे  
वृत्त छे. तेतुं लक्षण्य नीचे प्रभाण्य छे. आ छंदमां भ, ल, न,  
त, अने तगाणु एम पांच गण्या छे अने छेवटना ऐ अक्षरे  
दीर्घ छे. एकंदर आ छंदमां सत्तर अक्षर छे. आ छंदमां चोये,  
दशमे, अने सत्तरमे अक्षरे विराम छे—अर्थात् आ छंदमां  
त्रणु ‘ थति ’ छे ॥ २६ ॥

### जिने श्वराणां प्रणतिः—

जीयाद्राजी जनितजननज्यानिहानिर्जिनानां,  
सत्यागारं जयदमितरुक् सारविन्दावतारम् ।  
भव्योङ्गत्या भुवि कृतवती याऽवहद्यर्मचक्रं,  
सत्यागा रञ्जयदमितरुक् सा रविं दावतारम् ॥ ३० ॥

( ४७ )

जीयादिति । ‘या’ (जिनराजी) ‘सत्यागा’ त्यागेन समेता । ‘भव्योद्धृत्या’ भव्यानां—मोक्षगामिसत्त्वानामुद्धृति—भवोत्ताररूपा तथा हेतुभूतया । ‘भुवि’ पृथिव्याम् । ‘अवतारं’ जन्मग्रहणम् । ‘कृतवती’ विहितवती । (या च) ‘जयदं’ जयमुक्तर्ष ददातीति—अभ्युदयप्रदं । ‘रवि’ भानुम् । ‘रञ्जयत्’ रक्तीकुर्वत् । ‘अमित-रुक्’ अमिता—अपरिमिता रुक्—कान्तिर्यस्यतत् । अथवा रञ्जयदमित-तरुगित्येकं पदं धर्मचक्रविशेषणम् । ‘दावतारं’ दाववदुज्जवलम् । “दवदावौ वनाऽनले” इति हैमः । ‘धर्मचक्रं’ धर्मसमयोत्पन्नं वा धर्मप्रकाशकं चक्रं—रथाङ्गं । ‘अवहत्’ दधार ‘सा’ (जिनराजी) ‘सत्यागारं’ सत्यस्य—सूनृतस्याऽगारं—गृहम्, अजहलिङ्गोऽयम् । ‘इत-रुक्’ इता—गता रुक्—रोगोयस्याः सा । ‘सारविन्दा’ सह अरविन्दैः कमलैर्वर्तते या सा । ‘जनितजननज्यानिहानिः’ जनिता प्रकटिता जननस्य ज्यान्याश्च जन्मजरसोरथवा जननानां—लोकानां ज्यानेर्जराया हानिर्विनाशोयया सा । ‘जिनानां’ तीर्थकृतां । ‘राजी’ पञ्चः । ‘बत्’ इति विस्मये “खेदाऽनुकम्पासन्तोष—विस्मयाऽमन्त्रणे बतः” । इत्यमरः ॥ ‘अं’ शीघ्रम् । ‘जीयात्’ जयतु ॥ प्रथमान्तानि विशेषणानि द्वितीयान्तानि कृत्वा धर्मचक्रस्य योज्यानि वा । अथवा या भव्योद्धृत्या भुवि जयदं, सत्यागारं, अवतारं कृतवती, रवि रञ्जयत्, अमितरुक्, धर्मचक्रव बत, अवहत्, सा, इतरुक्, जनितजननज्यानिहानिः, सारविन्दा, सत्यागा—सारं विन्दते—लभत—इति सारविन्दा । जिनानां राजी, अं—शीघ्रं “अं शीघ्रे च चक्राङ्गे, शीघ्रगे पुनरन्यवत्” इति विश्वः । जीयात् ॥ ३० ॥

### जिनेश्वरैनी स्तुति—

श्लोकार्थ—लव्यल्लयेना ( लवेत्तारणुरुप ) उद्धार भाटे ने जिनश्रेष्ठीये, पृथ्वीने विषे अभ्युदय आपनार, अने सत्यना,

( ४८ )

મહિરદ્દિપ જન્મ ધારણુ કર્યો. તેમજ વિજય આપનાર, સૂર્યને રહૃત  
કરનાર, વળી અત્યંત કાંતિવાળા તેમજ દાવાના સમાન હેત્તિષ્યમાન,  
અહો ! મનુષ્યોને રાગ ઉત્પન્ન કરનાર અપરિમિત—પ્રમાણુ રહૃત  
પ્રભા—કાંતિવાળું ( હેવરચિત ) ધર્મચક્ર જેણે ધારણુ કર્યું છે,  
વળી દોગથી મુક્તા, તેમજ નાશ કર્યો છે જન્મ અને જરાનો જેણે,  
( હેવરચિત ) નવ સુવર્ણ ક્રમદોથી ચુક્તા, ( સાંવત્સરિક ) દાન સહૃત,  
અને પરાક્રમી એવી જિનશેણી સતત સર્વેત્કૃષ્ટપણે વર્તો ॥ ૩૦ ॥

### સિદ્ધાન્તસ્તુતિ:

**સિદ્ધાન્તઃ સ્તાદહિતહત્યેડ્રુલ્યાપયદં જિનેન્દ્રઃ;**

**સદ્રાજીવઃ સ કવિધિષણાપાદનેડ્કોપમાનઃ ।**

**દક્ષઃ સાક્ષાચ્છ્રવણચુલુકૈર્ય ચ મોદાદ્રિહાયઃ—**

**સદ્રાજી વઃ સકવિધિષણાપાદનેકોપમાનઃ ॥ ૩૧ ॥**

**સિદ્ધાન્તઇતિ । ‘ય’ ( સિદ્ધાન્તં ) રાદ્રાન્તં “ સમૌસિદ્ધા-  
ન્તરાદ્રાન્તૌ ” ઇત્યમરઃ । ‘સદ્રાજીવઃ ’ સન્તિ—શોભમાનાનિ રાજી-  
વાનિ—દેવરચિતાનિ કમલાનિ યસ્યસ: “ વિસપ્રસ્નનરાજીવ—પુષ્ક-  
રામભોરહાણિ ચ ” ઇત્યમરઃ । ‘ કવિધિષણાપાદને ’ કવય:—શાસ્ત-  
કારાસ્તેષાંધિષણા—પ્રતિભા તસ્યા આપાદને—આવિષ્કરણે । ‘ દક્ષઃ ’  
નિપુણઃ । ‘ અકોપમાનઃ ’ ન વિદેતે કોપમાનો યસ્ય સ: । ‘ અને-  
કોપમાનઃ ’ અનેકાનિ—અપરિમિતાનિ—શશાઙ્કવારધિપ્રભૃતીનિ, ઉપ-  
માનાનિ યસ્ય સ: । ‘ જિનેન્દ્રઃ ’ જિનાધિપ: । ‘ અરુલ્યાપયત્ત ’  
ખ્યાપિતવાન् । ‘ ય ચ ’ । સિદ્ધાન્તં । ‘ સકવિધિષણા ’ સહ કવિધિ-  
ષણાભ્યાં—ગુરુશુક્રાભ્યાં વર્તતે ચા સા । “ કવિ: કાઠ્યકરે સૂરૌ,  
પુંસિ વાલ્મીકિશુક્રયો: । ખલીનેડ્રસી કવિર્ઝેય: ” ઇતિગૌડઃ ।  
“ ધિષણસ્ત્રિદશાચાર્યો—ધિષણા તુ મનીષિકા ” “ ઉદ્દાના ભાર્ગવઃ**

( ४९ )

कविः, पोडशोऽर्चिदेवयगुरुः” इत्युभयत्राऽपि हैमः । ‘विहायःसद्राजी’ विहायसि—नभसि सीदन्तीति विहायःसदः—देवास्तेषां राजी—श्रेणिः । ‘श्रवणचुलुकैः’ श्रोत्राऽङ्गलिभिः । ‘मोदात्’ हर्षीत् । ‘साक्षात्’ प्रत्यक्षं । “साक्षात्प्रत्यक्षतुल्ययोः” इत्यमरः । ‘अपात्’ पिबति स्म । अत्यादरेण पानं श्रवणमुक्त्यत इति न्यायादश्रौषीदित्यर्थः । ‘स सिद्धान्तः’ आगमः । ‘वः’ युष्माकम् । ‘अहितहतये’ अहितममङ्गलं तस्य हतये—दूरीकरणाय नाशायेति यावत् । ‘स्तात्’ भवतु । एतानि प्रथमान्तविशेषणानि ‘सद्राजीवः’ इति मुक्त्वा सिद्धान्तस्य योज्यानि ॥ ३१ ॥

### सिद्धान्तनी स्तुति—

**श्लोकार्थ**—विद्यमान ( अथवा शोलायमान ) છે સુવर्ण કમલો । નેનां એવા, વળી વિદ્ધાનેને અથવા કવિઓને બુદ્ધિ પ્રાપ્ત કરાવવામાં નિપુણ, તથા કોધ અને માન રહીત, તેમજ અનેક ઉપમાયોગી શુદ્ધત એવા જિનેથરે જે સિદ્ધાન્તની પ્રદ્યપણું કરી, તેમજ જે સિદ્ધાન્તનું શુદ્ધ અને બૃહુદ્યપતિથી અલંકૃત એવી હેવોની પંક્તિએ હર્ષ સહિત સાક્ષાત् શ્રવણ—કાન્દ્રધી અંજલિયાબડે પાન કર્યું છે તે સિદ્ધાન્ત હે અધ્યાત્મા ! તમારા અહિતના નાશ માટે થાયો ॥ ३१ ॥

### वज्राङ्कश्याः स्तुतिः ।

वज्राङ्कश्यङ्कश्कुलिशभृत ? त्वं विघत्स्व ग्रयत्नं,  
स्वायत्यागे ! तनुमदवने हेमतारातिमत्ते ।  
अध्यारूढे ! शशधરकरश्वेतभासि द्विपेन्द्रे,  
स्वायत्यागेऽतनुमदवने हेऽमतारातिमत्ते ! ॥ ३२ ॥

( ५० )

**वज्रेति—( हे ) ‘ वन्नाङ्कुशि ! ’ देवि ! । हे इत्यामन्त्रणा-  
अभिव्यक्तये । “ हे है व्यस्तौ समस्तौ च, हूतिसम्बोधनार्थयोः ” इति  
विश्वः । ‘ अङ्कुशकुलिशभृत् ’ अङ्कुशश्च शृणिः कुलिशञ्च वज्रं तद् विभर्ति  
तस्याः सम्बोधनम् । ‘ स्वायत्यागे ’ आयश्च—अर्थस्याऽऽगमः, त्यागश्च—  
दानं सुष्ठु—शोभनौ, आयत्यागौ यस्याः सा तत्संबोधनम् । ‘ अतिमत्ते ’  
अतिशयेन मत्तस्तस्मिन्—मदाऽन्विते, ‘ मदी ’ हर्षग्लेपनयोरिति  
मद्धातोः ‘ कतक्तवतूनिष्टेति ’ क्त प्रत्यये ‘ रदाभ्यां निष्टातो नः पूर्वस्य च  
दः’ (पा० ८—२—८२) इति सूत्रेण तकारस्य नत्वे प्राप्ते ‘ न ध्याव्यापृ  
मूर्च्छिमदां (पा० ८—२—५७) इति सूत्रेण निषिद्धे मत्त इति सिद्ध-  
मन्यथा मन्त्र इत्यनिष्टापत्तिःस्यादिति बोध्यम् । ‘ शशधरकरश्वेत-  
भासि ’ शशधरस्य—चन्द्रस्य कराः—रश्मयस्तद्वच्छ्रुता—उज्ज्वला भाः—  
कान्तिर्यस्य तस्मिन् । “ करः शुण्डारदिमहस्ते, द्वित्वसंज्ञाधनोपले ।  
बलौ नक्षत्रसंज्ञायां, प्रत्यये कारके त्रिषु ” इति शब्दसिन्धुः ‘ स्वा-  
यत्या ’ स्वस्य आयत्या—आयामेन कृत्वा । “ दैर्घ्यमायाम आनाहः,  
परिणाहो विशालता । आयतश्च ” इति केशवः । ‘ अगे ’ सानुम-  
तीव गिरितुल्य इत्यर्थः । ‘ अतनुमदवने ’ अतनु—न तनु अतनु-  
प्रभूतं मदवनं मद एव वनं—दानवारि यस्य यस्मिन् वा तस्मिन् ।  
“ जीवनं भुवनं वनं ” इत्यमरः । अथवा अतनुमदरूपं वनं—काननं  
यस्य सः श्यामकत्त्वात्, तथा च गिरिप्राये इति विशेषणं संगच्छते  
“ वनं प्रस्तवणे गेहे, प्रवासेऽम्भसि कानने ” इति हैमः । ‘ द्विपेन्द्रे ’  
गजेन्द्रे । ‘ अध्यारूढे ! ’ अध्यासीने ! । ‘ अमतारातिमत्ते ! ’ अराति-  
मतो—विपक्षसहितस्य भावः—अरातिमत्ता, सा न मता—अनभिप्रेता  
यया सा तत्सम्बोधनम् । सकलविरोधितोऽद्वेदनादितिभावः । ‘ हे मतारा ’  
सुवर्णोज्ज्वला । ‘ त्वं ’ भवती । ‘ तनुमदवने ’ तनुमतां—देहिनामवने—  
रक्षणे ‘ प्रयत्नं ’ प्रकृष्टं यतनं । ‘ विधत्स्व ’ कुरुष्व । ‘ दुधाय् ’ धार-**

( ५१ )

णपोषणयोरिति धा धातोर्जुहोत्यादिगणस्थस्याऽस्तमनेपदस्य लोटो-  
मध्यमपुरुषस्यैकवचनम् ॥ ३२ ॥

### वज्रांकुशी हेवीनी स्तुति—

**६. वज्रांकुशी**—अंकुश अने वज्रने धारणु करनारी हे देवी !  
उत्तम प्रकाशनां छे ( अर्थांगभृत्यी ) लाल अने हान केनां एवी  
हे विद्याहेवी !, अत्यंत महोन्मत्त एवा, तेमज्ज चंद्रना किरणेषु समान  
श्रेष्ठत उज्ज्वल-कांतिवाणा, वणी पौताना विस्तारवडे पर्वत समान  
अने अत्यंत महज्जण ( अथवा महदृप वन-अरण्य ) ने धारणु करता  
एवा गजराज उपर आढ़ू थेषेवी, ( हेवी ) अभान्य छे शत्रुता  
केने-अर्थात् शत्रुताने त्याग करावी भित्रता करावी आपनारी  
हे वज्रांकुशी हेवी ! सुवर्णु समान उज्ज्वल एवी तुं शरीरधारी  
प्राणीयाना रक्षणु भाटे प्रथत्न कृ ॥ ३२ ॥

### ९—श्रीसुविधिनाथजिनस्तुतिः

तवाऽभिवृद्धिं सुविधिर्विधेया—

त्स भासुरालीनतपा दयावन् ? ।

यो योगिपङ्क्त्या प्रणतो नभःस—

त्सभासुरालीनतपादयाऽवन् ॥ ३३ ॥

**तवाभिवृद्धिमिति-** ‘ यः ’ ( श्रीसुविधिनाथः ) ‘ अवन् ’  
रक्षन्—प्राणिगणानित्यध्याहृत्य गम्यते । ‘ नभःसत्सभासुरालीनत-  
पादया ’ नभसि सीदन्तीति नभःसदो देवास्तेषां सभा—पर्षत् असु-  
राणां दैत्यानामाली—संहतिः, ताभ्यां नतौ—पादौ यस्याः सा तया ।  
“ वीथ्यालिरावलिः पङ्क्तिः, श्रेणी लेखास्तु राजयः ” इत्यमरः ।  
‘ योगिपङ्क्त्या ’ योगश्चित्तवृत्तिनिरोधलक्षणो येषां विद्यते तेषां योगिनां

( ५२ )

प्रद्वक्तिस्तया यतिपरम्परया “ आपरमाणुदर्शिनो योगिनः ” इतिन्या यविदः । ‘ प्रणतः ’ प्रकर्षेण-नतः । ‘ सः ’ पूर्वोक्तः ‘ भासुरालीनतपाः ’ भासुरं-घोरं, श्रेष्ठं आलीनं-आश्रितं तपः—अनशनादिरूपमनौदर्या-दिरूपं वा येन सः “ भयङ्करे तु डमर-मामीलं भासुरं तथा । ” इति हैमः “ भासुरं तु भये कुष्ठौषधौ स्फाटिकवीरयोः । दीप्तौ च ” इति शब्दसिन्धुः । तथाविधिः । ‘ सुविधिः ’ सुष्ठु विधिर्विधानं सत्क्रियाऽचरणादिकं यस्य सः सुविधिः—नवमजिनः । ( हे ) ‘ दयावन ! ) दयालो ! ( जन ! ) ‘ तव ’ भवतः । ‘ अभिवृद्धिं ’ अभ्युदयं । ‘ विधेयात् ’ विदध्यात् । विपूर्वक ‘ डुधान् ’ धारणपोषणयोरितिधातोराशिषि कर्त्तरि प्रथमपुरुषस्यैकवचनम् ॥३३॥ अस्मिन् पदे-उपजातिवृत्तं, तल्लक्षणञ्च—“ स्यादिन्द्रवज्ञा ग्रदि तौ जगौ गः, उपेन्द्रवज्ञा प्रथमे लघौ सा । अनन्तरोदीरितलक्ष्मभाजौ, पादौ यदीयावुपजातयस्ताः ” इति छन्दोमञ्चरी ।

### श्रीसुविधिनाथने प्रार्थना—

**६.लोकार्थ—** जे ( जगत्तु ) रक्षणु करनार छे, तेमज देव सभाए अने असुरोनी पंक्तिए जेना। यरणोमां नमन कुर्यां छे एवा, वर्णी योगी ( भुनि ) एतानी पंक्तिवडे जे वंदन करायेत छे, ते अनशनाहि धोर अथवा श्रेष्ठ तपश्चर्यानो आश्रय देनारा एवा श्रीसुविधिनाथ ( पुष्पदंत ) प्रलु-हे कृपावान् मानव ! तने समृद्धिवान् करै-अर्थात् तहने विशेष संपत्तिधारी बनावो ॥३४॥

आ पद्ममां उपलतिवृत्त छे. एटले ईंद्रवज्ञा अने उपेंद्रवज्ञाना भिक्षणुद्देशे आ वृत्त थाय छे. तेमां ईंद्रवज्ञामां ऐ तरणु अने एक जगणु तेमज छेवटना ऐ शुद्ध मणी अणीयार अक्षर छेय छे अने उपेन्द्रवज्ञामां प्रथम-४-त-४ अने अंतमां ऐ शुरु छे. अर्थात् ईंद्रवज्ञामां प्रथम अक्षर शुद्ध छे अने उपेंद्रवज्ञामां प्रथम अक्षर लघु छे, आ वृत्तमां प्रथम, द्वितीय अने यतुर्थ यरणु उपेंद्रवज्ञामां छे अने द्वितीय यरणु ईंद्रवज्ञामां छे.

( ५३ )

## जिनेश्वराणामभ्यर्थना—

या जन्तुजाताय हितानि राजी,  
 सारा जिनानामलपद् ममालम् ।  
 दिश्यान्मुदं पादयुगं दधाना—  
 सा राजिनानामलपद्ममालम् ॥ ३४ ॥

येति—‘जिनानां’ तीर्थाधिपानाम् । ‘या’ ‘सारा’ सारः—बलं विद्यते यस्यां सा सारा, अनन्तबलत्वात् श्रेष्ठा वा “सारो मज्जास्थिरांशयोः” । बले श्रेष्ठे च सारं तु—द्रविणन्याय्यवारिषु” इति हैमः । ‘राजी’ श्रेणिः । ‘जन्तुजाताय’ जन्तूनां—मानवानां जाताय—समूहाय । ‘हितानि’ पश्यानि कल्याणसाधनानीति यावत् । ‘अलपत्’ अकथयत् । ‘सा’ यत्तदोर्नित्याऽभिसम्बन्धात् । ‘राजिनानामलपद्ममालं’ राजिनी—राजनशीला—नाना—विविधा, अमला—निर्मला पद्मानां माला श्रेणिर्यस्य तत् । ‘पादयुगं’ पादयोर्युगं तत्—चरणद्वयम् । “पादोऽख्ती चरणे मूले, तुरीयांशोऽपि दीधितौ । शैलप्रत्यन्तशैले ना” इति विश्वलोचनः । ‘दधाना’ विभ्रती । (राजी) ‘मम’ मे ‘अलं’ अत्यर्थम् । “अलं भूषणपर्यामि—वारणेषु निरर्थके । अलं शक्तौ च निर्दिष्टम्” इति विश्वः । ‘मुदं’ हर्षम् । “मुत्तीत्यामोदसंमदाः” इति हैमः । ‘दिश्यात्’ वितीर्यात् । ‘दिश’ अतिसर्जन इति धातोः कर्त्तर्यांशिषि परस्मैपदे ग्रथमपुरुषस्वैकवचनम् ॥ ३४ ॥

### जिनेश्वरोने विनति.

**श्लोकार्थ—**जिनेद्रोनी जे अनंत अणवाणी (अथवा श्रेष्ठ) पंक्तिए, प्राणीयोना समूह भाटे हितकारक साधनोने। उपदेश क्यो। छे, ते जिनें द्वश्रेष्ठी अत्यंत शोलितां—भनेहुर विविध प्रका-

( ५४ )

રનાં અને નિર્મળ એવાં પદ્મોની માદાચે અથવા શ્રેણિઓ છે જે  
સંબંધી એવા ચરણુયુગલને ધારણ કરનારી એવી શ્રાવિનેંદ્રશ્રેણી  
ઝુને અતિશય હૃષ્ટ—આનંદ આપે। ॥ ૩૪ ॥ ઈદ્વભજા ॥

## जिनवाणीस्तुतिः ।

जिनेन्द्र ! भङ्गैः प्रसभं गभीराऽ-

शु भारती शस्यतमस्तवेन ।

निर्नाशयन्ती मम शर्म दिश्यात्-

शुभाऽरतीशस्य तमस्तवेन ? ॥ ३५ ॥

जिनेन्द्रेति । ( हे ) ‘ जिनेन्द्र ? ’ ( हे ) ‘ रतीशस्य ’  
रत्याः ईशः रतीशः—स्मरस्तस्य । ‘ इन ! ’ स्वामिन् ! । અથવા  
‘ અરતીશસ્ય ’ રતીશઃ—કામઃ સ નાસ્તિ યસ્ય સ તસ્ય મુનેઃ ઇન !  
મુનેરિતિ જાતિસ્વાદેકવચનમ् । ‘ ભङ्गैः ’ અર્થવિકલ્પૈः । “ ભङ્ગस્તરઙ્ગૈ  
ભેદે ચ, રુગ્વિશે પરાજયે । કौટિલ્યે ભયવિચિછિન્થ્યો: ” ઇતિ હૈમ: ॥  
‘ પ્રસભં ’ પ્રકટમત્વન્તં વા “ બલાત્કારસ્તુ પ્રસભં હઠ: ” ઇતિ હૈમ:  
“ પ્રસભં તુ બલાત્કારે, ચાડત્યન્તેડયયમસ્થિયામ् । ” ઇતિ શબ્દ-  
સિન્ધુઃ । ‘ ગભીરા ’ દુરવગાહા । ‘ શસ્યતમસ્તવેન ’ અતિશયેન શસ્ય:  
શસ્યતમસ્તેનસ્તવેન પ્રશસ્યતમસ્તવેન,—સ્તુત્યા દેતુભૂતયા સ્તુતા સતી ।  
“ સ્તવઃસ્તોત્રં સ્તુતિરૂતિ: ” ઇત્યમર: । ( રતીશસ્ય—કામસ્ય ) ‘ તમઃ ’  
મોહમજ્ઞાનમ् । ‘ આશુ ’ શીંગમ । “ આશુ બ્રીહ્મૈ ચ સન્ચરે ” ઇતિ  
વિશ્વઃ । ‘ નિર્નાશયન્તી ’ અપનુદન્તી । ‘ તવ ’ ભવતઃ । ‘ શુભા ’  
કલ્યાણી । ‘ ભારતી ’ વાણી ‘ બ્રાહ્મી તુ ભારતી ભાષા ’ ગીર્વા-  
ગ્વાણી સરસ્વતી । ઇત્યમર: । ‘ મમ ’ મત્સવાનિધિ । ‘ શર્મ ’ સુખં ।  
“ શર્મેસાતસુખાનિ ચ ” ઇત્યમર: । ‘ દિશ્યાત् ’ દેયાત् ॥ ३५ ॥

( ५५ )

## जिनेश्वरेनी स्तुति.

**श्लोकार्थ—**( हे ) जिनेंद्र ! ( कंदर्प—कामने वश करेवा हेवायी ) हे रतिपति—कामदेवना स्वाभिन् ! अथवा नथी काम करने विषे एवा मुनिएवाना ( पणु ) स्वाभिन् ? तेमज्ज अर्थना विकल्पे । वडे अति गहन एवी, तथा अत्यंत प्रशंसनीय स्तुतिवडे ( कामदेवना ) अज्ञानने सर्वथा तत्काण नाश करनारी अने उत्कृष्ट एवी तमारी वाणी भने सुभ आपो ॥ ३५ ॥ उपलतिवृत्त छे.

## ज्वलनायुधायै प्रार्थना—

दिश्याच्चवाशु ज्वलनायुधाऽल्प—  
मध्या सिता कं प्रवरालकस्य ।  
अस्तेन्दुरास्यस्य रुचोरु पृष्ठ—  
मध्यासिताऽकम्प्रवराऽलकस्य ॥ ३६ ॥

दिश्यादिति । ‘अल्पमध्या’ अल्पं—सूक्ष्मं मध्यं—कटिभागो यस्याः साऽल्पमध्या—कृशोदरी । “मध्यमं चावलग्नं च, मध्योऽखी” इत्यमरः । ‘सिता’ शुभ्रवर्णा । ‘प्रवराऽलकस्य’ प्रवराः—प्रधानाः कुटिला वा अलकाश्रूर्णकुन्तला यस्मिस्तत्तस्य प्रवरकुन्तलस्य । “अल-काश्रूर्णकुन्तलाः” इत्यमरः । “अलकस्तुकर्करालः, खञ्जरश्रूर्णकुन्तलः” इति हैमः । ‘आस्यस्य’ आननस्य । ‘रुचा’ कान्त्या । ‘अस्तेन्दुः’ अधःकृतशशाङ्कः । ‘अकम्प्रवरालकस्य’ अकम्प्रः—स्थिरो यो वरालकः—वराहो=देववाहनविशेषस्तस्य । ‘उह’ विशालं । ‘पृष्ठं’ उपरिभागम् । “पृष्ठन्तु चरमं तनोः” इति हैमः । ‘अध्या-सिता’ अध्यास्त्रूदा । ‘ज्वलनाऽयुधा’ ज्वलनान्यायुधानि यस्याः सा—ज्वलन एवाऽयुधं यस्याः सेति वा । प्रदीपसर्वाक्षा देवी । ‘तव’ भवतः । ‘कं’ सुखम् । “को ब्रह्माऽत्माऽनिलाऽर्केषु, शमने सर्व-

( ५६ )

नाम्नि च । पावकेषु मयूरे च, सुखशीर्षजलेषु कम् ” इति विश्वः । ‘ आशु ’ शीघ्रं । ‘ अशौटि ’ व्याप्तौ, अश्नुते तेजसा सर्वं केदारं वेत्याशुः सूर्योब्रीहिश्च, अशनं वाऽशु क्षिप्रम् । अश्नुते इति वा आशु शीघ्रगामि शीघ्रकारि च । ‘ कृवापाजि ’ ( सि० उणा० सू० १ ) इत्युण् प्रत्ययः । यच्च—दुर्गः—“ आश्वाख्या शालिशीघ्रयोः ” ‘ दिश्यात् ’ ददातु ॥ ३६ ॥

### ज्वलनायुधादेवीनी प्रार्थना—

<sup>१</sup>लेकार्थ—तनु—पातली ४७—४८मरवाली, शुभ्र वर्णवाणी, सर्वेत्तम डेशयुक्त मुखनी कांतिवडे परास्त कर्यो छे चांद ज्वेणीच्ये एवी तेमज्ज स्थिरतावाणा वरालक ( हेववाढन विशेष ) नी विशाण पीठ उपर घेठेली एवी ज्वलनायुधा एटले प्रहीस छे आयुध ज्वेनां अथवा अभि छे आयुध ज्वेनुं एवी—अर्थात् सर्वांच्य महाज्वलाना नामे ( हेवी ) हे अव्यञ्जन ! तडुने सत्त्वर सुण आप्ये ॥ ३६ ॥ ईश्वरजा.

### १० अथ श्रीशीतलनाथजिनस्तुतिः—

जयति शीतलतीर्थकृतः सदा,  
चलनतामरसं सदलं धनम् ।  
नवकम्बुरुहां पथि संस्पृशत—  
चलनतामरसंसदलझ्वनम् ॥ ३७ ॥

जयतीति । ‘ शीतलतीर्थकृतः ’ सकलसन्त्वसन्तापहरण-च्छीतलः, तथा गर्भस्थे भगवति पितुः पूर्वोत्पन्नाऽचिकित्स्यपित्तदाहो जननीकरस्पर्शादुपशान्तः, स चासौ तीर्थकृच्च तस्य शीतलनाम्नो जिनस्य । ‘ अम्बुरुहां ’ अम्बुनि—जले रोहन्ति अम्बुरुहिं तेषां सुरनिर्मितानां कमलानाम् । ‘ सदलं ’ दलैः—पत्रैः सह वर्तत इति सदलं सपत्रम् ।

( ५७ )

“ पत्रं पलाशं छदनं, दलं पर्णं छदः पुमान् ” इत्यमरः । ‘ धनं ’ सान्द्रम् । “ धनः सान्द्रे दृढे दाढर्ये, विस्तारे मुद्रेऽम्बुदे । संघे मुस्ते धनं मध्यनृतवाच्यप्रकारयोः ” ॥ १ ॥ इति हैमः ॥ अत्र तु सान्द्रवाचकं धनमव्ययमेव प्रतिभाति । ‘ नवकं ’ नवैव नवकम् । स्वार्थे कन् प्रत्ययः । ‘ पथि ’ अध्वनि । ‘ संस्पृशत् ’ स्पर्शेनाऽनुगृह्णत् । ‘ चलनतामरसं-संत् ’ चला-चब्बला, नता—नम्रा, अमराणां—देवानां संसत्—सभा यस्मिन् वा यस्य तत् । भक्त्यतिरेकवशात्संभ्रमेण चब्बलत्वं जायते । ‘ अलङ्घनं ’ नास्ति लङ्घनं—अधःकरणं कुतश्चिद्यस्य तत् । सर्वेषामपि वन्द्यत्वात्, केनाऽपि श्रियाऽनिर्जितमित्यर्थः । ‘ चलनतामरसं ’ चलन-मेव तामरसं चरणाऽम्बुजम् । ‘ सदा ’ सर्वदा । ‘ जयति ’ जयं लभते ॥ ३७ ॥ अस्मिन् पदे द्रुतविलम्बितवृत्तमस्ति—तळक्षणच्च—उक्तमेव ।

### श्रीशीतलजिन स्तुति—

**१६४**—पत्रोमे कुरी विराज्मान अने निषिड-गाठ एवां सुवर्णुनां नव कुम्हेनो । ( मार्गमां संचार करवाना समये ) स्पर्शं करनारा, तेमज चंचल अने नभ्र छे हेवसका नेने विषे अथवा ने संभंधी अने अदंधनीय—डोळी पछु परालव नहीं करी शकाय एवा श्रीशीतलनाथ प्रभुना चरणुकमल सहा जयवंता वर्ते छे ॥ ३७ ॥

### जिनेन्द्राणां स्मृतिः ।

स्मर जिनान् परिनुन्नजरारजो—  
जननतानवतोदयमानतः ।  
परमनिर्वृतिशर्मकृतो यतो—  
जन ! नतानवतोदयमानतः ॥ ३८ ॥

( ५८ )

स्मरेति—‘परिनुन्नजरारजोजननतानवतोदयमान्’ जरा—जीर्य-  
तेऽनयेति जरा—विस्सा,—वयःक्षतिरूपा, रजः—कर्मसूखं, जननं—जन्म,  
तनोर्भावः तानवं—कृशता, तोदो—द्विविधं दुःखं, यमः—भृत्युराजस्तेषा-  
मितरेतरद्वन्द्वस्ते परिनुन्नाः—परिक्षिप्ता यैस्तान् “संयमे यमजे धर्म-  
राजे ध्वाङ्गे युगे यमः। इति विश्व०। ‘यतः’ यस्मात्कारणात्। ‘परम-  
निर्वृतिशर्मकृतः’ परमं च तन्निर्वृतेः शर्म च—निर्वाणसुखं कुर्वन्तीति  
परमनिर्वृतिशर्मकृतस्तान्। “शिवं निःश्रेयसं श्रेयो—निर्वाणं ब्रह्म-  
निर्वृतिः” इति हैमः। ‘नतान्’ प्रह्लीभूतान्। ‘अवतः’ त्राय-  
माणान्। ‘जिनान्’ तीर्थङ्करान्। (हे) ‘जन !’ मानव ! ‘अदयं’  
निर्दयं—स्वशरीरावयवरक्षानिरपेक्षं यथास्यान्तथा। ‘आनतः’ प्रणतः  
सन्। ‘त्वं’ ‘अतः’ अस्मान् कारणात्। ‘स्मर’ चिन्तय ॥  
अथवा ‘यतः’ यस्मात्। (जिनाः) अनिर्वृतिशर्मकृतः—न विद्यते  
निर्वृतिर्यस्य तत् अनिर्वृति—नाशरहितं शर्म कुर्वन्तीति—मोक्षसुखविधा-  
यकाः “निर्वृतिः सुस्थितासौख्य—निर्वाणाऽस्तङ्गमाऽध्वसु” इति  
विश्व०। (भवन्ति) अतः परं। ‘अदयमानतः’ दयतेऽसौ दयमानः  
न दयमानोऽदयमानस्तस्माददयमानतः—निर्दयजनात्। ‘अवतः’  
अवन्तीति—अवन्तस्तानवतो—रक्षितून्—रक्षकान्। ‘परिनुन्नजरारजो-  
जननतानवतोदयमान्’ ‘जननतान्’ मानवैः प्रणतान्। ‘जिनान्’  
‘स्मर’ सृतिगोचरान् कुरु ॥ ३८ ॥

### जिनेश्वरेनुं स्मरण—

‘क्षेत्राकार्थ—नमस्कार करनारा ल्लयेनुं रक्षणु करनारा, वणी  
ह्वर कर्यां छे जरा—वृद्धावस्था, ( कर्मिणी ) २४, जन्म, ( हेणी )  
कृशता—हुर्भिता, बाधा—भीडा अने यम—भृत्यु जेमणे एवा अने  
एज भाटे उत्तम प्रकारना सुक्षितसुखने आपनारा एवा जिने-  
श्वरेनुं ( हे लब्धजन ! ) उपरेक्षत कारणेन लीघे अद्य—दया

( ५९ )

रहितपणे अर्थात् शारीरनी दरडार कर्या वगर नमन करतो छतो स्मरणु कर ! अथवा जेथी करीने जिनेश्वरो नाश रहित-अर्थात् शारीरतसुष्णना द्वायड होय छे तेथी अन्य जननुं निर्दिष्टनन्थी रक्षणु करनारा, तथा जेभणे वृद्धावस्थाडपी रजने हठावी हळ करी छे, तेमज जेअ, जन्म परत्वनी शारीरिक खीडा प्रत्ये यमराज-भूत्यु समान छे अेवा, तेमज लोडिवडे प्रणाम करायेला अेवा जिनेश्वरोने ( हे लज्जन ! ) तुं याह कर.॥ ३८ ॥

### सिद्धान्तस्वरूपम् ।

जयति कल्पितकल्पतरूपमं,  
मतमसारतरागमदारिणा ।  
प्रथितमत्र जिनेन मनीषिणा—  
मतमसा रतरागमदारिणा ॥ ३९ ॥

जयतीति । ‘असारतरागमदारिणा’ असारतरान्—अतिशयेन निःसारान्, शाक्यादिप्रणीतानागमान् हेतुयुक्त्यादिवचनैर्दारयति निराकरोतीत्येवंशीलोयस्तेन । ‘अतमसा’ नास्ति तमःपापमज्ञानं वा यस्य स अतमास्तेन—तमोरहितेन “तमो राहौ गुणे पापध्वान्ते” ॥ इति हैमः । ‘मनीषिणां’ मतिमताम् । ‘रतरागमदारिणा’ रतं—मैथुनं रागोधनाद्यभिलासोमदश्चजात्याद्युत्पन्नोऽभिनिवेशस्तेषां, रते-मैथुने यो रागो रतरागःस च मदश्च रतरागमदौ तयोर्बाऽरिर्विद्धिद् तेन । ‘जिनेन’ जयति रागद्वेषमोहान् इति जिनः “जीणश्चीदीबुध्यविमीम्यः कित्” (सि. उणा—२६१) इति न प्रत्ययः, तेन सर्वज्ञेन जिनवरेण । “अर्हन् जिनः पारगत्विकालवित्क्षीणाष्टकर्मा परमेष्ठयधीश्वरः । शम्भुः स्वयम्भूर्भगवान् जगत्प्रभुस्तीर्थकरस्तीर्थकरोजिनेश्वरः ॥ १ ॥ स्याद्वाच्यभयदसार्वाः, सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ । देवाधिदेवबोधिद—पुरुषो-

( ६० )

त्तमवीतरागाऽऽसाः ॥२॥” इति हैमः ‘अत्र’ इहलोके । ‘प्रथिं’ प्रख्यापितं । ‘कल्पितकल्पतरूपमं’ कल्पिता—समर्थिता कल्पत-रुण—कल्पवृक्षेण ( सह ) उपमा—साहृदयं यस्य तत् । सकलमनो-रथपूरकत्वात् । यदि वा कल्पितेषु—मनःसङ्कल्पितेषु वस्तुषु कल्प-तरोरुपमा यस्य तत् । ‘मतं’ श्रुतं—प्रवचनं ‘जयति’ सर्वम-तिशेते ॥ ३९ ॥

### सिद्धांत स्वरूप.

**क्लेक्टार्थ**—अत्यंत असार ( घौड़ाहि-भिथ्यारूप ) एवा आगमेनुं अंडन करनारा, तथा ( अज्ञानरूपी ) अंधकारथी रहित, अने भुद्धिमानेना मैथुन विषयक आसक्ति अने अलिमानना शत्रु एवा तीर्थकरहेवे आ पृथ्वीने विषे प्रदेखेवा वणी ( सर्व भव्य-ज्ञनेना भनेवांछित पूर्ण करीने ) सिद्ध करी छे कल्पवृक्षनी उपभा वेणु एवो आ जैनमत—निनेन्द्रसिद्धान्त ज्य पामे छे ॥ ३८ ॥

### मानवीदेव्याः स्तुतिः—

घनरुचिर्जयताद् भुवि मानवी,  
गुरुतराविहतामरसंगता ।  
कृतकराऽस्त्रवरे फलपत्रभा—  
गुरुतराविह तामरसं गता ॥ ४० ॥

घनरुचिरिति । ‘घनरुचिः’ घनो—मेघस्तद्वद्वुचिः—घना—सान्द्रा वा रुचिः—कान्तिर्यस्याः सा इयामवर्णेत्यर्थः । “घनस्तु मेघे मुस्तायां, विस्तारे लोहमुद्रे । काठिन्ये चाऽथ कठिने, सान्द्रेऽपि च घनस्त्रिषु” इति मुक्तावल्याम् ‘गुरुतराविहतामरसंगता’ गुरुतरा अतिमहान्तः, अविहता—केनचिदपि अपरिक्षता ये अमरास्तैः संगता—समेता । ‘फलपत्रभागुरुतरौ’ फलानि च पत्राणि च भजते यः उरुतरः—

( ६१ )

विशालवृक्षस्तस्मिन्दूपे, यद्वा फलपत्रैर्भातीति फलपत्रभः स चासाव-  
गुरुतस्त्र तस्मिन् । 'अस्त्रवरे' अस्त्रेषु वरं-प्रधानमस्त्रवरं तस्मिन्  
अस्त्रवरे प्रवरायुधे, इति तस्त्रविशेषणमन्येत्वाहुः, तस्याः शक्तिरूप-  
त्वात् । वृक्षानपि अस्त्रस्त्रान् करोतीति भावः । 'कृतकरा' कृतः  
स्थापितः करो-हस्तो यथा सा । 'तामरसं' पद्मम् । 'गता'-  
प्राप्ता । 'मानवी' देवी । 'इह' पृथिव्याम् । 'जयतात्' जयतु ।  
'जि' जये धातोराशीः प्रेरणयोर्लोटि "आशिषितुह्योस्तातडिति"  
( सिं० ४-२-११९ ) सूत्रेण जयतादिति सिद्धम् ॥ ४० ॥

### मानवी देवीनी स्तुति—

**९द्वेषाकार्थ**—सांद्र-गाठ डांतिवाणी ( अथवा भेदसमान प्रलभ-  
वाणी ) अतिशय भेडाटा अने अन्य सुर तथा असुरैथी अपरा-  
त ( अथवा भडा पराडनी ) एवा अभरै-देवोनी संगति-  
वाणी, वणी इत अने पत्रैथी युक्त एवा विशाण वृक्षदृपी उत्तम  
अस्त्र उपर ( अथवा उत्तम अस्त्रदृपी वृक्ष उपर ) स्थाप्ये छे  
हुथ नेण्हीये अने लाल कमण उपर आङ्ग थयेदी एवी मानवी  
हेवी आ पृथ्वी उपर जयवंती वर्तो ॥ ४० ॥

### ११—श्रीश्रेयांसनाथजिनस्तुतयः ।

अथ श्रीश्रेयांसनाथस्य परमविरागत्वम् ।

कुसुमधनुशा यस्मादन्यं न मोहवशं व्यधुः,

कमलसदृशां गीतारावा बलादयि तापितम् ।

ग्रणमतरां द्राक्ष श्रेयांसं न चाहृत यन्मनः,

कमलसदृशाङ्गी तारा वाऽबला दधिताऽपि तम् ॥४१॥

कुसुमधनुषेति । 'अलसदृशां' अलसा-मन्दाः दृशो-  
नयनानि यासां ता येषां ते वा तासां तेषां स्तिमितलोचनानां स्त्रीणां

( ६२ )

नृणां वा । अनेन गायकानां समद्वेष्टामस्त्वमाचष्टे । ‘गीतारावाः’  
 गीतानामारावाः—गान्धर्वनिनादाः गीतध्वनय इति यावत् । ‘यस्मात्’  
 श्रीश्रेयांसनाथात् । ‘अन्यं’ अपरं । ‘कं’ पुरुषं । ‘बलात्’ तरसा ।  
 ‘कुसुमधनुषा’ कुसुममेव धनुः कार्भुकं यस्य स तेन—कामेन । ‘तापितं’  
 पीडितम् । ‘मोहवशं’ रागाधीनम् । ‘न व्यधुः’ न विहितवन्तः ।  
 उक्तश्च—“येषां न चेतो विधुरेऽपि काले, विकारहेतावपि विद्यमाने ।  
 विकारतामाश्रयते त एव, प्रकीर्तिताः सत्त्वगुणाश्च धीराः ” ॥ १ ॥  
 तथाच—विकारहेतौ सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः ” ।  
 इति कुमारसंभवे । ‘यन्मनश्च’ यस्य चेतश्च ‘कमलसदृशाङ्गी’ कमलेन  
 सदृशं कोमलत्वादङ्गं यस्याः सा कुसुमसमानदेहा एतेन अङ्गस्पर्श-  
 मात्रादेव कामोद्रेको भवतीति सूचितम् । ‘तारा’ उज्ज्वला गौरा-  
 ङ्गीति यावत् । ‘अबला’ अन्यस्ति । वा ‘दयिताऽपि’ निजकान्ता-  
 ऽपि । ‘यन्मनः’ यस्य मानसं । ‘नाहृत’ नाऽश्चिप्रवती । ‘तं’  
 तथाविधं । श्रेयांसं जिनेन्द्रं श्रेयांसावंसावस्थेति श्रेयांसः पृषोदरादि-  
 त्वात्साधुः । यथा गर्भस्थेऽस्मिन् केनाऽप्यनाक्रान्तपूर्वदेवताऽधि-  
 ष्ठितशश्या जनन्याऽक्रान्तेति श्रेयोजातमिति श्रेयांसस्तं । “यतो  
 जगत्पतिर्जीतः, सोऽयं श्रेयसि वासरे । श्रेयांस इति नामाऽस्य,  
 जनकोऽजनयन्ततः” ॥ १ ॥ इति जिनचरिते ॥ अयि इतिकोमलाऽऽ-  
 मन्त्रणे “संबोधनेऽङ्गं भोःप्याद् पाद है है है हो अरेऽयि रे” इति  
 हैमः । हे ( भव्याः ! ) यूँ । ‘द्राकृ’ शीघ्रम् । ‘प्रणमततरां’  
 मुहुः वाऽतिशयेन प्रणामं कुरुत । ननु विरुद्धमेतत्, यदि निजदयिता  
 तदा कथं मनोनाऽहृत ?, मैवं, संयमप्रतिपत्तिं स्वीकृत्येदमभिधीयते  
 न सर्वदा, ततो नास्ति विरुद्धावकाशः ॥ ४१ ॥

हरिणीवृत्तम्—“भवति हरिणी न्सौ ओस्लौ गो रसाऽम्बुधि-  
 विष्टपैः” इति लक्षणात्.

( ૬૩ )

## શ્રી શ્રેયાંસનાથની વીતરાગતા.

**શ્રેદોકાર્થ**—( કામાતુરપણુને લીધે ) અલસ-મંદદિવિષાળી દ્વિતીયા-ખીએના અથવા પુરુષોના ગીતના ધ્વનિએ ને ( શ્રેયાંસનાથ ) ને સુડીને અન્ય ડેને ભલાત્કારપૂર્વક કામહેવથી પીડિત તેમજ મોહને વશ ન કરતા હુંવા ? અર્થાતું ને શ્રેયાંસનાથ સિવાયના બાકીના અધ્યા હરિહર આદિ દેવો પણ મોહવશ થયા, તેમજ કામથી સંતસ થયા. એટલે તે જેણે કામહેવનો પરાજય કર્યો હતો તે તથા કમલના જેવા ડેંભલ શરીરવાલી મનોહર, તેમજ પ્રિય એવી પણ વનિતા-સ્ત્રી ( અથવા પોતાની પત્ની પણ ) જેનું મન હરણ કરી શકી નહીં તે, ઉત્તમ છે ખલા જેના એવા અથવા વિશ્વને કલ્યાણકારી એવા શ્રી શ્રેયાંસનાથને ( હે અંધજનો ! ) અરે ! તમે જલદી અત્યંત લાવપૂર્વક પ્રણામ કરો ॥ ૪૧ ॥ આ શ્રેદોકાર્થાં અને પદ્ધતીના ત્રણ શ્રેદોકાર્થાં હરિણી નામે વૃત્ત છે. તેણું લક્ષ્ણ નીચે પ્રમાણે છે—આ વૃત્તમાં એકંદર ( ૧૭ ) અક્ષરો છે, તેમાં ન, સ, મ, ર, અને સગણ ચે પાંચ ગણો છે તથા ઉપાન્ય અક્ષર ઝુસ્વ છે અને અંત્ય અક્ષર દીર્ઘ છે. આ વૃત્તમાં છુટે દશમે અને સત્તરમે એમ ત્રણ સ્થળે વિરામ ( યતિ ) છે. ॥

## જિનેન્દ્રાણાં તલ્લક્ષણાઽન્વિતસ્તુતિઃ ।

**જિનવરતતિર્જીવાલીનામકારણવત્સલા�-**

**સમદમહિતાઽમારા દિષ્ટાસમાનવરાઽજયા ।**

**નમદમૃતભુક્પહૃત્યા નૂતા તનોતુ મતિં મમાઽ-**

**સમદમહિતામારાદિષ્ટા સમાનવરાજયા ॥ ૪૨ ॥**

**જિનવરેતિ—**‘ જીવાલીનાં ’ જીવાનામાલ્યસ્તાસાં—પ્રાળિસન્ત-  
તીનામ્ । ‘ અકારણવત્સલા ’ ન વિદ્યતે કારણ યસ્મિસ્તત, અકારણ  
નિમિત્તમન્તર વત્સલા—નિષ્કારણપ્રેમવતી । “ સ્નિગ્ધસ્તુવત્સલ: ”

( ६४ )

इत्यमरः । ‘असमदमहिता’ असमोऽसदृशो दमो येषां तेषां मुनीनां, वा असमस्य दमस्य इन्द्रियनियन्त्रणरूपस्य हिता—हितकारिणी । ‘अमारा’ न विद्यते मारो—मदनोमृत्युर्वा यस्याः सा कामहीना मरणहीना वा “मारोऽनज्ञे मृतौ विव्वे” इति हैमः । ‘दिष्टाऽसमानवरा’ दिष्टा—दत्ता असमाना—असदृशा वराः—प्रार्थितार्था यस्या सा वितीर्णपूर्वमनोऽभिलिषितवरा । ‘अजया’ न विद्यते जयः—अभिभवः कुतश्चिद्यस्याः सा, मिथ्यादृष्टिभिरपरिभूतत्त्वात् । यद्वा जयत्यन्तरारिष्टर्व्वर्गमिति जया, अकारप्रश्लेषं विना जयनशीला । अथवा न जायत इत्यजा तया । ‘नमदमृतभुक्पङ्क्त्या’ नमन्ती—प्रणमन्ती या अमृतभुजां—देवानां पङ्क्तिः श्रेणिस्तया । ‘समानवराजया’ मानवानां राजानः मानवराजास्तैः, “राजन् सखेः” (सि० ७—३—१०६) इति सूत्रेणाऽटि राजन् शब्दोऽकारान्तः । मानवेन्द्रैः सह वर्त्तते तया । ‘नूता’ स्तुता । ‘आरात्’ दूरादन्तिकाद्वा । “आराहूरसमीपयोः” इति हैमः । ‘इष्टा’ पूजिता । रुचिकरा वा । ‘जिनवरततिः’ जिनानां—सामान्यकेवलिनां मध्ये वराः—प्रधानास्तेषां ततिः—श्रेणिरित्युभयत्र तत्पुरुषः । ‘मम मतिं’ मदीयशेषुषीम् । ‘असमदमहितां’ मदेन जात्यादिगर्वेण सह वर्त्तन्ते ये ते समदाः, न समदाः असमदाः—शान्तचेतसस्तैर्महितां—पूजितां । ‘क्तक्तवतू’ (सि० ५—१—१७४) भूतार्थे पूज् धातोः कर्मणि क्त प्रत्ययः । ‘तनोतु’ विस्तारयतु=विदधातु । ‘तनु’ विस्तारे—इति धातोराशिषि लोट् प्रथमपुरुषस्यैकवचनम् ॥४२॥

**जिनेश्वरैनी लक्षण्युक्त स्तुति.**

**९६४।**—प्राणिवर्ग प्रति निष्ठारण वत्सल, वणी निःपम उपशम छे जेमने अेवा मुनिजनने हितकारी, तेमज भदन अथवा भूत्युथी रहित, तथा अर्पणु कर्यां छे अपूर्व वरहानो जेणीअै, डेहिथी पणु परालव न पानी शके अेवी, तेमज भिथ्यादृष्टिएथी

( ६५ )

अथवा अांतरिक घटशत्रुओंने ज्ञतनारी अथवा नहीं उत्पन्न थनारी  
अने नरेंद्रोथी युक्त नमस्कार करता एवा देवेनी श्रेणिवडे  
स्तुति करायेती, वणी सर्व जगत्ते पूज्य अथवा इचिकारक  
एवी तीर्थंकरेनी श्रेणि-पंडित भारी युद्धिने निरक्षिभान जनेवडे  
पूज्यत पवित्र अनावे ॥ ४२ ॥

---

### जिनागमस्य स्तुतिः—

भवजलनिधिभ्राम्यज्जन्तुत्रजायतपोत ! हे,  
तनुमति मतां सन्नाशानां सदा नरसम्पदम् ।  
समभिलषतामर्हन्नाथागमानतभूपतिं,  
तनु मतिमतां सन्नाशानां सदानरसं पदम् ॥ ४३ ॥

भवेति—‘ भवजलनिधिभ्राम्यज्जन्तुत्रजायतपोत ! ’ भवः—  
संसार एव दुस्तरत्वाज्जलनिधिस्तस्मिन् भ्राम्यन् यो जन्तूनां—प्राणिनां  
ब्रजः—समूहस्तस्योत्तरणादायतपोत ! आयतश्चासौ पोतश्च यानपात्रं  
तदामन्त्रणे प्रलम्बयानपात्र ! । भवसमुद्रस्वरूपं देवगुपाऽऽचार्येण  
प्रदर्शितं—“ नरकतिर्थङ्गमनुष्याभरगतिवत्तुष्यदुस्तरविपुलपात्रः, प्रिया-  
उप्रियविरहसंप्रयोगक्षुद्रभिघाताऽऽदिसन्निपातप्रतिभयाऽनेकदुःखाऽधा-  
तसलिलः, परोपघातिकूराऽनार्यजनाऽनेकमकरविचरितविषमः, मोह-  
महाऽनिलप्रेरणाधमायमानगम्भीरभीषणप्रमादपातालः, नरकाऽऽदिवि-  
कृतभीमवडवामुखप्रस्ययमानाऽनेकपापकर्मसत्त्वः, रागद्रेषप्रबलाऽनि-  
लोद्भूतसंजायमानवीचिप्रसृताशयवेलः । ” “ पोतः शिशौ प्रवहणे ”  
इति हैमः । “ पोतः शिशौ वहित्रे च, गृहस्थाने च वाससि ॥ ”  
इति भेदिनी । ‘ हे ’ इत्यामन्त्रणे । हे ‘ अर्हन्नाथाऽऽगम ! ’ जिने-  
न्द्राऽऽगम ! “ सन्नाशानां ” सन्ना—विनष्टा—विशीर्णा वा आशा मनोरथा

( ६६ )

येषां तेषां । तथैव ‘ सन्नाशानां ’ सन्-विद्यमानो नाशः—क्षति-  
र्येषां तेषां, “ सत्प्रशस्ते विद्यमाने ” इति विश्वः । स्वल्पायुषां ।  
‘ आनतभूपतिं ’ आनताः—प्रणता भूपतयः सामन्ता यस्यास्तां—नन्दी-  
भूतनरनाथाम् । ‘ तनुमति ’ तनुर्विद्यतेऽस्येति तनुमान् तस्मिन्-  
देहिविषये । तथा च ये बुद्धिमन्तोऽवसानसमये मानवसम्बन्धिनीं  
संपदमभिलषन्ति तेषां त्वं तथाविधं स्थानं देहि, यत्र दानरसो  
भवति । ‘ मतां ’ अभीष्टां । ‘ नरसम्पदं ’ मानवविभूतिम् । ‘ सम-  
भिलषतां ’ अभिकांक्षताम् । ‘ मतिमतां ’ बुद्धिमताम् । नराणाम् ।  
‘ सदानरसं ’ सह दानरसेन—दानवितरणाऽभिलाषेण वर्तते यद् एता-  
दृशम् । दानमुत्सर्जनं तस्य रसो गुणस्तेन सह वर्तते यत्तत् इति वा ।  
“ शृङ्गारादौ विषे वीर्ये, गुणे रागे द्रवे रसः ” इत्यमरः । “ शृङ्गा-  
रादौ जले वीर्ये, सुवर्णे विषशुक्रयोः । तिक्कादावसृते चैव, निर्यासे  
पारदे ध्वनौ ॥ आस्वादे च रसं प्राहुः ” इति शब्दार्णवः । ‘ पदं ’  
स्थानं “ पदं स्थाने विभक्त्यन्ते शब्दे वाक्येऽङ्गवस्तुनोः । त्राणे  
पादे पादचिन्हे, व्यवसायाऽपदेशयोः ” इति हैमः । ‘ सदा ’ अजखं  
‘ तनु ’ विधेहि ॥ ४३ ॥

### जिनागमनी स्तुति.

**श्लोकार्थ—**संसार—सागरमां परिश्रमणु करनारा जनसमु-  
दायने ( तरवा भाटे ) विशाण नाव समान ! હે તીર्थંકર આગમ !  
હે જિનેંદ્ર સિદ્ધાંત ! નષ્ટ થઈ છે આશાએ જેમની એવા અર્થાતું  
નિરાશ થયેલા, વળી વિદ્યમાન છે મરણ જેમનું એવા અર્થાતું કુંકા  
આયુષ્યવાળા, તેમજ અત્યાંત નસ્યા છે રાજાએ જેમને વિષે એવી,  
તથા પ્રાણીએને ઈછિત એવી ભાનવ સંપત્તિની ( મરણ સમયે )  
અલિકાણ રાખનારા એવા બુદ્ધિમાનોને દાનદ્રોપી રસથી ચુક્તા  
એવું પદં-સ્થાન તું સર્વદા સમર્પણુ કર ॥ ४४ ॥

( ६७ )

## श्रीमहाकालीदेव्या विजयः

धृतपविफलाक्षालीघण्टैः करैः कृतबोधित-  
 प्रजयतिमहा कालीमत्याधिपङ्कजराजिभिः ।  
 निजतनुलतामध्यासीनां दधत्यपरिक्षतां,  
 प्रजयति महाकाली मत्याधिपं कजराजिभिः ॥ ४४ ॥

धृतेति । ‘कजराजिभिः’ कस्मिन् जातं कजं, कजवद्-वारि-  
 जवद् राजन्त इति कजराजिनस्तैः कमलवत्सुन्दरैः । ‘धृतपविफ-  
 लाक्षालीघण्टैः’ धृताः पविः—वञ्च, फलं—कुसुमोत्तरकालभावि वस्तु-  
 रूपं, अक्षाली—जपमाला, घण्टा—वायविशेषो थैस्ते, “फलं हेतुस-  
 मुत्थे स्यात्, फलके व्युष्टिलाभयोः । जाति फलेऽपि कक्षोले, सस्य  
 बाणाग्रयोरपि ॥ १ ॥ फलिन्यां तु फलीं प्राहु-स्निफलायां फले क्वचित्”  
 इतिविश्वः । “फलं फले धान्यबीजे, निष्पत्तौ भोगलाभयोः” इति  
 केशवः । तथाभूतैः । ‘करैः’ हस्तैरूपलक्षिता । इत्यध्याहित्यते ।  
 ( अथवा करणभूतैः ) ‘कृतबोधितप्रजयतिमहा’ बोधिताः  
 प्रजा लोका थैस्तेषां यतीनां—श्रमणानां कृतो—विहितो महः—पूजा—  
 उत्सवो वा यथा सा । ‘अत्याधिपङ्कजराजिभिः’ अर्तिः—पीडा,  
 आधिर्मानसिकव्यथा, पङ्को देहमलः, जरा—वार्द्धक्यं, आजिः—सं-  
 ग्रामश्च “आजिःस्यात्संग्रामेऽपि समक्षितौ” इति विऽ तैः । “पुं-  
 स्याधिर्मानसी व्यथा” इत्यमरः । “अखी पङ्कं पुमान् पाप्मा, पापं  
 किल्विषकलमषम्” । इत्यमरः । “पङ्कोऽखीकर्देमे पापे” इति विश्व-  
 लोचनः । ‘अपरिक्षतां’ न परिक्षता अपरिक्षता तां, अविध्वस्ताम् ।  
 अदूषितामित्यर्थः । ‘मत्याधिपं’ पुरुषप्रकाण्डम् । ‘अधे: शीङ्गस्थास  
 आधारः ( सिद्ध है० २—२—२० ) इत्याधारस्य कर्मन्त्वम् । ‘अध्या-  
 सीनां’ समारूढाम् । ‘काली’ इयामवर्णाम् । ‘निजतनुलतां’ स्वा

( ६८ )

ज्ञयष्टिम् । 'दधती' विद्धाणा । 'महाकाली' महाकाल्यभिधेया देवी ।  
प्रजयति' प्रकर्षेण विजयते ॥ ४४ ॥

### श्री महाकालीदेवीनो विजय—

**श्रेष्ठाकार्थ—** कमल समान शोभायमान, वणी धारणु कर्यां छे  
वજा, इक्ष, जपमाला अने धंटा केमने विधे एवा चार हस्तवडे  
( उपलक्षित-जग्धाती ) एवी अथवा तेवा प्रकारना हस्तोवडे  
( सूच्यारित्रिना उपहेशवडे ) योध पमाल्यो छे प्रब्लने केमणे एवा  
मुनिएाना सत्कार ( अथवा भणेत्सवो ) कर्या छे जेण्याचे एवी  
तेमज श्याम वर्णवाणी, शारीरिक अने मानसिक पीडा, कर्मदृष्टी  
काढव, वृद्धावस्था अने संआभर्ती अपराजित-निहि दृष्टित थेवी  
तेमज मानवपति—श्रेष्ठपुङ्ख उपर वेसनारी अने पोतानी देहदृष्टी  
लताने धारणु करनारी एवी महाकालीदेवी ( अक्षत पराक्रम  
हेवाने लीघे ) अत्यंत ज्यवंती वर्ते छे ॥ ४४ ॥

### १२—वासुपूज्यजिनस्तुतयः ।

#### अथ श्रीवासुपूज्यवन्दनम्

पूज्य ! श्रीवासुपूज्याऽवृजिन ! जिनपते ! नूतनादित्यकान्ते—

मायासंसारवासावन ! वर ! तरसाली नवालानवाहो ! ।

आनन्द्रा त्रायतां श्रीप्रभवभवभयाद् विप्रती भक्तिभाजा—

मायासं सारवाऽसावनवरतरसालीनवाला न वाऽहो ! ॥४५॥

**पूज्येति—**( हे ) ' पूज्य ? ' पूजयितुं यौग्यस्तदामन्त्रणम् ।  
' अवृजिन ! ' न विद्यते वृजिनं—पापं यस्य स तत्संबोधने विगतक-  
त्वम् ! आस्त्रवद्वाराणां निरोधात् ' जिनपते ! ' हे जिनेन्द्र ! ' नूत-  
नादित्यकान्ते ! ' नूतनो—नवीनस्तत्कालमुदयगिरिमारुद्धो रक्तवर्णो य  
आदित्यः सूर्यस्तद्वत्कान्तिः—द्युतिर्यस्य स तत्संबोधनं नवार्कद्युते !

( ६९ )

रक्तद्युते ! इत्यर्थः । तथा चोक्तम् । “रक्तौ च पद्मप्रभवासुपूज्यौ”  
 इति हैमः । “पउमाभवासुपुजा रक्ता” इत्यागमात् । ‘अमाय !’ न  
 विद्यते माया यस्य स तत्संबोधने मायानिर्मुक्त ! ‘असंसारवासावन !’  
 न संसारवासं-भवावस्थानमवतीति, असंसारवासावनस्तस्यामन्त्र-  
 णम् । ‘वर !’ सर्वोक्तम ! “वरोऽभीष्टे देवतादे—र्वरोजामालृषिङ्गयोः ।  
 श्रेष्ठेऽन्यवत्परिवृत्तौ, वरं कश्मीरजे मतम् ॥ १ ॥ इतिविश्वः । ‘नवा-  
 लानवाहो !’ नवः—प्रत्यग्रः, आलानो—गजवन्धनस्तस्मरतद्वाहू यस्य  
 स तदामन्त्रणम् । “तोत्रं वेणुकमालानं, बन्धस्तम्भेऽथशृङ्खले” इत्य-  
 मरः । ‘श्रीप्रभव !’ श्रियः प्रभवः उत्पत्तिस्थानं यस्मात्स तदामन्त्रणम्,  
 अथवा संपदामुतपत्तिस्थान ! । ‘अहो !’ इत्यामन्त्रणे. हे श्रीवासु-  
 पूज्य !, वसुपूज्यस्याऽपत्यं पुमान् वासुपूज्यः, यद्वा गर्भस्थेऽस्मिन्  
 वसु—हिरण्यं=रत्नं तेन वासवो राजकुलं पूजितवानिति, वसवो देव-  
 विशेषास्तेषां पूज्यो वा वसुपूज्यः स एव वासुपूज्यः ‘प्रज्ञादिभ्योऽण्’  
 (सिद्ध० ७-२-१६५) चतुर्ख्यशदतिशयरूपया ज्ञानरूपया श्रियोप-  
 लक्षितवासुपूज्याभिघजिनेश्वर ! । ‘आनन्दा’ आ—समन्तात् नमन-  
 शीला । ‘आयासं’ अनवरतभवध्रमणरूपं श्रमम् । ‘विभ्रती’  
 दधाना । ‘सारवा’ आरवेण सहवर्तत इति सशब्दा—प्रारब्धस्तुतिपाठा,  
 मधुरस्वरेण स्तुति कुर्वन्तीत्यर्थः । ‘अनवरतरसालीनवाला’ अनवर-  
 तमजस्य रसायां भ्रूमिषीठे, (नमनसमये) आलीना—आश्लिष्टाः, वालाः-  
 केशा यस्याः सा, अनेन भक्त्यतिशयः सूचितः । ‘नवा’ अभिनवा,  
 अत्र यमकवशात् बवयोरैक्यं विज्ञेयम् । उक्तञ्च—रलयोर्द्दर्लयोस्तद्वज्ज-  
 ययोर्वययोरपि । शसयोर्नमयोश्चान्ते, सविसर्गाऽविसर्गयोः ॥ १ ॥  
 सविन्दुकाऽविन्दुकयोः, स्याद्भेदेन कल्पनम् ॥ कतिपयवासरलब्ध  
 बोधिरस्मदादिवदित्याकृतम् । तथा भूता । ‘भक्तिभाजां’ भक्तिः  
 पूज्येष्वनुरागः श्रद्धा वा तां भजन्ति ये ते भक्तिभाजस्तेषामाराधकानां,

( ७० )

“ श्रद्धारचनयोर्भक्तिः ” इत्यमरः । “ भक्तिः सेवागौणवृत्त्यो—  
भैदग्यां श्रद्धाविभागयोः । ” इति हैमः ।

‘ आली ’ श्रेणिः । ‘ तरसा ’ वेगेन—बलेन ‘ भवभयात् भवाद्  
भयं तस्मात् संसारत्रासात् । ‘ त्रायतां ’ रक्ष्यतां, त्वयेतिशेषः ॥ ४५ ॥

अस्मिन् पदे स्वर्गधरावृत्तम् । ऋभ्नैर्यानां त्रयेण त्रिमुनियतियुता  
स्वर्गधरा कीर्तितेयम् ॥ इति लक्षणात् ।

### श्री वासुपूज्यने वंहन—

**१. द्वैकार्थ**—त्रिणु द्वैकाने वंहन उत्पाद्योऽय एवा हे प्रलो !,  
( चात्रीश अतिशयउड्पी अथवा ज्ञानउड्पी लक्ष्मीवाणा ) एवा हे  
वासुपूज्य ! हे पापथी रहित ! हे जिनेश्वर ! नवीन सूर्यसमान  
दाल कांतिवाणा हे खारभा तीर्थिकर !, हे निष्ठपट ! तीर्थधिराज !  
( माक्षभां ज्वाथी ) संसारभां नथी निवास जेनो एवा हे ( हेवाधि-  
द्वेष ! ) हे रक्षक ! कृपट अने संसारउडप कारागृहीथी अचावनार  
हे जगत्पृष्ठे ! सामर्थ्य अथवा वेगमां उल्कृष्ट एवा हे विलो !;  
नवीन गजस्तांल समान हुस्तवाणा हे पूज्य ! नवीन—अर्थात्  
तत्काल प्राप्त उर्ध्वा हे धर्म—योधिष्ठीज जेणु एवी, वणी निरंतर  
पृथ्वीने रूपशीने रहेला हे उक्ष जेना, अर्थात् अतिशय लक्ष्मि-  
रागभां भग्न थयेली एवी, तेमज ( स्तुतिना प्रारंब उरेलो हेवाथी )  
शण्ह सहित एवी अत्यंत नम, श्रम ( अथवा हुःअने ) धारणु  
उत्तरारी एवी लक्ष्माजनेनी श्रेणिने, लक्ष्मीना उत्पत्ति स्थानउडप ! हे  
नाथ ! तुं संसारभ्रमणुड्पी लयथी ( अथवा लक्ष्मीथी उत्पन्न थयेल  
कामहेवनी भीतिथी ) सत्त्वर—जलही अचाव—रक्षणु कर ॥ ४५ ॥

आ स्तुति स्वर्गधरावृत्तमां हे. आ वृत्तमां भ, र, ल, न अने  
त्रिणु यगणु भणी सात गणु हे तेमज सात सात अक्षरे विराम हे.

( ७१ )

## जिनसमूहप्रार्थना—

पूतो यत्पादपांशुः शिरसि सुरततेराचरचूर्णशोभां,  
 या तापत्राऽसमानाऽप्रतिमदमवतीहारता राजयन्ती ।  
 कीर्तेः कान्त्या ततिः सा प्रविकिरतुतरा जैनराजी रजस्ते,  
 यातापत्रासमानाऽप्रतिमदमवती हारतारा जयन्ती ॥४६॥

पूतोयदिति । ‘पूतः’ पावनः । “पवित्रं पावनं पूतं, पुण्यं मेध्यम्” इति हैमः ‘यत्पादपांशुः’ यस्याः पादपांशुश्चरण-रेणुः । “अथ रजसि स्युर्धूलीपांशुरेणवः” इति हैमः । ‘सुरततेः’ सुराणां ततिस्तस्यास्त्रिदशश्रेणोः ‘शिरसि’ मूर्धनि । ‘चूर्णशोभा’ वासःक्षेत्रश्चियम् । ‘आचरत्’ कृतवान् । ‘चर’ गतिभक्षणयोरितिधातोर्लडि कर्त्तरिपरस्मैपदे प्रथमपुरुषैकवचनम् । ‘या’ (जिनेन्द्रराजिः) ‘तापत्रा’ तापात् त्रायत इति तापत्रा, तापात् कृतत्राणा । ‘असमाना’ न विद्यते समानस्तुल्यो यस्याः सा अनन्यसदृशी । ‘अप्रतिमदं’ न प्रतिगतो भद्रो यस्य तं, विगतमदं—मदोपलक्षितमदनादिभिः रहितं साधुजनमित्यर्थः । ‘अवति’ कामारिभ्यः पालयति । ‘इह’ अस्मिलोके । ‘अरता’ नास्तिरतं—सुरतादिकं सुखं यस्याः सेति, यद्वा नरता—अरता कस्मिन्नपि वस्तुनि अनासक्ता, अप्रतिवद्वेत्यर्थः । ‘राजयन्ती’ (भव्यान्) श्रियं लम्भयन्ती । ‘यातापत्रासमाना’ याता—विगता आपच्च त्रासश्च मानश्च यस्याः सा । ‘अप्रतिमदमवती’ अप्रतिमः—अनन्यसदृशो दम इन्द्रियजय उपशमो वा विद्यते यस्याः सा । ‘कीर्तेः’ यशसः । ‘कान्त्या’ प्रभया—करणभूतया । ‘हारतारा’ हाराश्चमुक्तावस्यः, ताराश्च—नक्षत्राणि ताः । ‘जयन्ती’ न्यक्कुर्वन्ती अथवा कीर्तेः कान्त्या हेतुभूतया हारतारा—हारोज्ज्वला, विपक्षान्

( ७२ )

जयन्त्यभिभवन्ती । ‘जैनराजी’ जिनराजानामियं—जिनराजसम्ब-  
न्धनी । ‘ततिः’ श्रेणिः । (हे भव्यप्राणिन् !) ‘ते’ तव । ‘रजः’  
अशुभं कर्म । “स्यादार्त्तवे शुभे । रजः परागे रेणौ च, रजं च परिकी-  
र्त्तिम्” इति विश्वः । ‘प्रविकिरतुतराम्’ अतिशयेन क्षयतु ।  
ग्र-विपूर्वक ‘कृ’ विक्षेपे इति तुदादिगणस्थधातोराशीःप्रेरणयोरिति  
कर्त्तरिलोटि प्रथमपुरुषैकवचनम् ॥ ४६ ॥

### जिनश्रेष्ठिने अल्प्यर्थना—

श्लोकार्थ—जे (जिनश्रेष्ठी) ना यरणुना पवित्र २८५षु  
हृवोनी पंक्तिना भस्तक उपर चूर्णनी शोका आचरता हुता (जे ने  
सुरैंद्रो भक्तिसावथी यरणुमां नमता हुता), वर्णी जे (जिनश्रेष्ठी)  
प्राणीसमूहने संतापथी मुक्त उडे छे. तथा जे (शुणोने बधने)  
असाधारणु छे. तेमज जे निरलिमानपणे (ल्लोतुं) रक्षणु करे  
छे, जे आ विश्वमां राग रहित होय छे तेमज जे (ल०योने)  
दीपावनारी छे, ते जिनेश्वरनी पंक्ति के जेनां आपति-विपत्ति,  
त्रास आकस्मिक लय अने अलिमान नाश थयेदां छे, वर्णी जे  
अनुपम हम-ईद्रियज्य अथवा उपशमथी युक्त छे, तेमज जे  
पोतानी श्रीर्तिरूपी कांतिवडे मौतिना हार तथा नक्षत्र मंडल उपर  
विजय मेणवनारी छे, अथवाजे श्रीर्तिरूपी कांतिवडे हार जेवी उन्नवल  
छे. तेमज जे शत्रुओने शतनारी छे, ते जिनेंद्रश्रेष्ठी (हे लघ्य  
जन !) तारा (कर्मरूपी) २८ने सर्वथा विजेरी नांगो ॥ ४६ ॥

### जिनभारत्याः स्वरूपम्—

नित्यं हेतूपपत्तिप्रतिहतकुमतग्रोद्धतध्वान्तवन्धा—

पापायाऽसाद्यमानाऽमदन ! तव सुधासारह्या हितानि ।  
बाणी निर्वाणमार्गप्रणयिपरिगता तीर्थनाथ ! क्रियानुमेऽ-

पापायासाद्यमानामदनत ! वसुधासार ! हृद्याहितानि ॥४७॥

( ७३ )

**नित्यमिति—(हे)** ‘अमदन’ न विद्यते मदनो यस्येति बहु-  
ब्रीहिस्तसम्बोधनं मदनरहित ! । ‘अपापायासाद्यमानामदनत !’  
पापं—पातकश्च आयासो विषादश्चेति समाहारद्वन्द्वः, तदादि येषान्ते  
दोषा न विद्यन्ते येषां मुनीनां ते अपापायासाद्यस्ते च ते अमाना मान-  
हीनाश्च ते अमदास्त्यक्तमदाश्च ते—अपापायासाद्यमानामदास्तैर्नेत ! व-  
न्दित ! । ‘वसुधासार !’ वसुधायां पृथिव्यां सार !—उत्कृष्ट ! ।  
‘तीर्थनाथ !’ तीर्थ—चतुर्विधः सङ्घः प्रथमगणधरो वा तस्य नाथः—  
स्वामी तत्सम्बोधनम् । तीर्थपते ! तीर्थशब्दोऽस्ति पुण्ड्रीबः, तीर्थते  
संसारसमुद्रोऽनेनेति तीर्थ प्रवचनाधारश्चतुर्विधः सङ्घः प्रथमगणधरो  
वा । यदाहुः—“तिथभन्ते ! तिथं तिथ्यरे तित्थं गोअमा ! अरिहा  
ताव नियमा तिथंकरे तित्थं पुण चाउवण्णे समणसंघे—पठमगणहरे  
वा” इति स्वसमयः । ‘नीनूरमितृतुदिवचिरिचिसिचिशि०’ (सिद्ध०  
उणा० २२७) इति कित्-थः । “तीर्थं शास्त्रे गुरौ यज्ञे, पुण्यक्षेत्राऽ-  
वतारयोः । ऋषिजुष्टे जले सत्रि—ण्युपाये स्त्रीरजस्यपि ॥ १ ॥ योनौ  
पात्रे दर्शने च” इति हैमः । ‘ते’ तव, ‘हेतूपपत्तिप्रतिहतकुमत-  
प्रोद्धतध्वान्तवन्धा’ हेतवो—साध्यवस्तुगमकानि लिङ्गानि, उपपत्तयो  
युक्तयः, हेतुभिश्चोपपत्तिभिश्च हेतूनामुपपत्तिभिर्वा प्रतिहतः—प्रति-  
षिद्धः, कुमतान्येव कुमतमेव कुमतस्य वा प्रोद्धतः-प्रोद्धामः ध्वान्तवन्ध-  
स्तिभिरग्रन्थिर्यथा सा । ‘अपापाया’ अपगता अपाया—विद्याता यस्याः  
सा । ‘आसाद्यमाना’ प्राप्यमाणा, मुनिभिरित्यध्याहार्य । अपापायै-  
र्निरपायैरासाद्यमानेत्येकं पदं वा । ‘सुधासारहृद्या’ सुधायाः आसारः—  
वेगवान् वर्षः सुधासारोऽमृतवृष्टिः स इव हृद्या—हृदयज्ञमा । “आसा-  
रो वेगवान्वर्षः” इति हैमः । ‘शेषश्वात्र—अथाऽसारे धारासंपात  
इत्यपि ।’ ‘निर्वाणमार्गप्रणयिपरिगता’ निर्वाणस्य—मोक्षस्य मार्गः  
—सम्यग्दर्शनज्ञानचारित्ररूपस्तस्मिन् प्रणयः—खेहो येषां तैः साधुभिः

( ७४ )

परिगता—स्वीकृतेत्यर्थः । “ निर्वाणं निर्वृतौ मोक्षे, विनाशे  
गजमज्जने ” इत्यमरः । ‘ तव ’ तावकीना । ‘ वाणी ’ भारती ।  
‘ मे ’ मम ‘ हृदि ’ चेतसि । ‘ आहितानि ’ स्थापितानि । ‘ हितानि ’  
पृथ्यानि । ‘ नित्यं ’ निरन्तरम् । ‘ क्रियात् ’ विवेयात् । ‘ डुक्कम् ’  
करणे धातोराशिषि कर्त्तरि परस्मैपदे प्रथमपुरुषैकवचने यात्, यादादौ  
“ रिङ्गायगिलङ्गम् ” ( पा० ७-४-२७ ) इति क्रतोरिङ्गादेशे  
क्रियादितिसिद्धम् ॥ ४७ ॥

### जिनवाणीनुं स्वरूप—

‘ लेकार्थ—महन—काम रहित ( वीतराग ! ) हे जिन ! गयेला छे  
पाप अने प्रयत्न आहि ( हाथे ) जेमना एवा, अथवा सर्वथा नाश  
कर्या छे पापाहि आरंभ जेमणे, तेमज नाश कर्या छे भान अने  
महनेा जेमणे एवा मुनिजनेा वडे वंहित—पूजित ( तीर्थपते ! )  
वणी हे पृथ्वीने विषे सारभूत ( तीर्थधीश ! ) सर्वदा हेतु अने  
युक्तिअवडे, अथवा वस्तुसिद्धकरनार लिंगे ( प्रमाणेा ) नीयुक्तिअ-  
वडे, निवृत्त कर्या छे कुदर्शनदृपी अत्यंत उच्च अंधकारनेा अंध  
जेणे एवी, वणी नाश कर्या छे क्लेश जेणे, तेमज ( तहने )  
प्राप्त थयेली ( अर्थात् तहारो आश्रय दीघेली ) अथवा नष्ट थयेा  
छे क्लेश जेमनेा एवा साधुजनोमे प्राप्त करेली, अर्थात् श्रवण-  
द्वारप्राप्त थयेली, तथा अभृतनी वेगवाली वृष्टि समान भनोहर,  
( सम्यक्-हर्शन ज्ञान अने चारित्ररूप ) मुक्तिमार्गना अनुरागी-  
जनोमे अंगीकार करेली एवी ( हे जिनेश्वर ? ) तहारी वाणी  
म्हारा हुद्यमां स्थापन करेलां म्हारां हित—म्हारां मनोवांछितोने  
हंभेशा संपादन करो ॥ ४७ ॥

( ७५ )

## श्रीशान्तिदेव्याः स्तुतिः—

**रक्षः क्षुद्रग्रहादिप्रतिहतिशमनी वाहितश्वेतभास्वत्—**

**सन्नालीका सदा सापरिकरमुदिता सा क्षमालाभवन्तम् ।  
शुभ्रा श्रीशान्तिदेवी जगति जनयतात् कुण्डिका भाति यस्याः,  
सन्नालीका सदासा परिकरमुदिता साक्षमाला भवन्तम् ॥४८॥**

रक्ष इति । ‘जगति’ भुवने । ‘यस्याः’ देव्याः । ‘परिकरं’ करं—हस्तं परि—उद्दिश्य लक्ष्यीकृत्येति यावत् । ‘उदिता’ उदयं प्राप्ना । सत्—शोभनं नालीकं कमलं यस्याः सा । ‘सदासा’ सद्भूरासा—प्राप्ना सदासा ‘कुण्डिका’ कुण्डी एव कुण्डिका—कमण्डलुः । “अखी कमण्डलुः—कुण्डी” इत्यमरः । ‘भाति’ शोभते । ‘भा’ दीप्तौ धातोर्वर्तमाने लटः प्रथमपुरुषस्यैकवचनम् । ‘सा’ तथाविधा । ‘रक्षःक्षुद्रग्रहादिप्रतिहतिशमनी’ रक्षांसि—यातुधानाः, क्षुद्राः—शाकिनीप्रमुखाः, ग्रहाः—शनैश्चरादयः, इति इतरेतरद्वन्द्वसमाप्तः आदिग्रहणादन्येऽपि भूपालव्यालकालभूतादयस्तेभ्यो या प्रतिहननं प्रतिहतिरूपथातस्तस्याः शमनी—विनाशिका । ‘वाहितश्वेतभास्वत्सन्नालीका’ वाहितं—वाहनीकृतं, श्वेतमुज्ज्वलं, भास्वत्—दीप्यमानं, “भास्वान् दीप्रे रवौ” इति हैमः । सत्—शोभनं, नालीक—मस्तुजं यथासा । नालीकं पुङ्कीबे, “विसप्रसूत नालीकं, तामरसं महोत्पलं” इति हैमः । ‘सापरिकरमुदिता’ सापरिकरेण—जटामण्डलेन, “भवेत्परिकरः सङ्गे, पर्यङ्कपरिवारयोः । प्रगाढग्रात्रिकाबन्धे, समारंभविवेकयोः ।” इति मेदिनी । मुदिताहृष्टा, साशब्दोऽत्र जटावाचकः, “कथिता सा जटायां च” इति हारावल्याम् परिकरशब्दश्च मण्डलवाचकः । ‘साक्षमाला’ अक्षमालया सहिता—अक्षावल्या समेता । कुण्डिकाया—वा विशेषणम् । ‘शुभ्रा’ श्वेतवर्णा । ‘सन्नालीका’ सञ्च—प्रणष्ठमलीकमस्तयं यस्याः

( ७६ )

साऽवितथवादिनी । ‘ सदाप्ता ’ सतां—साधूनामाप्ता—अविप्रतारिका, इति विशेषणद्वयं देव्या अपि योजनीयम् । ‘ श्रीशान्तिदेवी ’ श्रिया सहिता शान्त्याख्यदेवी, चण्डीख्यपरोक्षा । श्रीशब्दोऽत्र महत्वख्यापकः । ‘ भवन्तं ’ त्वां । ‘ सदा ’ नित्यम् । ‘ क्षमालाभवन्तं ’ क्षमणं क्षमा—उप-क्षमः ( पृथ्वी च ) तस्या लाभः सोऽस्याऽस्तीति क्षमालाभवान् तम् । “ क्षमा क्षान्तौ क्षितौ ” इति हैमः ‘ जनयतात् ’ कुरुतात् ॥४८॥

### श्री शांतिदेवीनी स्तुति—

**१. श्रीकार्थ—** हस्तने विषे ( भूषणुऽपे ) उदयपामेली, तेमज्ज सुंहर कमलथी सुशोभित अने सत्पुरभिष्माये स्तीकारेली जेनी कुडिकामंडलु जगत्भां शोले छे, ते श्री शांतिदेवी के जे राक्षसो, शाकिनी, डाकिनी आहि क्षुद्र अवा शैनैश्चराहिक अनिष्टअण्हे विगेरेना उपद्रवेने नाश करनारी छे, वर्णी १वेत, दीर्घमान—शोभायमान, तेमज्ज सर्वोत्तम कमल जेनुं वाढून छे, जटाना मंडलवडे आनंद भानती, वर्णी जपमाणाथी विभूषित, १वेतवर्णुने धारणु करती, सत्यवाही अने सज्जनोने भान्य ( तेमज्ज परिज्ञनवडे हृषित ) अवी ते शांतिदेवी ( हे मुसुक्षुज्जन ! तने क्षमा—शान्तिना लाभयुक्त ) ( अथवा पृथ्वीना लाभयुक्त अर्थात् राज्ययुक्त ) अनावो ॥ ४८ ॥

### श्रीविमलजिनस्तुतयः ।

#### अथ श्रीविमलनाथाय प्रणामः

अपापदमलं घनं, शमितमानमामो हितं,  
न तामरसभासुरं, विमलमालयाऽमोदितम् ।  
अपापदमलङ्घनं शमितमानमामोहितं,  
न तामरसभासुरं विमलमालयामोदितम् ॥ ४९ ॥

पृथ्वी ( ८९ )

( ७७ )

**अपापदेति—**‘ अपापदं ’ न पापं ददाति यत् तत् । ‘ अलं ’ अत्यर्थ, “अलं भूषणपर्यामि—वारणेषु निरर्थके । अलं शक्तौ च निर्विष्टं” इति विश्वः । ( अथवा अपापदमलभित्येकं पदम्, अपापं—पापरहितं, दमलं—दममुपशमं लाति—गृह्णातीति दमलं, अपापं च तत् दमलं चेत्य-पापदमलं ) । इति कर्मधारयः समाप्तः । ‘ घनं ’ अच्छिद्रं—निरन्तर-मित्यर्थः । इदं विशेषणद्वयं विमलप्रभोरपि लिङ्गव्यत्ययेन योजनीयम् । “घनो मेघे मूर्तिंगुणे, त्रिषु मूर्तें निरन्तरे ” इत्यमरः । समस्तकर्म-मलक्षयोत्पन्नम् । ‘ शं ’ सुखम् । “ शं सुखेऽपि च कल्याणे ” इति विश्वः । ‘ इतं ’ प्राप्तम् । ‘ हितं ’ हितकारिणम् । मोक्षाध्वप्रदर्शनात् । ‘ नतामरसभासुरं ’ नता—नमीभूता अमरसभा असुराश्च देवविशेषा यस्य तम् । ( अथवा नताः अमराः सभाः—सदीमिका असुराश्च यस्य तम् ) ‘ विमलमालया ’ विगतमला या माला—स्त्र॒ तया । ‘ आमोदितं ’ सुरभीकृतम् ॥ ‘ अपापदं ’ अपगता आपदो यस्माद् यस्येति वा बहुब्रीहिस्तम् । ‘ अलङ्घनं ’ न विद्यते लङ्घनं अधःकरणं कुतोऽपि यस्य तम् । ‘ शमितमानं ’ शमितः—क्षयं नीतो मानो येन तम् । ‘ न—आमोहितं ’ सर्वथा मोहवर्जितम् । ‘ ताम-रसभासुरं ’ तामरसं—कमलं तद्वद् भासुरो—दीप्यमानस्तम् । ‘ आल-यामोदितं ’ आलया—आवासास्तैरमोदितः—मोदमप्राप्तस्तम्, त्यक्तगृह-वासस्त्वात् । ‘ विमलं ’ विमलानि ज्ञानान्यस्येतिविमलःः,—विगतो मलः पापमस्येति वा विमलः । यद्वा गर्भस्ये मातुर्मतिस्त्वानुश्च विमला-ऽभवदिति विमलः । “ मलं किदृ पुरीषे च, पापे च कृपणे मलः ” इति विश्वः । तं श्रीविमलप्रभुम् । ‘ आनमामः ’ प्रणमामः । वय-भितिशेषः ॥ ४९ ॥ अस्मिन् पदे ( पृथ्वीवृत्तम् ) तलक्षणञ्च—जसौ जसयला वसु—प्रहयतिश्च पृथ्वीगुरुः ॥

**श्री विमलनाथने वंहन.**

**श्लोकार्थ—**अपाप—पुण्यने आपनार ( अथवा पापरहित

( ૪૮ )

પવિત્ર અને ઉપશમને અર્પણુ કરનાર, ) ( સમસ્ત કર્મનો ક્ષય થવાથી ઉત્પન્ન થતા ) નિબિદ-ગાઠ સુખને પ્રાપુ થયેલા એવા, ( સમયભુવનવર્ત્તિ ભવ્ય લોકેને માર્ગ ધતાવનાર હોવાથી ) હિતકારી, પ્રણામ કર્યો છે હેવ સલાચ્યે તેમજ અસુરોએ જેને એવા, અથવા નમ્યા છે હેવો તેમજ હેત્તિભ્યમાન અસુરો જેને એવા, નિર્મળ પુષ્પોની માલાવડે સુગંધિત, નષ્ટ થઈ છે આપત્તિએ જેની, અથવા જેનાથી એવા, અલંઘનીય-કોઈથી પણ નહીં ઉલંઘન કરી શકાય એવા, નાશ કર્યો છે અલિમાન ક્રેણે, સર્વથા મોહરહિત, કમલ સમાન પ્રકાશમાન અને ગૃહુવિષયક હુર્ષ તેમજ શૈક્થી રહિત, અર્થાત् સંસારી કાર્યોમાં અવિસ એવા ( તેરમાનિનેશ્વર ) કે વિમલ છે જ્ઞાન જેનું અથવા પાપરહિત, અથવા તે ગર્ભમાં આવેથી માતાની ઝુદ્ધ અને હેઠ બંને નિર્મલ થયાં એવા શ્રીવિમલનાથને અમે નમન કરીએ છીએ ॥ ૪૬ ॥ આ શૈક્થિત તથા પછીના પણ શૈક્થોમાં (પૃથ્વી) નામનું વૃત્ત છે. તેનું લક્ષણુ જ, સ, જ, સ, અને થગણુ એ પાંચ ગણો છે અને ઉપાંત્ય અક્ષર હુસ્વ છે તથા અંત્ય અક્ષર દીર્ઘ છે. આ વૃત્તમાં કુલ (૧૭) અક્ષરો છે અને આઠમે તથા સત્તરમે અક્ષરે વિરામ ( યતિ ) છે.

## સમસ્તજિનેશ્વરાણાં સ્તુતિઃ

સદાનવસુરાજિતા-અસમરાજિતા ભીરદાઃ,

ક્રિયાસુ રુચિતાસુ તે, સકલભારતીરા યતાઃ ।

સદાનવસુરાજિતા-અસમરાજિતાભીરદાઃ,

ક્રિયાસુરુચિતાસુ તે, સકલભા રતીરાયતાઃ ॥ ૫૦ ॥

**સદાનવેતિ—**‘ સદાનવસુરાજિતા:’ સહ દાનવૈર્વત્તન્ત ઇતિ સદાનવાશ્રતે સુરાશ્વ તૈરજિતાઃ-ઉપસર્ગાદિભિરક્ષોમિતાઃ । ‘અસમરા:’ નવિદ્યતે સમરઃ-સંગ્રામો યેષાં તે । ‘ભીરદા:’ ભિયં રદ્દન્તીતિ ભીરદાઃ,

( ७९ )

इति कर्मण्यणि कृते वृद्धावनिष्टं स्यादतो रदन्तीति रदाः भियो रदा इति  
 षष्ठीतपुरुषे 'रद' विलेखने धातोः 'पचाद्यचि' सिद्धम् । भयभिदः ।  
 'सकलभाः' सकला—सम्पूर्णा भा—प्रभा येषां ते । अथवा सह कलया  
 मधुरया भया—दीस्या वर्तन्त इति सकलभाः । "स्युः प्रभारुक्  
 रुचिस्त्वद्भा" इत्यमरः । "भा मयूखमहसी छविर्विभा" इति  
 हैमः । सदानवसुराजिताः 'सदानं—सविसर्जनं यद्ब्रह्म—द्रव्यं तेन  
 भूमिपालावस्थायां राजिताः—भूषिताः । सदा नवसु कमलेषु राजिता  
 वा, नवसंख्यकाभिः सुपुराभिः स्वर्णपङ्कजैर्वा "वसुस्त्वग्नौ, देवभेदे नृपे  
 रुचि । योक्त्रे शुष्के वसु स्वादौ, ( स्वर्णे ) रत्ने वृद्धयौषधे धने " ॥  
 इति हैमः 'असमरा जिताभीरदाः' असममतुल्यं राजन्त इत्येवं  
 शीला नाभी—नाभिः रदाश्च दशना येषां ते तथाभूताः 'सकलभार-  
 तीराः' सकलाः—सह कलाभिर्वर्तन्त इति सकलाः—'कल' क्षेपे इत्य-  
 स्माद्वातोः 'पचाद्यचि' कला इतिसिद्धम् सदोषाः—सांसारिककार्यरूपा  
 ये भारास्तेषां पर्यन्तस्थितत्वात्—तीरास्तीरभूताः अथवा असकला—  
 दोषरहिता या भारत्यस्ता ईरयन्ति—रान्ति ( ददति ) वा ये ते  
 तथा । 'यताः' धर्मोपदेशो वा संयमे यत्नं कुर्वाणाः, वशीकृतेन्द्रिया  
 इत्यर्थः । जिनाः 'वीतरागाः' । 'रुचितासु' अभिग्रेतासु । 'उचि-  
 तासु' योग्यासु । 'क्रियासु—कर्त्तव्येषु' । "क्रिया कर्मणि चेष्टायां,  
 करणे संप्रधारणे । उपायारम्भशिक्षाऽर्चा—चिकित्सानिष्कृतिष्वपि"  
 इति विश्वः । भो भव्य ! 'ते' तव । 'आयताः' दीर्घाः 'रतीः'  
 मुदः । 'क्रियासु' विधेयासुः ॥ ५० ॥

### सभस्त जिनेश्वरेनी स्तुति—

१. दोऽकार्थ—दानव अने देवे वडे पणु नडि छतायेला,  
 ( अर्थात् तेमणे करेला धार उपसर्गोर्थी अपशम्त ) वणी संथा-  
 भथी विमुण, लयने हर करनार, ( अर्थात् पैते निर्भय छोवाथी

( ८० )

अन्य प्राणीओंने निर्लय करनारा) संपूर्ण कांतिवाणा, (मनोहर कांतिसङ्खित, (सांवत्सरिक) हान (सभयना ग्रन्थसे अक्षयासी करोड अने एंसी लाख-३८८,८००००००) सुवर्णर्थी शोलायमान (अथवा सर्वदा नवकर्मणो उपर (अथवा कर्मणाथी) शोकता) निरूपमपणे शोकी रह्या छे (अथवा असाधारण तेभज सुशोलित छे) नालि अने दांत जेमना, तथा (सभस्त संसारद्वीपी) लारना तीर-तट सभान अर्थात् संसारथी अविस (अथवा पवित्र भारती-वाणीने प्रेरनारा अथवा अपूर्ण करनारा) धर्मनो उपदेश देवामां प्रथलवाणा अथवा संयमशील ऐवा ते जिनो (मुक्ति मेणववामां) योग्य अने (पंडित पुढेपोने) इच्छिकर ऐवी कियाओने विषे, (हे सुसुक्षुज्जन ! सव्यज्जन !) त्हारा विस्तृत (अतिशय) हर्षने उत्पन्न करो. ॥५०॥

### जिनवचनप्रणामः ।

सदा यति गुरो रहो ? न मत मानवैरञ्चितं,  
मतं वरदमेनसा रहितमायता भावतः ।  
सदायति गुरो रहो न मतमानवैरं चितं,  
मतं वरदमेन सारहित मायताभावतः ॥ ५१ ॥

सदेति—‘मानवैः’ मनुजैः ‘अञ्जितं अर्चितमभीष्टदम् । ‘अञ्जु’ गतिपूजनयोरित्यस्मान्निष्ठाक्तप्रत्यये ‘अञ्जोऽनर्चायां’ सिद्ध है० (४-२-४६) इति न लोपाभावे सिद्धम् । ‘एनसा’ पापेन । ‘रहितं’ वर्जितम् । ‘सदायति’ सती-शोभना आयतिः—उत्तरकालः (भविष्यकालः) प्रभावो वा जिनप्रवचनस्य कदापि केनापि खण्डयितुमशक्यत्वात्प्रभुता वा यस्य तत् । “आयतिस्तूत्तरः कालः” इति हैमः । “स्यात् प्रभावेऽपि चायतिः” इत्यमरः । ‘गुरोः’ महतः । (अर्हतः) ‘रहः’ रहस्यभूतम् । “रहो गुरुये तत्त्वे” इति हैमः । ‘न’ नेति निषेदे,

( ८१ )

उत्तरपदेन संबध्यते, 'मतमानवैरं' मानश्च वैरं च मानवैरे ते मते यस्य तत्, यन्नभवति, तथा भूतम् । "वैरं विरोधो विद्वेषः" इत्यमरः । 'मतं' सर्वेषामभिप्रेतम् 'आयता' आगच्छता । 'वरदमेन' वर-श्रासौ दमश्च तेन प्रधानशमेन । 'चितं' पुष्टम्-व्याप्तम् । 'सारहितं' सारं-श्रेष्ठं-प्रधानं हितं पश्यं यस्मिस्तत् यद्वा सारं च तत् हितश्च सारहितम् । 'आयताभावतः' आयता-विस्तीर्णचासावाभा-छाया विद्यते यस्य तस्य । 'यतिगुरोः' गृणाति धर्ममिति गुरुर्यथार्थो-पदेष्टा यतीनां गुरोस्तत्त्वोपदेष्टुर्जिनस्य । 'मतं' प्रवचनं-सिद्धान्तम् । अहो इत्यामन्त्रणे । हे ( भव्यजनाः । ) 'भावतः' भावादिति भावतः । 'पञ्चम्यास्तसिल् ( पा० ५-३-७ ) इति तसिल् प्रत्ययः । अनुरागात् । 'सदा' प्रस्त्रहम् । 'नमतं' प्रणमत ॥५१॥

### जिन भवयनने प्रणाम—

**श्लोकार्थ**—मनुष्योथी पूजित, वरदानने आपनार तथा पाप-रहित, तेमज श्रेष्ठ-सारो छे आगामीकाल (लविष्यकाल) क्लेनो अथवा प्रशस्त छे प्रभाव क्लेनो एवा, तथा शुड-तीर्थं कृना रहस्य भूत, नथी संभत मान अने वैर क्लेने एवा, आवता-प्राप्त थत उत्कृष्ट उपशमवडे व्याप्त, सर्व शुवेने संभत, श्रेष्ठ-कृद्याणुकारी छे सार-सावार्थ क्लेनो अथवा सारभूत अने हितकारी एवा, विस्तीर्णु प्रभा-कांतिशुक्त एवा भुनियोना शुडना सिद्धांतने अर्थात् सर्वज्ञ प्रणीत सिद्धांतने हे लब्ध्यात्माएँ । तमे भावपूर्वक नमन करो ॥५१॥

( ८२ )

## श्रीरोहिण्यै विनतिः—

प्रभाजि तनुतामलं, परमचापला रोहिणी,  
 सुधावसुरभीमना, मयि सभाक्षमालेहितम् ।  
 प्रभाजितनुतामलं, परमचापलाऽरोहिणी,  
 सुधावसुरभीमना मयिसभा क्षमाले हितम् ॥५२॥१३॥

प्रभाजीति । ‘अचापला’ न विद्यते चापलं यस्याः सा अचापला—चपलत्वहीना । ‘सुधावसुः’ सुधा—प्रासादानां लेपद्रव्यं तद्वद्सुस्तेजो यस्याः सा, अथवा सुधा—अमृतं सैव वसु—द्रव्यं यस्याः सा । “वसुस्त्वग्नौ, देवभेदे नृपे रुचि । योक्त्वे शुक्रे वसु स्वर्णे, रत्ने वृद्धधौषधे धने” ॥ १ ॥ इति हैमः । “सुधा खी लेपने मूर्व्यां, स्तुहीगङ्गेष्टकामृते” इति मेदिनी । ‘अभी-मनाः’ भीः—भयं तत्र मनो यस्याः सा, न भीमनाः, अभीमनाः । ‘सभाक्षमाला’ भया—प्रभया सह वर्तत इति सभा—सदीमिः अक्षमाला—जपमाला यस्याः सा । “अक्षो विभीतके कर्वे, रावणे शकटात्मनोः । पाशके मणिके चाक्षः, इन्द्रिये खण्ड-मोक्षयोः” ॥” इत्यनेकार्थतिलके । ‘प्रभाजितनुता’ प्रभया जितैस्ते-जसा तिरस्कृतैर्नुता—स्तुता । ‘परमचापला’ परमं—प्रधानं चापं—धनुर्लाति—गृह्णातीति परमचापला । “धनुश्चापोऽस्त्रमिष्वासः, को-दण्डं धन्वकार्मुकम् । द्रुणाऽसौ—इति हैमः । ‘सुधावसुरभी’ सुष्ठु धावतीति सुधावा—सद्वेगा सा चासौ सुरभी च गौस्ताम् । ‘आरो-हिणी’ अवश्यमारोहतीत्येवंभूता । ‘प्रहादिभ्यो णिन्’ (सिद्ध है० ५—१—५३) इति, आवश्यके णिनिः । ‘अनामयिसभा’ आमयो रोगोऽस्या अस्तीति आमयिनी—रोगिणी न विद्यते सभा—परिषद्यस्याः सा अनामयिनी ‘रोहिणी’ रोहन्ति कर्माणि—कार्याण्यस्यामिति

( ८३ )

रोहिणी, ‘नन्दिग्रहिपचादिभ्यो ल्युणिन्यचः’ (पा. ३-१-१३ ४) इति सूत्रेण णिनि प्रत्यये “षिद्वौरादिभ्यश्च” (पा. ४-१-४१) इति गौरादित्वात् स्त्रियां डीप् । रोहिण्यभिधेया देवी । ‘प्रभाजि’ प्रकर्षेण भजतीत्येवंशीलः प्रभाकृ तस्मिन् सततं भक्तिमति ‘क्षमाले’ क्षमां-शान्तिं लाति—गृह्णातीति क्षमालस्तस्मिन्नुपशमवति । ‘मयि’ मद्विषये । ‘परं’ उत्कृष्टम् । ‘अमलं’ अनवद्यं । ‘ईहितं’ वाञ्छितम् । ‘हितं’ शुभोदर्कम् । ‘अलं’ अतिशयेन । ‘तनुतां-तनोतु ॥ ५२ ॥

### श्रीरैषिहस्तीदेवीनी प्रार्थना.

**१३. प्रार्थना**—यपलताथी सर्वथा रहित एवा, वणी सुधा—यूना समान धवल कांति छे जेनी, अथवा अमृत एव छे लेपन द्रव्य जेनुं, तेमજ निर्दृश्य भनवाणी, अतिशय देहीप्यमान जपमालाथी युक्त, पोतानी कांतिवडे पराक्षव करायेताथी स्तुति करायेदी, सर्वोत्तम धनुषने अहंशु करनारी, वणी अतिशय वेगवाली एवी गायनी उपर असनारी—विराजनारी अने रोग रहित छे सला जेनी एवी देहिणी हेवी. उत्कृष्टपणे सेवातत्पर तथा क्षमायुक्त एवा भारे विषे उत्कृष्ट तथा निर्भर एवा वाञ्छितने अने हित-शुलभरिण्यामने विस्तारो ॥ ५२ ॥

### १४ श्रीअनन्तजिनस्तुतयः

अथ श्री अनन्तनाथस्य स्तुतिः—

सकलधौतसहासनमेरव-

स्तव दिशन्त्वभिषेकजलप्लवाः ।

मतमनन्तजितः स्तपितोङ्गसत-

सकलधौतसहासनमेरवः ॥ ५३ ॥

( ८४ )

**सकलेति—‘ सकलधौतसहासनमेरवः । सकलाः—समग्राः धौताः—प्रक्षालिताः सहासाः—सविकासाः नमेरवो—सुरपुन्नागाः—बृक्षविशेषा यैस्ते । ‘ ऋषितोऽसत्सकलधौतसहासनमेरवः । सह आसनेन—खात्रपीठेन, वा असनैः सर्जकतरुभिर्वर्तत इति सहासनः, “ सर्जकाऽसनबन्धूक् पुष्पप्रियकजीवकाः ” इत्यमरः । ऋषितः—प्लावितः—उल्सन्—शोभमानः, सकलधौतः—समुवर्णः सहासनो मेरु-यैस्ते, “ कलधौतं रूप्यहेम्नोः, कलधौतः कलध्वनौ ” इति हैमः । अथवा उल्सत् सकलधौतं—सकनकं, सह आरोहक्षममासनं—विष्टुरं यस्मिन् स तथा स चासौ मेरुश्च ऋषित उल्सन् सकलधौतः सहासनो मेरुयैस्ते । ‘ अनन्तजितः । अनन्तान् कर्माशान् जयति यद्वाऽनन्तैः कर्मादिभिर्जयति किंवा गर्भस्थिते जनन्या अनन्तरत्नदाम दृष्टं जयति च त्रिभुवनेऽपि इत्यनन्तजित् तस्य अनन्तजिन्नाम्नश्चतु-द्वाशतीर्थङ्करस्य । “ स्यादनन्तजिदनन्तः । इति हैमः । अनन्तानि ज्ञानादीनि यस्यासावनन्तः स चासौ जिच्च अनन्तजिदितिवा, नास्ति गुणानामन्तो यस्याऽसौ स चासौ जिच्च तस्येति वा । ‘ अभिषेकजल-प्लवाः । खानजलप्रवाहाः । “ अम्बुवृद्धौ पूरः प्लवश्चसः ( प्लवोऽ-पिच ) ” इति हैमः । हे भव्यात्मन् ! ) ‘ तव ’ भवतः । ‘ मतं ’ इष्टम् । ‘ दिशन्तु ’ अर्पयन्तु ॥५३॥ द्रुतविलम्बितवृत्तमिदं पूर्वमुक्तमेतलक्षणम् ।**

### श्री अनंतनाथनी स्तुति.

**श्लोकार्थ—**प्रक्षालितकर्या छे ( कुसुमादिकथी ) विकसित थयेवा समस्त नमेझ वृक्षेवा नेमणे, तेमज स्नान कराउयुं छे हेही॒ध्यमान अ॒वा कुनकुमय स्नानपीठ सहित ( अथवा ) असन—सर्वक नामे वृक्ष विशेष सहित भेदनुं नेमणे अ॒वा, ( अथवा हेही॒ध्यमान सुपर्णुभय अने हृषि छे आसन नेने विषे अ॒वा भेदने स्नान कराउयुं छे नेमणे ) अ॒वा, अनंतजित्—चौदमा अनंतनाथना अभिषेकना जल

( ८५ )

अवाहो ( हे भव्य ! ) तडारा भनोवांछितने पूर्णु करो ॥ ५३ ॥ आ  
हुतविलंभित वृत्तनुं लक्षण् पृष्ठ. २१ भां कहुं छे.

## जिनसमूहस्याऽभ्यर्थना—

मम रतामरसेवित ! ते क्षण—  
प्रद ! निहन्तु जिनेन्द्र कदम्बक ! ।  
वरद ! पादयुगं गतमज्ञता—  
ममरतामरसे विततेक्षण ! ॥ ५४ ॥

ममेति—‘रतामरसेवित !’ रताः—पूज्यबुद्धितयाऽसक्तचित्ताः  
ये अमरास्तैः सेवित ! । ‘क्षणप्रद !’ क्षणमुत्सवं प्रददातीति  
क्षणप्रदः उत्सवप्रदायी तत्सम्बोधनम् । “क्षणः कालविशेषे स्यात्,  
पर्वण्यवसरे महे । व्यापारविकल्प्त्वे च, परतन्त्रत्वमध्ययोः” इति  
हैमः ‘वरद’ वरं ददातीति वरदस्तदामन्त्रणम् । वाञ्छितप्रद ! ।  
‘विततेक्षण !’ वितते ईक्षणे यस्य स तदामन्त्रणम् । विशाल-  
लोचन ! । ‘जिनेन्द्रकदम्बक ! जिनेन्द्राणामहैतां कदम्बक ! समूह ! ।  
‘अमरतामरसे’ देवकृतनवकमले, जातित्वादेकवचनम् । “ताम-  
रसं महोत्पलं” इति हैमः । ‘गतं’ प्राप्तम् ‘ते’ तव । पादयुगं  
चरणद्वन्द्वम् । ‘मम’ मामकीनाम् । ‘अज्ञतां’ मूढताम् । ‘निहन्तु’  
नाशयतु । निपूर्वकात् ‘हन्’ हिंसागत्योरितिधातोराशीःप्रेरणयोर्लोँटि  
प्रथमपुरुषैकवचनम् ॥ ५४ ॥

## जिनसमूहने अल्पर्थना—

पूज्य बुद्धिने लीघे आसक्त ( चित्तवाणा ) देवोवडे सेवा  
करायेदा, ऐवा हे जिन समूह !, हे उत्सवदायक !, हे अभीष्ट-  
वांछित अर्थने आपनार, ! हे विशाण लोचनवाणा !, हे जिनेन्द्र

( ८६ )

सभूहु ! , हेवोम्ये रथेला ( सोनाना ) नव कमलोने विषे रहेला  
तम्हारा अने थरणु म्हारी अशता-भूढताने दूर करे ॥ ५४ ॥

## आगमस्तुतिः ।

परमतापदमानसजन्मनः—  
प्रियपदं भवतो भवतोऽवतात् ।  
जिनपतेर्मतमस्तजगत्रयी—  
परमतापदमानसजन्मनः ॥ ५५ ॥

**परमतेति—**‘अस्तजगत्रयीपरमतापदमानसजन्मनः’ अस्तः—  
क्षिप्तो—जगतां लोकानां स्वर्गमृत्युपाताललक्षणानां त्रयी—त्रिकं जग-  
त्रयी तस्याः जगत्रय्याः—जगत्रयस्य परमतापदः परमश्चासौ तापश्च-  
परमतापस्तं ददातीति—प्रकृष्टसन्तापदायको मानसजन्मा—मानसा-  
ज्जन्म उत्पत्तिर्यस्य सः—मनोभवो येन स तस्य । “मनः शृङ्खारसङ्क-  
ल्पाऽऽत्मनोयोनिः” इति हैमः । ‘जिनपतेः’ अहंतः । ‘परमतापद्’  
परेषां—बौद्धादिविपक्षाणां मतानां—आगमानामापद्धेतुच्चात्—आपद-  
व्यसनं । ‘अमानसजन्मनः प्रियपदं’ अमानानि अप्रमाणानि सजन्ति—  
सम्बद्धमानानि, मनः प्रियाणि—चित्तप्रीतिकराणि पदानि—पद्यते—  
गम्यते—कारकसृष्टोऽर्थं एभिरिति पदानि, ‘वर्षादयःङ्गीवे’ (सिद्ध० है.  
५-३-२९) इत्यल् । स्याद्यन्तानि त्याद्यन्तानि, अहदादीनि वा यस्मिन्  
तत्, अर्थसमाप्तिः पदमित्येके, स्याद्यन्तं त्याद्यन्तश्च तदित्यन्ये ।  
(५१०८८६८४०) श्लोकप्रमितान्याचाराङ्गदीनां पदानि तथा च—

“एकाधिकपञ्चाशत्—कोळ्योऽष्टौ लक्षकाः सहस्राश्र । षडशीति-  
श्रत्वारिं—शदधिकाष्टशतानि पुनः ॥ १ ॥ वर्णाष्टकमेकपदे, श्लोकानां मान-  
मस्योक्तम् ॥ जिनभाषितस्य सैका—दशाङ्गपूर्वस्य विद्वद्धिः ॥ २ ॥ ”

( ८७ )

### द्वादशाङ्गस्वरूपमाह—

अद्वारसपयसहसा, आर्यारे दुगुणदुगुण शेषेषु । सुयगडठाँै  
सँमवा—य भगौवई—नायधम्मकहा ॥ १ ॥ अंगं उवासगदस्ता, अंत-  
गड अनुत्तरोववाइदसा । पन्नावार्गंरणं तह, विवार्गंसुयमिगदिसं  
अंगं ॥ २ ॥ परिकर्म्मं सुत्ते पुष्टा—एउओगैपुष्टगर्यैचूलिआँ एवं । पण-  
दिड्वायभेया, चउदस पुष्टाँइं पुष्टगर्य ॥ ३ ॥

### पूर्वाणि नामानि पदसंख्याश्वाह—

उर्पाए पयकोडी, अग्गाणीयं मिछं नवइ लक्खा । विरिय पैवाए  
अतिर्थ—पवाइ लक्खा सयरि सद्धि ॥ ४ ॥ एगपउणाकोडी—पयाणनाण-  
प्पवायं पुष्टमि । सञ्चप्पवार्यं पुष्टे, एगापयकोडि सञ्चपया ॥ ५ ॥  
छष्टीसं पयकोडी, पुष्टे आयप्पवाँयनामंमि । कम्मर्पवायपुष्टे, पयकोडी  
असिहलक्खजुया ॥ ६ ॥ पञ्चक्रबाणभिहाणे, पुष्टे चुलसीइपयसयस-  
हस्सा । दसपयसहस्सज्ज्या, पयकोडी विजापवाँयमि ॥ ७ ॥ कल्ली-  
णनामधिजे, पुष्टमि पयाणकोडिछष्टोसा । छपनलक्खकोडी—पयाण  
पाणीउं पुष्टमि ॥ ८ ॥ किरियाविसैलपुष्टे, नवपयकोडि उ विंति  
समयविझ । सिरिलोकविदुसैरे, सहुदुवालस य पयलक्खा ॥ ९ ॥

छाया—“ अष्टादशपदसहस्रा—आचारे द्विगुणद्विगुणानि शेषेषु ।  
सूत्रकृतस्थानसमवायभगवतीज्ञाताधर्मकथाः ॥ १ ॥ अङ्गमुपासक-  
दशा—उन्तकृदनुत्तरोपपातिकदशाः । प्रश्वव्याकरणं तथा, विपाकश्रुतमे-  
कादशमङ्गम् ॥ २ ॥ परिकर्म्मसूत्रपूर्वाऽ—नुयोगपूर्वगतचूलिका एवम् ।  
पञ्चदृष्टिवादभेदा—श्रुतुर्दशा पूर्वाणि पूर्वगतम् ॥ ३ ॥ उत्पादे पदकोटी,  
अग्राणीये षणवतिलक्षाः । वीर्यप्रवादेऽस्तिप्रवा—दे लक्षाः सपत्निः  
षष्टिः ॥ ४ ॥ एकपदोना कोटी, पदानां ज्ञानप्रवादपूर्वे । सत्यप्रवादपूर्वे,  
एकापदकोटीषट् च पदानि ॥ ५ ॥ षड्बिंशतिपदकोटी, पूर्वे आत्म-

( ८८ )

प्रवादनाम्नि । कर्मप्रवादपूर्वे, पदकोट्यशीतिलक्षयुता ॥ ६ ॥ प्रत्याख्यानाभिधाने, पूर्वे चतुरशीतिपदशतसहस्राः । दशपदसहस्रयुक्ता, पदकोटी विद्याप्रवादे ॥ ७ ॥ कल्याणनामधेये, पूर्वपदानां कोटिः षड्विंशतिः । षट्पञ्चाशलक्षकोटी, पदानां प्राणायुपूर्वे ॥ ८ ॥ क्रियाविशालपूर्वे, नवपदकोटिस्तु ब्रुवते समयविदः । त्रिलोकविन्दुसारे, सार्वद्वादश च पदलक्षणि ॥ ९ ॥ इत्यागमविदो वदन्ति.”

“ पदं त्रिविधं—अर्थप्रमाणमध्यमभेदात्, तत्रमध्यमपदसंख्यामाह—सोलसयचउतीसा, कोटीतियसीदि लक्खयं चेव । सत्त्वसहस्रसहस्रया, अट्टासीडियपदवण्णा ॥ १ ॥ ” इति दैगम्बराः ।

‘ मतं ’ प्रवचनम् । ‘ भवतः ’ युष्मान् । ‘ भवतः ’ भवादिति भवतः—संसारात् । “ भवः सत्त्वाप्तिजन्मसु । रुद्रे श्रेयसि संसारे, इति कोषः । ‘ अवतात् ’ रक्षतात् । ‘ अव ’ रक्षणे धातोराज्ञीः प्रेरणयोः कर्त्तरि परस्मैपदे तुप्, ‘ तुष्योस्तातडाशिष्यन्यतरस्यां ’ ( पा० ७-१-३५ ) इति ताताडादेशेऽवतादितिसिद्धम् ॥ ५५ ॥

### आगमनी स्तुति—

‘ लोकार्थ—पराश्रुत कुर्याएँ छे त्रिषु लोकने संताप आपनार अवै। कामहेव जेण्हे अवा अरिहुंत लगवाननो सिद्धांत के जे ( औद्ध विग्रे ) अन्य हर्शनाने ( अंडन करनार छावाथी ) आपत्तिरूप, तेमज अनंत—अगणित छे ( परस्पर ) अविद्ध—संगत अने विद्वानोना यित्तानुं रञ्जन करनारां पहो—विलक्ष्यांत अथवा अरिहुंत अहादि तेमज १आचारांग आहि शास्त्रोनां पहो

१( १ ) आचारांग ( २ ) सुयगांग ( ३ ) हाण्यांग ( ४ ) समवायांग ( ५ ) लगवाती ( ६ ) शाताधर्मकथा ( ७ ) उपासकहशा ( ८ ) अंतगडहशा ( ९ ) अनुतरोववाधहशा ( १० ) प्रश्नव्याकरण ( ११ ) विपाकसूत्र. आ अगीयार अंगेनां उत्तरोत्तर ऐतुक्तमे अभणां अभणां पह जाणुवां जेभके आचारांगना १८००० सन्तद्वाह अंगना ३६००० ऐम उत्तरोत्तर जाणुवुः

( ८९ )

જેને વિષે છે અદો સિદ્ધાંત ( હે લવ્યો ! ) તમ્હારું ( સંસાર અમણુરૂપી ) લયથી રક્ષણુ કરેં ॥ ૫૫ ॥

## શ્રી અચ્યુતાયાઃ સ્તુતિઃ—

રસિતમુચ્ચતુરં ગમનાય કं,  
દિશતુ કાશ્વનકાન્તિરિતાઽચ્યુતા ।  
ધૃતધનુઃફલકાસિશરા કરૈ—  
રસિતમુચ્ચતુરજ્જમનાયકમ् ॥ ૫૬ ॥ ૧૪ ॥

**રસિતેતિ** — ( હેષારવાય ) ‘રસિતં’ શાબ્દાયિતં—મધુરધ્વનિં કુર્વન્તમ् । હેષારવસંયુતમિત્યર્થઃ । “હેષા—હેષા તુરજ્જાણાં” ઇતિ હૈમઃ । “સ્તનિતં ગર્જિતં મેઘ—નિર્ધેષે રસિતાદિ ચ ” ઇત્યમરઃ । ‘ગમનાય’ ગમનં કર્તૃમ् । ‘ઉચ્ચતુરં’ ઉત્પ્રાબલ્યેન ચતુરં—ગૃહીતશિક્ષસ્મ । અથવા રસિતે ધ્વનિતે મુદ્દ યસ્ય સ રસિતમુદ્દ, સ ચાસૌ ચતુરશ્ચ તમ ।

બારમું દિશિનાદચંગ વિચ્છેદ ગયેલું છે, તેના ( ૧ ) પરિક્રમે ( ૨ ) સૂત્ર ( ૩ ) પૂર્વાંત્રોગ ( ૪ ) પૂર્વગત અને ( ૫ ) ચુલિકા અભ પાંચ બેદ છે. તેમાં ચૈદ પૂર્વાંત્રોગનાને પૂર્વગતશ્રુત, તેનાં નામ અને પદની સંખ્યા અનુક્રમે આ પ્રમાણે છે:—

( ૧ ) ઉત્પાદ-એક કરોડ ( ૨ ) અચાયણી હશે લાખ  
( ૩ ) વીર્યપ્રવાદ ૭૦ લાખ ( ૪ ) અરિતપ્રવાદ ૬૦ લાખ ( ૫ ) રાન-પ્રવાદ-એક કરોડાંથી એક ઓછું ( ૬ ) સલ્યપ્રવાદ ૨ કરોડ અને ૭ ( ૭ ) આત્મપ્રવાદ ૨૬ કરોડ ( ૮ ) કર્મપ્રવાદ એક કરોડ ૮૦ હજાર ( ૯ ) પ્રત્યાખ્યાનપ્રવાદ ૮૪ લાખ ( ૧૦ ) વિદ્યાપ્રવાદ એક કરોડ દશ લાખ ( ૧૧ ) કલ્યાણપ્રવાદ ૪૭ વીસ કરોડ ( ૧૨ ) પ્રાણાશ્ચ પૂર્વ એક કરોડ ૫૬ લાખ ( ૧૩ ) કિયાવિશાળ ૮ કરોડ અને ( ૧૪ ) લોકભિદુસાર પૂર્વ સાડ બાર કરોડ ૫૬૦ વાંચું છે. પ્રાયઃ ( ૫૧૦૮૮૬૮૪૦ ) શ્લેષણું એક પદ થાય. પ્રવચન સારો-જીરમાં સાત, આડ અને દશમા પૂર્વમાં અનુક્રમે ( ૩૬ કરોડ ) ( ૧ કરોડ અને ૮૦ લાખ ) ( ૧૧ કરોડ અને ૧૫ હજાર ) પદો કલ્યાં છે.

( ९० )

इत्येकं पदं वा यद्वा रसितमुदिति भिन्नं पदं तच्च देव्या विशेषणम् ।  
 ‘असितं’ नीलवर्णम् । ‘उच्चतुरङ्गमनायकं’ उच्चः—प्रांशुः यस्तुरङ्ग-  
 माणां नायकः—तुरगप्रकाण्डस्तम् । ‘इता’ प्राप्ता । ‘काञ्चनकान्तिः’  
 काञ्चनमिव कान्तिर्यस्याः सा कनकद्युतिः । ‘करैः’ पाणिभिः  
 “पञ्चशाखः शयः शमः । हस्तः पाणिः करः” इति हैमः । ‘धृत  
 धनुःफलकासिशरा’ धनुश्च—चापः फलकञ्च—चर्म असिश्च—खङ्गः  
 शरश्च बाणः ते धृता यथा सा । “अङ्गुनं फलकं चर्म, खेटकावरणं  
 स्फुरः ( स्फुरकोऽपि )” इति हैमः । ‘अच्युता’ अच्युताऽभिधा,  
 अच्छुपाऽपरनाम्नी देवी । ‘कम्’ सुखम् । “कं शिरोजलमास्यात्,  
 कं सुखं परिकीर्तितम्” इति केशवः । “कं शीर्षेऽप्सु सुखे” इति  
 हैमः । ‘दिशतु’ ददातु ॥ ५६ ॥

### श्री अच्युतादेवीनी स्तुति—

**१६३**—( हेषास्वरूपी ) शण्ठ उरनारा, तथा श्याम वर्ण-  
 वाणा, गति उरवामां अति चतुर ( अथवा हेषारवने विंप्रे प्रीति  
 छे जेनी, तेमज चतुर एवा उच्च श्रेष्ठ अस्थ उपर स्वार थयेली,  
 वर्णी कनक-सुवर्ण समान कांति छे जेनी, अने हस्तोवडे धारणु  
 कर्यां छे धनुष, ढाल, तरवार अने आणु जेणु तथा ध्वनिने विषे  
 प्रीति छे जेने एवी अच्युता—अछुमिकादेवी सुख आपे ॥ ५६ ॥

### १५ श्री धर्मनाथजिनस्तुतयः ।

#### अथश्रीधर्मनाथनमस्तृतिः—

नमः श्रीधर्म ! निष्कर्मे—  
 दयाय महितायते !  
 मत्याऽमरेन्द्रनागेन्द्रै,—  
 दयाय महिताय ते ॥ ५७ ॥

( ९१ )

नम इति—‘ मर्त्योऽमरेन्द्रनागेन्द्रैः । मर्त्याश्च—मानवाः, अम-  
राश्च—निर्जरास्तेषामिन्द्राः—मर्त्योऽमरेन्द्रास्ते च नागेन्द्राश्च धरणेन्द्रादय-  
स्तैः । “ मनुष्यो मानुषो मर्त्यो—मनुजो मानवो नरः ॥ ” इति धनञ्जयः ।  
“ अमरा निर्जरा देवाः ॥ ” इत्यमरः । ‘ महितायते ! ’ महिता—  
पूजिता आयतिः—प्रभावो उत्तरकालो वा यस्य स तदामन्त्रणम् ।  
“ आयतिः संयमे दैव्ये, प्रभावागामिकालयोः ॥ ” इतिविश्वः । यद्वा-  
महिता आसमन्ताद् यतयो मुनयो यस्य स तदामन्त्रणम् । ( हे )  
‘ श्रीधर्म ! ’ श्रिया—चतुर्खिशदतिशयसमृद्धिरूपया समन्वित ! दुर्गतौ  
पतन्तं प्राणिसमूहं धारयतीति धर्मः, गर्भस्थितेऽस्मिन् माता दा-  
नादिधर्मपराऽजनीति वा धर्मस्तदामन्त्रणम् । श्रीधर्मनाथाऽभिधान !  
जिनेन्द्र ! । धर्मशब्देनाऽत्र धर्मनाथ एव गृह्णते, पदैकदेशे पदसमु-  
दायस्योपचारात्, भीमो भीमसेनवद् । ‘ निष्कर्मोदयाय ॥ ’ निर्गतः  
कर्मणां ज्ञानावरणीयादीनामुदयः कर्मोदयो—मलोत्पादो यस्य स तस्मै ।  
दयायमहिताय ॥ दया च कारुण्यं, यमाश्च यस्यते चित्तमेभिरिति यमाः  
पञ्चमहाब्रतानि, वाऽहिंसा सूनृतादयस्तेभ्यः, यद्वा दयाच यमाश्च  
सन्ति येषामिति मत्वर्थे ‘ अर्श आदिभ्योऽच् ॥ ’ ( पा० ५—२—१२७ )  
इत्यच्चप्रत्यये दयायमवद्भ्यो हिताय—रक्षकाय वृद्धिजनकत्वात् ।  
“ अहिंसा सत्यमस्तेय—ब्रह्माऽकिञ्चननता यमाः ॥ ” इति हैमः । ‘ ते ’  
तुभ्यं । ‘ नमः ॥ ’ नमोऽस्तु । नम इति निपातः । “ नेवाइयं पर्यं  
दद्व्यभावसंकोयणपयत्थो ॥ ” । नैपातिकं पदं द्रव्यभावसङ्कोचन-  
पदार्थः नमः—करचरणमस्तकसुप्रणिधानरूपो नमस्कारोऽस्त्वित्यर्थः ।  
‘ नमःस्वस्तिस्वाहास्वधाऽलंबद्योगाच ॥ ’ ( पा० २—३—१६ )  
इति नमो योगे चतुर्थी ॥ ५७ ॥

पञ्चमं लघु सर्वेषु, सप्तमं द्विचतुर्थयोः ।  
गुरुषष्टुं च सर्वेषा—मेतच्छ्लोकस्य लक्षणम् ॥ इतिलक्षणात् ।

( ९२ )

## શ્રી ધર્મનાથને પ્રણામ—

**ક્ષૈત્રાકાર્થ**—નરેંદ્ર, સુરેંદ્ર અને નાગેંદ્રોવડે, અર્થાત् સ્વર્ગ, ભર્ત્ય અને પાતાલ એ ત્રણું દોઢના અધિપતિઓવડે પૂજિત છે ઉત્તરકાલ ( મહિમા ) જેનો, અથવા પૂજિત છે પ્રભુતા જેની અથવા પૂજાચેલા છે સમસ્ત ભુનિઓ જેના, એવા હે પંદરમા તીર્થંકર ! શ્રી ધર્મનાથ ! નષ્ટ કર્યો છે જ્ઞાનાવરણીય આદિ કર્મનો ઉદ્ઘટન, —અર્થાત્ સર્વથા કર્મ રહિત, તેમજ દ્વારા અને વ્રતો ( ને પાલન કરનારા ) ને હિતકારી એવા તમછુને નમસ્કાર હો ॥૫૪॥

આ **ક્ષૈત્રાક** તથા પઠીના ત્રણું **ક્ષૈત્રાકમાં** અનુષ્ટુપ્ નામનું વૃત્ત છે, આ અનુષ્ટુપ્ વૃત્તના દરેક પાદમાં પાંચમો વર્ણ લખું તેમજ બીજા અને ચોથા પાદમાં સાતમો વર્ણ હુસ્વ વળી ચારે પાદમાં છુંઠો અક્ષર ગુરુ હોય છે, એ આ **ક્ષૈત્રાકનું** લક્ષણ છે.

## જિનસમૂહસ્ય સ્તુતિઃ—

જીયાજીનૌધો ધ્વાન્તાન્ત,  
તતાન લસમાનયા ।  
ભામણ્ડલત્વિષા યઃ સ—  
તતાનલસમાનયા ॥ ૫૮ ॥

**જીયાદિતિ**—‘ લસમાનયા ’ લસત ઇતિ લસમાના વિલ—સન્તી—વર્ધમાના વા તથા । ‘ તતાનલસમાનયા ’ તતઃ—પ્રસૂતો યોડ-નલઃ—શિખી, તેન સમાનયા સહિત્યા । યદ્વા તતઃ—વિપુલઃ અત એવાડનલસઃ—અમદો માનઃ—પ્રમાણાં યસ્યાઃ સા તથા ‘ ભામણ્ડલત્વિષા ’ ભાનાં—પ્રભાણાં મણ્ડલં ભામણ્ડલં દેવનિર્મિતં ભગવતૃષ્ટે પ્રભામણ્ડલં તસ્ય કાન્ત્યા પ્રભાવલયસંપદા, “ મણ્ડલં નિકુરમ્બેડપિ, દેશે દ્વાદશ-રાજકે । કુષાડહિભેદે પરિધૌ, ચક્રવાલે ચ મણ્ડલમ् । મણ્ડલં સ્યાન્મ-ણલકે, સારમેયે તુ મણ્ડલઃ ” ઇતિ વિશ્વો । ‘ યઃ ’ ‘ ધ્વાન્તાન્ત ’

( ९३ )

ध्वान्तस्य—तमसोऽज्ञानस्य वाऽन्तं—विनाशम् । “अन्तं विशुद्धे व्यापे स्यादन्तो नाशे मनोहरे । स्वरूपेऽन्तं मतं क्लीबं, न स्त्री प्रान्ताऽन्तिके त्रिषु” इतिविश्व० । “तमिस्त्रं तिमिरं तमः । ध्वान्तं भूछायान्धकारं, तमसं समवान्धतः ” इति हैमः । ‘ततान’ विस्तारयामास ‘सः’ जिनौघः—जिनानामोघः, उद्गते वहति वा ओघः, ‘न्यंकादित्वादवि कृतघत्वः साधुः,’ जिनेन्द्रसमूहः । “ओघो वृन्देऽभसां रये” इत्यमरः “ओघः परम्परायां स्या—हुतनृत्योपदेशयोः । ओघः पाथः-प्रवाहे च, समूहे च पुमानयम्” इतिविश्व० । ‘जीयात्’ जयतात् ॥५८॥

### जिनसभूहनी स्तुति—

१<sup>१</sup>लोकार्थ—जे जिनसभूहे विपुल अभि समान हेहीभ्यमान (अथवा विशाल अने निरलिमानी प्रभाणुवाणा एवा) लाभं ददना प्रकाशवटे अज्ञानदृष्टि अंधकारनो नाश कर्त्तो छे ते श्रीजिनसभूह (सर्वत्र) जयवंतो वर्तो ॥ ५८ ॥

### भारत्याः स्मरणम्—

भारति ! द्राग् जिनेन्द्राणां,  
नवनौरक्षतारिके ।

संसाराम्भोनिधावस्मा-

नवनौ रक्ष तारिके ? ॥ ५९ ॥

भारतीति—‘अक्षतारिके’ अक्षतमनुपहतं अरयः शत्रव एव कं—वारि यस्मिन् सः तस्मिन् । “कं शिरोजलमाख्यातम्” इत्यनेकार्थः । ‘संसाराम्भोनिधौ’ संसरणं संसारः स एव, अम्भांसि निधीयन्तेऽस्मिन्नित्यम्भोनिधिस्वस्मिन् भवसागरे । ‘नवनौः’ नवा प्रत्यग्रा चासौ नौश्र नूतना नौस्तद्रूपा, अथवा संबोधनम्, द्रोणी ॥

( ९४ )

“ स्त्रियां नौस्तरणिस्तरिः ” इत्यमरः । ‘ तारिके ’ समुद्धारिणि ! ‘ जिनेन्द्राणां ’ जिनवराणां, ( हे ) भारति ! वाणि ! ‘ अस्मान् ’ नः । ‘ अवनौ ’ भूमौ । ‘ द्राक् ’ शीघ्रम् । ‘ रक्ष ’ त्रायस्व । ‘ रक्ष ’ रक्षणे धातोराशिषि लिङ्गलोटावितिमध्यमपुरुषैकवचने कर्त्तरि हि प्रत्ययस्तस्य ‘ अतो हेः ( पा० ६-४-१०५ ) इति हेर्लुकि रक्षेति सिद्धम् ॥ ५९ ॥

### भारतीनी स्तुति—

**श्लोकार्थ**—अक्षत—अविनर्थर छे शत्रुउपी जप नेने विषे अंवा संसार समुद्रने विषे, नवीन नौका—नाव समान तारनारी ? हे जिनवरेनी वाणि ? हुं अम्हाइं ( आ ) पृथ्वी उपर सत्वर विलंभ रहित रक्षणु कर ॥ ५८ ॥

### श्री प्रज्ञसिद्देव्याः स्तुतिः—

केकिस्था वः क्रियाच्छक्ति—  
करा लाभानयाचिता ।  
प्रज्ञसिनूतनाम्भोज—  
करालाभा नयाचिता ॥ ६० ॥

**केकिस्थेति**—‘ केकिस्था ’ केकिनि तिष्ठतीति केकिस्था—मयूरा-रुढा । ‘ शक्तिकरा ’ शक्तिः आयुधविशेषः करे, यद्वा शक्तौ करो यस्याः सा—प्रहरणविशेषकरा । “ शक्तिरस्त्रान्तरे गौर्या—मुत्साहादौ बले स्त्रियाम् ” इति मेदिनी । ‘ अयाचिता ’ नास्ति याचितं यस्याः सा अयाचिता—अप्रार्थिता ( अभीष्टार्थप्रदा ) इत्यध्याहियते । ‘ नूतनाम्भो-जकरालाभा ’ नूतनं यदम्भोजं—कमलं तद्वत् कराला—अत्युल्बणा, भा-कान्तिर्यस्याः सा ‘ करालो दन्तुरे तुङ्गे ’ भीषणेऽप्यविधेयवत् ।

( ९५ )

‘करालो धूनतैले स्यात्करालं तु कुठेरके’ इतिविश्वा० । यद्वा नूतना-  
म्भोजकरा, अलाभा इति पृथक्पदे नूतनं—प्रत्यग्रमम्भोजं करे यस्याः  
सा, लभ्यन्ते इति लाभाः न विद्यन्ते लाभाः प्राप्तव्यार्था यस्याः सा,  
इत्यार्थ्येः । उक्तश्च—शक्तिसरोरुहस्ता, मयूरकृतयानलीलया कलिता ।  
प्रज्ञस्मिर्विज्ञस्मि, शृणोतु नः कमलपत्राभा ॥ १ ॥ इत्याचारदिनकरे ।  
‘नयाचिता’ नयेन—नीत्या, आ समन्ताचिता—व्याप्ता । ‘प्रज्ञस्मिः’  
ज्ञपनं ज्ञस्मिः प्रकृष्टा ज्ञस्मिर्धीर्थस्याः सा प्रज्ञस्मिर्देवी । ‘वः’ युष्माकं ।  
‘लाभान्’ अभीष्टार्थागमान् । ‘क्रियात्’ विदध्यात् । ‘ङुक्तश्’  
करणे धातोराशिषि परस्मैपदे प्रथमपुरुषैकवचने ‘रिः श—क्या-  
ऽशीर्ये’\* ( सिद्धहै० ४—३—११० ) इति सूत्रेण ‘रि’ इत्यादेशे-  
न क्रियादिति सिद्धम् ॥ ६० ॥

### श्रीप्रज्ञस्मिर्देवीनी स्तुति—

**श्लोकार्थ**—मथुर उपर आङ्ग थयेली तेमज्ज शक्ति नाभनुं  
आयुध छे हस्तमां लेना एवी, तथा नहि याचना कर्वा छतां  
( अलीष्टवस्तुने ) आपनारी, तेमज्ज नवीन कमल समान उत्कृष्ट  
छे कांति लेनी अथवा नवीन कमल छे हस्तमां लेना, वणी नथी  
अन्यनी अपेक्षा लेने एवी अने नीतिथी सर्वथा व्याप्त एवी प्रज्ञसि  
हेवी ( हे अविक्ष्यनो ! ) तम्हने सम्यक्त्वाहिना लाल करै ॥६०॥

### ॥ अथश्रीशान्तिनाथजिनस्तुतिः ॥

( शार्दूलविक्रीडितम् )

राजन्त्या नवपद्मरागरुचिरैः पादौर्जिताष्टापदा—

द्रेष्कोप ! द्रुतजातरूपविभया तन्वाऽर्थ ! धीर ! क्षमाम् ।

\* पृष्ठ सङ्ख्या २९२ मुनिश्रीहिमांशुविजयसंपादिताऽऽवृत्तिः । संशोधकः ।

( ९६ )

**बिभ्रत्याऽमरसेव्यया जिनपते ! श्रीशान्तिनाथास्मरो—  
द्रेकोपद्गुत ! जातरूप ! विभया तन्वार्यधी रक्ष माम् ॥ ६१ ॥**

**राजन्त्येति—‘ नवपद्मरागरुचिरैः ।’ नवं नूतनं यत्पद्मं कमलं तस्य यो रागो—रक्षिमा, यद्वा नवः प्रत्यग्रो यः पद्मरागो मणिस्तद्गुदु-चिरैश्चारुभिः, माञ्जिष्ठवर्णत्वात् । “ शोणरत्नं लोहितकं ( कः ) पद्मरागोऽथ मौक्किकम् । ” इत्यमरः । ‘ पादैः ।’ चरणैः । प्रत्यन्तपर्वतैश्च, भगवत्पक्षे पादैरितिबहुवचनं मानार्थत्वात्, प्राचीनाचार्यस्तथाविधाः प्रयोगाः स्वीकृताः, “ भवद्विंसरोरुहाणां ” ( क० श्लो० ४२ ) “ पादो मूलेऽस्तुर्यशाऽद्विषु प्रत्यन्तपर्वते ” । इति हैमः ‘ राजन्त्या ’ विभ्राजमानया । ‘ द्रुतजातरूपविभया ’ द्रुतं—विलीनं यत् जातरूपं—कनकं तद्वत् विभा—प्रभा यस्याः सा तया । “ द्रुतं शीघ्रे च विद्राणे, विलीने शीघ्रे त्रिषु ” इतिविश्व० “ चामीकरं जातरूपं, महारजत-काङ्क्ने ” इत्यमरः । ‘ क्षमां ’ क्षान्ति । ‘ बिभ्रत्या ’ दधानया । ‘ अमरसेव्यया ’ अमरैर्देवैः सेव्या—सेवनीया तया । ‘ तन्वा ’ मूर्त्या “ तनुर्देहत्वचोः स्थियाम् । तनु केशोऽपि विरले, स्वल्प-मात्रेऽपि वाच्यवत् ” इतिविश्व० ‘ जिताषापदाद्रे ! ’ जितस्तु-लितोऽर्थाद्वगणितोऽष्टापदाऽद्रिः—सुवर्णगिरिर्येन सः तस्यामन्त्रणम् । “ अष्टापदं सारिफले, हीवमस्त्री तु काङ्क्ने । शरभे मर्कटे पुंसि, चन्द्रमल्त्यां स्थियामपि ” विश्व० । उक्तञ्च—जिनागमे नामषोडशकम् । मन्दरो गिरिराजश्च, मेरुमनोरमस्तथा । स्वयंप्रभो लोकमध्यो, रत्नोच्चयः शिलोच्चयः ॥ १ ॥ सुदर्शनश्च नाभीच, सूर्यो वर्तश्च उत्तमः । सूर्यावर्णस्तथा अच्छो,—दिग्गादिरवतंसकः ॥ २ ॥ ‘ अकोप ! ’ न विद्यते कोपो यस्य स तत्संबोधने हे क्रोध-विमुक्त ! ‘ आर्य ! ( अर्य ! ) स्वामिन् ! श्रेष्ठ ! “ अर्यः स्वा-मिवैश्ययोः । पुंस्यार्यः सौविदले, स्यादार्यस्त्वभ्यहिते ” । इति**

( ९७ )

मुक्तावल्याम् । ‘धीर ! ’ संशयविपर्ययरहितां धियं राति—दत्ते धत्ते वा, धियमीरयति वा धिया राजते वा धीरः । यद्वा परीषहा-द्यक्षोभ्यत्वेन धैर्ययुक्तस्तदामन्त्रणम् । धैर्यशालिन् ! “ धीरः स्यात्पुंसि पण्डिते । धैर्यशालिनि मन्दे च त्रिषु धीरन्तु कुङ्कुमे ” इति विश्व० । जिनपते ! जिनानां—सामान्यकेवलिनां पतिः—स्वामी तदामन्त्रणम् तीर्थप्रवर्त्तकत्वात् जिनाधिप ! । ‘ अस्मरोद्रेकोपद्रुत ! ’ न स्मरो-द्रेकेण—कामवेगेन उपद्रुतः—पीडितो यस्तदामन्त्रणम् । यद्वा अस्मरो-द्रेक ! उपद्रुत ! इति पृथक्कपदे, न विद्यते स्मरस्य—कामस्योद्रेक आधिक्यं यस्य स तदामन्त्रणम् । उप समीपे द्रुतं चारित्रं यस्य स तत्संबोधनम् । “ द्रुतं स्थिरे चरित्रे च, ध्रौव्येऽनेकार्थभस्मनोः ” इत्यनेकार्थतिलकः । ‘ जातरूप ’ जातं—प्रादुर्भूतं रूपं—सौन्दर्यं यस्य सः तदामन्त्रणम्, तीर्थकृत्तामकर्मोदयात् ‘ विभय ’ ! विगत-त्रास ! । शरीरेऽपि निःस्पृहत्वात् ॥ ‘ अतन्वार्यधीः ! ’ अतनुः—विपुला आर्या—प्रशस्ता धीर्मतिर्यस्य स तत्सम्बोधनम्, प्रतिक्षणं परहितचिन्तनात् । (हे) ‘ श्रीशान्तिनाथ ! ’ श्रियोपलक्षितश्वासौ शान्तिः शान्तियोगात् तदात्मकत्वात् तत्कर्तृकत्वाचायं शान्तिः, तथा गर्भस्थेऽस्मिन् पूर्वोत्पन्नस्याऽशिवस्य शान्तिरभूदिति शान्तिः, स चासौ नाथश्वेति मध्यमपदलोपी समासः, तदामन्त्रणम् । त्वं ‘ मां रक्ष । मम रक्षणं कुरु । अत्र भगवत्तनोरष्टपदाद्रिणा श्लेषोऽपि लिङ्गव्यत्यय-विभक्तिविपरिणामेन ह्येयः । अस्मिन् पदे श्लेषालङ्कारः, यत्र शब्दे वाक्ये वाऽनेकार्थी द्योत्यन्ते तत्रायमलङ्कारः तत्था—वाग्भटालङ्कारे—पदैस्तैरेव भिन्नैर्वा, वाक्यं वक्त्येकमेव हि । अनेकमत्र यत्रासौ, ‘ श्लेष । ’ इत्युच्यते यथा ॥ ( ४—१२८ ) सोऽपि नवपद्मागहन्त्रिरैः—नवपद्मारूणमणिरूचिरैः पादैः—प्रत्यन्तपर्वतैः मूलप्रदेशे राजति ( ते ) द्रुतजातरूपविभः—प्रसृतसुवर्णकान्तिः, क्षमां—धरां, “ क्षमा

( ९८ )

क्षान्तौ क्षितौ” इति हैमः । विभर्ति, अमरसेव्यश्च ॥ ६१ ॥  
अस्मिन् पदे शार्दूलविक्रीडितं वृत्तम् । तलक्षणं प्रागुक्तम् ॥

### श्री शांतिनाथजिन स्तुति—

**श्लोकार्थ—** नवीन कमणी रक्तता अथवा नवीन पद्मराग-  
भण्डि समान शोलायमान चरणेषु वडे सुशोलित तपावेला सुवर्ण  
समान कांतिवाणा, तेमज्ज क्षमाने धारणु करनार, हेवोने सेवन  
करवा योग्य एवा शरीरवडे अत्यो छे ( नवीन पद्मरागभण्डिए  
वडे भनेहर एवी पर्वतनी भूण भूमिएथी शोलतो, तपावेला  
कांचन समान कांतिवाणे, पृथ्वीने धारणु करनारे, तेमज्ज हेवो  
वडे सेवायेदो एवा ) कनकाचल-भैरविनि क्षेषु एवा ( हे सेवमा  
तीर्थं कर ! ) हे कोधरहित ! हे स्वामिन् ! हे आर्य ( अर्थ )  
परीषङ्खादि सङ्क उरवामां धैर्यवान् अथवा भुद्धिशाणी सहभुद्धिने  
आपनार अथवा धारणु करनार वा भुद्धिवडे शोलता अथवा  
भुद्धिना प्रेरक ! हे अनेंद्र ! हे श्री शांतिनाथ ! कामहेवना वेगथी  
नहि पीडायेला एवा हे हेवाधिदेव ! अथवा अविघमान छे  
महननो उपद्रव जेने विष्ण एवा ( हे नाथ ! ) सभीप छे चारिन  
जेनुं एवा हे ( योगीश्वर ! ) उत्पन्न थयुं छे ( नैतोक्यमां  
अद्वितीय ) इप जेनुं एवा हे ( नाथ ! ) हे निर्बाय ! ( जगद्गुर ! )  
अत्यंत प्रशस्त छे भति जेनी एवा हे ( निनेश्वर ! ) तमे झुआँ  
रक्षणु करो ॥ ६१ ॥ आ तेमज्ज खीज त्रणु श्वेषें शार्दूल  
विक्रीडित वृत्तमां रचायेला छे.

---

( ९९ )

## जिनेश्वराणां विजयः ।

ते जीयासुरविद्विषो जिनवृषा मालां दधाना रजो-

राज्या मेदुरपारिजातसुमनःसन्तानकान्तां चिताः ।

कीर्त्या कुन्दसमत्विषेषदपि येन प्राप्तलोकत्रयी-

राज्या मेदुरपारिजातसुमनःसन्तानकान्ताञ्चिताः ॥ ६२ ॥

त इति—‘अविद्विषः’ विशेषण द्विषन्तीति विद्विषः न विद्यन्ते विद्विषो येषान्ते, विगताऽरयः । ‘रजोराज्या’ रजसां कुसु-  
मरेण्यनां राजिः श्रेणिस्तया परागश्रेण्या । “रजः पौष्टं परागः”  
इति हैमः ‘मेदुरपारिजातसुमनःसन्तानकान्तां’ मेदुराः—पीवरा  
याः पारिजातानां—कल्पतरूपाणां सुमनसः—कुसुमानि तासां सन्तानाः—  
समूहास्तैः कांतां—मनोहरां, अथवा पारिजातस्य सुमनसः प्रसूनानि,  
सन्तानकानि—सन्तानकपुष्पाणि च तेषामन्ता अवयवा यस्यां  
तां । “वृक्षाः कल्पः पारिजातो—मन्दारो हरिचन्दनः । सन्ता-  
नश्च” इति हैमः । “सुमनाः कुसुमे प्राङ्मे—धीरे सज्जनदेवयोः ।  
समितौ निम्बवृक्षे च” इति शब्दसिन्धुः “सुमनाः पुष्पमालत्योः—  
खियां ना धीरदेवयोः इतिमेदिन्याम् । खियः सुमनसः पुष्टं, प्रसूनं  
कुसुमं सुमं, इत्यमरः” ‘मालां’ सज्जम् । ‘दधानाः’ दधत इति  
दधानाः, ‘धा’ धातोः कर्त्तरि वर्त्तमाने शानच् । विभ्रतः । ‘कुन्द-  
समत्विषा’ कुन्देन—माघेन समा त्विट्कान्तिर्थस्याः सा तया  
कुन्दसदृशमनोहारिण्या । “कुन्दोऽच्युतेनिधौ चक्र—भ्रमौ माघे  
च” इति हैमः । ‘कीर्त्या’ अभिख्यया । “कीर्त्येशोऽभिख्या” इति  
हैमः । ‘चिताः’ व्याप्ताः । ‘प्राप्तलोकत्रयीराज्याः’ प्राप्तं लोकानां  
त्रयाः राज्यं यैस्ते प्राप्त०—प्राप्तलोकत्रयराज्यवैभवाः । ‘अपारिजात-  
सुमनःसन्तानकान्ताञ्चिताः’ अपगताः अरीणां जाताः—सन्दोहा

( १०० )

ये भ्यस्तेऽपारिजाताः ये सुमनसां देवानां सन्तानाः—समूहास्तेषां कान्ताः—मुख्ययोषितस्ताभिरञ्चिताः—पूजिताः, यद्वा सुमनसां विबुधानां सन्तानानां कान्ताः—कानां-शिरसामन्ताः प्रान्तभागास्तैरञ्चिताः, अपेर्गम्यमानत्वात्थाभूता अपि । ‘ये’ ( जिनवराः ) ’‘ईषदपि’ मनागपि । ‘न मेदुः’ मदं न प्रापुः । ‘मदि’ हर्षग्लेपनयोरितिधातोः कर्त्तरि परस्मैपदे परोक्षे लिटः स्थाने प्रथमपुरुषैकवचनम् । ‘ते’ जिनवृषाः—जिनेषु श्रेष्ठाः जिनपुङ्गवाः “वृषः शके गव्यनङ्गे, शत्रावच्युतशुक्रले । पुंराशिभेदयोः शृङ्गयां, वासुस्थाने च मूषके । केकिपिच्छे च वासाया—मरिष्टामुरधर्मयोः ॥” इति शब्दसिन्धुः ॥ ‘जीवासुः’ जयन्तु ६२

### जिनवरोनो विजय—

**१६३. कार्य—** शत्रु रहित एवा, परागनी पंडितवडे अतिशय स्तिंश्व एवा पारिज्ञतक्ना पुण्येना समूहवडे भनेहुर एवी ( अथवा अतिशय स्तिंश्व एवां पारिज्ञतक्नां पुण्येना तेमज संतानक्ना प्रांतबाग छे केमां एवी ) भावाने धारणु करनारा तथा कुंद-भोगराना कुसुमना सरणी ( १वेत ) कीर्तिवडे व्याम, वणी प्रास कुर्यां छे त्रैक्लेइचतुं साआज्ञय जेमणे, तेमज नष्ट थेवा छे शत्रु समूह केनो एवा देववर्गनी कांता—भुण्यस्त्रीएवडे भूजित अथवा शत्रुएना समूह रहित पंडित वर्गना भस्तक्ना अंत लागवडे भूनयेला ( छोवा छतां पणु ) ने जिनेंद्रोऽये किञ्चित् मात्र पणु गर्व न कर्यौ, ते जिनेश्वरो ज्यवंता वर्तो ॥ ६२ ॥

---

( १०१ )

## जिनशासनस्य स्तुतिः—

**जैनेन्द्रं मतमातनोतु सततं सम्यग् दृशां सद्गुणा—**

**लीलाभं गमहारि भिन्नमदनं तापापहृद् यामरम् ।**

**दुर्निर्भेदनिरन्तरतमोनिर्नाशि पर्युल्लुस—**

**लीलाभङ्गमहारिभिन्नमदनन्तापापहृद्यामरम् ॥ ६३ ॥**

**जैनेन्द्रमिति—‘गमहारि’ गमैरालापकैर्मनोहरं रम्यम् ।**

“गम आलापके पुंसि, मार्गे वूतान्तरे तथा । जिगीषुनृपप्रयाणेऽप-  
र्यालोचनविज्ञयोः” इति शब्दसिन्धुः । ‘भिन्नमदनं’ भिन्नो मदनः-  
पञ्चपर्येन तत् विदारितकामम् । ‘तापापहृत्’ तापं-संसारजनितं  
खेदमपहरति यत्तत् । ‘हृत्’ हरणे इत्यस्मात् किपि ‘हृस्वस्यपिति-  
कृतितु’ गितितुगागमे हृदितिसिद्धम् । ‘यामरं’ यामाः-यमा-महा-  
त्रतानि तान् राति-ददाति यत्तत् “यामौ प्रहरसंयमौ” इति  
हैमः । ‘दुर्निर्भेदनिरन्तरतमोनिर्नाशि’ दुर्निर्भेद-दुखेनभेद्यं  
निरन्तरं-निर्विवरं, आन्तरं-मनोन्तरर्भवं तमः-मोहं निर्नाशयतीत्येवं  
शीलं यत्तत् । “तमो ध्वान्ते पुंसि राहौ, गुणेऽज्ञानाऽविवेकयोः ।  
अविद्यायां तथा पापे, कूपे च नगरान्तरे ” ॥ १ ॥ इति शब्दसिन्धुः ।  
‘पर्युल्लुसलीलाभङ्गमहारिभित्’ पर्युल्लुसलीलान्-पर्युल्लुसन्ती-दीप्य-  
माना लीला येषान्ते पर्युल्लुसलीलास्तान् प्रोल्लुसद्विलासान् “लीला  
विलासो विच्छिन्नतिः” इति हैमः । अभङ्गान्, न विद्यते भङ्गः-पराजयो  
येषां तानजेयान् महारीन्-महान्तश्च तेऽरयश्च रागद्वेषादयस्तान् महा  
प्रतिपक्षान् भिनत्ति यत्तत् । ‘नमदनन्तापापहृद्यामरं’ नमन्तः-प्रणामं  
कुर्वन्तोऽनन्ताः-अपरिमिताः अपापाः-गतपापाः हृद्या-मनोहराः  
अमरा-देवा यस्य तत्, ‘जैनेन्द्रं’ जिनेन्द्राणामिदं जैनेन्द्रं ‘तस्ये-  
दमि’ त्यण्, आदिस्वरस्य वृद्धिः । जिनेन्द्रप्रणीतं । ‘मतं’ दर्शनम् ।

( १०२ )

‘ सम्यग्दृशां ’ सम्यग् दृग् येपान्तेषां अविपरीतमतीनाम् । अर्थात्स-  
म्यग् दृष्टीनाम् । तदुक्तं-या देवे देवताबुद्धि-र्गुरौ च गुरुतामतिः । धर्मे  
च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥ १ ॥ तथा—जीवाह नवप-  
यत्थे, जो जाणाह तस्स होइ सम्मतां । भावेण सहहंतो, अयाणमाणेवि  
सम्मतं ॥ २ ॥ “ जीवादिनवद्पार्थीन्, यो जानाति तस्य भवति  
सम्यक्त्वम् । भावेन श्रद्धानस्य, अजानानस्यापि सम्यक्त्वम् ॥ ” १  
‘ सद्गुणालीलाभं ’ सतां—साधूनां गुणानामाली आवली तस्याः लाभं,  
‘ सततं ’ निरन्तरं, ‘ आतनोतु ’ प्रथयतु ॥ ६३ ॥

### जिनभतनी स्तुति—

‘ द्वेषाकार्थ—आतापडे । ( सदृशपाठी ) ए इरीने भनेहुर,  
खेडी नाख्येए छे रतिपति—कामहेव नेण्ये, ( भवष्ट्रभण्टुपी ) संता-  
पने हुरनार, तेमज भहावतोने आपनार, वणी हुर्देघ तथा  
अंतर रहित अर्थात् अतिशय गाठ एवा आंतरिक अज्ञानदृप  
अंधकारने । अत्यंत नाश हुरनार, उद्य पामता छे विदास्ते नेना  
एवा हुर्व्य-हुःभेथी छुती शकाय एवा ( राग देष विगेह ) भहा  
शत्रुचेनो संहार हुरनार, प्रणाम हुरनारा छे अनंत अने वि-  
शुद्ध तेमज भनेहुर हेवो नेने एवा जिनेद्र संबंधि अर्थात्  
तीर्थं करे प्रदेषेवा सिद्धांत, सम्यग्दृष्टि आत्माएने हुमेशां ( क्षमा  
आदिक ) सहगुणेणी श्रेष्ठीने लाभ करे ॥ ६५ ॥

### श्रीब्रह्मशान्तियक्षस्य स्तुतिः—

दण्डच्छत्रकमण्डल्द्वनि कलयन् स ब्रह्मशान्तिः क्रियात् ,  
सन्त्यज्यानि शमी क्षणेन शमिनो मुक्ताक्षमाली हितम् ।  
तसाषापदपिष्टपिङ्गलरुचिर्योऽधारयन्मूढतां ,  
सन्त्यज्यानिशमीक्षणेन शमिनो मुक्ताक्षमालीहितम् ॥६४॥

( १०३ )

दण्डेति—‘ शमिनः । शमोऽस्यास्तीतिशमी तस्योपशमयुक्तस्य  
कस्यचिन्मुनेः । ० अनिशं । निरन्तरं । ‘ ईक्षणेन । आलोकनेन ।  
‘ मूढतां । मूढस्य भावस्तामज्जताम् । ‘ सन्त्यज्य । सम्यक् त्यक्त्वा ।  
‘ मुक्ताक्षमालीहितम् । मुक्ता—त्यक्ता अक्षमा—अशान्तिर्येस्ते मुमुक्षव-  
स्तेषामाली—परम्परा तस्या, ईहितं—इष्टम् । ( यः ) ‘ अधारयत् ।  
धृतवान् । ‘ सः । ‘ सन्ति । शोभनानि । ‘ अज्यानि । न विद्यते  
ज्या—हानिर्जरा वा येषां तानि, अज्यानि, देवताधिष्ठितत्वात्तसंभवः ।  
अहीनानि शाश्वतानीत्यर्थः—‘ दण्डच्छत्रकमण्डलूनि । दण्ड आषाढः—  
ब्रतिदण्डः, छत्रं—आतपत्रं, कमण्डलु—कुण्डिका तानि कलयन्,  
कलयतीतिकलयन्, वर्तमाने शत्रुप्रत्ययः । ‘ शमी । प्रशमवान् ।  
‘ इनः । प्रभुः । “ इनः सूर्ये प्रभौ राजा ” इत्यमरः । ‘ मुक्ताक्षमाली ।  
मुक्ताक्षमालानामक्षमाला जपमाला विद्यते ऽस्यासौ मुक्ताक्षमाली—मौक्ति-  
काक्षमालावान्, “ शुक्तिं मौक्तिं मुक्ता ” इति हैमः । ‘ तपाष्टापदपि-  
ण्डपिङ्गलस्त्वचिः । तप्तं—द्रुतं यदष्टापदं—कनकं तस्यपिण्डः—गोलकर्तद्वत्पि-  
ङ्गला—पितरक्ता स्तुतिः—युतिः यस्य सः, “ पितरक्तस्तु पिञ्चरः । कपिलः  
पिङ्गलः इयावः, पिशङ्गः कपिशो हरिः ॥ बभ्रुः कदुः कडारश्च, पिङ्गे ॥  
इति हैमः । “ पिङ्गलो मर्कटे वन्हौ, निधिभेदाऽहिभेदयोः । यक्षोल्के  
चित्रके च, वर्षभेदे च शङ्करे ॥ १ ॥ छन्दोप्रन्थेऽर्कपार्श्वस्थे, मुनौ च  
स्थावरे विषे । हरितालारयोः क्षीवे, त्रिषु च स्वर्णवर्णवत् ॥ २ ॥  
खियां वेश्याविशेषे च, हस्तिन्यां कुमुदखियाम् । नाडीभेदे शिशपायां,  
ज्योतिष्का रोचनाऽपि च” ॥ ३ ॥ इति शब्दसिन्धुः ‘ ब्रह्मशान्तिः ।  
ब्रह्मशान्तिनामा यक्षः । ‘ क्षणेन । वेगेन यथा तथा ( अज्यानि )  
‘ शं । ( अक्षयं ) सुखम् । “ क्षीवे शं श्रेयसि प्राहुः, सुखे चास्ति शम-  
व्ययः । शःप्रोक्तः शङ्करे शखे, शं वदन्त्यक्षरं बुधाः ॥ ४ ॥  
इति शब्दसिन्धुः ‘ क्रियात् । विधेयान् ॥ ६४ ॥

( १०४ )

## अल्पयक्षनी स्तुति—

**१६ोऽकार्थं—**उपशमयुक्ता एवा केऽधिक मुनिवरतुं निरंतर दर्शनं करवाथी अज्ञानताने तत्र धृते त्यागं कर्त्त्वे छे द्वीपं ज्ञेयं एवा मुमुक्षु-साधुपुद्घेणी श्रेष्ठिने अभीष्टं एवा डितने ने यक्षं धारणुं करते होते ते शोकनीयं अने हानि रहितं एवां दृढं छत्रं अने कमं लुने धारणुं करनारं तेमज्ज उपशमयुक्ता, प्रभु-स्वामी, तथा मैतीश्चानी जपमाला ज्ञेयं धारणुं करी छे अने तपावेदा सुवर्णं नापिंड समानं पीणी अने लालं कृतिवाणीं अक्षयाणांति ( नामने यक्षं ) छे लव्यो! तमने क्षण्णमात्रमां ( शाश्वत ) सुखं आपो ॥ ६४ ॥

## १७ श्री कुन्थुनाथाजिनस्तुतयः ।

**अथ श्रीकुन्थुनाथाय-नमस्कृतिः ।**

**मवतु मम नमः श्रीकुन्थुनाथाय तस्मा-**

**यमितशमितमोहायामितापाय हृद्यः ।**

**सकलभरतभर्त्ताऽभूजिनोऽप्यक्षपाशा-**

**यमितशमितमोहा यामितापायहृद्यः ॥ ६५ ॥**

**भवत्विति—**‘ यः ’ जिनेन्द्रः । ‘ हृद्यः ’ हृदयहारी । ‘ सकल-भरतभर्त्ता ’ सकलस्य-पट्टवण्डलक्षणस्य भरतस्य भर्त्ता—अधिपति-शक्रवर्त्ती । “ भर्त्ता स्वामिनि विष्णो च, धारके श्रेष्ठिनि नृपे । इति शब्दसिन्धुः । ‘ अमितापायहृत् ’ । अमिताश्रते अपायाश्र क्षेशास्तान् हरतीत्यमितापायहृत् । ‘ जिनः ’ ‘ अपि ’ अपि: समुच्चयार्थं, यद्वाऽपिशब्दोऽत्र यः सकलभरतभर्त्ता स कथं जिनःस्यादिति विरोधयोतकः चक्रवर्त्ती भूत्वा जिनो जातः वीतरागोऽपि “ अपि: सन्देहप्रश्ने च, संभावनाऽवधारणे । कामचाराऽनुज्ञाऽल्पे, निश्चयेऽशक्य उद्यमे ॥ १ ॥ समुच्चये च निन्दायां ” इति शब्दसिन्धुः ।

( १०५ )

अभूत-आसीन् । ‘‘ भू ’ सत्तायामिति धातोरद्यतन्यां लुडि प्रथम पुरुषैकवचनं कर्त्तरि । ‘तस्मै’ तथाविधाय । ‘अमितशमितमोहायामितापाय’ अमितः—अपरिमितः, शमितः—शमं नीतः । मोहस्य—मोहनीयस्य । आयामी—दीर्घः तापः—दवथुः येन स तस्मै । ‘अक्षपाशायमितशमितमोहाय’ अक्षपाशैः—अक्षाण्येव पाशा इति कर्मधारयस्तैः—इन्द्रियरज्जुभिरयमिताः, यमिता न भवन्तीत्ययमिता इति प्रसव्य-प्रतिषेधोऽयम्, “पर्युदासः सदृग्ग्राही, प्रसव्यस्तु निषेधकृदिति” हरिकारिकायाम् । अबद्वा ये शमिनो मुनयस्तेषां तमोऽज्ञानं हन्ति तस्मै । ‘श्री कुन्थुनाथाय’ श्री कुन्थुनाम्ने जिनवराय, कौ पृथिव्यां स्थितिरस्त्यस्येति पृषोदरादित्यात्साधुः । “क्षोणिः क्षितिः क्षमाऽनन्ता, ज्याकुर्वसुमती मही” इति हैमः । ‘मम’ मत्सम्बन्धी । ‘नमः’—नमस्कारः । ‘भवतु’ अस्तु ॥ ६५ ॥

### श्री कुंथुनाथने नमन—

‘**क्षेत्रार्थ**—जे भनोङ्गर एवा कुंथुनाथ समस्त भरतक्षेत्रना स्वाभी अर्थात् चक्रवर्ती’ डोवा छतां अनेक क्लेशोने हँडे कृ-नारा तीर्थं कर पछु थया, ते श्री कुंथुनाथ के जेमणे अपार भोङ्गा विस्तार पाभेला संतापनो नाश कर्या छे, तेमन् जेओ ईद्रियदृपी रञ्जु (होरडा) वडे नहि अंधायेला अने एज कार-छुथी उपशमयुक्त एवा ज्ञेनाना अज्ञानदृपी अंधकारनो नाश करनारा छे, ते कुंथुनाथने वारंवार नमन डो ॥ ६५ ॥ आ **क्षेत्र** तथा आ पठीना त्रण **क्षेत्रार्थां** भालिनीवृत्त छे ॥

( १०६ )

## समस्तजिनवराणां नमस्कृतिः—

**सकलजिनपतिभ्यः पावनेभ्यो नमः सन्-**

**नयनरवरदेभ्यः सारवादस्तुतेभ्यः ।**

**समधिगतनुतिभ्यो देववृन्दाद्वरीयो—**

**नयनरवरदेभ्यः सारवादस्तु तेभ्यः ॥ ६६ ॥**

सकलेति—‘पावनेभ्यः’ पावयन्तीति तेभ्यः पावनेभ्यः—  
 पवित्रेभ्यः ( पवित्रताजनकेभ्यः ) “ पवित्रं पावनं पूतं ” इति  
 हैमः ‘सन्नयनरवरदेभ्यः’ नयनानि च, रवश्च—देशनाध्वनिः,  
 रदाश्च—देशनास्तेषां समाहारो नयनरवरदं प्राणितुर्याङ्गाणाम्  
 ( सिद्ध० है० ३—१—१ ३७ ) इति प्राण्यज्ञन्त्वादेकवद्धावः । सत्—  
 शोभनं नयनरवरदं येषां ते तेभ्यः । अत्राऽरविन्दशोभान्यकारत्त्वेन  
 नयनयोः, हिंगधगम्भीरघोषत्त्वेन योजनगामित्वेन च देशनाध्वनेः,  
 मण्यादितिस्कारत्त्वेन च दशनानां शोभनत्वं ह्येयम् । ‘सारवाद—  
 स्तुतेभ्यः’ सारोऽर्थप्रधानः, वादः—उक्तिर्घेषां ते तैर्विद्वद्द्विः स्तुताः  
 तेभ्यः । सारेण वादेन स्तुतेभ्यो वा । ‘सारवान्’ आरवेण सह—  
 वर्तत इति सारवस्तस्मात् सशब्दात्—स्तुतिपरायणादिति यावत् ।  
 समारब्धस्तुतित्वात् । ‘देववृन्दात्’ सुरसमूहात् । अत्र सामान्यदेव—  
 शब्देन चतुर्निकायदेवा वेदितव्याः “ वृन्दं कलापः स्तोमश्च, समूहः  
 पुञ्ज उत्करः । सन्दोहश्च समुदयः, संघातगणराशयः ॥ १ ॥ चयः  
 प्रकर ओघश्च, निकरश्च कदम्बकम् । चक्रवालं च पटलं, कूटं जातं  
 च मण्डलम् ॥ २ ॥ निकुरम्बं च जालं च, समवायश्च सञ्चयः ।  
 निवहो विसरो ब्रातः, ब्रजश्च चक्रपेटके ॥ ३ ॥ व्यूहश्च समुदायश्च,  
 बारश्च संहतिः स्थियाम् ।” इति शब्दसिन्धुः । ‘समधिगतनुतिभ्यः’  
 समधिगता—प्राप्ता नुतिः—स्तुतिर्थेस्ते तेभ्यः । ‘गरीयो नयनरवरदेभ्यः’  
 अतिशयेन गुरवः गरीयांसो नया—नीतयो येषां ते ये च नराः—मनु-

( १०७ )

जास्तेषां वरदेभ्यः—वरं—वाङ्गिलं ददति ते वरदास्तेभ्यः “ देवाद्-  
वृते वरः श्रेष्ठे, त्रिषु हीवं मनाक्रिप्रये । ” इत्यमरः । ‘ तेभ्यः ’ प्रसि-  
द्धेभ्यः । अत्र तच्छब्दः प्रसिद्धार्थवाचकस्वाच्छब्दं नाऽपेक्षते ” ।  
यदुक्तम्—“ प्रक्रान्ताऽनुभूतार्थविषयस्तच्छब्दो यदुपादानं नापेक्षते ” ।  
‘ सकलजिनपतिभ्यः ’ समस्तजिनवरेभ्यः । ‘ नमः ’ प्रणतिः,  
‘ अस्तु ’ भवतु ॥ ६६ ॥

### जिनेन्द्रोने प्रणाम—

१६५—पवित्र ( अथवा पवित्र करनारा ) वली कमलनी  
शोलाने श्रुतवाथी उत्तम छे नेत्र, तेमज गंभीर अने चेजनगामी  
छेवाथी ( देशना समयने ) ध्वनि अने उत्तम प्रकारना भणिएनी  
शोलाने श्रुतवाथी हन्त-हांत जेमना, वर्णी सारलूत छे वाह-  
वयन जेमनां ऐवा विद्वानोपठे स्तुति करायेला अथवा अर्थं  
प्रधान वाक्यो वडे स्तुति करायेला, तेमज स्तुतिने समारंभ  
करवाथी शष्टिधायमान—शष्टि करता ऐवा हेव सभूहुथी ग्रास थैछे  
स्तुति जेमने ( अर्थात् हेवेना पञ्च स्तुतिपात्र ) ऐवा, श्रेष्ठ छे नीति  
जेमनी ऐवा अने उत्तम ज्ञेनाने भनेवांछित आपनार, ऐवा ते  
समय जिनेश्वरोने झडारा प्रणाम छे ॥ ६६ ॥

### सिद्धान्तस्मरणम् ।

स्मरत विगतमुद्रं जैनचन्द्रं चकासत्—  
कविपदगमभङ्गं हेतुदन्तं कृतान्तम् ।  
द्विरदमिव समुद्घानमार्गं धुताधै—  
कविपदगमभङ्गं हे तुदन्तं कृतान्तम् ॥ ६७ ॥

स्मरतेति—‘ हे ’ ( लोकाः ! ) ‘ विगतमुद्रं ’ विगता मुद्रा—

( १०८ )

इयत्ता=मानमितियावत्, यस्मात्स तं—विगतप्रमाणम् । “ मुद्रा माने च निष्के च, पिधाने चाङ्गुलीयके । लिप्यां चाङ्गुलिविन्यासे, आङ्गुतौ कर्णभूषणे ॥ १ ॥ संकोचने च ” इति शब्दसिन्धुः । ‘जैनचन्द्रं’ जिनचन्द्रसम्बन्धिनं । ‘चकासत्कविपदगमभङ्गं’ चकासन्तः—शोभमानाः, कविपदानि—कवेहृत्प्रेक्षाद्यलङ्घारव्यञ्जयसूचकानि पदानि कविपदानि—कवियोग्यशब्दाः, गमाः—सदृशपाठाः, भङ्गाश्च—एकद्वित्र्यादिपदसंयोगादुत्पन्नाः विकल्पत्राता यस्मिन् तं । ‘हेतुदन्तं’ हेतवः दृष्टान्ता एव प्रतिपक्षभेदकत्वात् दन्तौ—विषाणौ यस्य तम् । ‘समुद्यदानमार्गं’ समुद्यन—समुङ्गसन् दानमार्गो—ज्ञानादीनां वितरणकमो यस्मिन् तम् । सम्यग्ज्ञानेन मोक्षप्रदायकत्वात् ‘धुतावैकविपदगं’ अघा एवैकविपदस्तेव अगास्तरवो धुता येन सः तम् । धुतः—नाशितः अघः—पापं यस्य तत् तथाभूतभेदकमद्वितीयं विशिष्टं पदं—स्थानं तत् प्रतिगच्छतीति धुतावैकविपदगस्तमिति वा । ‘अभङ्गं’ न विद्यते भङ्गो यस्य तं । अजेयं ‘कृतान्तं’ अन्तकम् । मरणमिति यावत् । “ कृतान्तो यमसिद्धान्तेऽशुभे कर्मणि च द्विके । दैवे पापे भरण्यां च, शनिश्चरग्रहे तथा ” ॥ १ ॥ इति शब्दसिन्धुः । ‘तुदन्तं’ पीड्यन्तम् । एतत्प्रतिपादिताऽनुष्ठानविधायकजनस्य भवत्रहणाभावान्मरणाभावः । ‘कृतान्तं’ सिद्धान्तम् । ‘द्विरदमिव’ गजमिव । ‘स्मरत’ ध्यायत । ‘स्मृ’ चिन्तायामितिधातोः कर्त्तरि परस्पैपदे लोटोमध्यमपुरुषवहुवचनम् । यूयमितिशेषः । अत्र द्विरदेन सह श्लेषः, सोऽपि विगतमुद्रः—अपेतमर्यादः स्वच्छन्दचारी भवति । तस्याऽपि पदगमभङ्गाः कवे: वर्णयितुं योग्याः—पदप्रचारकमाश्चकासति । दन्ताश्च भवन्ति । दानमार्गः—मदप्रवाहः समुदेति, सोऽपि अगं—वृक्षं धुनोति, अभङ्गश्च, कृतान्तं—कृतनाशं विपक्षादिकं तुदति, तदेवं द्विरदमिव हे भव्याः ? जैनचन्द्रं कृतान्तं स्मरतेयन्वयः ॥६७॥

( १०९ )

## सिद्धान्तनुं स्मरण्—

**१. शोकार्थ—**अत्यंत विशाग, शोलायमान, कविओने वर्ण्णन  
 करवा लायक छे चरणुनी चालनी रचना जेनी, ( शत्रु सभूहनो  
 नाश करवामां ) कारणभूत छे दांत जेना, शोलि रहो छे भद-  
 जलवड मार्ग जेनाथी ऐवा, तथा नष्ट थयुं छे पाप जेतुं,  
 ( पुण्यशालि भनुष्योना ) अद्वितीय स्थानप्रति गमन करनार,  
 तेमज विनाश करनाराओने पीडा करनार, हस्ति समान अपरि-  
 भित, प्रकाशमान छे कवि योग्य पढो, ( उत्प्रेक्षाहि अदांकार व्यंग  
 सूचक पढो ) आलापडो अने रचनाएँ जेनी ऐवा, ( ऐष्ट  
 आहि दर्शनोतुं खंडन करवामां ) हेतुरूप छे दांत जेना, देही-  
 ध्यमान छे ( ज्ञान आहिनो ) हानमार्ग जेनो, तेमज विनाश  
 कर्यो छे पापरूपी असाधारण आपत्तिरूप वृक्षनो जेण्ये, अनेय-  
 नहि उत्ती शक्तय ऐवा, अने यम—मरणुने पीडा करनारा, ( सिद्धां-  
 तना आराधकोने पुनः जन्मभरणुनो अखाव होवाथी ) जिनयंद  
 विषयक सिद्धान्तनुं हे लब्ध्यलोडो ! तमे स्मरण करो ॥ ६७ ॥

---

## श्रीपुरुषदत्तायै प्रार्थना—

**प्रचलदचिररोचिश्चारुगात्रे ! समुद्घत-**

**सदसि फलकरामेऽभीमहासेऽरिभीते ! ।**

**सपदि पुरुषदत्ते ! ते भवन्तु प्रसादाः,**

**सदसि फलकरा मेऽभीमहासेऽरिभीते ! ॥ ६८ ॥**

**प्रचलदिति—**‘ प्रचलदचिररोचिश्चारुगात्रे ! ’ प्रचलन्ती—  
 प्रकर्षेण चलन्ती—परितःस्फुरन्ती या अचिररोचिः अचिरा  
 रोचिर्यस्याः सा—विद्युत् तद्रत् चारु—मनोहरं गात्रं यस्याः सा  
 तदामन्त्रणम्, सुन्दराङ्गि ! । ‘ समुद्घत्सदसिफलकरामे ! ’ समुद्घन्ती

( ११० )

प्रोल्लसन्ती ये सती—शोभने असिफलके—खड्गचर्मणी ताम्यां रामे !  
रमणीये ! । ‘अभीमहासे !’ अभीमः—सौम्यः हासो यस्याः सा  
तत्सम्बोधने हृद्यहसने ! । ‘अरिभीते !’ अरिभ्यः भीः अरिभीस्तस्या  
ईतिरिव ईतिस्तत्संम्बोधने हे ईतीभूते ! उपमेयं व्याघ्रादैः सामान्या-  
इनुक्तौ’ (सिद्ध० है० ३-१-१०२) इत्युपमित्युत्तरपदसमाप्तः ।  
“इतिरुपद्रवे स्त्रीत्वे, अतिवृष्ट्यादि पट्सु च । प्रवासे डमरे चैव,  
कृषेरुपालवे गतौ” ॥ १ ॥ इतिशब्दसिन्धुः । ‘अतिवृष्टि—रनावृष्टि—  
मूषकाः शलभाः शुकाः । प्रत्यासन्नाश्च राजानः, षडेता ईतयः स्मृताः’  
॥ २ ॥ ‘अभीमहासेरभीते !’ अभीरविद्यमानभया या महासेरभी—  
महामहिषी तामिते ! प्रामे ! “लुलायो महिषो वाह—द्विषत्कासर  
सेरिभाः” इत्यमरः । “लुलायः सेरिभो (सैरिभो) महः” इति हैमः ।  
सीरिभिर्दन्तेर्भाति सीरिभः—कुटंबी तस्याऽयमिति—अथवा सीयते—  
बध्यते इति सैरिभिः “सिटिकिभ्यामिभः सैरटिद्वौ च” (सि. उणा.  
३३२) इति साधुः ‘हे पुरुषदत्ते !’ पुरुषेषु दर्त्तं यस्याः सा पुरुषदत्ता  
तदामन्त्रणे हे पुरुषदत्ते ! (देवि ! “दत्तं विश्राणितेऽविते” इति विश्व०  
पुरुषाप्रदत्तानरदत्तेति नामान्तरे स्तोत्रादिषु दृश्येते । ‘ते’ तव ‘प्रसादाः’  
अनुग्रहाः । “प्रसादोऽनुग्रहे काव्य—गुणस्वास्थ्यप्रसन्निषु” इति-  
मेदिनी । ‘सदसि’ सभायाम् । “सभा समज्या परिषत्—समाजः  
पर्षत् सदः । समितिश्च घटाऽस्थानी, गोष्ठ्यास्था संसदस्तथा ॥ १ ॥  
नपुंसके तु चास्थानं, स्त्रीनपुंसकयोः सदः” । इति शब्दसिन्धुः ।  
‘सपदि’ तत्क्षणम् । ‘मे’ मम । ‘फलकरा’ कार्यसिद्धिविधा-  
यिनः । ‘भवन्तु’ सन्तु ॥ ६८ ॥

पु॒ष्पहता देवीने अ॒भ्यर्थना—

१द्वैकार्थ—स्तुरायमान सैदाभिनी—विज्ञी समान भनेत-  
हुर देहवाणी हे देवि ! देहीयमान तेभज उत्तम एवा अर्जु

( १११ )

अने ऐटक-दावपडे रमणीय अवी हे विद्यादेवि ! नथी ( अन्य जनोने ) लयंकर हास्य जेतुं अवी हे महादेवी ! शत्रुओऽतरझना लयप्रति धति-उपद्रव समान हे नरदत्ता ! हे निर्बाध ! अने भेणी भिणी उपर आळू थेली ( पुढेषाथदत्ता, नरदत्ता ) हे पुढपदत्ता ! त्हारा प्रसादो झुने सभामां सत्पर-ज्ञवदी इलहायक थाच्यो ॥ ६८ ॥

---

## १८—श्रीअरजिनस्तुतयः ।

अथश्रीअरनाथाय प्रणतिः—

व्यमुच्चचक्रवर्त्तिलक्ष्मीमिह तृणमिव यः क्षणेन तं,  
सन्नमदमरमानसंसारमनेकपराजितामरम् ।  
द्रुतकलधौतकान्तमानमतानन्दभूरिभक्तिभाव्,  
सन्नमदमरमानसं सारमनेकपराजितामरम् ॥६९॥ ( द्विपदी )

व्यमुच्चचक्रेति—‘यः’ प्रभुः । ‘अनेकपराजितां’ अनेकपाः अनेकाभ्यां—मुखशुण्डाभ्यां पिबन्तीत्यनेकपाः—करिणस्तैश्चतुरशीतिलक्ष्मीपरिभितगजै राजितां—विभूषिताम् । ( अनेकैः परैः—शत्रुभिरजितामपराजिताम् ) ‘चक्रवर्त्तिलक्ष्मी’—चक्रेण—चक्रायुधरत्नेन वा वर्त्तत इति चक्रवर्ती ‘ग्रहादिभ्यो णिन्, ( सिद्धहै० ५—१—५३ ) इति णिनिस्तस्य, चक्रधरस्य लक्ष्मी—संपदं, “चक्रवर्ती चक्रवाके, सार्वभौमे गणे तथा । श्रेष्ठे चक्रे च, इति शब्दसिन्धुः । इह—अत्र लोके । ‘तृणमिव’ तृणवत् । ‘क्षणेन’ सपदि । ‘व्यमुचन्’ त्यक्तवान् । ‘तं’ यत्तदोर्नित्यसम्बन्धात्—तथाभूतम् । ‘सन्नमदमरमानसंसारं’ सन्नः—क्षीणो मदश्च—जात्यादिकः मरश्च मृतिः, मानश्च संसारश्च यस्य तम् । ‘द्रुतकलधौतकान्तं’ द्रुतं—विलीनं यत्कलधौतं—कनकं तद्रुतकान्तं—मनोहरम् । “कलधौतं कलारावे, क्षीवं कनकरूपययोः इति विश्व० ।

( ११२ )

‘ आनन्दितभूरिभक्तिभाक्षसन्नमदमरमानसं ’ आनन्दित—आहादितं  
 भूरिभक्तिभाजां भूरिश्चासौ भक्तिश्च तां भजन्ति तेषां प्रभूतभावशा-  
 लिनां सन्नमताममरणां मानसं मनो येन तम् । ‘ सारं ’ श्रेष्ठम् ।  
 ‘ अनेकपराजितामरं ’ अनेके पराजिताः, दिग्विजयादिप्रकमेऽमराः—  
 मागधादिदेवा येन तम् । ‘ अंरं ’ अरनाथं, गर्भस्थेऽस्मिन्मात्रा सर्व-  
 रत्नमयोऽरो निरीक्षित इत्यरस्तम् । “ अरोजिनेऽरं चक्राङ्गे, शीघ्रशीघ्र  
 गयोरपि ” इत्यनेकार्थः । सर्वोत्तमे महासत्त्व—कुले य उपजायते ।  
 तस्याऽभिवृद्धये वृद्धै—रसावर उदाहृतः ॥ ६९ ॥ अस्मिन् पदे  
 द्विपदी छन्दः, तल्लक्षणश्च—षश्चुगौ द्वितीयषष्ठौ जोलीर्वाद्विपदी, अष्टा-  
 विंशतिमात्रकमिदं वृत्तं, तत्राद्य एको गणः षण्मात्रकः, पञ्च चतुर्मात्रा  
 एको गुरुश्च तेषां द्वितीयषष्ठौ जगणौ लघुरूपौ वा ।

### श्री अरनाथने प्रणाम—

१. लोकार्थ—**જેમણે આ જગતમાં અનેક હાથીઓએ શોભતી,**  
**અથવા અનેક શત્રુઓએ ( પણ ) અણુત—પરાજય ન કરી શકાય**  
**તેવી ચંકવતીની લક્ષ્મીનો એક ક્ષણમાં તૃણુની માઝે ત્યાગ કર્યો,**  
**તે અરનાથને કે જેણે મદ, મરણ, માન અને ( ભવભ્રમણ-  
 ઇપી ) સાંસારનો નાશ કર્યો છે, કે સુવર્ણ સમાન કાંતિવાળા**  
**છે, જેમણે મહા લક્ષ્મિવત ( હેઠા�ે લીધે ) પ્રણામ કરનારા**  
**હેવોના ચિત્તને આનંદ પમાદ્યો છે, કે શ્રેષ્ઠ છે, અને ( છ**  
**ખંડ સાધતી વેળાએ ) જેણે ( માગધ તીર્થ કુમારાદિ ) અગ-  
 ણિત હેવોના પરાજય કર્યો છે, તે ( અદારમા તીર્થંકરને ) ( હે**  
**લઘ્યાત્માએ ! ) તમે શીત્ર પ્રણામ કરો ॥ ६९ ॥ આ १. લોકમાં**  
**તથા પણીના વણુ १. લોકમાં ( દ્વિપદી ) નામનો છંડ છે, તેનું**  
**લક્ષ્મણ—આ છંડમાં પહેલાં એક છ માત્રાનો ગણુ પણી ચાર માત્રા-  
 વાળા પાંચગણુ અને અંત્ય વર્ણ ગુરુ હોય છે અથાત् એકંદર એકેંક**

( ११३ )

પાદમાં અહૃતીશ માગ્રાયે। છે તેમાં ખીલે અને છુટો ભધ્ય ગુરુ  
જગતું અથવા ચારે લધુ હોય તે દ્વીપદી છંદ કહેવાય છે—

## जिनवराणां प्रणमनम्--

स्तौति समन्ततः स्म समवसरणभूमौ यं सुरावलिः,  
सकलकलाकलापकलिताऽपमदाऽस्थणकरमपापदम् ।  
तं जिनराजविसरग्गुञ्जासित जन्मजरं नमाभ्यहं,  
सकलकला कलाऽपकलिताप मदारुणकरमपापदम् ॥७०॥

**स्तौतीति—**‘सकलकलाकलापकलिता’ सकलाः—समस्ताश्च ताः  
कलाश्च—विज्ञानानि, “कला तु मूलरैवृद्धौ, पोड़जांशो कलानिधेः । त्रिंश-  
त्काष्ठात्मके काले, सूक्ष्मांशो सर्ववस्तुनः ॥ १ ॥ मनःशिलायां शिल्पे  
चै—कस्मिन्मांसादिधातुषु । कलने च कला प्रोक्ता, ” इतिशब्दसिन्धुः ।  
तासां कलापः—समूहः, “ कलापः संहतौ बहें काङ्क्षयां, भूषणतूणयोः ।  
चन्द्रे विदधे व्याकरण—भेदेऽपि कथ्यते ब्रुधैः ” । इति मेदिनी ।  
तेन कलिता—समन्विता । ‘अपमदा’ अपगतो मदो यस्याः सा—  
विगताऽभिमाना । ‘सकलकला’ कलकलेन सहवर्त्तते सा सकल-  
कला—सकोलाहला “ पुंसि कोलाहले सर्ज—रसे कलकलः स्मृतः ” ।  
इति विश्र० । ‘कला’ मधुरा । ‘सुरावलिः’ । सुराणां श्रेणिः । ‘यं’  
जिनराजविसरं । ‘समवसरणभूमौ,’ समवसरणस्य भूमिस्तस्यां  
समवसृतिक्षितौ । ‘समन्ततः’ सर्वतः । ‘स्तौति स्म’ षट्कृत्सुतौ  
धातोर्वर्त्तमाने परस्मैपदं स्मयोगे भूतार्थता वक्तव्या । वन्दते स्म ।  
‘तं’ ‘अरुणकरं’ आताम्रकरं, सामुद्रिके सत्पुरुषाणां करक्रमा-  
रक्तत्वेन वर्णिताः । ‘अपापदं’ अपगता आपदो यस्मात्सः तं—  
विगतपापविपदम् । ‘उज्जासितजन्मजरं’ जन्म च जरा च

( ११४ )

जन्मजरे—उज्जासिते जन्मजरे येन तम् । ‘अपकलितापं’ अपगतौ कलिश्च तापश्च तौ यस्य तम् , अथवाऽपगतः कलेः—कलिकालस्य कलहस्य वा तापः—सन्तापो यस्मात्स तम् । ‘अदारुणकरं’ न दारुणमदारुणमरौद्रं तत्करोति यस्तम् । ‘अपापदं’ नपापमपापं—पुण्यं तत्प्रददाति तम् । ‘जिनराजविसरं’ जिनेन्द्राणां कदम्बकं, “समूहोनिवहव्यूह—सन्दोहविसरब्रजाः” इत्यमरः ‘अहं ‘नमामि’ नमस्करोमि ॥ ७० ॥

### जिनवरैने नभन.

**श्लोकार्थ**—सभय ( विज्ञानादिक ) कलाओना समूहथीयुक्त, तेमज त्याग कर्यो छे अभिमाननो क्षेषु, एवी वणी ( उच्च स्वरे स्तुति कर्ती हेवाथी ) केलाहुले करीने युक्त, तेमज ( मधुर स्वरे करीने ) मधुर एवी देवपंक्ति जिनसमूहनी सभवस-रथुमां चारे द्विशाओमां स्तुति कर्ती हुती एवा, तेमज रक्त छुस्तवाला, पुष्यने आपनार, नाश कर्यो छे जन्म अने जरानो क्षेषु वणी हर कर्यो छे कलह अने संताप क्षेषु, अथवा कलियुगनो संताप क्षेषु एवा, अथं कर कार्यथी हर रहेनारा अने निर्भूत थै छे विपत्तिए वेनी अथवा वेनाथी एवा ते जिनेंद्र समूहने हुं नसुं छुं ॥ ७० ॥

### जिनागमाय प्रणमनम्—

**भीममहाभवाद्विभवभीतिविभेदि परास्तविस्फुरत-**

**परमतमोहमानमतनूनमलं घनमघवते हितम् ।**

**जिनपतिमतमपारमन्त्यामिरनिर्वृतिशर्मकारणं,**

**परमतमोहमानमत नूनमलङ्घनमघवते हितम् ॥ ७१ ॥**

**भीमेति—‘भीममहाभवाद्विभवभीतिविभेदि’ भीमे—विभेत्यस्मादिति भीमस्तस्मिन् भयङ्करे, भव एवाद्विर्महांश्चासौ भवाद्विश्च**

( ११५ )

तस्मिन्-महाभवाद्यौ भवन्तीतिभवा स्ताश्रता भीतयस्तासां विभेदि—  
भेदनशीलम् । ‘परास्तविस्फुरत्परमतमोहमानं’ परास्ताः—विक्षिपाः  
विस्फुरन्तःपरमतानि च सौगतादिमतानि मोहश्चमानश्च परमतमोह-  
मानाः येन तत् । (यद्वा मोहाद्वज्ञानान्मानो—मिथ्याभिनिवेशः, परम-  
तानां मोहमानौ वा) ‘अतनून्’ तनु च—स्वरूपं ऊनञ्च—अपूर्णं यत्र भवति  
तत् अतनूनम् । ‘अलं’ अस्यर्थं । ‘घनं’ निविडं—प्रमेयेन गहनं ‘अघवते’  
अथं विद्यते<sup>३</sup>स्येत्यवबान् तस्मै, ‘तदस्यास्तास्मि’ निति (सिद्ध०  
७—२—१) मतुः हितसुखाभ्याम् (सिं० २—२—६५) इति हितयोगे  
चतुर्थी, पापिने । ‘हितं’ श्रेयःप्रदम् । ‘अपारमत्यामरनिर्वृत्ति-  
शर्मकारणं’ अपाराणि न विद्यते पारोऽवसानं येषां तानि—अपर्य-  
न्तानि यानि मत्यानाममराणाच्च निर्वृतेश्च—निर्वाणस्य सम्बन्धीनि  
शर्माणि—सुखानि तेषां कारणं—हेतुः तत्त्वज्ञानसंपादनेन मोक्षोत्पा-  
दकर्त्त्वात् । ‘परमतमोहं’ परमं—प्रकृष्टं तमो—मोहं हन्ति यत्तत्, यद्वा  
परमतमा—अतिशयेन परमा ऊहास्तर्का यस्मिंस्तत् । ‘अलङ्घनमधवता’  
न विद्यते लङ्घनं—अभिभवो यस्य तेन मधवता—महेन्द्रेण सामर्थ्याद-  
च्युत—स्वर्गनाथेनेत्यर्थः । ‘ईहितं’ अभिलषितम् । ‘जिनपतिमतं’  
जिनानां पतयस्तेषां मतं—सर्वज्ञप्रवचनम् । ‘नूनं’ निश्चयेन ।  
‘आनमत’ प्रणमत, यूयमितिशेषः । आड्पूर्वकात् ‘णमं’ प्रह्लवे  
धातोराशीःप्रेरणयोरिति मध्यमपुरुषबहुवचनम् ॥ ७१ ॥

### जिन आगमने प्रणुति—

**१. द्वाकार्थ**—लयंकर अने महान् एवा संसार समुद्रमांथी  
उत्पन्न थता लयने लेहनारा, वणी हूर क्याँ छे स्कुरायमान एवा  
अन्यमतो—जौङ्काहि भतो, मोह अने असिमान ते क्येहे, (अथवा  
नाश क्येहे छे स्कुरायमान अन्य दर्शनेना मोहनो अने गर्वनो  
ज्येहे, अथवा हृणी नाण्येहे छे स्कुरायमान एवो अन्य भतोनो

( ११६ )

( पेताना ) अज्ञानने लधने ( उत्पन्न थयेक ) भिष्याक्षिनिवेश  
ज्ञेण् एवा तथा अतिशय विशाल अने पूर्णि, तेमज् ( प्रभेय-  
वडे ) अत्यंत गहुन एवा, वली पापीच्छाने पणु हितकरी,  
मानव, अने देवना अपार निर्वाणु सुखना हेतुइप, अत्यंत  
( अज्ञानदृष्टी ) अंधकारनो नाश करनारा अथवा अतिशय तर्फ  
ज्ञेमां रहेदा छे एवा, वणी अदावनीय अन्य कोईथी न उद्घाघन  
करी शकाय तेमज् ईद्रने ( अर्थात् यारभा देवदेवाङ्ना स्वाभी  
अच्छुतेंद्रने ) ( पणु ) असीष्ट एवा जिनेंद्रप्रदिपित सिद्धांतने  
( हे सूयज्जने ? ) तर्मे प्रणाम करो ॥ ७१ ॥

### श्रीचक्रधरायाः स्तुतिः—

याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता हुतात्—

समतनुभागविकृतधीरसमदैरिव धामहारिभिः ।

तद्दिव माति सान्ध्यघनमूर्धनि चक्रधराऽस्तु सा मुदे—

इसमतनुभा गवि कृतधीरसमदैरिवधा महारिभिः ॥७२॥

येति—‘या’ देवी । ‘विचित्रवर्णविनतात्मजपृष्ठं’ विचित्रा-  
वर्णा यस्मिन् सः—शब्दवर्णः “आजानु कनकगौर—मानाभेः शङ्ख-  
कुन्दहरधवलम् । आकण्ठतो नवदिवाकरकान्तितुल्य—मामूर्ढतोऽ-  
ञ्जनसमं गरुडस्वरूपम्, इति पार्श्वनाथस्तोत्रे । एतादृक्स्वरूपो यो  
विनतात्मजो गहडस्तस्य पृष्ठं—गात्रोपरिभागम् ।” दितिर्माता च  
दैत्यानां, देवानामदितिस्तथा । विनतापक्षिणां माता, कदुःपन्नगमातरि ।  
इति मातृकाप्रकरणे । “पृष्ठन्तु चरमं तनोः” इति हैमः ।  
‘अधिष्ठिता’ अधिरूढा । ‘हुतात्मसमतनुभाक्’ हुतमत्तीति हुतात्,  
‘अदू’ भक्षण इत्यस्मात् किप् । अग्निस्तत्समां—तनुं—मूर्त्ति  
भजते या सा । ‘अविकृतधीः’ न चिकृता अविकृता—

( ११७ )

अविकारिणी धीर्यस्याः सा । ‘असमदैरिव’ असदृशद्वानलैरिव । “इवेन सह नित्यसमासो विभक्त्यलोपश्च” इति वार्तिकात् । अत्र वागर्थाविवेतिरघूदाहरणं विलोकनीयम् । ‘धामहारिभिः’ धाम्ना-तेजसा हारिभिः—कान्तैः प्रकाशैः । ‘सान्ध्यघनमूर्धनि’ सन्ध्यायां भवो यो यनो—जीमूतस्तस्यमूर्धनि—शिरसि । ‘तडिदिव’ विद्युदिव । ‘अत्र’ अस्मिँल्लोके ‘भाति’ शोभते, यथा सान्ध्यमेघस्य शिरसि विद्युद् भाति तथा देवी गरुडपुष्टे स्थिता राजत इति भावः । ‘भा’ दीप्तावित्यदादिगणस्याद्वर्त्तमाने प्रथमपुरुषैकवचनम् । ‘सा’ ‘असमतनुभा’ असमा—अनुपमा तनो—र्वपुषो भा यस्याः सा । ‘गवि’ पृथिव्यां स्वर्गे वा । “गौः स्वर्गे वृषभे रथमौ, वज्रे शीत-करे पुमान् । अर्जुनीनेत्रदिग्बाण—भूवाग्वारिषु योषिति ।” इति-मेदिनी । “गौर्वज्रे सुवृपे वेनौ, वाचि दिग्बाणयोर्गिरि । भूमयूख-सुखस्वर्गाऽसत्य वहयक्षिमातृषु ॥१॥ इति महीपकोशः । ‘महारिभिः’ अरा येषां सन्तीत्यरीणि—चक्राणि, महान्ति च तानि अरीणि च तैः महारिभिः । ‘कृतधीरसमदैरिवधा’ कृतो विहितो धीराणां समदानां वैरिणां शत्रूणां वधो नाशो यया सा । ‘चक्रधरा’ धरतीति धरा चक्रस्य धरा चक्रधरा—अप्रतिचक्रा देवी । उक्तञ्चाचारदिनकरे—गरु-न्मत्पृष्ठआसीना, कार्त्तस्वरसमच्छविः । भूयादप्रतिचक्रा नः, सिद्धये चक्रधारिणी ॥ १ ॥ ‘मुहे’ प्रीत्यै । ‘अस्तु’ भवतु । ‘असू’ भुवि सन्नायामित्यस्मादाशिषि तुप्रत्ययः ॥ ७२ ॥

### श्री यक्षधरा देवीनी स्तुति—

‘देवाकार्थ’—चित्रविचित्र रंग वर्णवाणा गड़नी पृष्ठ उपर आङ्ग थयेली, तेमज अजिन समान प्रहीस देहने धारणु कृनारी, अने विकार रङ्गित धुद्धिवाली, ने देवी असाधारणु दावानण समान उज्ज्वल प्रकाशवडे भनोङ्ग अेवां यडोवडे संध्या सम-

( ११८ )

થના ( રંગબેરંગી ) ભેદ ઉપર રહેલી તડિત-વિજળી જેમ આ  
જગતમાં શોલે છે, તે ( ચક્કધરા ) હેઠોકે જેના શરીરની કાંતિ  
નિરૂપમ છે, અથવા જેની કાંતિ અનુપમ તેમજ અનદિપ છે, જેણે  
પ્રથમ ચક્કોવડે પૃથ્વી ઉપરના અથવા સ્વર્ગમાંના પરાક્રમી તથા  
મહોન્મત શત્રુઓને સંહાર કર્યો છે એવી તે ચક્કધરા ( અપ્ર-  
તિચકા ) હેવી ( હે દીવ્ય સુખના અભિલાષિજનો ! ) ( તમારા )  
હૃષ્ણને માટે થાઓ. ॥ ૭૨ ॥

## ૧૯ શ્રીમલ્લિનાથજિનસ્તુતયઃ ।

અથ શ્રીમલ્લિનાથસ્ય સ્તુતિ:--

નુદંસ્તનું પ્રવિતર મલ્લિનાથ ! મે,  
પ્રિયજ્ઞરોચિરસુચિરોચિતાં વરમ् ।  
વિડમ્બયન् વરસુચિમણ્ડલોજ્વલઃ,  
પ્રિય ગુરોઽચિરસુચિરોચિતામ્બરમ् ॥૭૩ ॥ સુચિરાછન્દ:

નુદંસ્તનું-(હે) ‘મલ્લિનાથ ! ગુરો !’ પરીપહાદિમલ્લજ-  
યાદ-મલિઃ, નિરુક્તાત् । ગર્ભસ્થેઽસ્મિન્માતુ: સકલર્તુકુસુમમાલ્ય-  
શયનીયદોહદોહપુરિ દેવતયેતિમલ્લિર્વા સ ચાસૌ નાથશ્ર તદામન્ત્રણં,  
ગૃણાતિ ધર્મોપદેશં, યથાર્થોપદેષા વા, ગુરુ: હિતાઽહિતપ્રાપ્તિરિહારો-  
પદેષા ગુરુરિતિ નૈયાયિકાઃ । ‘ગૃશ્શ’ શાન્દે ધાતો: ‘કૃગ્ર ઋતુતર્દ્વે’  
(સિદ્ધહૈ ૦ ૩૦ ૭૩૪) ઇતિ કિત્સંજ્ઞિકઉ પ્રત્યય: ઋતુકારસ્ય ચ ઉરા-  
દેશઃ । “ગુરુર્મહત્યાઙ્ગિરસે, પિત્રાદૌ ધર્મદેશકે । અલઘૌ દુર્જરે ચાપિ”  
ઇતિ હૈમઃ । તત્સમ્બુદ્ધૌ હે મલ્લિનાથસ્વામિન ? । ‘અરુચિરોચિતાં’  
રુચિરા-શોમના ચાસૌ ઉચિતા ચ યોગ્યા, રુચિરા: બહુલકર્માણસ્તેષા-  
મુચિતા વા યા ન ભવતિ તામ, લઘુકર્મણાં સ્વલ્પકાલેનૈવ મોક્ષગામિ-  
ત્વેન તત્સ્યાગાત् ‘તનું’ દેહમ્ । “ત્વગ્રેહયોરપિ તનુઃ” ઇત્યમરઃ ।

( ११९ )

‘ नुदन् ’ प्रेरयन्—क्षिपन् । ‘ प्रियङ्गुरोचिः ’ प्रियङ्गुः—फलिनी वृक्षवि-  
शेषस्तद्वद्रोचिः इयामकान्तिर्यस्य सः । “प्रियङ्गुः फलिनीकङ्गु—पिप्पली  
राजिकासु च ” ॥ इति विश्वः । ‘ वरहूचिमण्डलोज्जवलः ’ वरं यत्  
रुचिमण्डलं तेनोज्जवलः—कान्तः । ‘ अचिररुचिरोचिताम्बरं ’ अचि-  
ररुच्या—विद्युता रोचित—मुद्गासितं यदम्बरं—नभस्तत् । “ अम्बरं  
रसकार्पास—ब्योमरागसुगन्धके ” इति विश्व० । ‘ विडम्बयन् ’  
हसन् । ( त्वं ) ‘ मे ’ मह्यं, । ‘ प्रियं ’ रुचिकरं, ‘ वरं ’ देवेभ्यः  
स्वसमीहितप्रार्थितार्थम् । ‘ वृङ् ’ वरणे धातोरप्रत्यये वरः “ तपो-  
भिर्वाऽङ्ग्यते यत्तु, सुरादेः स वरः स्मृतः । वरो विटे वृतौ श्रेष्ठे,  
जामातरि च गुगुले ॥ १ ॥ देवतादेरभीष्टेर्थे, इच्छाया याचने तथा ।  
वरं च धुसृणे चाऽल्पे, त्रिष्वभीष्टे मनाक्षिप्रये ॥ २ ॥ शतावर्या  
वरी प्रोक्ता, वरा चाऽस्ति कलत्रिके । वरमित्यव्ययं केचि—त्प्राहुः श्रेष्ठे  
च शोभने ” ॥ ३ ॥ इति शब्दसिन्धुः । ‘ प्रवितर ’ प्रवितनु ॥ ७३ ॥  
अस्मिन् पदे रुचिरावृत्तम्—जभौ सजौ गितिरुचिरा चतुर्ग्रहैः ॥ इति  
छन्दोमञ्जरीम् ।

### श्री भक्षिनाथनी स्तुति—

**श्लोकार्थ**—હે ભક्षिनાથ શુરૂ ? અમનોહર અને અનુચિત  
એવા દેહને દ્વાર ઝેંકટો, પ્રિયંશુ ( નામના વૃક્ષ ) ના જેવી શ્યામ  
કાંતિવાલો, ઉત્તમ ભામંડલથી વિભૂષિત અને એથી કરીને વિજળીના  
પ્રકાશવડે પ્રકાશિત થયેલા આકાશ—ગગનને વિડંખના પમાડટો  
થડો તું રહુને પ્રિય વરદાન ( ઈચ્છિત ) આપ ॥ ૭૩ ॥ આ  
શ્લોકમાં તથા પણીના ત્રણ શ્લોકોમાં દૃચિરા નામે વૃત્ત છે. તેનું  
દક્ષણુ—આ વૃત્તમાં જ, ભ, સ, અને જ, એમ ચાર ગણ્ણો છે.  
અને અંત્યાક્ષર દીર્ઘ છે. વલી ચૈથે અને નવમે એટલે તેરમે  
અક્ષરે વિરામ—યતિ છે આ વૃત્તમાં કુલ તેર અક્ષરે છે.

( १२० )

## जिनेश्वराणां स्तुतिः ।

जवाह्रतं जगदवतो वपुर्वर्था—  
कदम्बकैरवशतपत्रसं पदम् ।  
जिनोत्तमान् स्तुत दधतः सजं स्फुरत—  
कदम्बकैरवशतपत्रसम्पदम् ॥ ७४ ॥

**जवादिति**—‘वपुर्वर्थाकदम्बकैः’ वपुषः—शरीरस्य व्यथानां—  
पीडानां कदम्बकैर्वैन्दैः । “ वृन्दं चक्रकदम्बके समुदयः पुज्ञोत्करौ  
संहतिः ” इति हैमः ‘ अवशतपत्रसं ’ अवशाः—पराधीनाः तपन्तः  
तापमनुभवन्तः त्रसाः सत्त्वा—यस्मिन् तत् । ‘ पदं ’ स्थानं—नरका-  
दिकम् । ‘ गतं ’ प्राप्तम् । ‘ जगत् ’ विश्वम् । ‘ जवात् ’ वेगात् ।  
“ जवोवेगस्त्वरिस्तूर्णिः ” इत्यमरः । ‘ अवतः ’ रक्षतः । ‘ स्फु-  
रत्कदम्बकैरवशतपत्रसंपदं ’ स्फुरन्ती कदम्बानां—नीपानां कैरवाणां—  
कुमुदानां शतपत्राणां—कमलानां च सम्पत्—समृद्धिर्यस्यां वा यस्याः सा-  
ताम् । “ नीपः कदम्बः शालस्तु ” । “ श्रेते तु तत्र कुमुदं, कैरवं  
गर्दभाहयम् ” इति हैमः । “ सहस्रपत्रं कमलं, शतपत्रं कुशेशयम् ” ।  
इत्यमरः । ‘ सजं ’ कुमुदमालाम् । ‘ दधतः ’ धारयतः । ‘ जिनो-  
त्तमान् ’ जिनेन्द्रान् । ‘ स्तुत ’ प्रणत ‘ छुञ्ज ’ स्तुतावितिधातो-  
राशीःप्रेरणयोरिति मध्यमपुरुषबहुवचनम् ॥ ७४ ॥

## जिनेन्द्रानी स्तुति—

**श्लोकार्थ**—हेह संखंधी पीडाएना सभूषेवडे परतंत्र—  
पराधीन, ( अत्यंत ) संतापनो अनुभव उर्नारा श्रवो छे  
ज्ञेन विषे एवा ( नरकाद्विक आर गतिएवडे लक्षित ) पहने  
प्राप्त थयेका विश्वनुं वेगवडे रक्षणु उर्नारा एवा, तेमज्ज विक-  
स्वर छे कुहंध, कैरव अने शतपत्र-कमल संखंधी संपत्ति ज्ञेने  
विषे एवी पुष्पेनो भाणाने धारणु उर्नारा एवा श्रवेनी  
( हे ज्ञयो ! ) तमे स्तुति करै ॥ ७४ ॥

( १२१ )

## सिद्धान्तस्य वर्णनम् ।

स सम्पदं दिशतु जिनोत्तमागमः,  
शमावहन्तनुतमोहरोऽदिते ।  
सचित्तभूः क्षत इह येन यस्तपः—  
शमावहन्तनुत मोहरोदिते ॥ ७५ ॥

स इति—‘यः’ तपः शमौ’ तपश्च द्वादशविधं शमश्च—उपशमः इतीतरेतरद्वन्द्वः, तौ । “तपोलोकान्तरेऽपि च । चान्द्रायणादौ धर्मे च, पुमान् शिशिरमाघयोः” इतिमेदिनी । “तपः कृच्छ्रादिकर्मणि । धर्मे लोकप्रभेदे च, तपाः शिशिरमाघयोः” इति हैमः । ‘अहन्’ हतवान् । ‘अदिते’ न दिते—अदिते—अखण्डिते । ‘मोहरोदिते’ मोहश्चमिथ्याऽभिनिवेशः रोदितञ्च—विप्रलापः ते । ‘अतनुत’ विस्तारितवान् । ‘तनु’ विस्तारे, ‘अनव्यतने लडि’ तिसूत्रेणात्मनेपदे प्रथम-पुरुषैकवचनं कर्त्तरि । ‘सः’ ‘चित्तभूः’ कामः । ‘येन’ विभुना । ‘इह’ अत्र जगति । ‘क्षतः’ ध्वस्तः । ‘क्षण्’ हिसायामितिधातोर्निष्ठाकृप्रत्ययः । ‘सः’ ‘शं’ सुखम् । ‘आवहन्’ कुर्वन् । ‘अतनुतमोहरः’ । न तनु—अतनु—प्रभूतं तमोऽज्ञानतिभिरं हरतीति अतनुतमोहरः अथवा अतनुतमानूहान्—तर्कान् राति—ददाति यः, सः । ‘जिनोत्तमागमः’ जिनेपूत्तमास्तेषामागमः, जिनानामुक्तमः—श्रेष्ठो य आगमः—समयः इति वा, “आपोक्तिः समयागमौ” इति हैमः । अर्हतिसद्वान्तः । ‘सम्पदं’ श्रियम् । ‘दिशतु’ ददातु ‘दिश्’ अतिसर्जने इतिधातोराशीः प्रेरणयोरिति लोटःस्थानेतुप् । ७५।

**जिनसिद्धान्तनी भक्ता—**

‘क्षेत्राकार्थ—७६ ( भाष्य अने आख्यातर षार प्रकारना )

( १२२ )

तप अने उपशम-शांतिनो नाश करतो, तेमज जे अधित  
अज्ञान अने प्रवाप-इद्धननो विस्तार करतो हुतो ते कंठपं-  
कामहेवनो आ जगतभां लेणे नाश कर्यो, ते सुखने आपनार,  
तेमज अत्यंत अज्ञाननो नाश करनार ( अतिशय भैटा तड़ेने  
उत्पन्न करनार ) ऐवो श्री जिनेश्वरेनो ( अति उत्तम ) सिद्धांत  
( हे लब्ध्यात्माए ! ) तमने संपत्ति आपो ॥ ७५ ॥

### श्रीकपर्दियक्षराजस्मृतिः ।

द्विपं गतो हृदि रमतां दमश्रिया,  
प्रभाति मे चकितहरिद्विपं नगे ।  
बटाह्ये कृतवसतिथ यक्षराट्,  
प्रभातिमेचकितहरिद् विपन्नगे ॥ ७६ ॥

द्विपमिति । ‘चकितहरिद्विपं’ चकितस्तो हरिद्विपः—सुरे-  
न्द्रगजो येन तम्, स्थौल्यसौन्दर्यवलाऽतिशयादितिभावः ‘द्विपं’  
द्वाभ्यां-मुखशुण्डाभ्यां पिवतीति द्विपस्तं—हस्तिनम् । ‘गतः’ आरूढः ।  
‘विपन्नगे’ विगताः पन्नगा यस्मात्सतस्मिन् विगतसर्पे । ‘बटाह्ये’  
बटाभिधाने । “उदन्तोऽथाह्योऽभिधा । गोत्रसंज्ञानामधेया०” इति  
हैमः । ‘नगे’ वृक्षे । ‘कृतवसतिः’ कृता—विहिता वसतिः—स्थानं=  
गृहं येन सः । वसती रात्रिवेशमनोः” इत्यमरः । ‘प्रभातिमेचकित-  
हरित्’ प्रभया—कान्त्या अतिशयेन मेचकिताः—श्यामीकृताः, हरितः—  
ककुभः मेचकस्वरूपा येन सः । ‘यक्षराट्’ यक्षाधिपः ( कपर्दिनामा )  
“किन्नरकिपुष्पौ छौ, महोरग—स्तूर्यगान्धर्वः । यक्षो राक्षसभूतौ,  
पिशाचो व्यन्तरा अष्टौ ” ॥ यक्षस्वरूपं चोक्तं तत्त्वार्थाधिगमभाष्ये—  
यक्षाः श्यामाऽवदाता गम्भीरास्तुन्दिला वृन्दारकाः प्रियदर्शना मानो-  
न्मानप्रमाणयुक्ताः रक्तपाणिपादतलनखतालुजिह्वोष्टा भास्वरमुकुटधरा  
नानारकविभूषणा वटवृक्षध्वजाः । यक्षाणां त्रयोदश जातिभेदाः—

( १२३ )

पूर्णभद्रो माणिभद्रः, श्वेतभद्रो वनाधिपः ।  
व्यतिपातिकभद्रश्च, सुमनोभद्र एव च ॥ १ ॥

हरिभद्रसुभद्रौ च, सर्वतो भद्र इत्यसौ ।  
यक्षोत्तमो वनाहारो—मनुष्यरूपयक्षकौ ॥ २ ॥

यः पूर्वं तन्तुवायः कृतसुकृतलवैदैरितैः पूरितोऽपि  
प्रत्याख्यानप्रभावादमरमृगदृशामातिथेयं प्रपेदे ।  
सेवाहेवाकशाली प्रथमजिनपदाभ्योजयोस्तीर्थरक्षा—  
दक्षः श्रीयक्षराजः स भवतु भविनां विघ्नभर्दीं कपर्दी ॥ १ ॥

ब्रह्मशान्तिकर्पर्दिनामानौयक्षौ भेदान्तरेष्वन्तर्भूतौ, ‘मे’ मम ।  
‘दमश्रिया’ उपशमसम्पदा । ‘प्रभाति’ शोभमाने । ‘हृदि’

१ सौराष्ट्रे मधुमत्यां नगर्या कपर्दिनामा तन्तुवायस्तस्याऽडीकुहानामानौ  
भार्ये, अयच्छाऽभक्ष्याऽपेयलोकुरोऽभूत् । अनाचारिणं तं विलोक्य तस्य भार्ये  
प्रहारेण शिक्षयामासतुः, तदानीं वज्रसेनसूरीर्वहिर्भूमिं गच्छन् तदवस्थं तं निजानिके  
आजुहाव, सोऽपि कृताज्ञलिस्तं प्रणनाम, सुलभवोधिं मुहूर्तमात्रायुषं च तं श्रुतज्ञा-  
नेन विज्ञाय सूरिवोचत्, एतत्कष्टविमुक्तये त्वं धर्मध्यानं कुरु, प्रत्याख्यानश्च  
गृहाण—भोजानात्प्राक् परमेष्ठिमन्त्रमुच्चार्यं कटिबद्धदवरकस्य ग्रन्थं छोटयित्वा  
भोजनं विधेयं । भोजनोत्तरं नमस्कारमत्रं पठित्वा तद्रन्थिः पुनार्विधेया, इत्थं  
नियमस्तेन यत्रः सकाशाद्यग्रहीतः । सूरिः स्वस्थानं गतः । सोऽपि गृहं गत्वा  
तेनैव नियमेन भोजनं कुर्वन् विषमिथिराऽहिमांगभक्षणेनाज्ञानन्मुतः । अप्रज्ञोऽपि  
सकृचियमपालनेन प्रत्याख्यानप्रभावादेवत्वेन स समुत्पन्नः । इतस्तद्वये सूरि  
दत्तप्रत्याख्यानवृत्तान्तमजानाने निजपतिमरणदाताऽयं सूरिरतिमत्त्वा नृपति विज्ञा-  
पयामासतुः । त्रृपेण सूरिराकरितः, अनयोः स्वामी त्वया कथं व्यापादितः ?  
सूरिस्तुष्णीं स्थितः, ततः स कारागृहे स्थापितः । देवलोकस्थः कपर्दी ज्ञातवा-  
नवधिना, मदुपकारिसूरीर्महादुखे पातितः, अतस्तेन दिव्यशक्त्या तञ्चगरणच्छादन-  
भाण्डमिव विशाला शिखा विकुर्विता, नभस्थितेन तेनलोकाः प्रोचिरे, वज्रसेनसूरिर्भे  
ष्यिगुरुः महोपकारी प्रत्याख्यानदातास्ति । अतस्तं सूरि क्षमव्यं प्रणमत,  
अन्यथाशिलापातेन नगरनाशं विभास्ये, मरणभयेन भीतो तृपस्तं क्षमयित्वा

( १२४ )

मानसे । 'रमतां' क्रीडतु ॥ 'रमु' क्रीडायामितिधातोरात्मनेपदे  
आशिषि लोटः प्रथमपुरुषैकवचनम् ॥ ७६ ॥

### श्री यक्षराज ( कपहीनुं संस्मरणु )—

**श्लोकार्थ—**( पोतानी प्रचंडता, सामर्थ्य अने सुंहरता  
विग्रहे शुण्डिवडे ) भय पमाञ्चो छे औरावतने क्षेणु ऐवा गजराज  
उपर आङ्डे थधेक्षेण, वणी सर्प रहित ऐवा वड वृक्ष उपर  
निवास कर्त्त्वे छे क्षेणु, वणी अतिशय तेजवडे अत्यंत श्यामवरणी  
करी छे हिशाच्चा क्षेणु ऐवा ( कपहीं नामे ) ( आठ प्रकारना व्यं-  
तरहेवपैक्षिना यक्ष ए एक लेह छे अने यक्षजलतिना पूर्णभद्रादि  
( १३ ) लेह छे तेमां कपहीं ए अवांतर लेह छे, के ले वज्रसेन-  
सूरिना उपहेशथी पूर्वजन्ममां कुरुक्षमीं छावा छतां कपहीं नामनेा  
तंतुवाय गंडसी प्रत्याख्यान ( पञ्चयाण्य ) ना प्रलाववडे ऐ धडीनुं  
आयुष्य पूर्णु करी हेव थये अने तेणु शनुं ज्यतीयोंनी रक्षा  
करी ) ते यक्षराज उपशमद्भीषी लहमीवडे प्रकाशमान ऐवा म्हारा  
हुद्य-अंतःकरणुमां रमणु करो ॥ ७६ ॥

वन्दित्वा च मुक्तवान् । ततः कपर्दिना शिला संहता, प्रसञ्चवदनेन तैन च सप्रकाशं  
प्रोक्तम्—

“ मांसासी मज्जरओ, इकेणं चैव गंठिसहिषण ।  
सोऽहं तु तंतुवाओ, सुसाहुवाओ सुरो जाओ ” ॥ १ ॥

( मांसाशी मद्यरतः, एकेन चैव ग्रन्थिसहितेन ।  
सोऽहं तु तन्तुवायः, सुसाहुवादः सुरो जातः ॥ १ ॥ )

ततः स सरीश्वरं भक्त्या नत्वा कृताङ्गिः प्रोवाच-भगवन् ! प्राग्जन्मनि मया  
कीदृकर्माणि विहितानि ? सूरिणा प्रोच्ये-पुरा त्वया क्रूरकर्माणि कृतानि, अधुनाऽस-  
त्मशुद्धये श्रीशत्रुञ्जयगिरिं गत्वा त्वं श्रीकृष्णभप्रमुँ सेवस्व, इतिसूरिवचो निशम्य  
प्रमुदितस्तथैव स कृतवान् ।

( १२५ )

## २०—श्रीमुनिसुब्रताजिनस्तुतयः ।

अथश्री मुनिसुब्रतस्वामिनः स्तवनम्—

जिनमुनिसुब्रतः समवताज्जनताऽवनतः;

स मुदितमानवा धनमलोभवतो भवतः ।

अवनिविकीर्णमादित यस्य निरस्तमनः—

समुदितमानवाधनमलो भवतो भवतः ॥ ७७ ॥

तत्कुटकम् ( ७-१० )

जिनमुनीति—‘मुदितमानवाः’ मुदिताश्च ते मानवाश्चेति-  
कर्मधारयः, हष्टाः पुमांसः । ‘यस्य’ ‘अलोभवतः’ न विद्यतेलो-  
भोऽस्येत्यलोभवान् तस्य—लोभेनाऽयुक्तस्य दीक्षागृहीतुकामस्य ।  
‘भवतः’ भवतीति भवन् तस्य सतः । ‘अवनिविकीर्ण’ अवन्यां-  
पृथिव्यां विकीर्ण—राशीकृतम् । ‘धनं’ द्रव्यम् । ‘आदिषत’ आद-  
दत । ‘सः’ ‘जनताऽवनतः’ जनानां समूहो जनता ‘ग्रामजन-  
बन्धुगजसहायान्तत्त्वं’ ( सिद्धहेम० ६-२-२८ ) इति ‘समूहार्थे  
तत्त्वं’ तथा जनतया—मानववृन्देन अवनतः—प्रणतः । ‘निरस्तमनः  
समुदितमानवाधनमलः’ मानोऽहंकृतिः बाधनं बाधा—पीडा, मलो-  
दुरध्यवसायश्च निरस्ता—अपकीर्णा, मनसि समुदिता—हृदि समुद्रताः  
संहता वा मानश्च बाधनश्च मलाश्च ते येन सः । ‘जिनमुनिसुब्रतः’  
जिनश्चासौ मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिश्चासौ सुष्टुब्रता-  
नि यस्य सः सुब्रतश्चेति कर्मधारयः, मुनिसुब्रतनामा जिनः गर्भस्थेऽ-  
स्मिन् माता मुनिवत् सुब्रता जातेति वा मुनिसुब्रतः । मुनिरिति ‘मने-  
रुच’ ( उणा० ५६२ ) इत्युणादिसूत्रेणाकारस्योकार इश्चप्रत्ययः ।  
‘भवतः’ युद्धमान् । ‘भवतः’ संसारात् । ‘समवतात्’ संरक्षतु  
॥ ७७ ॥ अस्मिन् पद्ये तत्कुटकं वृत्तम्—“हयदशमिर्जौ भजजला-

( १२६ )

गुरु तत्कुटकम् ॥”। इति लक्षणात् । “ मुनिगुहकार्णवैः कृतयति वद् कोकिलकम् ॥”। इति वृत्तरत्नाकरे । “ ऊम्जजा लगाववितथ ” मितिच्छन्दोऽनुशासने । “यदि भवतो नजौ भजजला गुरुनकुटकम्”। इतिछन्दोमञ्जर्याम् ।

### श्री मुनिसुव्रतस्वामीनी स्तुति—

“**लोकार्थ**—( दीक्षा अहंषु कृत्वानी अतिशय अलिलापा हेवाथी ) लोक रहित थयेला ऐवा वे प्रखुना पृथ्वी उपर गगला करेला ( ३८८,००००००० ) धनने झर्ष पामेला भनुष्यो एक वर्ष पर्यंत अहंषु कृता हुता ते तीर्थं कृ मुनिसुव्रतस्वामी के ज्वेभने जनसमुदाये नमन कर्युं छे, तेमब ज्वेभाणे भनमां उत्पन्न थयेला—अथवा एकठा थयेला अहं करनो, पीडानो अने कर्मदृष्टी भवनो विनाश कर्यो छे, ते ( वीक्षमा श्रुतेवर ) हे अव्यात्माओ तम्हाडूं अव—संसारथी रक्षण्यु—पालन करो ॥ ७७ ॥

आ स्तुतिना यारे पद्मां तत्कुटक नामे वृत्त छे तेमब दृष्टेक चरण्यामां सत्तर अक्षर छे अने सात अने दश अक्षरे विराम छे.

### जिनसमूहस्य प्रणाति; ।

**प्रणमत तं जिनत्रजमपारविसारिजो—**

दलकमलानना महिमधाम भया समरुक् ।

**यमतितरां सुरेन्द्रवरयोषिदिलामिलनो—**

दलकमला ननाम हिमधामभया समरुक् ॥ ७८ ॥

**प्रणमतेति—**‘ अपारविसारिजोदलकमलानना ’ अपाराणि, न विद्यते पारोऽन्तोयेषांतानि—अपर्यन्तानि, विसारीणि—प्रसरण-शीलानि रजोदलानि रजसांदलानि—कणाः यस्य यस्मिन्वा तत्, अपार-

( १२७ )

विसारिरजोदलं, तच्च तत्कमलञ्च तद्वत्सुरभि आननं—मुखं यस्याः सा । अथवा रजांसि च दलानि पर्णानि चेति द्वन्द्वस्ततो वहुत्रीहिः । ‘अरुक्’ न विद्यते रुक्—रोगो यस्याः सा नीरोगा । ‘इलामिलनोदलकमला’ इलाया मिलनेन क्षितेर्वद्वनेनोद्रतो विलग्नोऽलकेषु—कुरलेषु मलो—रजो यस्याः सा । ‘हिमधामभया’ हिमं—शीतलं धाम—तेजो यस्य स—हिमधामा—शशाङ्कस्तस्य भया—दीत्या ‘समरुक्’ सदृशस्त्रिः, अनेन वपुषो रस्यन्त्वं प्रदर्शितम् । ‘सुरेन्द्रवरयोषित्’ सुष्ठु राजन्त इति सुराः, सुरा अस्ति एपामित्यर्श आद्यच् प्रत्यये वा सुराः । ‘सुरापरिग्रहाद्वासुराः, उक्तञ्च रामायणे—सुरापरिग्रहाद् देवाः, सुराख्या इतिविश्रुताः । अपरिग्रहणात्तस्या दैतेयाश्चासुराः स्मृताः॥’ यद्वा सुन्वन्ति सेवकदुःखमिति सुरन्ति—ऐश्वर्यमनुभवन्तीति वा सुराः, ‘बुर’ ऐश्वर्यदीहयोः, ‘इगुपधज्ञात्रीकिरःकः’ (पा० ३—१—१३५) इतिकप्रत्ययः, तेषामिन्द्रस्तस्य सुरेन्द्रस्य वरा—प्रधानभूता योषित्—भार्या शशी । ‘यं’ ‘अतितरं’ अतिशयेन । ‘ननाम’ नमति स्म । ‘तं’ तथाभूतं । ‘महिमधाम’ महिम्नः धाम—गृहं तत् । “धामाऽगारं निशान्तं च” इति हैमः । “धाम देशो गृहे रथमौ, चिन्हे स्थानाऽपराधयोः” इति विश्वः । ‘भयासं’ भयमस्यति क्षिपतीति भयासस्तम्,—भयनाशकम् । ‘जिनब्रजं’ अर्हत्समूहम् । ‘प्रणमत’ प्रणामं कुरुत ॥७८॥

### जिनसमुहायने प्रथुति—

**१. क्षेत्राकार्थ—** अपार—अपरिभित अने प्रसरणुशील ( अर्थात् दूर दूर सुधी प्रसार पामता ) ऐवा रञ्जकणु अने पत्रो छे जेनां ऐवां कमल—पद्म समान ( सुगंधमय छे मुण्ड बेनुं ऐवी, वणी शोणी विमुक्ता, तथा पृथिवीनुं संघटन—रूपर्शी थवाथी बेणीना उशोमां भलिनता प्राप्त थाई छे ऐवी, तेमन्य चंद्रनी कांति समान कांति छे जेनी ऐवी ईद्राणीच्ये, वे जिनसमुहायने अपूर्व अक्षितपूर्वक नभस्कार कर्यै छे. ते भडिभाना धाम—स्थानद्रूप अने

( १२८ )

ભયને નાશ કરનાર એવા જિનસમૂહને ( ભવ્યાત્માએ ! )  
તમે પ્રણામ કરો ॥ ૭૮ ॥

---

## સિદ્ધાન્તસ્ય સંસ્તવનમ् ।

ત્વમવનતાજીનોત્તમ કૃતાન્ત ! ભવાદ્વિદુપો—  
ઽવ સદનુમાન સર્જન ? યાત તમોદયિતઃ ।  
શિવસુખસાધકં સ્વભિદધત્સુધિયાં ચરણं,  
વસદનુમાનસં ગમનયાતત ? મોદયિતઃ ? ॥ ૭૯ ॥

( हे ) ‘ जिनोत्तमकृतान्त ! ’ जिनोत्तમानां कृतान्तः सिद्धान्तसदामन्त्रणं तीर्थकृतसिद्धान्त ! । ‘ सदનુમાનસર્જન ! ’ સદ-વિદ્યમાન શોભનં વા અનુમાનસર્જનન—અનુમાનસ્ય સર્જનન—સર્જતિ-ર્યસ્ય યસ્મિન્વાતદામન્ત્રણમ् । “ લિઙ્ગપરામર્શોઽનુમાનમ् ” ઇતિમળિ-કૃતઃ । “ પરાસૃદ્યમાનં લિઙ્ગમનુમાનમ् ” ઇલ્યુદ્યનાચાર્યાઃ । ‘ ગમન યાતત ! ’ ગમાશ્ર—સહૃદાપાઠાઃ નયાશ્ર—નૈગમાદ્યઃ ગમનયાસ્તૈરાતત ?—વિસ્તીર્ણ ? । ‘ મોદયિતઃ ’ પ્રમોદજનક ? ’ । ‘ યાતતમોદયિત ? ’ યાત—અપગતં તમો મોહોઽજ્ઞાનં વા યેષાં તે મુનયસ્તેષાંદયિતઃ—અમીષ્ટસ્તસ્યામન્ત્રણમ् । ‘ સુધિયાં ’ સુષ્ઠુ ધીર્યેષાં તે સુધિયસ્તેષાં ધીમતામ् । ‘ અનુમાનસં ’ માનસમનુ—લક્ષ્યીકૃત્યેત્યનુમાનસં તત् । ‘ વસત् ’ । વસતીતિવસત्, વર્ત્તમાને શરૂપ્રત્યયઃ । તિષ્ઠત् । ‘ શિવસુખસાધકં ’ સુક્તિસૌખ્યસ્ય વિધાયકમ् । ‘ ચરણ ’ અનુ-ષ્ઠાનમ् “ ચરિત્રં ચરિતાચારૌ, ચારિત્રચરણે અપि ” ઇતિ હૈમઃ । ‘ સ્વભિદધત् ’ સુષ્ઠુ—અભિદધાતીતિ સ્વભિદધત—સમ્યગાભિદધાનઃ । ‘ ત્વं ’ ‘ અવનતાન् ’ પ્રણતાન् । ‘ અવ ’ રક્ષણ । ‘ અવ ’ રક્ષણે ધાતોરાશિષિ મધ્યમપુરુષૈકવચનમ् ॥ ૭૯ ॥

( १२९ )

## श्री सिद्धांतनी स्तुति—

**श्वेताकार्थ**—हे जिनेंद्र सिद्धांत ! विद्यमान अथवा उत्तम छे अनुमाननी ( तथा उपलक्षणयुक्ती अन्य प्रभाणुनी पण ) संगति जेने विषे एवा हे अर्हत्प्रवचन ! ) हे गम-आलापक ! अने नैगमादिकनयथी विस्तीर्ण ! ( आगम ! ) हे प्रभोहकारी शास्त्र !, गये। छे मोहद्यपी अने अज्ञानद्यपी अंधकार जेभनो, एवा अुनिवर्देने प्रिय, तथा विद्वानोना हुद्यमां वसनारा, तेमज्ज भाक्षसुखना साधक-आपनार एवा चारित्रनो प्रकाश करनारा तुं ( तीर्थंकर प्रणीत सिद्धांत ) अत्यंत नम्र थयेता पंडितेतुं संसारथी रक्षणु कर ॥ ७८ ॥

---

## श्री गौरीदेव्याः स्तुतिः—

अधिगतगोधिका कनकरुक्त तव गौर्युचिता-

झङ्गमलकराजि तामरसभास्यतुलोपकृतम् ।

मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती,

कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ८० ॥

**टीका**—अधिगतेति—‘अधिगतगोधिका’ अधिगता—प्राप्ता गोधा—देववाहनविशेषो यथा सा अधिगतगोधिका, ‘शेषादिभाषा’ ( सि० कौ० ५—४—१५४ ) इतिक्षेप प्रत्ययः ‘कनकरुक्त’ कनकं सुवर्णं तद्वद्वुक्त—प्रभा यस्याः सा—सुवर्णद्युतिः । ‘मृगमदपत्रभङ्गतिलकैः’ मृग-मदस्य—कस्तूरिकाया ये पत्रभङ्गाः—पत्रच्छेदास्तैरुपलक्षितातिलकाः—विशेषकास्तैः “मृगनाभिर्मृगमदः, कस्तूरी गन्धधूल्यपि” । इति हैमः । ‘उचिताङ्कं’ उचिता—योग्या अङ्का—लाङ्कानानि यस्य तत् । “अङ्कः समीपे उत्सङ्गे, चिह्ने स्थानापराधयोः” “कलङ्काङ्कौ

( १३० )

लाङ्घनं च ” इत्यमरः । ‘ अलकराजि ’ अलकैः—कुरुलैः राजत  
इत्येवंशीलम् । “ कुरुलोभ्रमराऽलकः ” इति हैमः । ‘ तामरस-  
भासि ’ तामरसं—पद्मं तद्भासनशीलम् । ‘ अतुलोपकृतं ’ निज-  
प्रभासंविभागप्रदानादिना, कृपाकटाक्षमात्रैणैव सुखजनकत्वाद्वा,  
अतुलं—असदृशमुपकृतमुपकारो यस्य तत् । अथवा अतुलं यथाभव-  
त्येवमुपकृतमुपकारे स्थितम् । ‘ वदनं ’ मुखम् । ‘ दधती ’ विभ्राणा ।  
‘ कमलकरा ’ कमलं नलिनं करे यस्याः सा, क्रीडायै तद्वह्नादि-  
तिभावः । अथवा कमलवत् करौ यस्याः सा । ‘ जिताऽमरसभा ’  
जिता—निष्प्रभीकृता ( रूपनेपथ्यप्रागलभ्यादिभिः ) अमराणां सभा  
यया सा । ‘ गौरी ’ गौर्याद्वया विद्यादेवी । उक्तञ्च निर्वाणकलिकायां—  
“ गौरीदेवीं कनकगौरीं गोधावाहनां चतुर्भुजां वरदमुशलयुत-  
दक्षिणकरामक्षमालाकुवलयाऽलङ्घतवामहस्ताञ्चेति ‘ तव ’ त्वदीयम् ।  
‘ लोपकृतं ’ लोपो विनाशस्तं करोतीति लोपकृत्—प्रतिपक्षादिस्तम् ।  
‘ अस्यतु ’ विनाशयतु । ‘ असु ’ क्षेपणे धातोराशीःप्रेरणयोः  
कर्त्तरि परस्मैपदे प्रथमपुरुषस्यैकवचनम् ॥ ८० ॥

### श्री गौरीदेवीनी स्तुति—

१. श्रोकार्थ—प्राप्त थयुं छे जोधिका—धोदप ( देववाहन विशेष )  
જेने एवी, वणी सुवर्णु समान कांतिवाणी ( सुवर्णु समान ग्रलावाणा ) कस्तुरीना पत्रोनी रथना वडे उपलक्षित एवा तिळडेने  
योग्य छे लांछने—चिह्नो जेने विषे, तेमज भ्रकुटी अने वांकडीया  
डेश विगेरे वडे शोभायमान एवा तेमज कमलना! जेवी कांतिवाला  
अने कर्यो छे अनुपम उपकार जेणे ( अथवा अत्युतम अनुपम छे  
हीरा भोती विगेरेना अलंकारै जेने विषे एवा मुखने धारणु  
करनार ?, तथा कमल छे हुस्तमां जेना एवी ) ( अथवा कमल  
समान हुस्त छे जेना ) एवी अने ( पैताना नेपथ्यदृप भूषण-  
हिना सौंदर्यवडे ) कांति रहित करी छे देवसला जेणे एवी जैरी

( १३१ )

( हेवी ) ( हे लव्यज्जन् ! ) तडारै विनाश करनारा ( अव्य-  
तर शत्रुओंने ) नाश करे ॥ ८० ॥

## २१ श्रीनमिजिनस्तुतयः ।

अथश्रीनमिनाथस्य संस्मरणम्—

स्फुरद्विद्युत्कान्ते ! प्रविकिर वितन्वन्ति सततं,  
ममायासं चारो !, दितमद ! नमेऽधानि लपित ! ।  
नमद्वृद्यश्रेणी-भवभयभिदां हृद्यवचसा—  
ममायासञ्चारो-दितमदनमेघानिल ! पितः ॥ ८१ ॥

शिखरिणीवृत्तम् ॥

टीका—स्फुरदिति—स्फुरद्विद्युत्कान्ते ? स्फुरतीति स्फुरन्ती—  
दीप्यन्ती या विद्युत्—तडित्, तद्वत्कान्तिः—प्रभा यस्यासौ तत्संबोधनम् ।  
'चारो' ! दर्शनीय ! 'दितमद' ! दितः—उन्मूलितो मुन्मोहसंभेदो  
येन सः स्फुरिष्टदर्प ! 'नमद्वृद्यश्रेणीभवभयभिदां' नमन्त्याः नम-  
स्कुर्वन्त्याः भवन्तीति भव्यास्तेषां भव्यानां—सम्यग्हृशां श्रेण्याः भवभयं  
भवादभयं भवभयं—संसारभीति भिन्दन्ति—निर्भूलयन्ति यानि तेषां  
“श्रेणी लेखास्तुराजयः” इत्यमरः । ‘हृद्यवचसाम्’ हृद्यानि च  
तानि वचांसि च तेषां हृद्यङ्गमवचनानाम् । ‘लपितः !’ लपन-  
शील ! । ‘अमायासञ्चार !’ न विद्यते मायायाः—कपटस्य सञ्चारो  
यस्मिन् वा मायया सञ्चारो यस्य सः अशाळ्यप्रचारस्तस्म्बोधनम् ।  
‘उदितमदनमेघाऽनिल !’ मदनो मेघ इव मदनमेघः, उदित-  
उद्रूतो यो मदनमेघस्तस्य विघट्टने हेतुत्वात् । ‘अनिल !’ वायो !  
‘पितः !’ पातीति पिता तदामन्त्रणे जनकरूप ! निष्कारणहित-  
कारित्वात् । ‘नमे !’ परीषहादिनाऽनमनाश्रमिः, गर्भस्थितेऽस्मिन्न-

( १३२ )

श्रिभूपै रुद्धे पुरे भगवच्छक्तिपुण्यप्रेरितां प्राकारोपरिस्थितां प्रभुजननीः  
वीक्ष्य ते वैरिनृपाः प्रणता इति वा नमिस्तदामन्त्रणम् । हे नमिजिन ! ।  
'मम' मदीयं, आयासं—श्रमम्—भवभ्रमणक्षेशमित्यर्थः । 'वितन्वन्ति'  
विस्तारयन्ति । 'अघानि—पापानि' । "अघं दुःखे व्यसनैनसो"  
रिति हैमः । सततं नित्यम् । 'प्रविकिर,' निर्मलय ॥८१॥ अस्मिन्पदे  
शिखरिणीवृत्तम्, तलक्षणञ्चेदम् । "रसैरुद्वैश्लिङ्गा, यमनसभलगः  
शिखरिणी" ॥

### श्री नमिनाथनुः स्मरण—

**१. श्रोकार्थ—** कांचन समान हेहुनी कांति छेवाथी, स्कुरायमान  
विजली समान प्रला छे जेनी एवा हे ( नाथ ! ), हे भनेहुर  
प्रेक्षणीय ! ( हेवाधिहेव ! ), नाश कर्यो छे अभिमाननो जेष्ये  
एवा हे ( जिनेश ! ), भक्तिलावथी वंहन करनारी एवी भव्य  
प्राणीज्ञानी पंक्तिना संसारङ्गी भयने लेहनारां भनेहुर वय-  
नोना ओलनारा ( अर्थात् ) अभृतमय उपदेश आपनारा एवा  
हे एकवीसमा तीर्थंकर !, नथी भायानो संचार ( सर्वथा )  
जेने विषे अथवा नथी भाया-कपटवडे संचार जेने। एवा हे  
जिनेंद्र !, उद्य पामेला कामहेवरङ्गी मेघने ( विषेरी नाभवामां )  
पवन समान एवा हे जगहीश !, हे जनक-पिता !, हे नमि-  
नाथ !, तुं भुरा ( संसार भ्रमणुरूप ) प्रयासनो निरंतर  
विस्तार करनारां पापकर्माने विषेरी नाभ. अर्थात् सर्वथा निर्भूत  
कर. ॥८१॥ आ श्रोकमां तेभज आ पठीना त्रण श्रोकामां  
( शिखरिणी नामनुं वृत्त छे. तेतुं लक्षण आ प्रभाष्ये छे. आ  
वृत्तमां य, भ, न, स, अने लगणे एम पांच गणे छे अने  
छेवटना ऐ अक्षरे अनुकर्मे हुस्व अने हीर्ध छे. छहे अने अग्नी-  
यारमे अक्षरे विरामस्थान ( थति ) छे. आ वृत्तमां सत्तर अक्षरे छे.

( १३३ )

## जिनेश्वराणां विजयः—

नखांशुश्रेणीभिः कपिशितनमन्नाकिमुकुटः,  
 सदा नोदी नानामयमलमदारेरिततमः ।  
 प्रचक्रे विश्वं यः, स जयति जिनाधीशनिवहः,  
 सदानो दीनानाम—यमलमदारेरिततमः ॥ ८२ ॥

टीका—नखांश्विति—‘यः’ जिनब्रातः, ‘विश्वं’—जगत् । ‘इत-  
 तमः’ इतं—विनष्टं तमोऽज्ञानं शोको वा यस्य वा यस्मात्तत् इत-  
 तमः, “तमोन्धकारे स्वर्भानौ, तमः शोके गुणान्तरे” इत्यमरः ।  
 ‘गतमोह’ ‘प्रचक्रे’—चकार । यत्तदोर्नित्यसम्बन्धात्, ‘सः’ नखांशु-  
 श्रेणीभिः’ नखानां—करस्त्रहाणामंशवो मयूखास्तेषां श्रेणीभिः—सन्त-  
 तिभिः । ‘कपिशितनमन्नाकिमुकुटः’ कपिशिताः—पिशङ्गीकृताः नमतां—  
 नाकिनां मुकुटाः—किरीटा येन सः, “पिशङ्गः कपिशो हरिः” इति  
 हैमः । “मौलिः कोटीरमुष्णीषं, किरीटं मुकुटोऽव्ययाम्” श्लो० १३५,  
 इति वैजयन्ती । ‘नानामयमलमदारेः’ नाना अनेकरूपा ये आम-  
 याश्च मलाश्च—कर्मलेपाः मदाश्च—दर्पाः त एवाऽरथस्तेषाम् । (सदा)  
 सततं । ‘नोदी’ प्रेरणशीलः दूरीकरणस्वभाव इत्यर्थः । ‘दीनानां’  
 कृपणानाम् । ‘सदानः,’ दानेन सह वर्तते इति सदानः—दानसमेतः ।  
 दीनानां—दुःखितानां सदानः—अभयद्वानसहितो वा ।

### दानं पञ्चविधम्—

अभयं सुपत्तदाणं, अणुकंपा उचियं कित्तिदाणं च ।

दोहि वि मुक्खो भणिओ, तिन्नि वि भोगाइयं दिंति ॥ १ ॥

धर्मोपष्टमभ्जानाऽभयानुकम्पादानमित्यपि वदन्ति—ज्ञानाऽभयो-  
 पग्रहसहदानमितित्रिधाऽपि केचित् । यथा—

( १३४ )

ज्ञानाऽभयोपग्रहदानभेदा—तच्च त्रिधा सर्वविदो वदन्ति ।  
तत्राऽपि निर्वाणपथप्रदीपं, ज्ञानस्य दानं प्रवरं वदन्ति ॥ १ ॥

स्थानाङ्गठीकायां दशधा दानं निर्दिष्टम्—तथा च—अनुकम्पा—  
संग्रह—भय—कारण्य—लज्जा—गौरव—अधर्म—धर्म—करिष्यत्—कृतदा—  
नच्च । ‘अदारेरिततमः,’ अतिशयेन दारैः—कलैत्रैरितः—धैर्याच्चालितो  
दारेरिततमः, स यो न भवति इत्यदारेरिततमः । ‘अयं’ ‘जिना—  
धीशनिवहः,’ जिनानामधीशास्तेषां निवहः उभयत्र पष्ठीतत्पुरुषः ।  
जिनेन्द्रविसरः । “समूहो निवहव्यूह,—सन्दोहविसरब्रजाः”  
इत्यमरः । सदा, अजस्रम् । अलं, अतिमात्रं । ‘जयति,’ सर्वमतिशेते ८२

### जिनेंद्रोनो जय—

शेषाकार्थ—ज्ञेषु जगत्‌ने अज्ञान अथवा शोकथी मुक्ता क्युं,  
ते जिनेंद्रोनो सभूहु के ज्ञेषु पोताना चरण—नप्येना किञ्चित्तेजी  
पंक्तिच्छेवडे नमन करनारा देवेना मुकुटोने कपिल वर्णवाणा  
कर्या छे, तेमज अनेक प्रकारना रैणो, ( अष्टकर्मदीपी ) भव,  
तेमज मह—अलिमानदीपी शत्रुओनो वे निरंतर नाश करनारै  
छे, तेमज वे हीनजनोने ( सांवत्सरिक ) दान आपे छे, अथवा  
हुःखी प्राणीओने अलयहान आपे छे, अने वे किञ्चित् भाव  
पशु तश्यांखीओ वडे चलायमान थतो नथी ते आ जिनेंद्रोनो  
सभूहु निरंतर जय पामे छे ॥ ८२ ॥

### सिद्धान्तमहिमा—

जलव्यालव्याघ—ज्वलनगजरुक् बन्धनयुधो—

गुरुर्वाहोऽपाता—पदघनगरीयानसुमतः ।

कृतान्तस्त्रासीष्ट, स्फुटविकटहेतुप्रमितिभा—

गुरुर्वाहो ? पाता, पदघनगरीयानसुमतः ॥ ८३ ॥

( १३५ )

टीका—जलेति—‘अहो !’ इत्यामन्त्रणे । (भव्याः !) ‘अपाता-पदधनगरीयानसुमतः’ पातः—च्यवनं, न विद्यते पातश्च आपश्च अर्थं च पापं यस्यां सा अपातापदधा सा चासौ नगरी च अपातापद-धनगरी—युत्त्या मुक्तिरेव तस्यां यानं—प्रयाणं तस्मिन् सुमतः—सुषुसंमतः, इदं विशेषणं वाहस्यापि योजनीयम् । ‘गुरुः’ गृणाति हिताऽहितमिति गुरुः—महान् । वाहः—वाह्यत इति वाहः वाह इव वाहः तुरगः वाहो हि ग्रामादिगमने सुमतः । “ वाहो वाजी हयो हरिः” इति हैमः । ‘स्फुटविकटहेतुप्रमितिभाक्’ प्रमितयः—प्रमाणानि, हेतवश्च—कारणानि ते च प्रमितयश्च हेतुप्रमितयः, स्फुटाः—अविसंवादिनः शब्दतः विकटाः—अतिगम्भीरा: अर्थगहन-त्वाद् । अक्लिष्टा इति यावत् । या हेतुप्रमितयस्ता भजते यः सः । ‘ऊरुः,’ विशालः । ‘पाता,’ पातीति पाता—त्रायकः । दुर्गतिपत-नात्प्राणिनां रक्षकत्वात् ‘ पदधनगरीयान् ’ घनः—अर्थनिविडः, गरीयान्—महत्त्वाऽतिरेकेण युक्तः । पदेषु—वाक्याऽवयवेषु पद वा घनश्च गरीयांश्च । ‘ वा ’ वाशब्दश्चकारार्थे । कृतान्तः—कृतः अन्तो य निश्चयो यस्य सः—सिद्धान्तः । “ अन्तः स्वरूपे निकटे, प्रान्ते निश्चयनाशयोः । अवयवेऽपि ” इति हैमः । ‘ असुमतः ’ असवः—प्राणा विद्यन्ते येषां तान् । प्राणिनः । ‘ जलव्यालव्याघ—ज्वलनगरुक्बन्धनयुधः ’ व्यालो—भुजङ्गः रुक्—रोगो जलोदरादिः, बन्धनं—कारादिनिरोधः, युत्—संग्रामः, जलं च समुद्रादि व्यालश्च व्याघश्च ज्वलनश्च गजश्च रुक् च बन्धनं च युज्व तेषां समाहारस्त—स्माज्जलादेरुपसर्गात्, अर्थादष्टभयेभ्यः ‘ त्रासीष्ट ’ रक्षितात् । त्रैङ्-पालने धातोराशिषकर्त्यात्मनेपदीयप्रथमपुरुषैकवचने सीष्टप्रत्यये ‘ आत्सन्ध्यक्षरस्य ’ (सिद्ध० है० ४—१—१) इति आत्मम् ॥८३॥

( १३६ )

## सिद्धांतनो परिचय—

‘**शोकार्थ**—अहो ! ( लक्ष्यात्माच्यो ) ! अविद्यमान छे अधःपतन, आपत्ति अने पाप केने विषे एवी मुक्तिङ्गप नगरी तरक्षे गमन करवाभां, अत्यंत अलिष्ट, तथा भृत्यविशाल अने ईन्द्रियतस्थणे लक्ष ज्वाभां अथ समान वर्णी स्पष्ट, तथा विस्तृत छेतुच्यो—कारणे। तेमज्ज प्रभाण्याने लज्जनारे। ( अथवा शब्दोथी स्पष्ट अने अर्थाथी विकट एवा छेतुच्योना ज्ञानने लज्जनारे ) तथा विशाल, तेमज्ज रक्षण्य—पालन करनारे, पद्धोने विषे गड्हन अने भृत्यविशाली अथवा अर्थवडे गंभीर अने शब्दवडे गौरवतायुक्त पदवाण्या एवो। ( अर्हत ) सिद्धांत प्राणिच्योने जल, सर्प, व्याघ्र, अभि, हाथी, रौग, डेहभातुं अने युद्ध ( ए आठ ) अथथी जग्यावो—अर्थात् प्राणीभात्तुं संरक्षणु करे। ॥ ८३ ॥

## श्रीकालीदेव्याः स्तवनम्—

विपक्षव्यूहं वो—दलयतु गदाक्षावलिधरा,—

असमा नालीकाली—विशदचलना नालीकवरम् ।

समध्यासीनाऽम्भो—भृतघननिभाऽम्भोधितनया—

समानाली काली, विशदचलनानालिकवरम् ॥ ८४ ॥

**टीका**—विपक्षेति—‘गदाक्षावलिधरा’ गदां अक्षावलि—शब्दविशेषं च मालिकां चेतिद्वन्द्वः या दधाति सा। ‘असमा’ न समा असमेति नव्यतपुरुषेऽसद्वशी सौन्दर्यातिशयात्। ‘नालीकालीविशदचलना’ नालीकानां—कमलनामाली पङ्किः नालीकाली—पद्मश्रेणिस्तद्विशदौ—उज्जवलौ—चलनौ—चरणौ यस्याः सेति बहुब्रीहिः। “विसप्रसूतं नालीकं, तामरसं महोत्पलम्” इति हैमः ‘विशदचलनानालिकवरं’ विशद्विर्निलीयमानैरचलैः—स्थिरैः, नानालिभिर्विचित्रमधुकरैः

( १३७ )

कवरं—कर्बुरं यत्तत् “ कवरः करम्बो मिश्रः, कर्बुरः खचितस्तथा,  
 ‘ संपृक्तश्चित्रशबलौ ‘ इतिशब्दसिन्धुः ’ नालिकवरं, ’ प्रधानकमलम् ।  
 ‘ समध्यासीना ’—सम्यगधिरोहन्ती । ‘ अम्भोधितनयासमानाली ’  
 अम्भोधेस्तनया—लक्ष्मीस्तस्याः असमाना—अनन्यसमा, आली—  
 सहचरी या सा, तस्याः समाना आल्यः—सहचर्यो यस्याः सेति वहु-  
 ब्रीहिर्वा “ हरिप्रिया पद्मवासा, क्षीरोदतनयाऽपि च ” इति  
 हैमः । ‘ अम्भोभूतघननिभा ’ अम्भोभिर्वारिभिर्भूतो भरितो यो  
 घनो—मेघस्तद्वन्निभा—सदृशा कान्तिर्यस्याः सा इयामवर्णत्यर्थः निभः  
 स्यात्सदृशो व्याजे, ” इति हैमः । ‘ काली ’ कालिकादेवी । ‘ वः ’  
 युष्माकम् । ‘ विपक्षव्यूहः ’ अरिसमूहम् । व्यूहो निर्माणतर्कयोः ।  
 समूहे वलविन्यासे ” इति हैमः । दलयतु—पिनष्टु ॥ ८४ ॥

### कालीहेवीनी स्तवना—

१६४—गहा तेमજ जपमालाने धारण ठरनारी, वणी  
 सौंहर्यादिकमां निरूपम—सुंदर तथा कमलोनी श्रेष्ठि—पंक्ति समान  
 निर्भत छे चरण लेना, वकी लीन थनारा तेमज निश्चित एवा  
 विविध प्रकारना अभरोथी युक्ता एवा उत्तम कमल उपर ऐस-  
 नारी तेमज जलथी परिपूर्ण भेघना लेनी रथाम वर्णवाली अने  
 लक्ष्मी समान लव्य छे सणीए। लेनी एवी काली ( हेवी ) छे  
 कल्यात्माए। तमारा शत्रु सभूहनो नाश करे ॥ ८४ ॥

## २२ श्री नेमिजिनस्तुतयः—

अथ श्रीनेमिनाथाय नमस्कारः ।

चिक्षेपोर्जितराजकं रणमुखे यो लक्ष्यसंख्यं क्षणा—  
 दक्षामं जन ! भासमानमहसं राजीमती तापदम् ।

( १३८ )

तं नेमि नम नग्निर्वृत्तिकरं चक्रे यदूनां च यो-  
दक्षामञ्जनभासमानमहसं राजीमतीतापदम् ॥ ८५ ॥

### शार्दूलविक्रीडितम्

टीका—चिक्षेपोर्जितेति—‘यः’(विभुः) अक्षामं—नक्षाममक्षा-  
मं तत्—समर्थं । ‘लक्ष्मसंख्यं’ लक्ष्माः संख्या—प्रमाणं यस्य तत्,  
( अथवाऽलक्ष्यसंख्यं ) अविभाव्यपरिमाणम् । ‘ऊर्जितराजकं’  
ऊर्जोबलं सज्ञातमस्येत्यूर्जितं, राजां समूहो राजकमूर्जितञ्चतद्राजकं  
चेतिकर्मधारयः । “स सम्राट्थ राजकं” ॥ राजन्यकं च नृपति—  
क्षत्रियाणां गणे क्रमात् ॥ इत्यमरः । तत् बलिष्ठराजसमूहं ।  
‘रणमुखे’ रणस्य मुखमारम्भस्तस्मिन्, संग्रामारंभे “मुखं  
निःसरणे वक्त्रे, प्रारम्भोपाययोरपि” इतिविश्वः । ‘क्षणात्’  
अक्षेपण, ‘चिक्षेप’ निरस्तवान् । ‘यश्च’ ‘यदूनां’ यादवानाम् ।  
‘दक्षां’ असंमूढाम् । ‘राजीं’ श्रेणीं ( सेनां ) ‘अतीतापदं’  
अतीता आपदो यस्याः सा अतीताऽपद तां अतिक्रान्तविपदम् । ‘चक्रे’  
कृतवान् । ‘तं’ ( हे ) ‘जन !’ मानवसङ्क ! ‘भासमानं’  
विराजमानम् । ( अथवा जनैर्भासमानं ) ‘अहसं’ न विद्यते हसो  
हास्यं यस्य स इति वहुब्रीहिः, ‘हासस्तु हसनं हसः’ “घर्षरो हासि-  
का हास्यं, तत्राऽदृष्टरदे स्मितम्” इति हैमः । ‘अविद्यमानहासं’  
( अथवा जनभासमानमहसमित्येकं पदम् ) जनेषु भासमानं मह-  
स्तेजो यस्य तम् ।

‘राजीमतीतापदं’ राजीमती—उप्रसेनराजधारिण्योः सुता  
तस्या मनोरथविफलीकरणात् तापदं—तापं ददातीति तापदस्तं सन्ता-  
पदायिनं पश्चात्तु शिवसुखप्रदम् । ‘नग्निर्वृत्तिकरं’ नग्नाणां निर्वृत्ति—  
मोक्षसुखं वा करोतीति तम् “निर्वृतिः सुस्थितासौख्य—निर्बाणाऽस्त-  
ञ्जमाध्वसु” इति विश्वः ‘अञ्जनभासमानमहसं’ अञ्जनस्य भया—  
प्रभया—कज्जलकान्त्या समानं—सदृशं महस्तेजो यस्य तम् । “महस्त्-

( १३९ )

तस्वतेजसोः ॥ इतिविश्व० । ‘नेमि’ धर्मचक्रस्य नेमिवन्नेमिस्तं  
नेमिनामानं, “नेमि: कूपत्रिका प्रधिः तिनिशोऽरिष्टनेमिश्च” इति  
हैमः नेमिशब्द इत्रन्तोऽस्यस्ति, “नेमिनं नौमि भत्त्या” इति  
प्रयोगदर्शानात् । “नेमौ नेमीत्यपीक्ष्यते” इति हैमशिलोब्लेतीर्थ-  
कुतम्, ‘नम’ प्रणम ॥ ८५ ॥

अस्मिन्पदे शार्दूलविक्रीडितम् । तलक्षणं पूर्वं कथितम् ॥

### नेमिनाथ भ्रम्भुने नमस्कार—

**श्लोकार्थ—**जेणे अतिशय पराङ्मभी राज्याना एक लाभनी  
( अथवा अपरिमित ) संभायाना समूह ( सैन्य ) ने रणसं-  
श्रामना अथ लागमां क्षणुमात्रमां हठावी हीधुं, तेमज जेणे  
यादवेनी दक्ष-यतुरश्रेष्ठि ( सेना ) ने आपत्तिथी सर्वथा मुक्ता  
करी, ते ( ज्ञेषुषे ) शेषता, हास्य रहित राज्यमतीने ( तेना  
संयोगादिक भनेत्रयेना नाश करनारा हेवाथी ) संताप करनारा,  
( पठीथी भेदक्षमुख आपनारा ) नमन करनारा प्राणीयाने मुक्ति  
( अथवा सुख ) आपनारा, तेमज ( श्यामवर्णु हेवाथी )  
कर्जणी कांति समान भ्रमावाणा बावीसभा भ्रम्भु श्री नेमिनाथ  
भगवानने, हे जन ! तु नमस्कार कर ॥ ८५ ॥ आ श्लोकमां  
तथा तेना पठीना त्रण श्लोकामां शार्दूल विक्षिडित नामनु वृत्त  
छे. तेनु लक्षण प्रथम चाथा पृष्ठमां कहेलुं छे.

### जिनसमुदायस्य स्तुतिः ।

प्रात्राजीज्जितराजका रज हव ज्यायोऽपि राज्यं जवाद्-  
या संसारमहोदधावपि हिता शास्त्री विहायोदितम् ।  
यस्याः सर्वत एव सा हरतु नो राजी जिनानां भवा-  
यासं सारमहो दधाव पिहिता शास्त्रीविहायोऽदितम् ॥ ८६ ॥

( १४० )

**टीका—प्राब्राजीदिति—**‘या’ ‘जितराजका’ जितं—वशी-  
कृतं—पराजितं, राजकं—राजसमूहो यथा सा स्याद् राजपुत्रकं राज-  
न्यकं राजकमाजकम् ॥ इति हैमः । ‘संसारमहोदधावपि’ संसरणं  
संसारः स एव महोदधिस्तस्मिन्नपि, ‘हिता’ श्रेयस्करी । ‘शास्त्री’  
शास्ति सा शास्त्री—शिक्षादात्री, द्वासप्रतिकलाशिक्षणं पुरा भगवता  
प्रदत्तम्, यदिवा जीवाऽजीवादिशिक्षणदायिनी । ‘उदितं’ प्राप्तो-  
दयम् । ‘ज्यायोऽपि’ प्रशस्तमपि । ‘राज्यं’ राज्यव्यापारम् । ‘रज  
इव’ रेणुमिव । “रेणुर्द्वयोः स्थियां धूलिः पांशुर्ना न द्वयो रजः”  
इत्यमरः । “अथ रजसि स्युर्धूलीपांसुरेणवः” इति हैमः ।  
“रजेनाऽपि रजः सममिति” शब्दप्रभेदः । ‘जवात्’ तरसा ।  
‘विहाय’ त्यत्त्वा । ‘प्राब्राजीत्’ प्रब्रज्यामगृहीत् । ‘यस्याः’ (च)  
सकाशात् । ‘पिहिताशास्त्रीविहायः’ पिहिताः आशा एव स्थियो-  
दिग्बनिताः विहायो—ठ्योम च येन तत् । ‘अदितं’ न दितमदितं—  
अखण्डितम् । ‘सारमहः’ प्रधानतेजो—महार्हतेजः । ‘सर्वत एव’  
सर्वस्मादिति सर्वतः—समन्तादेव । ‘दधाव’ वेगाज्जवात् प्रससार ।  
‘सा’ ‘जिनानां राजी’ जिनेन्द्रश्रेणिः । ‘नः’ अस्माकम् ।  
‘भवायासं’ संसारविषादं । ‘हरतु’ अपनयतु ! ॥ ८६ ॥

### जिनश्रेष्ठीनी स्तुति—

**श्लोकार्थ—**पराल्पत—वश कर्या छे राजन्यो नेहें अवी वणी  
ने जिनश्रेष्ठी संसारङ्गी भडासागरमां पणु हितकारी हती,  
तेमज्ज ने ( अज्ञानङ्गी अंधकारमां रभडता भनुष्याहिक्ने धर्म  
देशनावडे ) शिक्षा—आध आपती हती अने ने ( जिनेवरोनी  
पंकितम्ये ) उद्यमां आवेला अर्थात् प्राप्त थयेला भोटा राज्यने  
पणु रज—धूलनी भाईक जलही त्याग करीने हीक्षा अहं उरी  
हती. तेमज्ज आच्छाहन कर्युं छे हिशायोऽपि स्त्रीमानुं अने

( १४१ )

આકાશનું જેણું એવું, તથા અણંદિત-અવિનિષ્ઠ રહેણું અને  
સારભૂત એવું જે જિનેં દ્રશ્યેણીનું તેજ-પ્રભાવ સર્વ સ્થળે પ્રસરી  
ગયું છે તે જિનેથરેની પંજીત સંસાર વિષે રખાડવારૂપ અમારા  
પરિશ્રમ-આચાસને હુરો અર્થાત् ફર કરો ॥ ૮૬ ॥

## જિનવાપણ મહત્વમ् ।

કુર્વાણાઽણુપદાર્થદર્શનવશાદ् ભાસ્વત્પ્રભાયાસ્ત્રપા—  
માનત્યા જનકૃત્તમોહરત ! મે શસ્તાઽદરિદ્રોહિકા ।  
અશ્વોભ્યા તવ ભારતી જિનપતે ! પ્રોન્માદિનાં વાદિનાં,  
માનત્યાજનકૃત તમોહરતમેશ ! સ્તાદરિદ્રોહિકા ॥ ૮૭ ॥

ટીકા—કુર્વણેતિ—‘આનત્યા’ પ્રણામેન હેતુના । ‘જન-  
કૃત્તમોહરત ! જનાનાં ભવ્યલોકાનાં કૃત્તે—છિન્ને મોહરતે—અજ્ઞાન-  
સુરતે ચ યેન સઃ તત્સંબોધનમ्, નનુ ભગવતોઽયમપુરુષાર્થઃ ?  
સુખસ્યાઽપિ ક્ષતેરિતિચેન્ન, અતિશયદુઃখાનુષ્ડ્યતયા સુખસ્યાપિદુઃખ-  
વદ્રેયત્વાત् । મધુદ્રોડમિશ્રિતાન્નભુક્તિત્વસુખવત् । યદ્વા કૃતં મોહરસ્ય  
સુખ્ય યેનેતિ વિવક્ષયા ન કોઽપિ દોષઃ । ‘કૃતિ’ સંછેદને ઇત્યસમા-  
દ્ધૂતે નિષ્ઠાક્તપ્રત્યયે કૃતઇતિસિદ્ધમ् । ‘ઈશ !’ સ્વામિન् ! ।  
‘જિનપતે !’ જિનાનાં પતિસ્તસંબોધનમ् જિનનાથ ! ‘અણુપદાર્થ-  
દર્શનવશાત्’ અણવઃ—અતિસૂક્ષ્મા યે પદાર્થી નિગોદજીવપરમાણવાદય-  
સ્તેષાં યદ્વ દર્શનન—દ્વયક્તીકરણ તસ્ય વશાત् સ્વાયત્તીકરણાત् । તદાન-  
યત્તભાવત્વાત्, હેત્વર્થે પદ્ધમી । “પ્રમિતિવિષયાઃ પદાર્થાઃ” ઇતિ વૈશે-  
ષિકાદ્યઃ । “પરસ્પરનિર્લુઠિતક્ષણક્ષયિલક્ષણનિરંશાઃ પરમાણવઃ”  
પદાર્થાઃ ઇતિ બૌદ્ધાઃ । ‘ભાસ્વત્પ્રભાયાઃ’ ભાસ્વતો રવેઃ પ્રભાઃ  
કાન્તિઃ તસ્યાઃ । ‘ત્રપાં’ બ્રીડામ । ‘કુર્વાણા’ કુરુત ઇતિ કુર્વાણ-  
જનયન્તી । ‘શસ્તા’ પ્રશસ્તા । ‘અદરિદ્રોહિકા’ ન વિદ્યન્તે

( १४२ )

दरिद्रास्तुच्छरूपाः ऊहा—वितर्का—यस्याः सा अदरिद्रोहिका । अत्र स्वार्थे कन्, अथवा शस्ताऽदरिद्रोहिका इत्येकं पदम् । ‘प्रोन्मादिनां’ प्रकर्षेणोन्मादो येषामस्तीतिप्रोन्मादिनः तेषामुन्मदवताम् । दर्पाऽसमझसचेष्टानामित्यर्थः । “ उन्मादश्रितविष्ववः ” इति हैमः । ‘ वादिनां ’ परतीर्थिकानाम् । ‘ अक्षोभ्या ’ क्षोभितुं योग्या क्षोभ्या, न क्षोभ्या अक्षोभ्येति नज् तत्पुरुषसमासः । अचाल-नीया चालयितुमशक्येत्यर्थः । ‘ मानत्याजनकृत् ’ मानस्य स्तब्धतायाः त्याजनं—मोक्षणं करोतीति सा । ‘ हस्वस्य तः पितॄकृति ’ (सिद्ध० है० ४—४—११३) इति सूत्रेण कृधातोः किपि तोऽन्तादेशे च कृदिति सिद्धम् । ‘ तमोहरतमा ’ अतिशयेन तमोऽज्ञानं हरति सा । ‘ तव ’ त्वत्संबन्धिनी । ‘ भारती ’ वाणी । ‘ मे ’ मम । ‘ अस-दिवामन्त्यं पूर्वं (सिद्ध० है० २—१—२५) इत्यनेनाऽऽमंत्रितस्याऽविद्यमानत्वेऽपि आनत्येतिपदमाश्रित्य मे आदेशः ‘ मे ’ इति षष्ठ्यन्तविभक्तिरूपकाऽव्ययत्वान्निपातेनाऽऽदेशाभाव इतिवा । ‘ अरिद्रोहिका ’ अरीणां—शत्रूणां द्रोहिकाद्रोहकारिका । ‘ स्तात् ’ भूयात् । ‘ अस् ’ भुवि सत्त्वायामितिधातोराशिषितुवः स्याने तु ह्योस्तातडाशिष्यन्यतरस्यामिति तातडादेशेस्तादिति सिद्धम् ॥ ८७ ॥

### जिनवाणीनो भहिभा—

“**लोकार्थ**—नमस्कार करवाथी नाश कर्त्तौ छे मनुष्योना भेड अने काभडेलिनो ( अथवा अज्ञान जन्य सुखनो ) ज्ञेणे एवा ( छे जिनेंद्र ! ) अति सूक्ष्म ( निगोद अने ज्ञाहि नवतत्त्व तेमज्ज परमाणु आहि ) पदार्थेनुं दर्शन करावीने सूर्यना प्रकाशने लक्जा करनारी, वगी ( अविसंवादी छेवाने लीधे ) वगाण्यवा येण्य, तेमज्ज प्रौढ छे तर्कौ ज्ञेने विषे एवी, अथवा प्रशस्त तेमज्ज भवतत्तर छे युक्तिअो ज्ञेमां एवी भद्रोन्मत्त वाहीअोथी

( १४३ )

पथु द्वेषाल नहीं पाभनारी, तथा प्रथाम कराववा वडे तेभना  
भानने लेहनारी, अज्ञानदृष्टि अंधकारने सदा हृनारी एवी हे  
नाथ ! तारी देशनाडृष्टि वाणी झुटा अंतर शत्रुओंनो संहार  
करनारी थाए। ॥ ८७ ॥

### अंबादेवयः स्तुतिः—

हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जनोऽभ्यागमद्—  
विश्वासेवितताम्रपादपरतां वाचा रिपुत्रासकृत् ।  
सा भूतिं वितनोतु नोऽर्जुनरुचिः सिंहेऽधिरूढोऽल्लसद्—  
विश्वासे वितताम्र पादपरताम्बा चारिपुत्राऽसकृत् ॥ ८८ ॥

टीका—हस्तेति—‘यस्याः’ अम्बायाः। ‘जनः’ लोकः।  
‘विश्वासेवितताम्रपादपरतां’ विश्वेन—जगता, आसेवितयोः ताम्रयोः  
रक्तयोः पादयोः—क्रमयोः—परतां—तदेकशरणताम्। ‘अभ्यागमत्’  
जगाम। ‘सा’ प्रसिद्धा देवी। ‘हस्तालम्बितचूतलुम्बिलतिका’  
हस्ते—करे आलम्बिता—गृहीता, चूतस्याऽऽम्रस्य लुम्बिरेव लतिका—  
शाखा यथा सा। “शिखा शाखा लताः समाः” इति हैमः।  
‘वाचा’ गिरा। ‘रिपुत्रासकृत्’ रिपूणां—वैरिणां त्रासं—भयमा-  
कस्मिकं भयं वा करोतीति रिपुत्रासकृत्। ‘अर्जुनरुचिः’ अर्जुनं—  
कनकं तद्वदुचिः—कान्तिर्यस्याः सा। “तपनीय चामीकरचन्द्रभर्माऽ-  
र्जुननिष्ककार्त्तस्वरकर्वुराणि” इति हैमः। ‘उल्लसद्विश्वासे’  
उल्लसतीति, उल्लसन्—जाग्रद्विश्वासो—विश्रम्भो यस्य तस्मिन्। ‘सिंहे’  
केसरिणि। अधिरूढा—आसीना। ‘वितताम्रपादपरता’ विततो  
विस्तीर्णो यः पादैः—मूलैः पिबतीति पादपञ्चूतरहस्तस्मिन् रता—आ-  
सक्तमानसा। ‘चारिपुत्रा’ चरत इत्येवं शीलौ चारिणौ—विहरण-  
शीलौ पुत्रौ यस्याः सा। ‘अम्बा’ अम्बिकादेवी। ‘नः’ अस्मा-

( १४४ )

कम् । ‘भूति’ सम्पत्ति “भूतिर्भस्मनि-संपदि” । इत्यमरः ।  
 ऋद्धिः विभूतिः सम्पत्तिः ॥ इति हैमः ‘असकृत्’ नसकृत्  
 असकृत् निरन्तरम् । ‘वितनोतु’ विस्तारयतु । ‘ततु’ विस्तार  
 इत्यस्मादादिःप्रेरणयोरितिलोट् प्रथमपुरुषैकवचनम् ॥ ८८ ॥

### अंभादेवीनी स्तुति—

**श्लोकार्थ—**जगतज्ञनेए अहु प्रेमथी सेवेदा तेमज्ज रक्षत  
 वर्णवाणा जे हेवीना अरण्युरुप शरणुने लोडे प्राप्त थया छे ( अर्थात्  
 लोडे ए जेतुं शरणु स्वीकार्युं छे ) ते अंभादेवी के जेणे हस्तमां  
 डेरीना अुभणावाणी आम्रवृक्षनी शाखा-लता अहुणु करी छे, तथा  
 जे हेवी वाणीवडे शत्रुओने वास आपे छे, ( अर्थात् जेनां वीर  
 शण्ड सांलणी शत्रुओनां हृदय लथभीत थाय छे ) वणी जेनी  
 कनक-सुवर्णु समान कांति छे, वणी जे हेवी उद्घास पामता विश्वास  
 सहित एवा सिंह उपर आउदृथयेती छे, तेमज्ज जे हेवी विस्तार  
 पामेदा आम्रवृक्ष उपर राणवाणी छे, अने जेना पुत्रो संचार-  
 गमन करवाना स्वभाववाणा छे, ते ( अंभादेवी ) अमारी लक्ष्मीनो  
 वारंवार विस्तार करे ॥ ८८ ॥

### २३—श्री पार्श्वजिनस्तुतयः—

#### अथ श्रीपार्श्वनाथप्रार्थना—

मालामालानवाहुर्धदधदरं यामुदारा मुदार,-

ह्लीनाऽलीनामिहाली मधुरमधुरसां सूचितोमाचितो मा ।

पातात्पातात्स पार्श्वो रुचिररुचिरदो देवराजीवराजी-

पत्राऽपत्रा यदीया तनुरतनुरवो नन्दको नोदको नो ॥८९॥

समधरावृत्तम्

**टीका—**मालामिति—‘यदीया’ यस्येयं यदीया—यस्य पार्श्व-  
 प्रभोः सम्बन्धिनी । ‘ततुः’ मूर्तिः । ‘देवराजीवराजीपत्रा’

( १४५ )

देवानां संबन्धिनी राजीवानां राजी—पङ्कजश्रेणिः सैव पञ्च—वाहनं यस्याः सा “ पत्रं वाहनपक्षयोः ” इत्यमरः । ‘ आपत्रा ’ आपदः सकाशात् त्रायते या सा । ‘ सः ’ ‘ आलानवाहुः ’ आलानाविव बाहु यस्य सः । ‘ मधुरमधुरसां ’ मधुरः मधुरसो मकरन्दरसो यस्यां सा ताम् । “ मधु मद्ये पुष्परसे ” शृङ्गारादौ विषे वीर्ये, गुणे रागे द्रवे रसः ” इत्युभयत्राप्यमरः । ‘ मालां ’ स्त्रजम् । ‘ अलीनां ’ भ्रमराणाम् । ‘ उदारा ’ प्रचुरा । “ उदारो दावृमहतोः ” इत्यमरः । ‘ मुदा ’ हर्षेण । ‘ आरात् ’ अन्तिके । “ आराहृसमीपयोः ” इतिविश्वः । ‘ अरं ’ शीघ्रम् । ‘ इह ’ अत्र । ‘ लीना ’ श्लिष्टा । ‘ आली ’ पङ्क्षः । ‘ अदधत् ’ पीतवती । ‘ तां मालां ’ ‘ दधत् ’ दधानः । ‘ सूचितोमाचितः ’ सूचिता—सुषु उचिता या उमा—कीर्तिः तया आसमन्तात् संयुक्तः । “ उमा सीता हैमवती, हरिद्राकीर्तिकानित्थु ” इति विश्वः । ‘ हचिरहचिरदः ’ हचिरा रुचिर्येषान्ते हचिरहचयः—कान्तद्युतयः रदा दन्ता यस्य सः । “ रोचिरुम्भरुचिशोचिरंशुगो—ज्योतिरर्चिरुपधृत्यभीशवः ” इति हैमः । ‘ अतनुरतः ’ अतनुर्योजनप्रमाणभूमौ श्रूयमाणत्वात् प्रौढोरवो—देशनाध्वनिर्यस्य सः । ‘ नन्दकः ’ नन्दयतीति नन्दकः समुद्दिजनकः आनन्दयिता वा । ‘ नोनोदकः ’ नोदयतीति नोदकः—क्षेपको न भवति । तथा भूतः ‘ पार्श्वः ’ स्पृशति—जानाति सकलं ज्ञानेनेति पार्श्वः ‘ स्पृश ’ संस्पर्शने पृष्ठोदरादित्त्वात्साधुः । त्रयो विशो जिनः । ‘ पातात् ’ भ्रंशात् । ‘ मां ’ ‘ पातात् ’ रक्षतु, ‘ पा ’ रक्षणे धातोराशिः—प्रेरणयोर्लोट् तुवः स्थाने ‘ तुद्योस्तातडितिसूत्रेण तातजादेशो सिद्धम् ’ ॥ ८९ ॥ अस्मिन् पद्ये स्वग्धरावृत्तं तलक्षणं पूर्वमुक्तम् ।

**श्री पार्श्वनाथने विज्ञाप्ति—**

**१ लेखाकृथ—**जेनी भूर्ति देवेाच्ये रथेकां कमलेआनी ५अंकित३पी  
१९

( १४६ )

વાહનવાળી છે, તેમજ જે મૂર્તિ આપત્તિમાંથી સંરક્ષણુ કરનારી છે, તે આદાન-ગજ સ્તંભ સરખા હુસ્તવાદા, તેમજ મધુર છે મકરંદનો. રસ જેમાં એવી જે ( પુષ્પ ) માલાનું, પ્રચુર અને હુર્ષલેર પાઈવાગમાં અત્યંત લીન થયેલી એવી બ્રમરોની શ્રેણી-પંચિત પાન કરતી હતી, તે માલાને ધારણુ કરનારા, વળી અતિ-શય ઉચ્ચિત-યોગ્ય કીર્તિવડ વ્યાસ, તેમજ જેના દાંતની ડાંતિ મનોહર છે એવા, વળી ( યોજન પર્યંત શ્રવણ ગોચર અને મેધના જેવી ગંભિર વાળી હોવાને લીધે ) પ્રૌઢ છે ધ્વનિ ( નાદ ) જેનો એવા, તથા આનંદહાયક ( અથવા સમૃદ્ધ આપનાર ) અને કલેશનો નાશ કરનાર એવા શ્રી પાઈવાનાથ જિનેશ્વર ( તેવીસમાં તીર્થંકર ) ( નરકાદિ ) અધઃ પતનથી મહારં રક્ષણુ કરેના ॥ ૮૬ ॥

## जिनेन्द्राणां स्तुतिः ।

राजी राजीववक्त्रा तरलतरलसत्केतुरङ्गत्तुरङ्ग-  
 व्यालव्यालग्नयोधाचितरचितरणे भितिहृद् याति हृद्या ।  
 सारा साराज्ञिनानामलममलमतेवोधिका माऽधिकामा-  
 दव्यादव्याधिकालाननजननजरात्रासमानाऽसमाना ॥९०॥

टीકा—રाजीति—‘યા’ ‘જિનાના’ જિનેશ્વરાણામ् ‘રાજી’ શ્રેणિઃ । ‘રાજીવ વક્ત્રા’ રાજીવમિવ વક્ત્રં—મુखં યસ્યાઃ સા રાજીવ વક્ત્રા—કમલાનના । “ પરં શતસહસ્રાભ્યાં, પત્રં રાજીવ પુષ્કરે ” ઇતિ હૈમઃ । ‘તરલતરલસત्केतુરङ्गત्तुરङ्गव्यालव्यालગ્નયોધાચિતર-ચિતરણે ’ અતિશયેન તરલાશ્વરલાઃ કેતવો ધ્વજાસ્તૈસ્તથા રઙ્ગન્તશ્રી તે તુરઙ્ગાશ્રી રઙ્ગતુરઙ્ગાસ્તેપાં રઙ્ગતુરઙ્ગાણાં વ्यાલાનાશ્રી—દુષ્ટદન્તિનાં વ્યાલગ્ના અભિઘટિતાઃ કૃતાઽવિરોહણા વા યે યોધાઃ સુભટા-સ્તૈરાચિત આકીર્ણઃ, રચિતઃ—કૃતો યો રણઃ—સંગ્રામસ્તસ્મિન् । “ વ્યાલઃ શઠે ભુજઙ્ગે ચ, શ્વાપદે દુષ્ટદન્તિનિ ” ઇતિવિશ્વ । ‘ ભીતિ-

( १४७ )

हृत्' भीति हरतीति भीतिहृत्-भयाऽपहारिणी । 'अतिहृद्या' अतीवहृदयङ्गमा । 'सारा' उत्कृष्टा । "सारः स्यान्मज्जनि बले, स्थिरांशोऽपि पुमानयम् ॥ सारं न्याय्ये जले वित्ते, सारं स्याद्वाच्यद्वरे" इति विश्व० ( अस्ति ) 'सा' 'अमलमते: ' अमला मतिर्यस्य सः अमलमतिस्तस्य निर्मलधियः । 'अलं' अतर्थम् । 'बोधिका' बोधयतीति बोधिका-बोधजनका । 'अव्याधिकालाननजननजरा-त्रासमाना' कालाननं-कालस्थाननं । यममुखं मरणमित्यर्थः । न विद्यते व्याधिश्च कालाननच्च जननच्च जन्मजरा च-विस्त्रसा त्रासश्च-भयं-मानश्च-अभिमानो यस्याः सेति बहुपदबहुत्रीहिः । 'असमाना' नविद्यते समानस्तुत्यः कोऽपि यस्याः साऽसमाना-अनुपमा । 'अधिकामात्' अधिकआसौ आमश्च रोगः अधिकाम-स्तस्माद् उत्कट रोगात् । "अमो रुक् तद्विदोः पुंसि, स्यादपकेऽन्य-लिङ्गकः" इति मेदिनी । ( अथवा आधिश्च कामश्चेति समाहार-द्वन्द्वस्तस्मात् । ) 'मा' मां । 'आराद्' अन्तिकात्, दूराद्वा । आराहूरसमीपयोरित्यव्ययम् । अलम् । 'अव्याद्' पायात् । 'अव' रक्षणे धातोराशिःप्रेरणयोरितिकर्त्तरि पस्मैपदे प्रथम पुरुषैकवचनम् ॥ ९० ॥

### जिनेंद्रोनी स्तुति—

**१. जिनेंद्रोनी**—जे जिनेन्द्रोनी श्रेष्ठि-पंडित इमल समान मुण्ड-वाली छे, तेमज ने अत्यंत चंचल तथा सुशोभित ध्वनियोवडे अने नाथता झूहता घोडायें तथा दुष्ट हाथीयें उपर आळठ थयेला एवा सुखटो ( घोड्हायें ) वडे व्यास तेमज तेमणे रथेला रणुसंग्रामना लयने हुरनारी, वणी जे अतिशय भनोहुर अने सारभूत तेमज निर्भल भतिवाला प्राणीयाने अतिशय घोध आपनारी, वणी रोग,-मरण, जन्म, जरा, त्रास-लय अने अभिमानथी रहित, तेमज उपमा रहित, एवी ते जिनेन्द्रोनी

( १४८ )

पंक्ति—श्रेष्ठि वृद्धि पामेका रैगथी ( अथवा मानसिक व्याधि अने विषय वासनाथी ) झुने हरस्थी वा सभीपथी भवावे ॥ ६० ॥

## जिनवाण्या: स्मरणम् ।

सद्योऽसद्योगभिद् वागमलगमलया जैनराजीनराजी—  
नूता नूतार्थधात्रीह ततहततमः पातकाऽपातकामा ।  
शास्त्री शास्त्री नराणां हृदयहृदयशोरोधिकाऽधिका वा—  
इदेया देयान्मुदं ते मनुजमनुजरां त्यजयन्ती जयन्ती ॥९१॥

टीका—सद्य इति । ‘ सद्यः ’ इटिति । ‘ असद्योगभिद् ’ असन्तमशोभनं योगं—कायादिव्यापारं, असद्धिर्वा असाधुभिर्योगं सम्बन्धं भिनत्ति या सा । ‘ अमलगमलया ’ अमलो—निर्मलो गमानां—सदृशपाठानां लयः श्लिष्टता यस्यां सा । ‘ इनराजीनूता ’ इना ईश्वराश्चकवर्त्तिवासुदेवादयः, पतयः, आदित्या वा तेषां राज्या—श्रेष्या नूता—स्तुता । “ इनः पत्यौ नृपार्कयोः ” इति मेदिनी । ‘ नूतार्थधात्री ’ नूता नवा—ये अर्थस्तेषां धात्री—धरण—शीला । अथवा नूताः स्तुता ये अर्थस्तान् दधातीति नूतार्थधात्री । “ अर्थोऽभिधेयरैवस्तु—प्रयोजननिवृत्तिषु ” इत्यमरः । “ अर्थः प्रयोजने चित्ते, हेत्वभिप्रायवस्तुषु । शब्दाऽभिधेये विषये, स्यान्नि-वृत्तिप्रकारयोः ” इति विश्व ० ‘ इह ’ अत्र । ‘ ततहततमः पातका-पातकामा ’ तताः—प्रसृताः हतास्तमश्च पातकं च अपातः—पतनरहितः कामश्च यथा सा । अपातकामेति पृथग्विशेषणं वा; नास्ति पातकं कामश्च यस्यां सा यद्वा पातकञ्च आमश्च पातकामौ न विद्यते पातकामौ यस्यां सा न विद्यते पातकामौ—पतनेच्छे यस्यां सेति वा “ कामः स्मरेच्छयोः काम्ये ” इति विश्व ० ‘ शास्त्री ’ शास्त्रस्येयं शास्त्री—शास्त्री—शास्त्रसंबन्धिनी । “ निर्देशग्रन्थयोः शास्त्रं ” इत्यमरः ।

( १४९ )

‘ नराणां शास्त्री ’ पुंसां शासिका । यद्वा शास्त्रीशा, शास्त्रं जानन्ति ते शास्त्रिणस्तेषां शास्त्रिणमीशा—स्वामिनी । स्त्रीनराणां, स्त्रीणां नराणां च । ‘ हृदयहृत् ॥ हृदयं हरतीति हृदयहृत् ॥ ’ ‘ हृज् ॥ हरणे इत्यस्मात् किपि ‘ पितिकृतिरुग् ॥ ’ इति तुगागमः । मनोहारिणी ‘ अयशोरोधिका ॥ ’ अयशसां रोधिका—प्रचारघातकारिका । ‘ अवाधिका ॥ ’ बाधत इति बाधिका न भवतीत्यबाधिका—अवाध—जनयित्री । ‘ आदेया ॥ ’ आदातुं योग्या, आदेया—प्राद्या । ‘ मनुजमनु ॥ मनुजं—मानवं अनुलक्षीकृत्य ‘ जरां ॥ —वयोहानि । ‘ त्याजयन्ती ॥ ’ मोचयन्ती । ‘ वा ॥ ’ च शब्दर्थे । ‘ जयन्ती ॥ ’ जयमासादयन्ती केनाऽप्यपरिभूयमानत्वात् । ‘ जैनराजी ॥ ’ जिनराजानामियं जिनराजसंबन्धिनी । ‘ वाग् ॥ ’ वाणी । ‘ ते ॥ ’ तुभ्यम् । ‘ आनन्दं ॥ ’ मुदम् । ‘ सद्यः इह ॥ ’ देयात् वितीर्यात् ॥ ९१ ॥

### जिन वाणी संबंधी विचार—

**श्लोकथ॑—**( मानसिक, वाचिक अने कायिक ) अशुभ व्यापारेनो ( अथवा हुष्टज्ञेनोना संसर्गेनो ) तत्काल नाश करनारी, वली निर्भूति अवा सदृशपाठ—आलापडनो लय—अङ्गता छे ज्ञेने विषे अवी, धनवानेनी पञ्चितवडे ( अथवा सूर्यचक्रवत्ता वासुदेव आहिनी पञ्चितवडे ) स्तुति करायेली, नवीन अर्थेने धारणु करनारी, ( अथवा स्तुति करायेला अर्थेने धारणु करनारी ) आ लोकमां नष्ट कर्यां छे विस्तार पाभेल अज्ञान तेमज्ज पापेनो ज्ञेणु अवी, तेमज्ज पतन अने अभद्रेवथी रहित, अथवा नथी विद्यमान पातक अने रोग ज्ञेने विषे अथवा नथी पात—अधःपात अने छाच्छा ज्ञेने विषे मनुष्येने शास्त्र संबंधी सङ्घोषाध आपनारी, तेमज्ज मनुष्येना चित्तने चोरनारी ( अथवा शास्त्रोनी स्वामिनी, तेमज्ज स्त्री अने पुरुषोना हृदयने हरनारी ) अपश्चित्तिने रोकनारी, उपद्रवने नहि उत्पत्त करनारी, ( अथवा आधा

( १५० )

रहित-अविद्या ) ( सर्वज्ञने ) अहंषु कृत्वा चेष्य, तेभज  
मनुष्योनी वृद्धावस्थानो त्याग करावनारी, अर्थात् मानवोने नृनन-  
नवीन चौकन आपनारी, अने जयवंती ओवी किनेश्वर संगवाननी  
वाणी ( हे अव्यज्ञन ! ) तने ( आ जगतभां जलही ) आनंद  
आपे ॥ ६१ ॥

### श्री वैरोद्धादेव्याः स्तुतिः ।

याता या तारतेजाः सदसि सदसिभृत् कालकान्तालकान्ताऽ  
पारि पारिन्द्रराजं सुरवसुरवधूपूजितारं जितारम् ।  
सा त्रासात् त्रायतां त्वामविषमविषभृद्भूषणाऽभीषणा भी-  
हीनाहीनाऽऽयपत्नी कुवलयवलयश्यामदेहाऽमदेहा ॥ ९२ ॥

टीका—यातेति—‘सदसि’ सभायाम् । ‘तारतेजाः’ तारं  
तेजो यस्याः सा तारतेजाः—उज्ज्वलप्रभा । “तारमुज्ज्वलस्ययोः”  
इति शब्दासिन्धुः । ‘सदसिभृत्’ सन्तं—शोभनमसि विभर्तीति  
सदसिभृत्—खड्गधारिणी ‘कालकान्तालकान्ता’ कालाः—इयामाः  
कान्ता मनोहरा अलकानां—केशानामन्ता अग्राणि यस्याः सा ।  
“अन्तः प्रान्तेऽन्तिके नाशे, स्वरूपेऽतिमनोहरे” इतिविश्वः ।  
‘जितारं’ जितं आरं—अरीणां समूह इत्यारम्, ‘समूहार्थेऽण् प्रत्ययः  
अरिसमूहो येन तम् । (अत एव) ‘अपारि’ अपगता अरयो विद्विषो  
यस्य सः अपारिस्तमपगतशत्रुम् । ‘पारिन्द्रराजं’ पारिन्द्राणां राजा  
पारिन्द्रराजस्तम्, ‘राजन्सखेः’ । (सिद्ध० है० ७-३-१०६)  
इत्यट् प्रत्ययः । अजगरेन्द्रं “चक्रमण्डलयजगरः, पारिन्द्रो वाहसः  
शयुः” इति हैमः । ‘याता’ प्राप्ता—गता । ‘सुरवसुरवधूपूजिता’  
सुष्ठु रवो यासां ताश्च ताः सुराणां वधवश्च तामिः पूजिता ।  
‘सा’ ‘अविषमविषभृद्भूषणा’ अविषमाः—सौम्याः विष-

( १५१ )

भृतः—सर्पा एव भूषणं—अलङ्कारो यस्याः सा । ‘अभीषणा’ नभीषयतीत्यभीषणा । अरौद्रा । ‘भीहीना’ भिया हीना—भयरहिता । ‘कुवलयबलयश्यामदेहा’ कुवलयानि—नीलोत्पलानि तेषां बलयं—समूहस्तद्वत्—इयामो देहो यस्याः सा । ‘अमदेहा’ अमदा—मद रहिता ईहा—चेष्टा यस्याः सा । ‘अहीनाश्यपत्नी’ अहीनां नागानामिनः प्रभुर्धरणेन्द्रस्तस्याऽश्यपत्नी—कलत्रप्रधानम् । वैरोळ्यादेवीत्यर्थः । धरणेन्द्रस्य षडग्रमहिष्यः, इति भगवतीसूत्रे, तन्नामानि च इला, शुक्रा, सदारा, सौदामिनी, इन्द्रा, घनविद्युता च, तत्रैकैकाया देव्याः पट् पट् देवी सहस्राणि परिवाराः प्रज्ञमाः । पद्मावती वैरोळ्या च द्वे नामान्तरे तासु स्त इति ज्ञायते । तथा चोक्तम्—“ॐ श्री पार्श्वनाथाय विश्वचिन्तामणीयते ह्रीं धरणेन्द्रवैरोळ्या पद्मावती देवीयुतायते ” । वैरोळ्यास्वरूपमाचारदिनकरे चोक्तम्—

“ खञ्जस्फुरत्स्फुरितवीर्यवद्धूर्ध्वहस्ता,  
सद्बन्दशूकवरदापरहस्तयुग्मा ।  
सिंहासनाब्जमुदतारतुषारगौरा,  
वैरोळ्याऽप्यभिधयाऽस्तु शिवाय देवी ”

‘त्वां’ भवन्तम् । ‘त्रासात्’ भयात् । ‘अरं’ शीघ्रम् । ‘त्रायतां’ रक्षतु । ‘त्रैङ्’ पालने धातोराशिःप्रेरणयोरिति कर्त्तर्यात्मनेपदे तुवः स्थाने तातडादेशः ॥ ९२ ॥

### वैरोळ्या देवीनी स्तुति—

‘त्वेाक्षार्थ—॥१॥ वैरोळ्यादेवी, सखामां उज्ज्वलं प्रकाश आपनारी छे, तेमજ उत्तम खर्जुने धारणु ४२नारी छे, वर्णी ज्वेना क्षेशना ग्रांत-अंतिम भागे ३४ाम अने सुंदर हीणे छे, तथा पराजित क्षेये छे शत्रु समूह ज्वेणु अेवा अने ( अे कारण्युथी )

( १५२ )

શત્રુ રહિત એવા અજગર રાજ ઉપર થેઠેલી છે, તેમજ જે મધુર શણદવાલી દેવાંગનાંયો વડે પૂજયેલી છે. તે નારેંદ્રની સુખ્યપત્તની અર્થાત् ધરણેંદ્ર નામે નારેંદ્રની પદ્મરાણી કે જ્ઞાનિનું સૈામ્ય ( મને-હું ) સર્વ ભૂષણું છે, વળી જે બયંકરતાથી રહિત છે, તેમજ જે નિર્ભય છે, જેનું શરીર નીલકન્ધના સમૂહ સમાન શ્યામ છે, અને ગર્વની જે ધચ્છા રાખતી નથી અર્થાત् જેની ચેષ્ટા મદ રહિત છે તે એવી તે ( વૈરેખ્યા નામની દેવી ) હે લંઘ ! તહું મને ત્રાસમાંથી જલદી બચાવો ॥ ૬૨ ॥

## ૨૪—શ્રીવીરજિનસ્તુતયઃ ।

અથ શ્રીવીરનાથાય વિજસ્તિઃ—

નમદમરશિરોરૂહસ્સસ્તસામોદનિનિદ્રમન્દારમાલારજોરજીતાંડ  
હે ! ધરિત્રીકૃતાંડ—  
વન ! વરતમસઙ્ગમોદારતારોદિતાંડનઙ્ગનાર્યાવિલીલાપદેહે  
ક્ષિતામોહિતાક્ષો ભવાન् ।  
મમ વિતરતુ વીર ! નિર્વાણશર્માણિ જાતાંવતારોધરાધીશ—  
સિદ્ધાર્થધામ્નિ ક્ષમાલઙુતાંડ—  
વનવરતમસઙ્ગમોદારતારોદિતાંડનઙ્ગનાર્યાવ ! લીલાપદે હે  
ક્ષિતામો હિતાંક્ષોભવાન् ॥ ૧૩ ॥

અર્ણવદણદકચુન્દઃ ।

ટીકા—નમદિતિ । ( હે ) ‘ નમદમરશિરોરૂહસ્સસ્તસામોદ-  
નિનિદ્રમન્દારમાલારજોરજીતાંડ—હે ? ’ નમન્તીતિ નમન્તઃ વર્ત્તમાને  
શત્રુપ્રત્યયઃ, તેવાં નમતામમરાણાં—સુરાણાં શિરોરૂહેભ્યઃ—શિરસિ  
રોહન્તીતિ શિરોરૂહાસ્તેભ્યઃ કેશેભ્યઃ સ્થસ્તાઃ—પતિતાઃ સામોદાઃ—  
સુરભ્યઃ—નિનિદ્રાણાં—વિકસિતાનાં મન્દરાણાં—દેવતરુકુસુમાનાં યા

( १५३ )

माला: सजस्तासां रजसा—परागेण रञ्जितावंही चरणौ यस्य स तदा-  
मन्त्रणे रञ्जिताऽहे ! पाटलितचरण ! ‘धरित्रीकृताऽवन !’ धरित्र्याः—  
पृथिव्याः कथञ्चिदभेदाद्धरित्रीगतलोकस्थ कृतमवनं येन स तदामन्त्र-  
णम्, कृताऽवन ! विहितरक्ष !। “धात्री धरित्री धरणी” इति हैमः ।  
“धरित्री धरणी विश्वं, लोकः क्षेमेषु शाश्वतं” इतिव्याडिः । ‘असङ्ग-  
मोद ! सङ्गश्च मोदश्च ताभ्यां रहित ! अथवा सङ्गाद्यो मोदः स  
नास्ति यस्य स तदामन्त्रणम् । ‘अरत !’ असक्त ! । ‘अरोदित !’  
रोदितरहित ! । ‘अनङ्गन, ’ अङ्गनावर्जित ! । ‘आर्याव !’ आर्यान्—  
सङ्गनानवति यस्तस्यामन्त्रणम् । ‘हित’ हितकारिन् ! । ‘हे वीर !’  
वर्धमान ! विशेषण ईरयति—नाशयति शत्रून् कामादीनिति वीरः,  
“विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च,  
तस्माद्वीर इति स्मृतः ॥” इति धर्मसंग्रहे । विपूर्वक ‘ईर’ गतिप्रेरण-  
योरित्यस्मात्पचाव्यचि सिद्धम् । विशिष्टा चासौ ईर्लक्ष्मीश्च तपोरूपा,  
तीर्थकृत्रामकमोदयसमुद्भूता वा वीस्तया राजत इति वीरो वा । यद्वा  
ईरणमीरः ‘ईर् गतौ’ भावे घञ् । ‘ये गत्यर्थास्ते ज्ञानार्थाः  
प्राप्यर्था’श्चेति वचनात् विशिष्टः ईरो—ज्ञानमस्य स वीरः, यद्वा  
विशिष्टा पञ्चत्रिशत्रागगुणोपेता इरा—वाणी यस्येति “इराऽस्मो-  
वाक्तुराभूमिषु; ” इति हैमः वा कर्मशत्रुजेतृत्वाद्विशितपराक्रमो  
वा वीरः । यद्वा निरुक्तिवशात् कर्मतिविदारणाद् वीरस्तस्य

१ मूलमिधातः खलु वर्धमानो,  
देवार्यनाम्नाऽमिदधे प्रजामिः ॥  
वीरः पुनर्वीरतया प्रसिद्धः,  
स सन्मतिश्चात्तसुतोऽप्यभावि ॥ (२)  
प्राचीनवर्णाश्रमवर्त्मना स्वां,  
गति तनोति त्रिशलाङ्गजन्मा ॥  
चतुष्वसौ विश्रमाश्रमेषु,  
कुर्वन् क्रमादन्तत एति पूर्णम् ॥ (३) इति वीरविभूतिः ॥

( १५४ )

संबोधनं हे वीरप्रभो ! । ‘ वरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्थव-  
लीलापदेहेक्षितामोहिताक्षः । ’ अतिशयेन वरा इति वरतमा—प्रधान-  
तमा सङ्गमस्य—सङ्गमनाम्नो वैमानिकसुरस्य सम्बन्धिनी उदारा  
च तारा च, अथवा वरतमः सङ्गमः—समागमो यस्याः सा  
वरतमसङ्गमा, उदारतारा—अदीनलोचनकनीनिका, ‘ उदिताऽनङ्गा, ’  
उदितः अनङ्गो यस्याः सा, उद्गतकामा या नार्थवली—नारीणामावली  
श्रेणिस्तस्या लापेन—जलिपतेन, देहेन, ईक्षितेन च अमोहितानि  
अक्षणि—इन्द्रियाणि यस्य सः । अथवा हे वरतम ! श्रेष्ठतम !  
इति पृथक्पदम् । ‘ क्षमाऽलङ्कृतौ ’ क्षमाया भुवः अलङ्कृतौ अल-  
ङ्कारभूते । “ क्षितिः क्षोणी क्षमाऽनन्तो ” इति हैमः । ‘ लीला-  
पदे ’ लीलानां—विलासानां पदं स्थानं तस्मिन् । ‘ धराधीशसिद्धार्थ-  
धाम्नि ’ धराधीशः—क्षितिपतिर्यः सिद्धार्थाऽभिधानस्तस्य धाम्नि—  
गृहे । ‘ जाताऽवतारः । जातोऽवतारो यस्य स जाताऽवतारोऽव-  
तीर्णः । ‘ क्षितामः । ’ क्षितः क्षयं नीतः । आमो रोगो येन सः  
क्षितामः—क्षयपितरोगः । ‘ अक्षोभवान् ’ नास्ति क्षोभोऽस्येत्यक्षोभवान्—  
भयरहितः । ‘ भवान् ’ त्वम् । ‘ मम ’ मे । ‘ निर्वाणशम्र्माणि ’  
निर्वाणस्य—मोक्षस्य शम्र्माणि—सुखानि । “ निर्वाणं ब्रह्म निर्वृतिः ”  
इति हैमः । ‘ अनवरतं ’ निरन्तरम् । ‘ वितरतु ’ प्रयच्छतु ॥ ९३ ॥

अस्मिन्नयेऽर्णवदण्डकवृत्तमस्ति ॥

तत्त्वश्नणब्र—

यदिह नयुगलं ततः सप्तरेकास्तदाचण्डवृष्टिपातो भवेद् दण्डकः ।  
प्रतिचरणविवृद्धरेकाःस्युर्णाऽर्णवव्यालजीमूलीलाकरोहामशङ्गादयः॥

इति वृत्तरत्नाकरे ।

श्री वीरभुने विनांति—

**१ लोकार्थ—** नमन उरता हेवोना डेश उपरथी पडेली, तेमज्ज  
सुवासित अने विकसित एवी भंहारनी अर्थात् कवचवृक्षना कुसु-  
भानी भाणाओना परागवडे रंगायेला छे थरण्हे जेना एवा

( ૧૫૫ )

( હે દેવાધિહેવ ! ) પૃથ્વીનું અથવા પૃથ્વીવાસી પ્રાણીઓનું રક્ષણ કર્યું છે જેણે એવા હે ( પ્રલો ! ) સ્વીસંગથી તથા ( ઈષ્ટની પ્રામિથી થતા ) હર્ષથી રહિત ( અથવા અવિદ્યમાન છે સંસાર ) સંગનો હર્ષ જેને વિષે એવા અથવા સંગતિથી ઉત્પજ્ઞ થતા હર્ષથી રહિત, અર્થાત् સ્વતંત્ર સુખનો અનુભવ કરનારા, અથવા હે અનિષ્ટ સંગથી સુકૃત થયેલા ! હે હર્ષદ્વાયક ! ( સ્વભિન્ન ) હે ( વિષયથી ) અનાસક્તા ! -આસક્તિ રહિત ! હે દૃદ્ધન રહિત ! અર્થાત્ શોક રહિત ! હે સ્વીએથી વિમુખ ! હે આર્થજનોના રક્ષક ! હે હિતકારી ! હે વીર ! વિશેષ કરીને કામાહિ શત્રુઓના નાશ કરનાર, અથવા વિશેષ લક્ષ્મીવડે શોભતા એવા ( જિનેશ્વર ! ) હે ઉત્તમ ( જગદીશ ! ) તેમજ સંગમ નામના દેવે અનુકૂલ ઉપસર્ગ કરવા માટે વિકુર્વેલી એવી, ઉદ્ધાર તેજસ્વી અને કામો-દીપક કામિનીએની શ્રેણિનાં સંલાષ્ણ તથા દેહના અવલોકનથી નથી મોહ પામી ઈદ્રિયો જેની, અથવા અલ્યાંત પ્રિય છે સંગતિ જેની એવી તથા વિશાળ છે નેત્રોની કીકી તારાએ જેમની એવી અને ઉહિત-પ્રગટ થયો છે મદન ( કામ ) જેમને વિષે એવી મહિલા-સ્વીએની પંક્તિના આલાપ, હેહ અને અવલોકનવડે અમોહિત છે ઈદ્રિયો જેની એવા, અથવા અતિ ઉત્તમ છે સંગતિ જેની એવા હે ( ત્રૈલોક્યપતિ ! અદીન છે નેત્રની કીકીએ જેની એવી, તેમજ કામાતુર સ્વીએની પંક્તિના સંલાપ તથા દેહના દર્શનવડે ( પણુ ) મોહ નથી પામી ઈદ્રિયો જેની એવા ( અથવા હે વરતમ ! અતિશય શ્રેષ્ઠ ! વળી પૃથ્વીમંડળના ભૂપણુરૂપ અને કીડાના સ્થાનરૂપ એવા સિદ્ધાર્થ રાજના ભવનમાં જન્મ થયો છે જેનો એવા, તેમજ નાષ થયો છે રોગ જેનો, વળી દ્વોલ રહિત એવા ( હે પ્રલો ! ) આપ મણે નિર્વાણ ( મોક્ષ ) નાં સુખ આપો ॥ ૬૩ ॥ આ શ્લોક પણીના ત્રણ શ્લોકો અર્થવદંડક છંદમાં છે, તેનું લક્ષણ નીચે મુજબ —

કે પાદમાં પ્રથમ એ નગણુ હોય ત્યારખાઈ સાત રગણુ હોય તો તે ચંડવૃષ્ટિ પ્રપાત હંડક કહેવાય છે તેમાં ( ૨૭ ) અશ્વર હોય છે, તેમજ એ નગણુ અને ( ૮ ) રગણુ આવે તો તે ( ૩૦ )

( १५६ )

અક્ષરને અર્થાદંડક કહેવાય છે. વળી એ નગણું અને ( ૬ ) રગણું  
હોય તો તે અર્થાદંડક કહેવાય છે એમાં ( ૩૩ ) અક્ષરો આવે  
છે—તેમજ એકેક વધારે રગણું આવે તો અનુકૂળે તે દંડકોને  
વ્યાલ—જીભૂત—લીલાકર—ઉદામ અને શાખનામે એણખાય છે—

## जिनसमूहस्य स्तुतिः ।

समवसरणमत्र यस्याः स्फुरत्केतुचक्रान्-  
कानेकपद्मेन्दुरुक्-चामरोत्सर्पिसालत्रयी-  
सदवनमदशोकपृथ्वीक्षणप्रायशोभा-  
तपत्रप्रभागुर्वराराद् परेताहितारोचितम् ।  
प्रवितरतु समीहितं साऽर्हतां संहतिर्भक्तिभाजां  
भवाभ्योधिसंब्रान्तबव्यावलीसेविताऽ-  
सदवनमदशोकपृथ्वीक्षणप्रा यशोभातपत्र-  
प्रभागुर्वराराद् परेताहितारोचितम् ॥ ९४ ॥

टीકा—समवसरणमिति—‘ यस्याः ’ जिनश्रेण्याः । ‘  
स्फुरत्केतुचक्रानकानेकपद्मेन्दुरुक्-चामरोत्सर्पिसालत्रयीसदवनमदशोक-  
पृथ्वीक्षणप्रायशोभातपत्रप्रभागुरु ’ કेतुः—धर्मध्वजः, ચक्र—धर्म-  
ચक्र, આનકો દેવदुન्दुમિ:, અનેકપद્માનિ—સુરનિર્મિતપઙ્કજાનિ,  
ઇન્દુરુક् ચામરાણિ, ચન્દ્રાડવાતપ્રકીર્ણકાનિ, “ ચામરં બાલબ્યજનં  
રોમપુચ્છપ્રકીર્ણકમ् ” ઇતિ હૈમઃ । ઉત્તસર्पिणી ચાસૌ સાલાનાં—વપ્રાણ-  
ત્રયી—પ્રવૃદ્ધપ્રાકારત્રયી, સદવનમદશોક:—પ્રધાનાડવનમદશોકતરુ:,  
પृથ્વીક्षणપ્રાયશોભા—મેદિન્યુત્ત્સવભૂતચ્છાયા, આતપત્રાણિ—છત્રત્રયં,  
પ્રભાકાન્તિ:, સ્ફુરન—વિભાજમાનઃ, કેતુશ્ર ચક્રં ચ આનકશ્ર, અને-  
કાનિ ચ તાનિ પદ્માનિ ચ, ઇન્દુરુક् ચામરાણિ ચ, ઉત્તસર्पિસાલ-  
ત્રયી ચ, સન्—શોભનઃ અવનમન् પલ્લવાદિપ્રાગ્ભારેણ ખર્વીભવન्  
અશોકશ્ર, પृથ્વીક्षણપ્રાયશોભા—પૃથ્વ્યાઃ-સુવઃ ક્ષણપ્રાયશોભા—ઉત્તસવ-

( १५७ )

कल्पशोभा च, आतपत्राणि—छत्रत्रयं च, प्रभा च ताभिर्गुरु—महार्हम्। “ सालः पादपमात्रे स्यात् प्राकारे ” इति विश्वः । ‘ परेताहिता-रोचितं ’ परेताः—अपगताः; अहिताः शत्रवो येषां तैर्मुनिभिरारोचित-मुपशोभितम् । अथवा परा—प्रधाना इताहिता इताः—नष्टा अहिताः शत्रवो यस्याः सेति विशेषणद्वयमहृत्संहत्याः । ‘ आरोचितं ’ अरन्ति—संसारपारं गच्छन्तीत्यरा मुनयस्तेषां समूह आरं तस्य मुनिसमुदायस्योचितम् । “ आरः शत्रुसमूहे ना, अमणे मुनिवृन्दके । तथा रीरी शनिभैमः ” इति शब्दसिन्धुः ‘ रोचितं ’ शोभितम् । ‘ यशोभातपत्रप्रभागुर्वराराट् परेताहितारोचितम् ’ यशसा—कीर्त्या भातानि—शोभितानि पत्राणि गजाश्वसुखासनादीनि वाहनानि तानि प्रभजन्तीति यशोभातपत्रप्रभाजः, “ पत्रं स्याद्वाहने पर्णे, पक्षे च शरपक्षिणोः ” । इति मैदिनी । एतादृशा ये उर्वराराजः—पृथ्वीपालाः परेताः—पिशाचा व्यन्तरदेवविशेषाः, अहयो नाग-कुमाराः, ताराः—ज्योतिषिकाः, यशोभातपत्रप्रभागुर्वराराजश्च परेता श्च अहयश्च ताराश्चेतीतरेतद्बुद्धस्तेषामुचितं—योग्यम् । “ यत्र-द्वित्वं बहुत्वं च, स द्वन्द्व इतरेतरः समाहारो भवेदन्यो—यत्रैकत्वं नपुं-सके ॥ १ ॥ ” ‘ समवसरणं ’ सुरकृतं तीर्थकृतां देशनास्थानम् । ‘ अत्र ’ इह । ‘ अराराट् ’ अतिशयेन व्यराजत् । ‘ राजृ ’ दीप्ती, अनद्यतने कर्त्तरि परस्मैपदे यड्लुगन्तरूपम् । ‘ सा ’ ‘ भवाम्भोधि-सम्भ्रान्तभव्यावलीसेविता ’ भव एवाऽस्मोधिः—समुद्रस्तस्मिन् संध्रान्ता—व्याकुलीभूता या भव्यानामावली—श्रेणिस्तया सेविता, ‘ असद्वन्मदशोकपृथ्वी ’ सह दवनेन वर्तते सदवना च सोपतापा च मदशोकाभ्यां च पृथ्वी च । वितता या न भवति सा । ‘ ईक्षणप्रा ’ ईक्षणानि—नेत्राणि प्राति—पूरयति—आप्यायति या सा । अथवा ईक्षणानि—ज्ञानानि प्राति—ददातीति ईक्षणप्रा । ‘ अहतां ’ तीर्थकृताम् । संहतिः ’ समुदायः । ‘ भक्तिभाजां ’ अनुरागजुषाम् । ‘ समीहितं ’ वाच्छितम् । ‘ प्रवितरतु ’ प्रयच्छतु प्रकर्षेण विदधात्वित्यर्थः ॥ ९४ ॥

( १५८ )

## जिनसमूहनी स्तुति—

**१. लोकार्थ—** स्कुरण्यायमान (धर्म) धृज, (धर्म) चक्र (हेव) हुंडलि, अनेक ( हेवोचे रथेलां सुवर्ण ) कमल, चंद्र जेवी कांति-वाला चामर, विस्तार पामता ( रत्न, सुवर्ण अने इपाना ) त्रिषु किद्वाच्चा, तेमज उत्तम तथा ( पुण्य, पत्र अने इलना लारथी ) नमन करता अशोक ( वृक्ष ) अने पृथ्वीने विषे उत्सव दृप छे शोला जेनी एवां त्रिषु छत्रोनी कांतिवडे अमूल्य एवुं, तेमज नष्ट थया छे शत्रुच्चा जेना एवा ( मुनिच्चा ) वडे अत्यंत शोलायमान, ( तेमज संताप, गर्व अने शोकथी रहित छे भूमि जेनी एवुं ) तथा कीर्तिवडे सुशोभित एवां ( हाथी घाडा आहि ) वाहनेने सेवनारा राज्येत्तेन ( भूत, प्रेत अने पिशाचेने, नाग (हेवा) ने तेमज ज्येतिष्ठ देवोने योग्य एवुं जे ( जिन पंक्तितुं ) समवसरण आलोकमां वारंवार शोलतुं हुतुं, ते जिनेश्वरोनो समुदाय के जे संसारउपी झागरमां संब्रांत थयेला लव्य ( शुद्धोनी ) पंक्तिवडे अत्यंत सेवित छे. तेमज जे सर्वथी उत्कृष्ट छे, जेना शत्रुच्चा नष्ट थयेला छे, तथा जे संताप, अक्षिमान अने शोकथी लेवायेल नथी, अने जे शान अने दर्शन आपनार छे, ते तीर्थंकरोनो समूह लक्तज्ञेनाम भनेवांछितने पूर्णु करै ॥ ६४ ॥

## श्रीभारत्यै प्रार्थना

परमततिमिरोग्रभानुप्रभा भूरिभङ्गभीरा  
भृशं विश्ववर्ये निकाश्ये वितीर्याच्चराम् ।

अहति मतिमते हि ते शस्यमानस्य वासं  
सदाऽतन्वतीतापदानन्दधानस्य सामानिनः ॥  
जननस्मृतिरङ्गनिष्पारसंसारनीराकरान्त-

( १५९ )

निंमज्जनोत्तारनौर्भास्ती तीर्थकृत् ?  
 महति मतिमते हितेशस्य मानस्य वा संसदा  
 तन्वती तापदानं दधानस्य सामानि नः ॥ ९५ ॥

टीका—परमतेति । ‘अतन्वतीतापत्’ अतन्वयः विपुलाः  
 अतीता आपदो यस्य सः यस्माद्वा तदामन्त्रणम् । (मतिमते  
 हित ! विदुषे हितकारिन् !) (हे) ‘तीर्थकृत्’ तीर्थाधीप ! ।  
 ‘हि’ निश्चयेन । ‘शस्यमानस्य’ शस्यतेऽसौ शस्यमानस्त-  
 स्य’ वर्तमाने कर्मणि शानच् । स्तूयमानस्य । ‘आनन्दधानस्य’  
 आनन्दस्य धानं—पदं तस्य प्रमोदस्थानस्य । ‘अमानिनः’ निरह-  
 ङ्कास्य । अथवा सामानिनः इत्येकं पदं, सहाऽमानिभिः—दर्परहितै-  
 वर्तते यस्तस्य । ‘ईशस्य’ स्वामिनः । ‘नः’ अस्माकम् । ‘सा-  
 मानि’—प्रियाणि । ‘दधानस्य’ धर्त्तेऽसौ दधानस्तस्य पुष्टिः ।  
 “ते” तव । ‘सा’ तथा भूता । ‘परमतिमिरोप्रभानुप्रभा’  
 परमतान्येव परेषां वौद्धादीनां मतानि परमतानि तान्येव तिमिराणि  
 तेषां ध्वंसहेतुत्वात् उप्रभानोस्तिगमांशोः प्रभा—कान्तिकल्पा ।  
 ‘भूरिभूर्गभीरा’ भूरिभिः प्रचुरैर्भूर्गर्थविकल्पैर्भूशं गभीरा दुर्ग्राह्या ।  
 ‘जननमृतितरङ्गनिष्पारसंसारनीराकरान्तर्निंमज्जनोत्तारनौः’ जन-  
 नानि च मृतयश्च ता एव तरङ्गा यस्य स जननमृतितरङ्गः स चासौ  
 निष्पारसंसारनीराऽकरश्च—तीररहितभवाबिधश्च तस्याऽन्तर्निंमज्जतां  
 जनानामुत्तारे नौद्रेणीभूता । ‘मतिमतेहिता’ मतिमता—प्रज्ञावता  
 ईहिता—समीहिता (अथवा हे हित !) मानस्य संसद्वा मानस्य—पूजायाः  
 संसद्वा—सभा इव “मानं प्रमाणे प्रस्थादौ, मान श्रितोनतौ ग्रहे ॥  
 मानः स्यादपि पूजायां, इति शब्दसिन्धुः “मन्ये शङ्के ध्रुवं प्रायो—  
 नूनमित्येवमादिभिः । उत्प्रेक्षा व्यज्यते शब्दैरिव शब्दोऽपि तादृशः ॥ ११ ॥  
 “वा प्रचेतसि जानीया—दिवार्थे च तदव्ययम्” इति मेदिनी ।

( १६० )

( इवार्थे वा शब्दः ) तापदानं तापस्य संतापस्य दानं खन्डनम् ।  
 ‘आतन्वती’ विस्तारयन्ती ‘भारती’ वाणी । ‘विश्ववर्ये’  
 विश्वस्मिन् सर्वत्र वर्ये-प्रधानं यत्तस्मिन् । ‘महति’ विस्तीर्णे ।  
 ‘अतिमते’ अतिशयेन मते—अभीष्टे ।

‘अहतिमति’ अविद्यमानहनने । अथवा अहति—अविद्यमान-  
 विश्वातमिति द्वितीयान्तं वासस्य विशेषणम् । ‘निकाच्ये’ निवासे ।  
 “मन्दिरं सदनं सद्य, निकाच्यो भवनं कुठः” इति हैमः “गृहाः  
 पुंसि च भूम्नयेव, निकाच्यनिलयालयाः” इत्यमरः । मोक्षे  
 इत्यर्थः ‘वासं’ आश्रयं, ‘सदा’ अजस्रम् । ‘वितीर्यात्तराम्’  
 अतिशयेन वितरतु ॥ ९५ ॥

### भारती देवीनी प्रार्थना—

**१. लोकार्थ—** निवृत्त थर्धे छे झेणारी विपत्तिया जेनी अथवा  
 (जेनाथी) विद्वानोने हितकारी ! ऐवा तीर्थं कर ! निश्चये करीने मनुष्य  
 अने हेव दानयोवडे ) स्तुति करयेदा, तथा आनंदना निवास इप,  
 तेमज निरलिभानी अथवा गर्वरहित ऐवा मुनियांचितने धारणु करनारा  
 वणी सर्वशक्तिमान्, तथा अमारां भनेवांचितने धारणु करनारा  
 ऐवा तम्हारी; ऐस्त्र आहि अन्यमतइप अंधकारनो। नाश करवामां  
 प्रयंड सूर्यसमान कांति छे जेनी ऐवी, वणी नाना प्रकारना अर्थ  
 विकल्पे वडे अत्यंत गंभीर, वणी जन्म अने मरणुइपी तरंगे  
 छे जेमां ऐवा अपार संसार समुद्रमां द्रुष्टता मनुष्योनो उद्धार  
 करवामां नौका समान, तेमज भुद्धिशालीने अलीष ऐवी, वणी  
 संभान—पूजनी जाणू सक्षा हेयने शुं तेवी, तेमज संतापनो उच्छेद  
 करनारी वाणी, विश्वमां सर्वेत्तम, ( पिस्तालीश लाभ योजन  
 पर्यंत ) विस्तारवाला, अतिशय धृच्छवा लायड अने नाशरहित  
 ( मोक्षइप ) धरने विषे, नाशरहित ऐवा निवास निरंतर अमने  
 आपे ॥ ६५ ॥

( १६१ )

## श्री अम्बिकादेव्याः स्तुतिः—

सरभसनतनाकिनारीजनोरोजपीठीलुठ—  
 तारहारस्फुरद्रश्मिसारकमाम्भोरुहे ?,  
 परमव सुतराङ्गजास्तरावसन्नाशितारातिभाराऽजिते  
 भासिनी हारतारा बलक्षेमदा ।  
 क्षणरुचिरुचिरोरुचञ्च त्सटासङ्गटोत्कृष्ट—  
 कण्ठोङ्गटे संस्थिते ! भव्यलोकं त्वम्भाऽम्बिके!,  
 परमवसुतरां गजारावसन्ना शितारातिभा  
 राजिते ! भासि नीहारतारावलक्षेऽमदा ॥ ९६ ॥

टीका—सरभसेति । ‘ सरभसनतनाकिनारीजनोरोजपीठी-  
 लुठत्तारहारस्फुरद्रश्मिसारकमाम्भोरुहे ! ’ सरभस—रभसेन—रंहसा  
 सहितं यस्मिन्कर्मणि यथा तथा नतः—प्रणतो यो नाकिनारीजनः—  
 नाकिनां नार्यस्तासां जनः—समूहः तस्योरोजपीठीषु—स्तनपर्यङ्गिकासु  
 लुठतां तारहाराणां रफुरद्धी रश्मिभिः सारे—कर्बुरे क्रमाम्भोरुहे—  
 चरणकमले यस्याः सा तत्सम्बोधनम् । “ सारः शब्दवातयोः ”  
 इति विश्वः । ‘ अजिते । ’ केनाऽप्यनभिभूते । ‘ क्षणरुचिरु-  
 चिरोरुचञ्चत्सटासङ्गटोत्कृष्टकण्ठोङ्गटे ’ क्षणरुचिरुचिराभिः—क्षणा  
 रुचिर्यस्याः सा क्षणरुचिस्तडित्तद्वुचिराः उज्ज्वलास्ताभिः—  
 विद्युदीपाभिः उरुभिश्चन्नन्तीभिः सटाभिः सङ्गट उत्कृष्टो यः कण्ठ-  
 स्तेनोङ्गटः—करादस्तस्मिन् ‘ राजिते ’ शोभिते । ‘ भासि ’  
 दीपिमति—तेजस्विनि । ‘ नीहारतारावलक्षे ’ नीहारो हिमं, तारा—  
 नक्षत्राणि तद्वद्वलक्षः—धवलः तस्मिन् “ अवद्यायग्नु तुहिनं,  
 प्रालेयं मिहिकाहिमम् । स्यान्नीहारस्तुपारञ्च हिमानी तु महद्विमम् ”  
 इति हैमः । “ अवदातगौरशुभ्र—वलक्षधवलार्जुनाः ” इति हैमः ।

( १६२ )

‘अजिते’ अनभिभूते । ‘गजारौ’ केसरिणि । ‘संस्थिते !’  
निषणे ! । ‘राजिते !’ भ्राजिते ! । ‘अम्ब !’ मातः ! ।  
(नीहारतारावलक्षे ?) इति देव्या विशेषणम् । ‘अस्मिंके’ अम्बा-  
देवि ! । ‘परमवसुतराऽङ्गजा’ अतिशयेन परमवसू—परमतेजसौ,  
अङ्गजौ—पुत्रौ यस्याः सा । पूर्वभवाऽपेक्षया इदं विशेषणम् ‘आरावस  
आशितारातिभारा’ आरावेण—ध्वनिना सन्नाशितः—सम्यग्दर्शनं  
प्रापितः (सर्वथा नाशितः) अरातीनां भारोऽरातिभारः शत्रुसमूहो यया  
सा । ‘भासिनी’ भासते इत्येवंशीला भासिनी—भासनशीला । ‘हार-  
तारा’ मौक्तिकमालावदुज्जबला । ‘बलक्षेमदा’ बलं च—सामर्थ्यं,  
क्षेमं च—कल्याणं ते ददातीति बलक्षेमदा । ‘असन्ना’ न सन्ना  
असन्ना—अखिन्ना । ‘शितारातिभा’ आरशव्देन रीतिकाङ्गार  
कश्चोच्यते । शितस्य—तनूकृतस्याऽरस्येव पित्तलस्येवाऽतिशयेन भा-  
दीप्तिर्यस्याः सा । “रीतिः ख्यामारकूटो,—न ख्यामथ ताम्रकं”  
इत्यमरः “ पित्तलारेऽथारकूटः, कपिलोहं सुवर्णकम् । (रसी  
रीरी च रीतिश्च, पितलोहं सुलोहकम् । ” इति हैमः ) ‘अमदा’  
न विद्यते मदो यस्याः सा अमदा मदहीना । ‘त्वम्’ भवती । ‘परं’  
भव्यलोकम् । ‘सुतरां’ नित्यम् । ‘अब’ रक्ष ॥ ९६ ॥

श्री चतुरवर्षशति जिनस्तुतिः समाप्ता ।

श्री अंभिकादेवीनी स्तुति—

श्लोकार्थ—वेग अथवा हुर्षथी नभेदा देवोनी स्त्रीयोनां  
स्तनदृपी आसन उपर रहेदा एवा भनोहर भोतीयोना हारना  
स्कुरायमान उरेषेवडे सार—चित्रविचित्र छे चरणुकमल नेना एवी  
हे ( हैवी ! ) ( डैरथी पणु ) नहि शतायेदी एवी हे हैवा-  
गना ! विजली समान प्रकाशमान तथा विशाल अने अस्थिर  
एवी सटा—केशवाणीवडे व्यास एवा कंठवडे उदार—शौर्यवान्, वणी  
हैरीज्यमान, तेमज प्रकाशमान, हिम अने तारा समान ५वेत  
एवा सिंह उपर ऐसनारी ! ( कांतिवडे ) सुशोभित ! हे जननी !  
हे अंभिका !, वली उत्कृष्ट तेजस्नी छे ये पुत्रो नेना एवी,

( १६३ )

तेभज (निः) नादवडे सर्वथा नष्ट (सम्यक्तव्यधारी) कर्यो हे शत्रु  
समूह जेणे अवी, तेजस्वी, हारना जेवी उज्ज्वल, अल अने सुखने  
आपनारी, ऐह रहित, तीक्ष्ण उरेला पित्तस्थी अधिक हे प्रला जेनी  
अवी तथा निरक्षिभानी अवी तुं ( सम्यक्तव्यी अलंकृत हेवाने  
दीधे ) उत्तम अवा अव्यज्ञनेनातुं हुमेशां रक्षणु क२. ॥ ६६ ॥

## प्रशस्तिः

कल्याणश्रियमाश्रितोऽतिविपुलां मोहादिविद्विषिणः,  
छित्त्वाऽजस्रविशुद्धकेवलरविं लेभे विकासद्विभः  
यो देवेन्द्रसुरासुरार्चितपद्मन्द्वः सदा राजते,  
स श्रीवीरप्रभुः श्रियं वित्तनुतां भव्यात्मनां भूतले ॥ १ ॥  
श्रीमत्तीर्थकृतां धुरीव विदितः पार्श्वप्रभुः क्षमातले,  
सर्वेषां गुरुगौतमो गणभृतामादेयतामाभजत् ।  
यन्नामाक्षरचिन्तनेन सकलाः सिद्धयन्ति सच्चिन्तिताः,  
सद्यः स्वेष्टमनोरथाः परिहृतानर्थब्रजाश्रानिशम् ॥ २ ॥  
एकादशाद्यगणभृत्सु तपस्विमुख्यो—  
यः पञ्चमो विदितकीर्तिसुधर्मनामा ।  
लेभे समुत्सुकतया तमनन्तबोधं,  
श्रीवीरपट्टपदुसंपदगम्यरूपा ॥ ३ ॥  
तस्य प्रभोः स्थविरवृन्दपरम्परायां,  
चान्द्रादिसत्कुलगणब्रजचिह्नितायाम् ।  
श्रीमानभूजगति लघ्वशतार्थिकीर्तिः,  
सोमप्रभः सुविदितोऽस्तिविलसूरिवये: ॥ ४ ॥  
तत्पट्टलक्ष्मीधर उत्तम श्री—रासीजगच्छन्द्र इतिप्रसिद्धः ।  
महातपस्वी तत एष लोके, तपागणः ख्यातिमगादपूर्वाम् ५  
तस्मिन्नेव तपोगणेऽतिविवुधो जडे क्रमादक्षधीः,  
श्रीमद्वीरसमानहीरविजयः सूरिप्रधानो गुरुः ।

( १६४ )

यद्वाक्यामृतपानतोऽक्वरनृपाधीशो दयावानभूद्,  
 भव्यानामुपकारकुद्गुणनिधिः पूज्यः सतां सर्वदा ॥ ६ ॥  
 तत्पटं स्वपरम्परागतमुं संशोभयामासिवान्,  
 योगीन्द्रश्रुतबुद्धिसागरगुरुः सूरीश्वरो विश्रुतः ।  
 येनाऽरच्यत धर्मतत्त्वनिचिता ग्रन्थावली शोभना,  
 यत्सद्वेशनयाऽभवन् भुवि गणाः सद्गर्मनिष्ठाः सताम् ॥ ७ ॥  
 यत्पादाम्बुजपट्पदः शुचिगुणः श्रीवाचकानां धुरि,  
 विख्यातोऽजितसागरः श्रुतचणः कीर्त्त्या कविख्यातिभाक् ।  
 शिष्याऽध्यापनताकृते कृतमतिश्चारित्रिणामग्रणीः,  
 काव्यालङ्कृतिकोविदो नयविदां मान्यो मनीषावताम् ॥ ८ ॥  
 येनाऽभ्यर्थनया स्वशिष्यसमुदायस्य श्रुतध्यायिन—  
 श्रीकेयं सरलाभिधा विरचिता श्रीशोभनाख्यस्तुतेः ।  
 नानाऽलङ्कृतिसम्पदाश्रितपदब्रातान्वितायाः शुभा,  
 वृत्तीनामनुसारिणी परकृतानामन्वयार्थानुगा ॥ ९ ॥  
 भव्यश्राद्धकदम्बवराजितपथे प्रह्लादने पत्तने,  
 चातुर्मास्यकृते स्थिति कृतवता येनोपकारक्षमा ।  
 औक्षाऽश्वाँऽङ्गशशाङ्कसंमितवरे (१९७५) संवत्सरे श्रावणे,  
 सप्तम्यां रविवासरे शुभतिथौ पूर्णकृता स्वातिगे ॥ १० ॥  
 गच्छतः स्वलभं काऽपि, भवत्येव प्रमादतः ।  
 हसन्ति दुर्जनास्त्र, समादधति सज्जनाः ॥ ११ ॥  
 सज्जनास्तुष्टिमन्तः स्युः, खलाः कुध्यन्तु मा मयि ।  
 ग्रीत्या भीत्या क्रमादेता-नशेषान् प्रणमास्यहम् ॥ १२ ॥  
 सवृत्तिकैषा मुनिशोभनस्तुतिः,  
 सतां सदाऽनन्दविधायिनी जने ।  
 आभानुचन्द्रं विलसत्प्रभावा,  
 विलासमासादयतु प्रकामम् ॥ १३ ॥

परिशिष्टम् । (१)

न्यायाचार्यन्यायविद्वारदभवोपाध्याय—  
श्रीमद्यशोविजयविरचिताः

॥ ऐन्द्रस्तुतयः ॥

१ ऋषभजिनस्तुतयः ।

ऐन्द्रत्रातनतो यथार्थवचनः प्रध्वस्तदोषो जगत्,  
सद्योगीतमहोदयः शमवतां राज्याधिकाराजितः ।  
आद्यस्तीर्थकृतां करोत्विह गुणश्रेणीर्दधनाभिभूः  
सद्यो गीतमहोदयः शमवतां राज्याधिकाराजितः ॥१॥

†शार्दूलविक्रीडितम् ( १२, ७ )

उभूतानतिरोधबोधकलितत्रैलोक्यभाववजा—  
स्तीर्थेशस्तरसा महोदितभयाऽकान्ताः सदाशापदम् ।  
युष्णान्तु स्मरनिर्जयप्रसुमरग्रौढप्रतापप्रथा—  
स्तीर्थेश स्तरसा महोदितभयाः कान्ताः सदा शापदम् ॥२॥

जैनेन्द्रं सरताऽतिविस्तरनयं निर्माय मिथ्यादशां,  
सङ्गत्यागमभङ्गमानसहितं हृद्यप्रभावि श्रुतम् ।

†म्सौ ज्सौ तौ गः शार्दूलविक्रीडितं छैः ( कलिकालसर्वज्ञश्री  
हेमचन्द्राचार्यकृत छन्दोऽनुशासने ) ।

( १६६ )

मिथ्यात्वं हरदूर्जितं शुचिकथं पूर्णं पदानां मिथः,  
 सङ्गत्या गमभङ्गमानसहितं हृद्यप्रभा ! विश्रुतम् ॥ ३ ॥  
 या जाड्यं हरते स्मृताऽपि भगवत्यम्भोरुहे विस्फुरत्—  
 सौभाग्या श्रयतां हिता निदधती पुण्यप्रभाविक्रमौ ।  
 घाग्देवी वितनोतु वो जिनमतं ग्रोल्ला सयन्ती सदाऽ—  
 सौ भाग्याऽश्रयतां हितानि दधती पुण्यप्रभावि क्रमौ ॥ ४ ॥

## २ श्रीअजितजिनस्तुतयः ।

मुनिततिरपि यं +न सय( शीर्ण )मोहा  
 शमजितमारमदं भवन्दिताऽपत् ।  
 भज तमिह जयन्तमाप्तुमीशं  
 शमजितमारमदम्भवन् ! दितापत् ॥ १ ॥ \*पुष्पिताग्रा०  
 हर रुचिर ! ददञ्जिनौघ ! तं द्राक्  
 परमतमोहर ! यं भयानि दानम् ।  
 +नियतमुपगता भवे लभन्ते  
 परमतमोहरयं भया निदानम् ॥ २ ॥  
 नयगहनमतिस्फुटानुयोगं,  
 जिनमतमुद्यतमानसा ! धुतारम् ।  
 जननभयजिहासया निरस्ता—  
 जि नमत मुद्यतमानसाधुतारम् ॥ ३ ॥

+‘ निरस्तमोहा ’ इति ख—पाठः । \*नारलगा नजज्ञा अपर-  
 वक्त्रम्, गान्तं पुष्पिताग्रा । +पूर्वार्धोत्तरार्धयोः पौर्वार्पर्यविपर्ययः ख—  
 प्रत्याम् ।

( १६७ )

पविमपि दधतीह मानसीन्द्रै—  
 र्महितमदम्भवतां महाधिकारम् ।  
 दलयतु निवहे सुराङ्गनाना—  
 महितमदं भवतां महाधिकारम् ॥ ४ ॥

---

### ३ श्रीसम्भवजिनस्तुतयः ।

सम्भव ! सुखं ददत् त्वं,  
 भाविनि भावारवारवारण ! विश्वम् ।  
 वासवसमूहमहिताऽ—  
 भाविनिभाऽवाऽरवारवाऽरण ! विश्वम् ॥ १ ॥

— \* स्कन्धकम् ( आर्यागीतीत्यपरनामकम् )

यद्धर्मः शं भविनां.  
 सन्ततमुदितोऽदितोदारकरः ।  
 स जयतु सार्वगणः शुचि—  
 सन्ततमुदितोऽदितोदितोऽदारकरः ॥ २ ॥

जैनी गीः सा जयतात्,  
 न यया शमितामिता मिताक्षररुच्या ।  
 किं सन्तः समवतरन्—  
 नयया शमिताऽमिताऽमिताक्षररुच्या ॥ ३ ॥

दलयतु काञ्चनकान्ति—  
 जनतामहिता हिता हि तारागमदा ।

---

\* चेऽष्टमे स्कन्धकम् ।

( १६८ )

इह वज्रभूष्णला दु-  
 र्जनतामहिताऽहिताऽहिताऽरागमदा ॥ ४ ॥

### ४ श्रीअभिनन्दनजिनस्तुतयः ।

त्वमभिनन्दन ! दिव्यगिरा निरा-  
 कृतसभाजनसाध्वस ! हारिभिः ।  
 अहतधैर्य ! गुणैर्जय राजितः  
 कृतसभाजन ! साध्वसहारिभिः ॥ १ ॥ - \*द्रुतविलम्बितम्  
 भगवतां जननस्य जयन्निहा-  
 ऽशु भवतां तनुतां परमुत्करः ।  
 त्रिजगतीदुरितोपशमे पद्मः,  
 शुभवतां तनुतां परमुत्करः ॥ २ ॥  
 त्रिदिवमिच्छति यथतुरः स्फुरत्-  
 सुरसमूहमयं मतमर्हताम् ।  
 स्फुरतु चारु ददत् पदमुच्चैः  
 सुरसमूहमयं मतमर्हताम् ॥ ३ ॥  
 धृतसकाण्डधनुर्युतु तेजसा  
 न रहिता सदया रुचिराजिता  
 मदहितानि परैरिह रोहिणी  
 नरहिता सदया रुचिराऽजिता ॥ ४ ॥

\* नभ्रा द्रुतविलम्बितम् ।

( १६९ )

## ५ श्रीसुमतिजिनस्तुतयः ।

नम नमदमरसदमरस-

सुमति॒ सुमति॒ सदसदरमुदारमुदा॑ ।

जनिता॑जनितापदपद-

विभवं॒ विभवं॒ \*नरकान्तं॒ नर ! कान्तम्॑ ॥१॥ स्कन्धकम्

भवभवभयदा॑भयदा-

बली॒ बलीयोदयोदयाऽमायामा॑ ।

दद्याद्याऽमितमित—

शमा॒ शमादिष्टदिष्टबीजाऽबीजा॑ ॥ २ ॥—स्कन्धकम्

दमदमसुगमं॒ सुगमं॒,

सदा॒ सदानन्दनं॒ दयाविद्याविद्॑ ।

परमपरमस्मर !॒ स्मर

महामहा॒ धीरधीर !॒ समयं॒ समयम्॑ ॥३॥ स्कन्धकम्

काली॒ कालीरसरस-

भावाभावाय॒ नयनसुखदा॑सुखदा॑ ।

महिमहितनुता॑ तनुता-

दिता॑दिता॑मानमानरुच्या॒ रुच्या॑ ॥ ४ ॥स्कन्धकम्

## ६ श्रीपद्मप्रभुस्तुतयः ।

पद्मप्रभेश !॒ तव॒ यस्य॒ रुचिर्मते॒ सद्-

विश्वासमानसदयापरा॑ !॒ भावि॒ तस्य॒ ।

\* ‘नरनरकान्तं’ इति ख-पाठः । † ‘भर’ इति ख-पाठः ।

( १७० )

नोच्चैः पदं किमु पचेलिमपुण्यसम्पद् ,  
 विश्वाऽसमान ! सद्याऽपर ! भावितस्य ॥१॥<sup>‡</sup>वसन्ततिलका

मूर्तिः शमस्य दधती किमु या पट्टनि,  
 पुण्यानि काचन सभासु रराज नव्या ।  
 सा स्त्रूयतां भगवतां विततिः स्वभक्त्या,  
 पुण्याऽनिकाचन ! सभासुरराजनव्या ॥२॥—वसन्त०

लिप्सुः पदं परिगतैर्विनयेन जैर्नीं,  
 वाचंयमैः सततमश्चनु रोचितार्थम् ।  
 स्याद्वादमुद्ग्रितकुतीर्थनयावतारां,  
 वाचं यमैः सततमं चतुरोचितार्थम् ॥३॥—वसन्त०

साहाय्यमत्र कुरुषे शिवसाधने या—  
 पाता मुदा रसमयस्य निरन्तराये ! ।  
 गान्धारि ! वज्रमुसले जगतीं तवास्याः,  
 पातामुदारसमयस्य निरन्तराये ॥४॥—वसन्त०

### ७ श्रीसुपार्श्वजिनस्तुतयः ।

यदिह जिनसुपार्श्व ! त्वं निरस्ताकृतक्षमा—  
 वनमद ! सुरवाऽधा हृदयशोभाऽवतारम् ।  
 तत उदितमजसं कर्वैर्धैर्गीयते ना—  
 वनमदसुरवाधाहृद यशो भावतारम् १—\*मालिनी (८,७)  
 जगति शिवसुखं ये कान्तिभिर्भासयन्तो—  
 दुरितमदरतापध्यानकान्ताः सदाऽऽशाः ।

<sup>‡</sup> त्वौ जौ गौ वसन्ततिलका । \* नौ स्यौ यो मालिनी ।

( १७१ )

जिनवरवृषभास्ते नाशयन्तु प्रवृद्धं,  
दुरितमदरतापध्यानकान्ताः सदाशाः ॥२॥—मालिनी  
मुनितिरपठद् यं वर्जयन्ती हतोद्यत—  
तमसमहितदात्रासाऽधिमानन्दितारम् ।  
समयमिह भजाऽसेनोक्तमुच्चर्दिधानं,  
तमसम ! हितदात्रा साधिमानं दितारम् ॥३॥—मालिनी  
अवतु करिण याता साऽर्हतां प्रौढभक्त्या,  
मुदितमकलितापा या महामानसी माम् ।  
वहति युधि निहत्यानीकचक्रं रिष्णा—  
मुदितमकलितापाया महामानसीमाम् ॥४॥—मालिनी

---

### ८ श्रीचन्द्रप्रभजिनस्तुतयः ।

तुम्यं चन्द्रप्रभ ! भवभयाद् रक्षते लेखलेखा—  
नन्तव्याऽपापमदमहते सन्नमोऽहासमाय ! ।  
श्रेयःश्रेणीं भृशमसुमतां तन्वते ध्वस्तकामा—  
नन्तव्यापाऽपमद ! महते सन्नमोहाऽसमाय ॥ १ ॥

\* मन्दाक्रान्ता ( ४, ६, ७ )

श्रेयो दत्तां चरणविलुठन्नप्रभूपालभूयो—  
मुक्तामाला समदमहिता वोधिदानामहीना ।  
मोहापोहादुदितपरमज्योतिषां कृत्सनदोषै—  
मुक्ता मालाऽसमदमहिता वोऽधिदानाऽमहीना २—मन्दा.

---

\* मो भनौ तौ गौ मन्दाक्रान्ता घचैः ।

( १७२ )

रङ्गदभङ्गः स्फुटनयमयस्तीर्थनाथेन चूला—  
 मालापीनः शमदमवताऽसङ्गतोपायहृष्टः ।  
 सिद्धान्तोऽयं भवतु गदितः श्रेयसे भक्तिभाजा—  
 मालापी नः शमदमवता सङ्गतोऽपायहृद् यः ३—मन्दा-  
 सा त्वं वज्राङ्कशि ! जय मुनौ भूरिभक्तिः सुसिद्ध—  
 प्राणायामेऽशुचि मतिमतापाऽपदन्ताऽवलानाम् ।  
 दत्से वज्राङ्कशभुदनिशं दर्पहन्त्री प्रदत्त—  
 प्राणा या मे शुचिमतिमता पापदन्तावलानाम् ४—मन्दा.

---

### ९ श्रीसुविधिजिनस्तुतयः ।

यस्यातनोद् देवततिर्महं सु—  
 प्रभावतारे शुचि मन्दरागे ।  
 इहास्तु भक्तिः सुविधौ दृढा मे  
 प्रभावतारे शुचिमन्दरागे ॥ १ ॥—+उपजातिः  
 अभूत् प्रकृष्टोपशमेषु येषु,  
 न मोहसेना जनिताऽपदेभ्यः ।  
 युष्मभ्यमासा प्रथितोदयेभ्यो—  
 नमोऽहसेना ! जनितापदेभ्यः ॥ २ ॥—उप०  
 वाणी रहस्यं दधती प्रदत्त—  
 महोदयाऽवद्धिरनीति हारि ।  
 जीयाज्जिनेन्द्रैर्गदिता त्रिलोकी—  
 महो दयावद्धिरनीतिहारि ॥ ३ ॥—उप०

---

+ तौ जो गाविन्द्रवज्रा, जतजा गावुपेन्द्रवज्रा, एतयोः  
 परयोश्च सङ्कर उपजातिः ।

( १७३ )

जगद्विर्बिंश्च(द्रु)मकान्तकान्तिः,  
 करोऽतुलाभं शमदस्मभवत्याः ।  
 ददन्तानां ज्वलनायुधे ! नः,  
 करोतु लाभं शमदं भवत्याः ॥ ४ ॥—उपेन्द्रवज्रा

---

### १० श्रीशीतलजिनस्तुतयः ।

जयति शीतलतीर्थपतिर्जने,  
 वसु मती तरणाय महोदधौ ।  
 ददति यत्र भवे चरणग्रहे,  
 वसुमतीतरणाय महो दधौ ॥ १ ॥—द्रुतविलम्बितम्  
 वितर शासनभक्तिमता जिना—  
 वलि ! तमोहरणे सुरसम्पदम् ।  
 अधरयच्छिवनाम महात्मना  
 वलितमोहरणे ! सुरसं पदम् ॥ २ ॥—द्रुत०  
 भगवतोऽभ्युदितं विनमाऽगमं,  
 जन ! यतः परमापदमादरात् ।  
 इह निहत्य शिवं जगदुन्नतिं,  
 जनयतः परमापदमादरात् ॥ ३ ॥—द्रुत०  
 स्तवरवैद्विदशैस्तत्र सन्ततं,  
 न परमच्छविं ! मानवि ! लासिता ।  
 न घनशास्त्रकलाऽप्यरिदारिणी,  
 न परमच्छविमानविलासिता ॥ ४ ॥—द्रुत०

---

( १७४ )

## ११ श्रीश्रेयांसजिनस्तुतयः ।

जिनवर ! भजन् श्रेयांस ! स्यां व्रताम्बुहतोदयद्—  
 भवदव ! नतोऽहं तापातङ्गमुक्त ! महागम ! ।  
 गतभववनभ्रान्तिश्रान्तिः फलेग्रहिस्त्वसद्—  
 भवदवनतो हन्तापातं कमुक्तमहागम ! ॥१॥—\*हरिणी(६,४,७)

जिनसमुदयं विश्वाधारं हरन्तमिहाङ्गिनां,  
 भवमदरदं रुच्याऽकान्तं महामि तमोहरम् ।  
 विनयमधिकं कारंकारं कुलादिविशिष्टता—  
 भवमदरदं रुच्या कान्तं महामितमोहरम् ॥ २ ॥—हरिणी.

शुचिगमपदो भज्ञैः पूर्णो हरन् कुमतापहोऽ—  
 नवरतमलोभावस्थामाश्रयन्यशोऽभितः ।  
 जन ! तव मनो यायाच्छायामयः समयो गल—  
 नवरतमलो भावस्थामाश्रयं नयशोभितः ॥ ३ ॥—हरिणी.

सुकृतपदुतां विघ्नोच्छिन्या तवाऽरिहतिक्षमाऽ—  
 पविकलकरा द्युत्याऽगेहा घनाधनराजिता ।  
 वितरतु महाकाली घण्टाक्षसन्ततिविस्फुरत्—  
 पविकलकरा द्युत्यागेहा घनाधनराजिता ॥ ४ ॥—हरिणी.

## १२ श्रीवासुपूज्यजिनस्तुतयः ।

पद्मोललासे पदुच्चं दधदधिकरुचिर्वासुपूज्यार्कतुल्यो—  
 लोकं सद्वीरपाताशमरुचिरपवित्रासहारिप्रभाऽव ।

\* नसौ औ स्लौ गोहरिणी चैः ।

( १७९ )

लुम्पन् स्वैर्गोविलासैर्जगति घनतमो दुर्नयध्वस्ततत्त्वा—  
॥५८॥—  
लोकं सद्गीरपाता शमरुचिरपवित्रास ! हारिप्रभाव ! ॥१॥—  
×स्वग्धरा ( ७, ७, ७, )

लोकानां पूर्यन्ती सपदि भगवतां जन्मसंज्ञे गतिमें,  
हृद्या राजी वनेऽत्राभवतुदमरसार्थानताऽपातमोहा ।  
साक्षात् किं कल्पवल्लिर्विबुधपरिगता क्रोधमानार्तिमाया—  
हृद् या राजीवनेत्रा भवतु दमरसाऽर्थानतापा तमोहा २-स्वगू०  
उतुङ्गस्त्वय्यभङ्गः प्रथयति सुकृतं चारुपीयूषपानाऽ—  
स्वादे शस्तादरातिक्षतशुचि सदनेकान्त ! सिद्धान्त ! रागः ।  
रङ्गङ्गङ्गप्रसङ्गोल्लसदसमनये निर्मितानङ्गभङ्ग—  
स्वादेश ! स्तादऽरातिक्षतशुचिसदने कान्त ! सिद्धान्तरागः ३-स्वगू०  
वाग्रदे ! विप्रीणयन्ती पटु विविधनयोन्नीतशास्त्रार्थनिष्ठा—  
शङ्कान्ते देहि नव्येरितरणकुशले ! सुभ्रु ! वादे विशिष्टम् ।  
अद्वाभाजां प्रसादं सुमतिकुमुदिनीचन्द्रकान्ति प्रपूर्णा—  
शं कान्ते ! देहिनव्येऽरितरणकुशले सुभ्रुवा देवि ! शिष्टम् ४-स्वगू०

### १३ श्रीविमलजिनस्तुतयः ।

नमो हतरणायते ! उसमदमाय ! पुण्याशया—  
सभाजित ! विभासुरैर्विमल ! विश्वमारक्षते ।  
न मोहतरणाय ते समदमाय ! पुण्याशया—  
उसभाजितविभासुरैर्विमलविश्वमारक्षते ! ॥१॥—†पृथ्वी ( ८, १ )  
महाय तरसाहिताऽजगति वोधिदानामहो  
दया भवतुदां तताऽसकलहासमानाऽभया ।

× म्रौ भ्नौ यिः स्वग्धरा छैः । † उसजस्यलगाः पृथ्वी जैः ।

( १७६ )

महायतरसा हिता जगति वोऽधिदाना महो—  
 दया भवतु दान्तताऽसकलहाऽसमानाऽभया ॥२॥—पृथ्वी  
 क्रियादरमनन्तरागततयाचितं वैभवं,  
 मतं समुदितं सदा शमवताऽभवेनोदितम् ।  
 क्रियादरमनन्तरागततया चितं वैभवं,  
 मतं समुदितं सदाशमवता भवे नो दितम् ॥ ३ ॥—पृथ्वी  
 प्रभा वितरतादरं सुरभियाततारोहिणी—  
 हिताऽशुगुरु चाऽपराजितकराशमारोपिता ।  
 प्रभावितरताऽदरं सुरभियाऽतता रोहिणी  
 हिताऽशु गुरुचापराजितकरा शमारोपिता ॥ ४ ॥—पृथ्वी

---

### १४ श्रीअनन्तजिनस्तुतयः ।

कलितमोदमनं तरसाऽश्रये,  
 शिवपदे स्थितमस्तभवापदम् ।  
 त्रिदशपूज्यमनन्तजितं जिनं,  
 कलितमोदमनन्तरसाश्रये ॥१॥—द्रुतविलम्बितम्  
 जिनवरा गतापदरोचितां,  
 प्रददतां पदवीं मम शाश्वतीम् ।  
 दुरितहृदचना न कदाचना—  
 जिनवरागतापदरोचिताम् ॥ २ ॥—द्रुत०  
 सुरसमानसदक्षरहस्य ! ते,  
 मधुरिमागम ! सोऽस्तु शिवाय नः ।  
 जगति येन सुधाऽपि घनप्रभा—  
 सुरसमानसदक्षर ! हस्यते ॥ ३ ॥—द्रुत०

( १७७ )

सदसिरक्षतिभा सुरवा जिनं,  
 जगदिता फलकेषुधनुर्धरा ।  
 जयति येयमिह प्रणताऽच्युता,  
 सदसि रक्षति भासुरवाजिनम् ॥ ४ ॥

### १५ श्रीधर्मजिनस्तुतयः ।

श्रीधर्म ! तव कर्मद्वा-वारणस्य सदायते ! ।  
 स्तवं कर्तुं कृतद्वेषि-वारणस्य सदा यते ॥ १ ॥—\*अनुष्टुप्  
 गिरा त्रिजगदुद्वारं, भासमाना ततान या ।  
 श्रिया जीयाजिनाली सा, भासमानाऽतताऽनया ॥२॥  
 चचः पापहरं दत्त-सातं केवलिनोदितम् ।  
 भवे त्राणाय गहने, सातङ्केऽबलिनोदितम् ॥ ३ ॥  
 दद्युः प्रसादाः प्रज्ञस्याः, शक्तिमत्या जिता दराः ।  
 तस्या यया द्विषां सर्वे, शक्तिमत्याजितादराः ॥ ४ ॥

### १६ श्रीशान्तिजिनस्तुतयः ।

अखाभूद् व्रतघाति नातिरुचिरं +यद्येव संसेवना-  
 दक्षोदं भरतस्य वैभवमयं साराजितं तन्वतः ।  
 लिप्सोः (प्सो !) शान्तिजिनस्य शासनरुचिं सौरुण्यं जयद् ब्रह्म भो-  
 दक्षोऽदम्भरतस्य वै भवमयं साराजितं तन्वतः ॥१॥—  
 शार्दूलविक्रीडितम्

\* अनुष्टुप् जातौ वक्त्रं ।

+ ‘यच्छ्रेयसे सेवना’ इति पाठान्तरम् ।

( १७८ )

येषां चेतसि निर्मले शमवतां मोक्षाध्वनो दीपिका—  
 प्रज्ञालाभवतां क्रिया सुरुचिताऽरं भावनाऽभोगतः ।  
 ते श्रीमञ्जिनपुङ्गवा हतभया नित्यं विरक्ताः सुखं,  
 प्रज्ञाला भवतां क्रियासुरुचितारम्भावना भोगतः ॥ २ ॥  
 मिथ्यादृष्टिमतं यतो ध्रुवमभूत् प्रध्वस्तदोषात् क्षिता—  
 वाऽचारोचितमानमाऽरयमदंभावारिताऽपाप ! हे ।  
 तं सिद्धान्तमभङ्गभङ्गकलितं श्रद्धाय चित्ते निजे,  
 वाचा रोचित ! मानमारयमदं भावारितापापहे ॥ ३ ॥  
 शत्रूणां घनधैर्यनिर्जितभया त्वां शासनखामिनी,  
 पातादाऽनतमानवा सुरहिता रुच्या सुमुद्राऽजिषु ।  
 श्रीशान्तिक्रमयुग्मसेवनरता नित्यं हतव्यग्रता—  
 पातादानतमा नवासु रहिता रुच्या सुमुद्राजिषु ॥ ४ ॥

---

### १७ श्रीकुन्थुजिनस्तुतयः ।

स जयति जिनकुन्थुलोभसंक्षोभहीनो—  
 महति सुरमणीनां वैभवे सन्निधाने ।  
 इह भवति चिना यं मानसं हन्त केषां,  
 महति सुरमणीनां वैभवे सन्निधाने ॥१॥—मालिनी०  
 जयति जिनततिः सा विश्वमाधातुमीशा—  
 ऽमदयतिमहिताऽरं किन्न रीणाऽमपाशम् ? ।  
 विलसितमपि यस्या हन्त नैव स्म चित्तं,  
 मदयति महि तारं किन्नरीणामपाशम् ॥ २ ॥  
 अवतु गदितमासैस्त्वा मतं जन्मसिन्धौ,  
 परमतरणहेतुश्छायया भासमानैः ।

( १७९ )

विविधनयसमूहस्थानसंगत्यपास्ता—  
परमतरणहेतुश्छायया भाऽसमानैः ॥ ३ ॥

कलितमदनलीलाऽधिष्ठिता चारु कान्तात्,  
सदसि रुचितमाराद् धाम हन्ताऽपकारम् ।  
हरतु पुरुषदत्ता तन्वती शर्म पुंसां,  
सदसिरुचितमाराद्वाऽमहं तापकारम् ॥ ४ ॥

### १८ श्रीअरजिनस्तुतयः ।

+हरन्तं संस्तवीम्यहं त्वामरजिन ! सततं भवोद्भवा—  
मानमदसुरसार्थवाचंयम ! दम्भरताऽधिपापदम् ।  
विगणितचक्रवर्तिविभवमुदामपराक्रमं हता—  
मानमदसुरसार्थवाचं यमदं भरताधिपाऽपदम् ॥ १ ॥—\*द्विपदी  
भीमभवं हरन्तमपगतमदकोपाटोपमर्हतां,  
स्मरत रणाधिकारमुदितापदमुद्यमविरतमुत्करम् ।  
भक्तिनताखिलसुरमौलिस्थितरत्नरुचाऽरुणक्रमं,  
स्मरतरणाधिकारमुदितापदमुद्यमविरतमुत्करम् ॥ २ ॥  
भीमभवोदधेर्भवनमेकतो विधुशुभ्रमञ्जसा—  
ऽभवदवतो यशोऽभितरणेन नमाऽदितं नयमितं हि तम् ।  
जिनपसमयमनन्तभङ्गं जन ! दर्शनशुद्धचेतसा,  
भवदवतोय ! शोभित ! रणेन न मादितं न यमितं हितम् ॥ ३ ॥

+ ‘ संस्तवीम्यहं त्वा हरन्तमरजिन ! ’ इत्यपि पाठः ।

\* षश्वृगौ द्वितीयषष्ठौ जो लीर्वा द्वीपदी ।

( १८० )

चक्रधरा करालपरधात बलिष्ठमधिष्ठिता प्रभा—  
 सुरविनता तनुभवपृष्ठमनुदितापदरंगतारवाक् ।  
 दलयतु दुष्कृतं जिनवरागमभक्तिभृतामनारतं,  
 सुरविनता तनुभवपृष्ठमनु दितापदरंगतारवाक् ॥ ४ ॥

### १९ श्रीमाल्लिजिनस्तुतयः ।

महोदयं प्रवितनु मल्लिनाथ ! मे—  
 ऽधनाघ ! नोदितपरमोहमान ! सः ।  
 अभूम्हाव्रतघनकाननेषु यो—  
 घनाघनोऽदितपरमोहमानसः ॥ १ ॥—†रुचिरा  
 मुनीश्वरैः स्मृत कुरु सौख्यमर्हतां,  
 सदानतामर ! समुदाय ! शोभितः ।  
 घनैर्गुणै र्जगति विशेषयन् श्रिया,  
 सदानतामरस ! मुदा यशोऽभितः ॥ २ ॥  
 जिनः स यं पठितमनेकयोगिभि—  
 मुदा रसं गतमपरागमाह तम् ।  
 सदागमं शिवसुखदं स्तुवेतरा—  
 मुदारसंगतमपरागमाहतम् ॥ ३ ॥  
 तनोतु गीः समयरुचिं सतामना—  
 विला सभा गवि कृतधीरतापदा ।  
 शुचिद्युतिः पदुरणदच्छकच्छपी,  
 विलासभागविकृतधीरतापदा ॥ ४ ॥

† ज्मौ स्जौ गो रुचिरा धैः ।

( १८१ )

## २० श्रीमुनिसुब्रतजिनस्तुतयः ।

तव मुनिसुब्रत ! क्रमयुगं ननु कः प्रतिभा-  
वनधन ! रोहितं नमति मानितमोहरणम् ।

नतसुरमौलिरत्नविभया विनयेन विभा-  
वनध ! नरो हितं न मतिमानितमोहरणम् ॥ १ ॥

\*अवितथम्

अवति जगन्ति याशु भवती मयि पारगता-  
वलि ! तरसेहितानि सुरवारसभाजितया ।

दिशतु गिरा निरस्तमदना रमणीहसिता-  
वलितरसे हितानि सुरवा रसभाजि तया ॥ २ ॥

यतिभिरधीतमहितमतं नयवज्रहता-  
घनगमभङ्गमानमरणैरनुयोगभृतम् ।

अतिहितहेतुतां दधदपास्तभवं रहितं,  
घनगमभङ्गमानम् रणैरनु योगभृतम् ॥ ३ ॥

वितरतु वाञ्छितं कनकरुग् भुवि गौर्ययशो-  
हृदिततमा महाशुभविनोदिविमानवताम् ।

रिपुमदनाशिनी विलसितेन मुदं ददती,  
हृदि ततमामहाशु भविनो दिवि मानवताम् ॥ ४ ॥

---

## २१ श्रीनामिजिनस्तुतयः ।

यतो यान्ति क्षिप्रं नमिरघवने नात्र तनुते,  
विभावयोऽनाशंकमनलसमानं दितमदः ।

---

\* न्जभज्जा लगाववितथम् ।

( १८२ )

दधद् भासां चक्रं रविकरसमूहादिव महा-  
विभावयों नाशं कमनलसमानन्दितमदः ॥ १ ॥

ॐ शिखरिणी ( ६, ११ )

भवोच्छूतं भिन्न्यात् भुवि भवभृतां भव्यमहिता,  
जिनानामायासं चरणमुदिताऽली करचितम् ।  
शरण्यानां पुण्या त्रिभुवनहितानामुपचिता—  
जिनानामायासं चरणमुदितालीकरचितम् ॥ २ ॥

जिनानां सिद्धान्तश्चरणपदु कुर्यान् मम मनो—  
उपराभूतिलोके शमहितपदानामविरतम् ।  
यतः स्याच्चक्रित्वत्रिदशविभुताद्या भवभृतां,  
परा भूतिलोकेशमहितपदानामविरतम् ॥ ३ ॥

गजव्यालव्याघ्रानलजलसमिद्वन्धनरुजो—  
गदाक्षाऽकाली काली नयमवति विश्वाऽसमहिता ।  
जनैर्विश्वध्येया विघटयतु देवी करलसद्—  
गदाक्षाऽकाली नयमवति विश्वाऽसमहिता ॥ ४ ॥

## २२ श्रीनेमिजिनस्तुयः

त्वं येनाक्षतधीरिमा गुणनिधिः प्रेम्णा वितन्वन् सदा,  
नेमेऽकान्त ! महामनो ! विलसतां राजीमतीरागतः ।  
कुर्यास्तस्य शिवं शिवाङ्गज ! भवाम्भोधौ न सौभाग्यभाग्,  
नेमे ! कान्तमहामनाविल ! सतां राजीमतीरागतः ॥ १ ॥

शार्दूलविक्रीडितम्

ॐ यम्नस्भल्गाः शिखरिणी चैः ।

( १८३ )

जीयासुजिनपुङ्गवा जगति ते राज्यद्विषु प्रोह्लसद्-  
 धामानेकपराजितासु विभयाऽसन्नाभिरामोदिताः ।  
 योधालीभिरुदित्वरा न गणिता यैः स्फातयः प्रस्फुरद्-  
 धामानेकपराऽजितासु विभया सन्नाभिरामोदिताः ॥ २ ॥  
 या गङ्गेव जनस्य पङ्कमखिलं पूता हृत्यङ्गसा,  
 भारत्यागमसङ्गता न यतताऽमायाचिता साधुना ।  
 अध्येतुं गुरुसन्धिधौ मतिमता कर्तुं सतां जन्मभी-  
 भारत्यागमसंगता न यततामायाचिता साऽधुना ॥ ३ ॥—शा०  
 व्योम स्फारविमानतूरनिनदैः श्रीनेमिभक्तं जनं,  
 प्रत्यक्षामरसालपादपरतां वाचालयन्ती हितम् ।  
 दद्याच्चित्यमिताऽम्रलुम्बिलतिकाविभ्राजिहस्ताऽहि तं,  
 प्रत्यक्षामरसालपादपरताऽम्बा चालयन्तीहितम् ॥ ४ ॥—शा०

### २३ श्रीपार्श्वजिनस्तुतयः

सौधे सौधे रसे स्वे रुचिररुचिरया हारिलेखारिलेखा,  
 पायं पायं निरस्ताघनयघनयशो यस्य नाथस्य नाथ ।  
 पार्श्वं पार्श्वं तमोद्रौ तमहतमह ! न क्षोभजालं भजाऽलं,  
 कामं कामं जयन्तं मधुरमधुरमाभाजनत्वं जन ! त्वम् ॥ १ ॥:

—स्मरण-

तीर्थे तीर्थेशराजी भवतु भवतुदऽस्तारिभीमारिभीमा—  
 लीकालीकालकूटाऽकलितकलितयोस्सा समूहे समूहे ।  
 या मायामानहत्री भवविभवविदां दत्तविश्वासविश्वा—  
 ऽनासानासाभिशङ्का विमदविमदनत्राऽसमोहाऽसमोहा ॥ २ ॥

( १८४ )

गौरागौरातिकीर्तेः परमपरमतद्रासविश्वासविश्वा—  
 देया देयान् मुदं मे जनितजनितनूभावतारावतारा ।  
 लोकालोकार्थवैत्तुर्नयविनयविधव्यासमानासमाना—  
 ऽभज्ञाऽभज्ञात्युयोगा सुगमसुगमयुक्त प्राकृतालङ्कृताऽलम् ॥३॥  
 लोके लोकेशनुत्या सुरससुरसभां राजयन्ती जयन्ती,  
 व्यूहं व्यूहं रिष्णां जनभजनभवद्गौरवा मारवामा ।  
 कान्ता कान्ताहिपस्येरितदुरितदुरन्ताहितानांहितानां,  
 दद्यादद्यालिमुच्चरुचितरुचितमा संस्तवे च स्तवे च ॥४॥

## २४ श्रीमहावीरजिनस्तुतयः ।

तव जिनवर ! तस्य वदध्वा रतिं योगमार्गं,  
 भजेयं महावीर ! पाथोधिगम्भीर ! धीरानिशम् ।  
 मुदित ! विभव ! सन्निधानेऽसमोहस्य,  
 सिद्धार्थनामक्षमाभृतकुमारापहेयस्य वाचा रतः ।  
 मुनिजननिकरश्चरित्रे पवित्रे परिक्षीणकर्मा  
 स्फुरदज्ञानभाक्त सिद्धिशर्माणि लेभेतरा—  
 मुदितविभवसन्निधानेऽसमोहस्य सिद्धार्थ !  
 नाम क्षमाभृत कुमारापहे यस्य वाऽचारतः ॥ १ ॥

—\*\*अर्णवदण्डकम्

नयकमलविकासने का सुरी विस्मयस्मेरनेत्राऽजनि  
 ग्रौदभामण्डलस्य क्षतध्वान्त ! हे

\* ना ऋ चण्डवृष्टिः, यथोत्तरमेकैकरवृद्धया अर्णर्णवव्यालजीमूत्त-  
 लील्यकरोहामशब्दखाद्यः ।

( १८५ )

न तव रविभया समानस्य रुच्यांगहाराहिते-  
 पारिजातस्य भास्वनमहेलास्यभारोचिते ।  
 कनकरजतरत्नसालत्रये देशनां तन्वतो  
 ध्वस्तसंसार तीर्थेशवार ! द्युसद्गोरणी-  
 नत ! वर ! विभयाऽसमानस्य रुच्याङ्गहारा हिते  
 पारिजातस्य भास्वर ! महे लास्यभारोचिते ॥ २ ॥  
 वचनमुचितमहतः संश्रय श्रेयसे प्रीणयद् भव्य !  
 भीमे दधद् ध्वस्ततापं भवाम्भोनिधौ  
 परमतरणहेतुलाभं गुरावार्यमानन्दिताऽपायशो  
 भावतो भासमानस्य माराजितम् ।  
 दलितजगदसद्ग्रहं हेतुदृष्टान्तनिःपिष्टसन्देह-  
 सन्दोहमद्रोह ! निर्मोह ! निःशेषिता-  
 परमतरण ! हेतुलाभङ्गरावार्यमानं  
 दितापाय ! शोभावतो भाऽसमानस्य माराजितम् ॥ ३ ॥  
 अहमहमिकया समाराद्युमुक्तिष्ठितायाः क्षणे  
 वाङ्मयस्वामिनी शक्तिमद्वाय दद्यात्तरां  
 सकलकलशता रमाराजिता पापहाने कलाभा  
 स्थिताऽसद्विपक्षे मराले खार्यांगमम् ।  
 दधतमिह सतां दिशन्ती सदैङ्गारविस्फारसारस्वत-  
 ध्यानदृष्टा स्वयं मङ्गलं तन्वती  
 सकलकलशताऽरमाऽराजितापापहाऽनेकला  
 भास्थिता सद्विपक्षेऽमरालेखार्याऽगमम् ॥ ४ ॥

---

( १८६ )

**अथ प्रश्नस्तिः—**

यस्यासन् गुरवोऽत्र जीतविजयाः प्राज्ञाः प्रकृष्टाशया  
 आजन्ते सनया नयादिविजयाः प्राज्ञाश्च विद्याप्रदाः ।  
 प्रेम्णां यस्य च सब्द पदविजयो जातः सुधीः सोदरः,  
 सोऽयं न्यायविशारदः स्म तनुते विज्ञः स्तुतीर्हताम् ॥१॥  
 शार्दूल०

कृत्वा स्तुतिस्त्रजमिमां, यदवापि शुभाशयान्मया कुशलम् ।  
 तेन मम जन्मवीजे, रागद्वेषौ विलीयेताम् ॥ २ ॥—आर्य०  
 सूर्याचन्द्रमसौ यावदुदयेते नभस्तले ।  
 तावन्नदत्त्वयं ग्रन्थो, वाच्यमानो विचक्षणैः ॥ ३ ॥—अनु०





શુદ્ધિપત્રકમ્.

( ગુજરાતી પ્રસ્તાવનાનું શુદ્ધિપત્રક )

પૃષ્ઠ.	પાંકિત.	અથુદ્ધ	શુદ્ધ
૬	૨૦	મારે	મારુ
૧૦	૨૭	પીગઘું	પીગઘું
૧૨	૫	કરે	કરું
૧૩	૨૦	હૈમડોષ	૨ હૈમડોષ
૧૩	૨૧	હૈમડાય્યાં	૩ હૈમડાય્યાં
"	"	હૈમણન્દેડતું	૪ હૈમણન્દેડતું
૧૩	૨૫	"xxx...૦ત"	xxx૧"xxx...૦ત:"xx ।
"	૨૬	મજામજાભ્યાં	મજાડમજાભ્યાં
"	૨૭	સાગરીયાવૃત્તિ	સાગરની આવૃત્તિ
"	૨૮	તથા	૪
૧૫	૧૧	શોલન	૦
૧૭	૨૭	૧ [	૧
૧૮	૧૬	સમતિકા	સમતિદીકા
૧૮	૧૬	"	સર્વદ્વિ
૨૧	૧૦	અર્વાચિન	અર્વાચીન
૨૨	૧૬	અર્સ્તી	હર્સ્તી
૨૩	૨૦	સમતિકા	સમતિદીકા

( १८८ )

## ( संस्कृतप्रस्तावना )

पृ.	पं०	अशुद्ध०	शुद्धिः
३३	७	सहदयह	सहदयह
”	१०	व्यवहति	व्यवहति
”	१६	संग्रहीता	संगृहीता:
”	१८	विरचिता	विरचिता:
३४	१५	ज्योर्विद्	ज्योतिर्विद्
३५	१	अवतरण	अवतरणा
३९	१०	कुर्वत्	कुर्वन् स
४३	२	चेत्पूर्वजेन	पूर्वजेन
”	१३	स्तुतिविहिता	स्तुतिर्विहिता
५५	२०	पाञ्चलादि	पाञ्चलादि
५७	३	महेद्र	महेन्द्र
६४	१६	गोरी	गौरी
६८	७	दत्	वदत्

## श्रीजिनस्तुतिचतुर्विंशतिकाशुद्धिः

पृष्ठ.	पंक्ति.	अशुद्धि.	शुद्धि.
२	६	व्यरच-	ऋचय-
”	१०	विभूषयामास सूरि-	व्यभूषयसूरिवर-
”	१८	विधेयम्-	विधत्ते-
”	२१	तस्मि	तस्मि

( १८९ )


पृष्ठ.	पंक्ति.	अशुद्धि.	शुद्धि.
१	१	घती	घुती
”	७	ईत्यु	इत्यु
”	”	हैम	हैमः
”	८	वो	वः
१४	३	तृप्लवन	तृप्लवन
२०	१५	ण्यनदू	ण्यनद्,
२१	१०	द्रत	द्रुत
२७	६	निशिथि	निशीथि
२०	१५	जिनेंद्रो	जिनेंद्रो
३२	२	अथात्	अर्थात्
३३	२४	કथे। छे	कथे। छे
”	२५	अथात्	अर्थात्
३५	१	यामाद्यां	आद्यां
”	”	यां	‘ यां ’
४२	९	दात	दात्त
४३	१४	सूर्यों	सूर्यों
”	१५	आसो	आसौ
४५	१९	सद्यश	सद्वश १
४६	१	शक्तर्थ	शक्तर्थ
५३	२४	कथे।	कथे।
६५	१९	प्रस्ययमाना	प्रस्यमाना
१४७	३	द्वाच्य	द्वाच्यवद्वरे

( १९० )

पृष्ठ.	पंक्ति.	अशुद्धि,	शुद्धि,
६६	१५	अजस्तं	अजस्तं
७६	९	कुंडिका	कुंडिका-
८१	१७	थता	थता
८३	१०	अवा	अवा
पृष्ठ.	पंक्ति.	अशुद्धि.	शुद्धि.
८६	२०	आचाराङ्ग	आचाराङ्गा
८७	८	णीयं मिछं नवइ-	णीयंमि छंनवइ-
८८	२५	अनुक्तमे	अनुक्तमे
९१०	६	ईति	ईति
,,	१५	दते ?	दते ?
९११	११	भाक्	भाक्
९२३	२२	नृपण	नृपेण
९२९	४	आलाप्त ?	आलाप्त
,,	२०	लक्षितातिलकाः	लक्षितास्तिलकाः-
९३१	१	अक्षय	अक्षय-
९३५	१४	पदवा	पदैर्वा
,,	१६	अन्तो य	अन्तो-
,,	१९	बन्धन	बन्धन
,,	२३	राशिष	राशिषि
९४१	१२	प्रभाः	प्रभा-
९४२	३	मुन्मद	मुन्माद-
९४४	१०	मेना	मेना

( १९१ )

पृष्ठ.	पंक्ति.	अशुद्धि.	शुद्धि.
१४६	८	गंभिर	गंभीर
„	१४	भिति	भीति
„	१६	पस्मै	परस्मै
१४८	२२	विद्यते	विद्येते
„	२४	शास्त्री—शास्त्री—	शास्त्री
१४९	१०	मानत्वात्—	मानस्त्वात्
„	१७	यङ्कपत्ता।	यङ्कपत्ती
१५३	८	‘ अनङ्गन ’	‘ अनङ्गन
„	२६	चतुर्ष्वसौ	चतुर्ष्वसौ
१५४	२२	विवृद्ध	विवृद्ध
१५९	६	तीर्थाधीप	तीर्थाधिप
„	१०	निरहङ्कारस्य	निरहङ्कारस्य
१६०	१	खण्डनम्	खण्डनम्
१६२	६	सम्यग्	सम्यग्
१७३	९	दधौ	दधौ
१८२	१८	महामनो	महामत



( १९२ )

## ॥ सुभाषितम् ॥

सन्तताः स्वयमातपेन सततं कुर्वन्ति भूमीरुहाः,  
 छायामाश्रितदेहिनां शुभफलैः सन्तोषयन्त्यङ्गिनः ।  
 कामं कामितदाः परोपकृतयः कष्टं परं विभ्रतः,  
 सन्तः सत्यवचःपराः परदयासंपादनैकव्रताः ॥ १ ॥

मेघा अम्बरचारिणोऽपि वसुधां स्त्रिग्धां सदा पाथसा,  
 कुर्वन्ति क्रमतश्च सस्यविभवाऽलङ्घारभाजं मुदा ।  
 जीवन्त्यक्षुभिता जना उपकृतिं येषां स्मरन्तः सदा,  
 ते धन्या उपकारकारकपराः सन्तः सतां शेखराः ॥ २ ॥

सन्तोषाऽमृतजीवना निरुपमाः सत्कर्मसेवोद्यताः,  
 सर्वाऽनर्थगिरीन्द्रवज्रविवृथाः सद्ध्यानिनो निर्मलाः ।  
 सर्वोत्कर्षतया त्रिलोकविदिताः सत्यप्रमाभाविता-  
 वर्तन्ते भुवने प्रसन्नमनसः सन्तः सदा न्यायिनः ॥ ३ ॥

दुष्कर्मारिचयेन तप्तहृदया दीना जगत्यां जना,  
 याचन्ते जगदीशमिष्टमचलं दीर्घं सुखं सादरम् ।  
 किन्त्वेतत्त्वं विद्वन्ति कर्मनृपते राज्यस्थितिं मोहिताः,  
 सन्तस्तद्विमेव बोद्धुमनघाः शक्तात्त्रिलोक्यां स्तुताः ॥ ४ ॥

सन्तः शुद्धिकरा विशुद्धचरितैर्भूमिं पुनन्तः स्वयं,  
 भ्राजन्ते शिवरामसागरगता निर्मापिताः सहृणैः ।  
 सद्विद्याद्युमणिप्रभाविकसिताऽमेयोपदेशप्रदाः,  
 सत्त्वाना भववारिद्धौ निपततामुद्धारकाः सर्वदा ॥ ५ ॥

सर्वेषामभयप्रदाः श्रुतविदः सत्यार्थसंबोधनात्,  
 सर्वेषां सुखदायकाः श्रितदयाः साम्यं सदा संश्रिताः ।  
 सर्वेषां प्रियतालयाः प्रतिपदं सर्वेषुसिद्धिप्रियाः,  
 सन्तः सज्जनदोखराः शुचिगुणाः सन्ति क्षितौ केचन ॥ ६ ॥



**न्याय-काव्यतीर्थ मुनि श्री हिमांशुविजयज्ञनां पुस्तकोः।  
( संशोधित तथा रचेदान् )**

**१ प्रभाणनयतत्त्वालेक सटीक ( न्याय ) :-** वाहि हेवसूरिनो आ  
अंथ नैतोमां प्रसिद्ध छे. आना उपर पं. रामगोपालाचार्यनी छानोने  
उपयोगी थाय तेवी ठीका छे. पहेली ज वार ते ठीका साथे भूण अंथने  
नवी पक्षतिए भंशोधित करवामां आव्यो छे. खास करी आनी प्रस्ताव-  
नामां नैन न्याय विषे सारो प्रकाश पाखो छे. भूण अंथकारना ज्ञवन  
विषे तथा अंथ विषे जाणुवा नेवी धणी आपतो आमां लभी छे. ॥१॥

**२ जैनी सम्पदार्थी ( न्याय ) :-** नैन न्यायमां प्रवेश करवा भाटे  
आ अंथ तर्कसंघनी गरेज सारे छे. आमां नैन प्रमेय अने नैन  
प्रभाणोनुं वर्णुन टूंकाखुमां सुन्दर रीते कर्युं छे. हेरेक विद्यार्थीयोने भणु-  
वामां सुलब पडे ते भाटे आमां चार परिशिष्टो गुजरातीमां योन्यां छे.  
प्रस्तावनामां अंथ अने अंथकारनी आलोचना करी छे. आना कर्ता श्री  
यशस्वत् सागर गणि छे. किंभत पांच आना.

**३ सिद्धहेमचंद्रशण्डातुशासनलघुवृत्ति ( व्याकरण ) :-** कलिकाण सर्वज्ञ  
श्री हेमचंद्राचार्यना व्याकरणुनी भहता भैयाभोटा विद्वानो जलणी गया छे.  
आ व्याकरण सिद्धराज सोलांकीनी प्रार्थनाथी बन्युं छे. सरल अने पूर्ण  
छे. नवी पक्षतिए आने भंशोहित कर्युं छे. विनिध इष्टिए उपयोगी आमां  
सात परिशिष्टो योन्यां छे. भहत्वनी प्रस्तावना अने विषयातुकम पणु छे.  
डिन रथले टिप्पणी पणु कर्युं छे. आ अंथने श्री आणुद्दृ कल्याणज्ञनी  
पेहीये अमदावाही अहार पाखो छे. त्यांथी ३. ४। मां गणी शके छे.

**४ धर्म वियोगभाणा ( काव्य ) :-** श्री विजयधर्मसूरिना निर्वाणु  
पछी तेमना वियोगाथी आ काव्यनी उत्पत्ति थध छे. आमां संस्कृत विग्रहे  
सात लापायोनां उज पदो छे. काव्यप्रेमीया आने पमंह करे छे. कि. ॥५॥

**५ ज्येन्त प्रथ-थ ( चरित्र ) :-** आमां शांतभूति मुनिराज श्री ज्येन्त  
तविजयज्ञनो टूंक परिचय छे. अंथ संस्कृत लापानी कवितामां छे. गुज-  
राती अनुवाद पणु साथे ज छे. किंभत ॥५॥

**६ महा कवि शोलानमुनि अने तेमनी कृतिः—** आमां श्री शोल-  
नमुनितुं ज्ञवनचरित्र आलोचनात्मक लघ्युं छे. साथे तेमनी कृतिना  
ख्लोडा नमुना तरीकि टांकया छे. किंभत ॥६॥

अथवा. <b>ज्येति कार्यालय-नगरशेषः। भारकीट रतनपोषः。 अमदावादः。</b>	} प्राप्तिस्थानः <b>मंत्रीः—विजयधर्मसूरि जैन अंथभाणा। छाटा सराक्षा उज्जैन ( भागवा )</b>
--	--



